
શ્રી સાઈનું સત્ય ચચિત્ર

॥ ઓં શ્રી પરમાત્મને નમઃ ॥

॥ પરબ્રહ્મ સ્વરૂપ બ્રહ્માંડ નાયક શ્રી સાઈ નાથાય નમઃ ॥ દ્રાં દત્તાત્રેય નમઃ । હરિ: ઓં ॥

॥ અધ્યાય ૧ ॥

શ્રી ગોવિંહ રઘુનાથ દાભોળકર કે જેમને શ્રી સાઈબાબાએ ‘હેમાડ પંત’ કહીને સંબોધ્યા હતા તેમણે ‘શ્રી સાઈ સચ્ચચિત્ર’ની રચના પૂજય સાઈબાબાની હ્યાતીમાં તેમની આજ્ઞા લઈને કરી છે. અહીં ‘સચ્ચચિત્ર’ શાબ્દનો ઉપયોગ હેતુપૂર્વક થયેલો છે. સત્ત એટલે કે જે પરમ સત્ય છે તે અથવા સૌને સત્યને માર્ગે દોરી જય છે તે. એ બંને અર્થમાં તે શાબ્દ પ્રયોગ સાચો છે. ‘શ્રી સાઈ સચ્ચચિત્ર’ ગ્રંથ શ્રી સાઈબાબા સદેહે પૃથ્વી ઉપર અવતર્યા હતા તેમની લીલાઓ દ્વારા તેનું સમર્થન કરે છે. તેજ પ્રમાણે શ્રી સાઈનું આ ચચિત્ર સાધકને કે શિષ્યને પરમ સત્ય સુધી લઈ જય છે. આ વાતને અનુમોદન આપતા હોય તેમ સ્વ. બાળકૃષ્ણ વિશ્વનાથ દેવ કહે છે ‘શ્રી સાઈ સચ્ચચિત્રમાં શ્રી સાઈ બાબાએ જે જે લીલાઓ કરી તે લીલાઓનું કથાઓ દ્વારા વર્ણન કરાયું છે. તેમાંની ઘણી ખરી લીલાઓ અણણા સાહેબ શ્રી હેમાડપંતણે ખૂબ જ માધુર્યપૂર્ણ વર્ણન કર્યું છે.’ તે વાત એ બાબત સ્થૂચયે છે કે શ્રી સાઈનાથની બની ગયેલી ઘટનાઓને સચ્ચાઈ અને પ્રમાણીકતાથી રજૂ કરેલી છે જે સત્ય તરફ દોરી જય છે.

મંગલાચરણ

શ્રી ગણેશજીને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કુળહેવતાને વંદન,

શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રજીને વંદન અને શ્રી સદ્ગુરુ સાઈનાથ મહારાજને વંદન.

કોઈપણ શુભકાર્યનો ગ્રારંભ મંગલાચરણથી થાય છે જેથી સમગ્ર કાર્ય નિર્વિદ્ધનપણે સંપૂર્ણ થાય. મંગલાચરણ દ્વારા દેવની કૃપા મેળવાય છે. તે સાથે ઋષિઓ, પૂર્વને, વડીલો વગેરેનું પૂજન અને અભિવાદન પણ મંગલાચરણ દ્વારા કરાય છે, જેથી કાર્ય સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે. પ્રારંભમાં વાંકી સૂંદરવાળા અને ગરીબોના પાલનકર્તા, ચૌદ વિદ્યાઓ જેવી કે ઋગવેદ, યુજ્વાંગ, સામવેદ અને અથર્વવેદની વેદ શુંખલાઓ તેમજ છ અંગો-વેદાંગ-જેવા કે શિક્ષા, વ્યાકરણ, કલ્યા, છંદ, નિરુક્ત, જ્યોતિષ અને ચાર ઉપાંગો જેવા કે પુરાણો, ન્યાય, મીમાંસા અને ધર્મશાસ્ત્રો એમ ચૌદ વિદ્યાઓના અધિપતિ મંગલકૃપવાળા અને હાથીની મુખાકૃતિવાળા શ્રી ગણપતિને પ્રથમ વંદન કરને. જેમના વિશાળ ઉદ્ઘરમાં ભૂલોક, ભૂવલોક, સ્વલોક, મહલોક, જનલોક અને સત્ય અથવા બ્રહ્મલોક તેમજ અતિલ, વિતલ, સુતલ, રસાતલ, તલાતલ અને પાતાલ અથવા નાગલોક એમ ચૌદ લોક સમાચેલા છે. તેવા શ્રી ગણેશ લંબોદર અથવા મોટા પેટવાળા કહેવાય છે. વિદ્ધનોનો નાશ કરવા માટે હાથમાં પરશુધારણ કરેલા હે ગણનાથ ગજનના ! મારા શાબ્દોને તારો પ્રસાદ બનાવ. હું તને દંડવત્ પ્રણામ કરું છું કારણ કે તું મારો અને સહુ ભક્તોનો છે. વિદ્ધનો તારા ચરણોમાં ધારણ કરેલા અલંકરોની જેમ તારા પગમાં આળોટી રહ્યા છે. તારી દષ્ટિ પડતાની સાથે જ સર્વ વિદ્ધનો અને દારીદ્રય દૂર ભાગી જય છે. તુંજ સંસારઝપી સાગર તરવાની નાવ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

છે. હે પ્રભુ ! તુંજ અજાનકૃપી અંધકારને હણનારી શાનકૃપી જ્યોત છે. હે નાથ ! રિદ્ધિ અને સિદ્ધિ સહિત મારી ઉપર તારી અમીદષી નાખ. હે ગિરિજના પુત્ર ! હે મંગલ વદનવાળા અને મુશક સવારી કરનાર પ્રભુ ! તું વિધોના વનનો સર્વનાશ નોતરનારો છે. હે વિધેશ ! હું તારું અભિવાદન કરું છું. મારા આ કાર્યની નિર્વિધે સમાપ્તિ થાય અને મારું કાર્ય વધુ લાભદાયી થાય તે માટે હું ઈષ્ટદેવને નમસ્કાર કરું છું. સાઈ પોતે જ ગજનન ગણપતિ છે. તે પરશુધારી ગણેશ સ્વરૂપે પોતાનું સવિસ્તર વિવેચન કરશે. શ્રી સાઈનાથ પોતેજ કપાળ ઉપર ચંદ્ર ધારણ કરનાર ભાતચંદ્ર ગજનન છે. બાબા પોતેજ એકદંત, ગજકર્ણ અને વિરાટ છે. સાઈનાથ સાથે એકરૂપ થયેલા હે સર્વકલ્યાણ કર્તા ગણારાયા મને જ્યાં આત્મસુખ પ્રાપ્ત થાય તે સ્થાને લઈન્ન. (ઓ. ૧ થી ૧૨)

કેવળ ‘હણપણ’ જ (wisdom) જેનો સ્વભાવ છે તે બ્રહ્માણની પુત્રી સરસ્વતી માતાને મારા કોટી કોટી વંદન. હે મા ! મારી લુભને હંસ બનાવીને તે ઉપર બીરાને. જેમણે હાથમાં બ્રહ્મવીણા ધારણ કરી છે, જેના કપાળ ઉપર પાતળી કંકુની રેખા શોભી રહી છે અને શુભ્ર-સફેદ-વરણો ધારણ કરેલાં છે તેમજ હંસ જેમનું વાહન છે એવી મા શારદા મારી ઉપર કૃપા કરો. વાણીની દેવી માતા જગજનની જે પ્રસન્ન ન થાય તો કાવ્ય અને કથાઓ ભરેલી સાહિત્ય સંપત્તિ મને પ્રાપ્ત થઈ શક્શોકે ? અને તે વિના મારાથી શું આ ચરિત્ર લખી શકાશોકે ? આ જગજનની માતે ! વિદ્યાની સંપત્તિ અને ગુણકૃપી નદીના અમૃતપ્રવાહને મારા દ્વારા શ્રી સાઈ સમર્થના ચરિત્રના અમૃત ધૂંટ પીવડાવ. શ્રી સાઈ પ્રભુ સ્વંય ભગવતી સરસ્વતી બનીને અને ઊંકારની વીણા કરમાં ધારણ કરીને પોતેજ પોતાનું ચરિત્ર ગાઈ રહ્યા છે. (ઓ. ૧૩ થી ૧૭)

ઉત્પત્તિ, સ્થિતિ-પાલન પોખણ અને સંહાર કરનાર તેમજ ૨૪, સત્ત્વ અને તમસનું મૂર્તિમંત સ્વરૂપ એવા બ્રહ્મા, વિષણુ અને શંકર ભગવાનને મારા અનેક અનેક વંદન. હે સ્વંય પ્રકાશિત સાઈનાથ મહારાજ ! અમારે માટે તો આપજ ભગવાન ગણેશ, બ્રહ્માણ, વિષણુ ભગવાન તથા શિવજી છો. અમારા જેવા ભક્તોને આ ભવસાગરથી પાર ઉતારીને મોક્ષનો સામેનો કિનારો બતાવો. પૂર્વજન્મમાં કોઈપણ જ્ય, સાધના આહી સાધન કર્યા વિનાના આ પગકેવી રીતે ઉપહરો? અમને ચોક્કસ ડેકાણું પ્રાપ્ત થશે ઝુંકું કે ? (ઓ. ૧૮ થી ૨૧)

મારા કુળદેવતા આદિનારાયણ ક્ષીરસાગરમાં વસે છે. તે સર્વેનાં બધાંજ દુઃખો હરનારા છે. તેમને મારા સ્નેહપૂર્ણ નમસ્કાર હો. ભગવાન શ્રી પરશુરામે સમુદ્રને પૂરીને નૂતન ધરતીનું સર્જન કર્યું. તે ધરા કોંકણ પ્રદેશ તરીકે પ્રસિદ્ધ થઈ. તે ભૂમિમાં નારાયણ પ્રભુ પ્રગટ થયા. તે પરમાત્મા સૌનાં હદ્યમાં બીરાળને નિયમન કરે છે અને માત્ર કૃપા કટાકથી જ ભક્તોનું સરક્ષણ કરે છે. એવા નારાયણ પ્રભુની પ્રેરણાને આધિન થઈને રહું છું. તેજ રીતે યજમાં સહ્યોગ માટે ભાગવ શ્રી પરશુરામે ગૌડ દેશ-(બંગાલ)ના એક મહામુનિને કોંકણ પ્રદેશમાં બોલાવ્યા. તે મૂળ પુરુષને મારા અત્યંત આદરપૂર્વક નમસ્કાર કરન્ને. હવે હું મારા ગોત્રના સ્વામી તથા ઋગવેદની શાકલ શાખાના પ્રવર્તક તેમજ સમગ્ર આદિ ગૌડ જિતિના બ્રાહ્મણોના પૂર્વજ ઋષિરાજ ભારકાજ ઋષિને નમસ્કાર કરું છું. બ્રાહ્મણોને પૃથ્વી ઉપરના સાક્ષાત પ્રગટ દેવો તથા પરબ્રહ્મનો અવતાર ગણાય છે. તે સૌ બ્રાહ્મણોને હદ્યપૂર્વક વંદન કરું છું. સદા પ્રેરણાદાયી અને પ્રાતઃસ્મરણીય યોગીશ્વર યાજણવલ્ક્ય, ભૃગુ, પારાશર તેમજ નારદજી વગેરે મહર્ષિઓને મારા સાણાંગ નમસ્કાર કરું છું. પારાશર પુત્ર સતનકુમારને દંડવત્ પ્રણામ કરું છું. પરમહંસ શુક્લ, સુત્ર રચ્યીતા શૌનક, વિશ્વામિત્ર, વશિષ્ઠ, વાલ્મીકી તથા વામદેવ, જૈમિની, વૈશાંપાયનને પ્રણામ કરું છું. નવ યોગીદ્ર આહી મુનીઓ જેવા કે કવિ, હરિ, અંતરિક્ષ, પ્રભુદ્વ તથા પિપળાયન, આવિહોત્ર, દુમિલ, ચમસ અને કરબાજન તે સહુને સાણાંગ પ્રણામ કરું છું. હવે મહારાષ્ટ્રનાં સંતરતનો

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

નિવૃત્તિનાથ, જ્ઞાનહેવ, મુક્તાબાઈ, સોપાન, એકનાથ મહારાજ તથા સ્વામી જનાર્દન, તુકારામ મહારાજ, કાન્હોબા, નરહરિ વગેરેનાં ચરણોમાં મસ્તક મૂકીને નમસ્કાર કરું છું. (ઓ. ૨૧ થી ૩૧)

મારા પુણ્ય પુરુષ દાદાશ્રી સદાશીવ કે જેમને સંસારની નિર્થક્તા સમજતાં હિમાલયમાં બદ્ધિનાથ અને કેદારનાથમાં નિવાસ કર્યો તેમને હું વંદન કરું છું. તેજ રીતે ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરતા મારા પૂજ્ય પિતા શ્રીનાં ચરણોમાં નમસ્કાર કરું છું. જનમદાની મારી માતાને અને તેણે કરેલા ઉપકારોને કેમ ભૂલાય ? તેણે મારે કાજે રત-દિવસ અનેક કષે વેદ્યાં તેવી મારી માતાને હું વારંવાર નમસ્કાર કરું છું. માતાનું સુખ મેં બાળપણમાં જ ગુમાવ્યું હતું. તે કપરા સમયમાં મારાં કાકીએ કેટલાંથી કષે સહન કરીને મને ઉછેર્યો. મારો ઉછેર કરતાં કરતાં તે હરિનાં સ્મરણમાં મળન રહેતાં. એવાં મારા કાકીને ભાવસભર વંદન કરું છું. મારા મુરઘ્યી મોટાબાઈને મારે માટે અનન્ય પ્રેમ હતો. તે જરૂર પડ્યે મારે માટે પ્રાણ ન્યોચછાવર કરવા માટે તત્ત્વર રહેતા. એવા બંધુપ્રેમી મોટાબાઈને હદ્યપૂર્વક વંદન કરું છું. (ઓ. ૩૨ થી ૩૬)

મેં શ્રી સાઈનાથ વિષે જે કઈ આ પોથીમાં લખ્યું છે તેને વાંચનારા સર્વ વાંચકોનો તથા આ પોથીનું કોક દ્વારા જે કોઈ શ્રવણ કરે તે સૌ શ્રોતાજનોનો આભાર માનું છું. જે તમે આ પોથીનું વાંચન કે શ્રવણ ન કર્યું હોત તો સાઈ ગુણ ગાથા લખ્યાનો સંતોષ ન લઈ શકત. વિક્તા શ્રેષ્ઠ હોય પરંતુ શ્રોતાઓ તેને ધ્યાનથી ન સાંભળે તો તેને પોતાના વક્તવ્યનો શ્રમ નીર્થક-નકામો લાગે છે. તેવું જ વાચકો માટે પણ કહી શકાય. આ કારણે હું આપને સ્નેહપૂર્વક નમસ્કાર કરું છું.

મને શાક્ત કે સાહિત્ય વિષે કોઈ ખાસ જ્ઞાન નથી. મને સદ્ગુરુનું વાંચન કે પારાયાણ કરવાનો અવસર પ્રાપ્ત થયો નથી. તેજ રીતે મેં સંતો દ્વારા ગવાતી-કહેવાતી કથાઓનું રસપાન કર્યું નથી. મને મારા અવગુણો અને ઉણપની સારી રીતે ખખર છે. પરંતુ સદ્ગુરુએ કરેલી આજા પૂર્ણ કરવા માટે હું આ અલ્પ પ્રયત્ન કરું છું. બાકી મારી હૈસિયત એક ધાસના તણખલા જેવી હોવા છીતાં હે ગુરુદેવ ! તમે મને આપની છત્રછાયામાં આશ્રય દીધો છે. (ઓ. ૩૭ થી ૪૨)

હે બુદ્ધિમાં પ્રગટાતી જ્ઞાન જ્યોતને પ્રગટાવનારા સદ્ગુરુનાં ગુણ કિર્તન ગાઈશ ! કાયા, વાચા અને મન દ્વારા ઊંડાર સ્વર્ણપ મારા ગુરુદેવને પ્રેમ પૂર્વક તેમનાં શ્રી ચરણોમાં વંદન કરું છું. ભોજન કર્યા પછી અંતમાં મિશાન લેવાય છે તેમ ગુરુદેવને નમસ્કાર કરીને ‘નમસ્કાર’નો કેમ પૂર્ણ કરવાનું દીચ્છુ છું. પરંતુ સદ્ગુરુ દેવની અસીમકૃપાનાં ગુણગાન ગાવા માટે હું મારી જાતને રોકી શકતો નથી. ગુરુદેવ સમસ્ત ચર અને અચરમાં વીલસી રહ્યા છે, તે ખૂબજ દ્યાળું છે. ગુરુદેવ ! આપજ સમગ્ર વિશ્વનું નિવાસસ્થાન છો. બ્રહ્માજ અથવા બ્રહ્મથી જંબુ, કુશ, પલક્ષ, શાલમલી, કૌંચ, શાક અને પુષ્કરએ સાત દ્વિપો સર્જયા. તેજ રીતે પૃથ્વી, સાત સ્વર્ગો અને સાત પાતળ જેના દ્વારા ઉત્પન્ન થયાં તે બ્રહ્મ છે. બ્રહ્માંને જે શક્તિ જન્મ આપે છે તેને અવ્યક્ત કે માયા કહેવામાં આવી છે. સદ્ગુરુ મહારાજનું નિવાસસ્થાન માયાની પેલેપાર છે. જેના મહિમાનું વર્ણન થઈ શકે તેમ નથી. માટે તો વેદશાસ્ત્રોએ નેતી નેતી કહીને મૌન ધારણ કર્યું છે. ત્યાં જુદા જુદા પ્રકારની યુક્તિઓ દ્વારા સિદ્ધ કરેલાં પ્રમાણ ચાલી શકે તેમ નથી. એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે. હે ગુરુદેવ આપને જે જે ઉપમા અપાય તે તે વસ્તુઓના કુદરતી ગુણો આપનામાં છે તેવું સિદ્ધ થાય. તે દશ્ટિએ દેરેક વસ્તુઓ સાથે સરખાવતાં આપમાં બધાજ ગુણો છે એવું સાબિત થયાં આપ સર્વત્ર સર્વવ્યાપી છો તેમજ દેરેક વસ્તુઓ આપનું જ સ્વર્ણપ છે એમ સહજ રીતે માની શકાય. હે દ્યાસાગર સદ્ગુરુ ! આપ પોતેજ પોતાને જાણનાર છે. હે સાઈનાથ ! સૂચિનો પ્રારંભ, આદિ, મધ્ય અને અંત આપજ છો તેથી હું પ્રણામ કરું છું. આપ સર્વમાં શ્રેષ્ઠ અને નિત્યાનંદ સ્વર્ણપ છો અને પૂર્ણકામ છો. હે સાંદી ! તમે પ્રકાર સ્વર્ણપ, મંગળધામ, આત્મારામ તથા ગુરુવર્ય છો. આપને મારાં અનેકો પ્રણામ. વેદો અને શ્રુતી સ્મૃતિ આપને જાણી શકે તેમ નથી

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

તો મારું અલ્પજ્ઞાન તમને કેવી રીતે ઓળખી શકશે ? (ઓ. ૪૩ થી ૫૨)

હે કરુણાના અંગર જેવા સદગુરુ આપનો જ્ય જ્યકાર હો. ગોદાવરીને તીરે બ્રહ્મ, વિષણુ અને મહેશના દસ્તઅવતાર સ્વરૂપ વિચરતા હે સદગુરુ આપનો જ્ય હો. બ્રહ્મદેવને બ્રહ્મની પ્રાપ્તી થાય છે તે સદગુરુની કૃપા વિના શક્ય નથી. માટે સદગુરુની પંચપ્રાણોની દિવેટો પ્રગટાવીને આરતી ઉતારવી જોઈએ. અનન્ય ભાવે તેમના શરણે જઈને અને નતામસ્તક થઈને ગુરુજીનું અભિવાદન કરવું જોઈએ તેમજ પોતાના હાથ વડે તેમની ચરણસેવા કરવી જોઈએ. પોતાની આંખો દ્વારા ગુરુ મુખાદૃતિનાં દર્શન કરવાં જોઈએ તેમજ નાક વડે તેમના ચરણોદક-તીર્થની વાસ લેવી જોઈએ. પોતાના કાન વડે શ્રી સાઈનાથના ગુણ વર્ણિનાં શ્રવણ કરવું જોઈએ. મનમાં શ્રી સાઈ મૂર્તિનું ધ્યાન ધરવું જોઈએ. જ્યારે ચિત્ત દ્વારા અખંડ સાઈ ચિંતન થાય ત્યારે સમજવું કે હવે સંસારનાં બંધનોમાંથી ધૂટકારો મળ્યો છે. સદગુરુનાં ચરણોમાં ભક્તિભાવથી તન, મન અને ધન ન્યોગ્યાવર કરી દેવું જોઈએ. એ રીતે એમની સેવામાં સમગ્ર જીવન ખર્ચી નાખવું જોઈએ. ગુરુનું નામ સ્મરણ, ગુરુ સાથે સહલાસ, ગુરુકૃપા, ગુરુનું ચરણોદક-તીર્થ અને ગુરુમંત્રની પ્રાપ્તિ અત્યંત કષ્ટથી તેમજ મહાપ્રયત્ને મળે છે. ઉપરોક્ત સર્વ બાબતોમાં પ્રચંડ શક્તિ હોય છે. ભક્તોને મોક્ષના ઉંબરા સુધી અન્જણતાં દોરી જવા માટે એક ભક્તોની અનેકવાર કસોટીઓ થાય છે. ગુરુ સહલાસનું ગંગાજળ મના મેલને ધોઈને તેને નિર્મણ કરે છે. હરિનાં ચરણોમાં મન પણ સ્થિર થઈ જાય છે. ભક્તોને મન તો સદગુરુની સેવા તથા તેમનું નામ સ્મરણ વેદ પુરાણોનું પઠન છે. ગુરુજીને કરાતાં સાંચાંગ પ્રણામ એજ ભક્તને મન યોગ, યજા, તપ અને સાધનો છે. ‘શ્રી સાઈ સમર્થ’ એ શાબ્દ જ ભક્તોને માટે મંત્ર, તંત્ર અને યંત્ર છે. (ઓ. ૫૩ થી ૬૨)

શ્રી સાઈભાબા પોતાના ભક્તોને બ્રહ્મ સત્ય છે તેની પ્રતીતિ કરાવે છે અને જગત મિથ્યા છે તેવી સભાનતાવાળી પરમોચ્ચ સ્થિતિએ લઈ જાય છે. તે પરમાનંદ સ્વરૂપ કે પરમ સુખની સ્થિતિ તરીકે ઓળખાય છે. ભક્તોને તો મનની સતત આનંદમયી વૃત્તિ જોઈએ. જેઓ મનને સ્થિર કરવાની પદ્ધતિ જાણી લે અને તેમને હંમેશાં આનંદમય સ્થિતિમાં રહેવાનું ફાવી જાય તેમને સુખ શાંતિ અને સમાધાન મળે છે. પરમાનંદની પ્રાપ્તિ થાયી તેજ જીવની શ્રેષ્ઠ પ્રાપ્તિ છે. શ્રી સાઈનાથ પરમ આનંદની મોટી આણ છે. તેઓ સમુદ્રની જેમ પૂર્ણ છે. ભાગ્યવાન ભક્તને શ્રી સાઈભાબા પરમાનંદની ખોટ કરી પડવા દેશે નહીં. શિવ અને શક્તિ, પુરુષ અને પ્રકૃતિ, પ્રાણ અને ગતિ તેમજ હિપક અને પ્રકાશ તે સૌ શુદ્ધ બ્રહ્મનાં બદલાયેલાં સ્વરૂપો છે. આ બંને આમ તો એકજ સ્વરૂપમાંથી પ્રગટયાં હોવા છતાં સામાન્ય જનો તેમને બે સ્વરૂપે એટલેકે દ્વૈતમાં માને છે. બૃહદાકરણ્યક ઉપનિષદ-૧,૩,૪ના કલ્યા પ્રમાણે ‘એકલું ગમતું નથી.’ માટે તૈતરીય ઉપનિષદ ૨ અને ઇનાં શ્રુતીવેદ વાક્યો પ્રમાણે ‘બહુ સ્યામ -એકમાંથી અનેક’ થવાનું મન થાય છે. બીજની સંગત ગમે છે તેમ છતાં ફરીથી એકલા થઈ જવું જોઈએ એમ લાગે છે - અર્થાત્ એકાંત જ પ્રિય લાગે છે. શુદ્ધ બ્રહ્મની સ્થિતિ એટલે ત્યાં પુરુષ કે પ્રકૃતિ બંને નથી. સૂર્ય જ્યાં રહેતો હોય ત્યાં હિવસ અને રાત્રી એમ બે સ્થિતિ કેવી રીતે હોઈ શકે ? શ્રી સાઈભાબાનું મૂળ સ્વરૂપ ગુણોની પેલેપારના નિર્ણય સ્વરૂપનું છે. તેઓ તો ભક્તોના કલ્યાણને માટે ઉત્તમ ગુણો સાથે સગુણ સાકાર સ્વરૂપે પ્રગટ્યા છે. હું એવા સાઈને શરણે જાઉ છું. શ્રી સાઈ સમર્થને શરણે જે કોઈ ગયા છે તેમને બાબાએ અનેક સંકોટમાંથી મુક્ત કર્યા છે. હું પણ મારા એ પ્રકારના સ્વાર્થથી તેમનાં ચરણોમાં મારું મસ્તક ટેકવું છું. વાસ્તવિક રીતે જોતાં તેમનું મહત્વનું માપ નીરાળું અનોખુ જ છે. સાઈ ભક્તોના સુખ માટે અનોખા - સામાન્ય માનવી જેવા સ્વરૂપે રહે છે અને પોતે તો ઈશ્વરના ભક્ત છે એમ દર્શાવીને વર્તે છે તેવા પ્રેમાળ સાઈભાબાને મારા નમસ્કાર કરજે. જે સર્વ જીવોમાં રહેતું ચૈતન્ય છે અને જીન શક્તિનો

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

આધાર છે તેમજ જે ચર અને અચરઙ્યે પ્રગટ થયા તે પ્રેમાળ સાઈબાબાને મારા પ્રણામ કરને. હે સુખમૂર્તિ ગુરુરાયા ! તમે મારી પરમગતી છો. તેમજ મારી વિશ્વાંતિ છો. મારી પીડાઓ-દુઃખોને દુર કરનારા તેમેજ છો. (ઓ. ૬૩ થી ૭૪)

હવે આ બધાં નમસ્કારોના અંતમાં ‘સર્વા ભૂતીં ભગવંતિ ।’ સર્વ ભૂતોમાં વસેલા ભગવંતને ધ્યાનમાં રાખીને હું સર્વ પ્રાણી માત્રાને વંદન કરું છું. અને જે મારા દોષો દેખાય તો મને ક્ષમા આપીને મારો સ્વીકાર કરવા માટે વિનંતી કરું છું. વિશ્વંભર અંદર બહાર બધે જ વ્યાપેલો સર્વવ્યાપી છે. તેથી એકતા જરા પણ વિભાજિત નથી. તે સર્વનું ભરણપોષણ કરતો હોવાથી, જે કોઈ જીવ માત્રાને વંદન કરે તો પ્રભુને ખૂબ જ આનંદ થશે. આમ હવે ‘નમન’ પરિપૂર્ણ થયું તેથી તેને સમાપ્ત કરું છું. આ ગ્રંથનું મંગલાચરણ પણ એજ સૂચયે છે કે આરંભ કરેલા વિષયને વ્યવસ્થિત રીતે સમાપ્ત કરવો. હવે હું આ ગ્રંથનું પ્રયોજન-હેતુ અને નિવેદન કરું છું. (ઓ. ૭૫ થી ૭૭)

જે દિવસથી શ્રીસાઈનાથ મહારાજે મારી ઉપર કૃપા વરસાવીને અનુગ્રહ કર્યો ત્યારેથી હું રાત-દિવસ એમનું જ ચિંતન કરી રહ્યો છું. તેથી મારો સંસાર પ્રત્યોનો ભય નાશ પામ્યો છે. હું શ્રી સાઈનું સગુણ સ્વરૂપ જ જેઠ રહ્યો છું. મારે માટે તે સિવાય બીજા કોઈ જ્યું કે તપ નથી. બાબાની મુખાકૃતિનાં દર્શન કરતાં કરતાં હું ભૂખ અને તરસ વીસરી જાઉ છું તો બીજા સુખો પ્રત્યેની રૂચીની તો વાતજ શું કરવી ? સંસારનાં દુઃખો ભૂતવાં પડે છે. બાબાનાં નથનોને નીરખતાની સાથે જ તે આપોચાપ ભૂતી જવાય છે. હૃદયમાંથી જે પ્રેમના ઉછાળા ઉભરાય છે તેમાંથી જન્મતા આનંદમાં મનની વૃત્તિઓ દુબી જથ છે. ધર્મ અને કર્મ, શાસ્ત્ર અને પુરાણો તથા યોગ કે યાગ તેમજ અનુષ્ઠાન તીર્થયાત્રા કે તપશ્વર્યા તે બધાંજ મારા સાઈના ચરણોમાંજ છે. ગુરુના કહેવા પ્રમાણે તેનું તે પ્રમાણે સતત વર્તવાથી તથા ચિત્તવૃત્તિની શદ્ધાપૂર્વક સ્થિર સ્થિતિ રાખવાથી મનને શાશ્વત-કાશ્યમી-શાંતિ પ્રાપ્ત થાય છે. મારી સાઈચરણોની પ્રિતિ વધી અને ન માની શકાય તેવી પ્રચંદ શક્તિની અનુભૂતિ મને થઈ. તે શક્તિ દ્વારા ભક્તિ ઊભી થાય છે. તેથી શ્રી સાઈનાથના ચરણોની તૃષ્ણા વધે છે. તેમજ તે દ્વારા સંસારમાં રહેવા છતાં તેને સંસાર, વૈરાય અને આનંદની વૃત્તિ પ્રાપ્ત થાય છે. તે શક્તિનું હું કેટલું વર્ણન કરું ? (ઓ. ૭૫ થી ૮૫)

વિવિધ સંપ્રદાયોમાં ભક્તિના અલગ અલગ પ્રકારો કહ્યા છે. તેમને હું બને તેટલી કાળજ રાખીને તેમના સારાંશરૂપે કહીશ. જેમ કે પોતાના આત્માનું સતત ધ્યાન ધરવું તેને ‘સ્વ સ્વરૂપાનુંસંધાન’ કહેવામાં આવ્યું છે. આ રીતે ભક્તિનાં મુખ્ય લક્ષણો બ્રહ્મવેતા ઋષિઓ તેમજ વેદશાસ્ત્ર નિપુણ જ્ઞાન સંપન્ન આચાર્યોએ જણાવ્યાં છે. પારશર ઋષિના પૂત્ર શ્રી વેદ વ્યાસજીએ જણાવેલ નવધા ભક્તિના એક પ્રકારને અર્થન ભક્તિ કહેવામાં આવે છે. આ ભક્તિમાં પૂજન માટે તૈયારી કરવી તે પણ ભક્તિનાં અંગો ગણાય છે. જેમ કે ગુરુલની પૂજન માટે બગીચામંથી પારિનત આઢી પુણ્યો ચૂંટવાં, આંગણુ સ્વરચ્છ કરીને પાણીનો છંટકાવ કરવો અને તેને ગાયના ઘણાથી લીંપવું તે પછી સ્નાન સંધ્યા કરીને પૂજન માટે જલમિશ્રિત અષ્ટગંધ અર્પણ કરવું. ત્યારબાદ પંચામૃત, શુદ્ધ જળ અને શુદ્ધ જળથી સ્નાન કરાવવું. ગુરુદેવને ધૂપ દીપ તથા નેવેદ્ય અને આરતી અર્પણ કરવાં. ભક્તિ અને પ્રેમ પૂર્વક કરેલી આ કીયાને ‘અર્થન’ કહેવામાં આવે છે. આપણા હૃદયમાં રહેલા શુદ્ધ જ્ઞાન સ્વરૂપ નિર્મળ ચૈતન્યને મૂર્તિમાં આમંત્રિત કરીને પૂજનો પ્રારંભ કરવો. પૂજન અર્થન પત્યા પછી તે ચૈતન્યને પુનઃ પોતાના હૃદયમાં પહેલાંની જેમ પદ્ધરાવવું. ગગાચાર્થના મત પ્રમાણે ઉપરોક્ત ભાવને મનમાં સંપૂર્ણ પણે હરિભક્તિમાં પરોવવાથી તે હરિ ગુણ અને હરિકિર્તનમાં લીન થઈ જથ છે. શાંદિલ્ય મુનીએ પણ એમ કચ્ચું છે કે આત્માનું અખંડ ધ્યાન કરવું. કથા કિર્તન કરવું અને શાસ્ત્રોમાં જણાવ્યા અનુસારનું વર્તન કરવું. જેમનું ધ્યેય પોતાનું હિત સાધવાનું છે તેઓ વેદાઓ જણાવ્યા પ્રમાણેનું આચરણ કરે છે. આવા સાધકો વેદોએ જે આચરણ કરવાનું નથી તે આચરતા નથી. તે સમજે છે કે વેદે

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

નકારેલું આચરણ પોતાના હીત માટે બાધક છે તેથી તે ટાળે છે. (ઓ. ૮૬ થી ૯૬)

‘બ્રહ્માપર્ણ યોગ’ની એવી સમજણ છે કે હું કોઈ પણ કિયા તથા તેનાથી જન્મતા ફળનો ભોક્તા નથી, માટે મારે સર્વ કર્મનું ફળ પરમેશ્વરને કરવું જોઈએ. આ પ્રમાણે કર્મ કરવાથી નૈજકર્મયતા અથવા નિજકામ કર્મ કરવાની વૃત્તિ સહજ સાધ્ય થાય છે. શ્રીમહ ભગવદ્ગીતાના ત્રીજી અધ્યાયનો ૩લોક - ૪ તેમજ અધ્યાય ૧૮ લોક ૪૮માં આ અંગે ભગવાતે સમજલવ્યું છે. કર્મનો ત્યાગ કોઈથી પણ થઈ શકતો નથી. (અ.નુ. ૩લોક પાંચ) પરંતુ પોતે કર્મ કર્યા પછીનું પોતાનું કર્તત્વ છોડી શકાય છે. જેમ કાંટાથી કાંટો કઢાય છે તેમ કર્મ કર્યા સિવાય કર્મ અટકતાં નથી. પોતાનાં આત્માને જાણવાથી કર્મ સંપૂર્ણપણે અટકી જય છે. ફળની આશાનો પૂર્ણપણે નાશ કરવો એજ કર્મત્યાનું રહસ્ય છે. અહીં પોતાનો ફાયદો કે પોતાની ઈચ્છાપૂર્તિ માટે કર્મ કરવું તે છૂટી જય છે. નિત્ય અને નૈમિત્તિક કર્મોને સ્વર્ધર્મ કહેવાય છે. સર્વકર્મો પરમાત્માને અર્પણ કરવાં તેમજ એકલ્લાણ પણ દરેક વસ્તુને ભૂલવાથી મન વૈરાગ્ય યુક્ત થાય છે. નારદમુનિએ ભક્તિનાં જુદાં જુદાં લક્ષ્ણાઓ સમજલવ્યાં છે. ખાસ કરીને નારદ ભક્તિ સુત્ર - ૧૫ થી ૧૮માં તેનું દર્શન થાય છે. આમ ભક્તિનાં અનેક લક્ષ્ણાઓ છે. આપણું ધ્યેય તો કેવળ ગુરુ કથાનું વારંવાર સ્મરણ કરીને સંસારદ્વારી સાગરને તેમાં ભીજયા વિના કોરા પગે તરી જવો તે છે. આ ગુરુ કથા સાંભળવાનો મને નાદ લાગ્યો. તેને સાંભળીને જાણે હું દંગ થઈ આ ગ્રંથ લખવો જોઈએ. (ઓ. ૮૭ થી ૧૦૩)

એક સમયે હું શિરડીમાં હોવાને કારણે ભસ્ત્રદમાં દર્શન કરવા માટે ગયો. ત્યાં મેં સાઈબાબાને ઘઉં દળતા જેયા, જેથી મને ઘણું જ આશ્રય થયું. હું પહેલાં આ કથા કહું છું જે આપ સ્વર્સ્થ ચિત્તે સાંભળો. તે પછી એમાંથી સાઈ ચરિત્રનો ઉગમ કેવી રીતે થયો તે સાંભળનો, જેની કીર્તિ ઉત્તમ છે. તેમાં શ્રી સાઈનાથના ગુણોનું વારંવાર વર્ણન કરવાથી આનંદ થાય છે. અને સાથે બેસીને તેમની પ્રેમળ કથાઓની ચર્ચા કરવાથી ચિત્ત શુદ્ધ થાય છે. તેથી બુદ્ધિમાં વિચારોની સ્પષ્ટતા થાય છે. જેમનું નામ જપવું જ મંગલદાયક છે અને જેમના ગુણોનું વર્ણન તથા તેમની લીલાની વાતો સાંભળીને ભગવાનને પણ આનંદ થાય છે. લીલા શ્રવણ કરવાથી આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક એમ તરફે પ્રકારનાં દુઃખોનો કલેશ નાશ પામે છે અને મનને શાંતિ પ્રાપ્ત થાય છે. ઉપરોક્ત ત્રીવીધ તાપથી ઘેરાયેતા લોકો તથા પોતાનું કલ્યાણ થાય તેમ ઈચ્છા મનુષ્યો અને જેમને આત્મધ્યાનનું ઘેલું લાગ્યું છે એવા મુમુક્ષુજ્ઞનો એમના ચરણોનું શરણું લે છે. તે સહૃદ બાબાના અનેક પ્રત્યક્ષ અનુભવો મેળવીને સંપન્ન થાય છે. હવે ધ્યાનથી આ મધુર વૃત્તાંત શ્રવણ કરો તેનાથી બાબાની ફૂપા અને દ્વારા પણાનો અનુભવ થશે અને તમે આશ્રય અનુભવશો. (ઓ. ૧૦૪ થી ૧૦૮)

એક દિવસ બાબાએ સવારે મુખ ઘોઇને તથા દાંત સાફ કરીને ઘંટી લીધી અને દળવાની શરૂઆત કરી. હાથમાં સૂપડુ લઈને ઘઉંના કેથળા પાસે ગયા અને માપી માપીને સૂપડામાં ઘઉં કાઢવા માંડ્યા. પછી તેમણે જમીન ઉપર કેથળા પાથરીને તેમની ઉપર ઘંટીનાં પડ સાફ કરીને મૂક્યાં. તેમણે ઘંટીનો ખીલડો ઢીલો ન પડે તે માટે બરોબર ઢોકાને બંધ બેસતો કર્યો. તે બાદ કફનીનો ઘેરાવો સંકોરીને બાંધ્યો ઉપર ચઢાવી અને બંને પગ પહોળા કરીને બાબા ઘંટી પાસે બેસી ગયા. તેમની આવી લીલા જોઈને મને ખૂબજ આશ્રય થયું. બાબાની દળવાની તે વળી કેવી કલ્પના ? કોઈપણ વસ્તુનો સંગ્રહ ન કરનાર સાઈને એવી તે કથ ચિંતા હશે ? બાબાએ ઘંટીના પડમાંથી ખીલડાને પકડ્યો અને ગરફન નીચે કરીને પોતાના હાથ વડે દળવા લાગ્યા. સંતો તો અનેક જોયા પણ અનાજ દળતા તો આ પહેલા સંત જોયા. ઘઉં દળવાનું આ કૌતુક કર્યું તે જોઈને મનને સુખ થયું - આનંદ થયો. પરંતુ એ સમજનું નહિંતું કે તેઓ આમ કેમ કરી રહ્યા છે. આમ તે શા માટે કરતા હશે તેની તો ફક્ત બાબાને જ ખબર. આજુબાજુ ભેગા થયેતા લોકો તેને આશ્રયથી જોઈ રહ્યા હતા હતા પરંતુ બાબા આ શું કરો છો ? એમ પૂછવાની કોઈનીય હિંમત

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

ચાલી નહીં. આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. તેથી ખૂણે ખૂણેથી લોક ટોળાં મસ્નિદમાં આવી પહોંચ્યા. સ્ત્રીઓ પણ થાકી જવાય ત્યાં સુધી દોડી દોડિને મસ્નિદમાં આવી. તેમાંની ચાર સ્ત્રીઓએ બાબાના હાથમાંથી ખીલડો ઝૂટવી લીધો. આથી બાબા તેમની સાથે જઘડવા લાગ્યા. તેમ છતાં પેલી સ્ત્રીઓએ દળવાનું ચાલુ જ રાખ્યું અને બાબાની લીલાઓનાં ગુણગાન ગાવા લાગી. તે સ્ત્રીઓનો પોતાને માટે આવો પ્રેમ જોઈને બાબાનો ગુરુસો શાંત થઈ ગયો. આમ ગુરુસાનું પ્રેમમાં ઢપાતર થયું. તે સમયે બાબા મનોમન હસવા લાગ્યા. સ્ત્રીઓએ સુપડામાનું ચાર શેરનું દળણું દળી નાખ્યું. તે સમયે જે સ્ત્રીઓ ત્યાં બેઠી હતી તેમના મનમાં અનેક તરંગો અને તર્કવિર્તક થવા લાગ્યા. તે વિચારવા લાગી કે બાબા પોતે તો કોઈ હિવસ રોટલા ઘડતા નથી. પોતે તો ભીક્ષા માગીને ખાય છે તો પછી આ લોટનું શું કરશે? તેમને પત્નીએ સંતાન તો છે નહીં કે નથી ઘરબાર કે સંસાર. એમનું તો ‘એકલો જીવ સદાય શિવ’ એના જેવું છે. એમને આટલો બધો ઘઉંનો લોટ શા માટે જોઈએ? ત્યારે એક મહિલા બોલી – ‘બાબા તો પરમ કૃપાળું છે. આ ખેલ તો આપણે માટે જ કર્યો છે. તે આ લોટના ચાર ભાગ કરીને આપણને સૌને વહેંચી આપશો.’ પેલી સ્ત્રીઓ મનમાં આ પ્રમાણે વિચારવા લાગી. બાબાનો ખેલ તો બાબા જ જણે. એ વાતનો મર્મ બીજી કોઈથી સમજન્ય નહીં. પરંતુ બાબાને લૂંટી લેવાનો લોભી વિચાર તે સ્ત્રીઓમાં આવ્યો. બધા જ ઘઉં દળાઈ જતાં પેલી સ્ત્રીઓએ લોટને ચારે બાજુ ફેલાવ્યો અને ધંટીનાં પડને સાફ કરીને ભીતને ટેકે મૂકી આવી. તે પછી સ્ત્રીઓ લોટને સુપડામાં ભરીને પોતાને ધેર લઈ જવાની તૈયારી કરવા લાગી. બાબા ત્યાં સુધી એક પણ શાબું બોલ્યા નહીં. પરંતુ જ્યારે તે સ્ત્રીઓએ લોટના ચાર ભાગ કર્યા અને પોતાને ધેર લઈ જવાની પેરવી કરવા માંડી ત્યારે બાબા બોલ્યા ‘ચાલ્યા કેમ? આ લોટને કયાં લઈ ચાલ્યાં? શું એ તમારા બાપનો માલ છે કે? જીવ આ બધોય લોટ ગામને સીમાડે નાખી આવો. ફેંગણનું ખાવા વાળી ઓ રાંડો! શું તમે મને લુંટવા આવી હતી કે શું? આ ઘઉં મેં તમારી પાસેથી ઉછીના લીધા હતા કે તમે મારી પાસેથી લોટ લઈ જવા આવ્યાં છો?’ આ સાંભળીને તે સ્ત્રીઓ ખૂબજ નીરશ થઈ ગઈ, કારણ કે તેમની લોભી વૃત્તિનો ફજેતો થયો હતો. તેઓ એકબીજના કાનમાં ગુણગણવા લાગી અને ગામને સીમાડે લોટ નાખવા ચાલી નીકળી. (ઓ. ૧૧૦ થી ૧૩૧)

બાબાનાં કાર્યો અને તેમનો હેતુ કોઈને સમજાતો નહીં. તેમનાં કાર્યોના પ્રારંભને પણ જાણી શકાતો નહીં. પરંતુ ધીરજ ધરવાથી બાબાનો પ્રેમજ વર્તાવ કલ્પનામાં ન આવે તેવું ફળ આપતો. મેં લોકોને પૂછ્યું કે બાબા આવો વર્તાવ કેમ કરે છે? તેઓ બોલ્યા ‘બાબાએ ધંટી વડે ઘઉં દળ્યા અને તેનો લોટ સીમાડે નાખીને રોગચાળાને આવતો રોક્યો છે. તે ઘઉં નહતા પરંતુ કાલેરાની બિમારીનો સાદ હતો. તેને ધાન્ય સમજુને ધંટી દ્વારા ભરડી-દળી નાખ્યો અને તેને ગામ બહાર સીમાડે વેર્યો.’ આ રીતે લોટ વેરીને રોગને ભગાડ્યો અને ગામના ખરાબ હિવસોનો અંત આણ્યો. બાબાનું આવું ન સમજન્ય તેવું કર્તૃત્વ હતું. સાઈનાથ મહારાજે આવો રૂચકો આપીને શિરડી ગામની મહામુસીબત ટાળી અને ગામને શાંતિ અપ્પી. (ઓ. ૧૩૨ થી ૧૩૬)

હું અહીં મંગલાચરણ સમાપ્ત કરું છું. મેં સંતો તેમજ સગાં સંબંધીઓને નમન કર્યું. તેમજ ગુરુને પણ વંદન કર્યો જે અહીં પૂર્ણ થાય છે. હું હેમાડપંત શ્રી સાઈનાથને શરણે આવ્યો છું. હવે પછીના અધ્યાયમાં ગ્રંથનું પ્રથોજન ગ્રંથકર્તાનો

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

અધિકાર અને વિષય સાથેના સંબંધને મારી બુદ્ધિ પ્રમાણે સમજવવાની કોશિષ કરીશ. શ્રોતાઓ અને સ્વર્ણ ચિત્તે સાંભળો. આ શ્રી સાઈ ચરિત્રને રચનારા હેમાડપંત કે જે શ્રોતા અને વક્તાના કલ્યાણ કાજે ગ્રંથ રચના કરે છે તેમને વિશે પણ આગળ સમજવવામાં આવશે. (ઓ. ૧૪૦ થી ૧૪૨)

સર્વનું કલ્યાણ થાઓ. આ પ્રકારે સંત અને સજજનોની પ્રેરણા પામેલા ભક્ત હેમાડપંત રચિત ‘શ્રી સાઈ સમર્થના સત્ય ચરિત્ર’નો ‘મંગલાચરણ’ નામનો પહેલો અધ્યાય અહીં સમાપ્ત થાય છે.

શ્રી સદ્ગુરુ સાઈનાથને અર્પણ..



અધ્યાય પહેલાનું અર્થ વિવરણ

ઉપરની જણાવેલી ૧૩૨ થી ૧૩૬ ઓવીઓમાં જણાવેલી બાબાની ઘઉં દળવાની વિગત શિરડીના લોકોએ શ્રી હેમાડપંતને કહી. એ અંગેનો એક અધ્યાત્મિક અર્થ શ્રી નાગેશ વાસુદેવ ગુણાજુએ તેમના શ્રી સાઈ ચરિત્રના અંગેઝ ભાષાંતરમાં કર્યો છે. શ્રી સાઈબાબા શિરડીમાં આશરે સાઈઠ વર્ષ સુધી રહ્યાં. આ દીર્ઘકાળ દરમિયાન તેઓ લગભગ ઘણીબાર ધંટીથી ઘઉં દળતા હતા. તેઓ માત્ર ઘઉં જ નહતા દળતા. પરંતુ તે સાથે ભક્તોનાં પાપ, સંતાપ, માનસિક અને શારીરિક દુઃખોને પણ દળતા હતા. ધંટીનાં પદ્ધથરનાં બે પડ કર્મ અને ભક્તિ હતા. નીચેનો પદ્ધથર તે કર્મનું પ્રતિક હતો તો ઉપરનો પદ્ધથર ભક્તિનું પ્રતિક હતો. બાબા જે ધંટીનો ખીલડો પકડીને દળતા હતા તે જ્ઞાનનું પ્રતિક હતો. બાબા જણેકે દઢ વિશ્વાસથી સૂચવતા હતા કે મનુષ્યમાં રહેલી સર્વ આશા અને આકાંક્ષાઓ તેમજ પાપો અને સત્ય, રજ અને તમ એ ત્રણે ગુણો તથા સુક્રમ છતાં છોડવામાં અધરો અહંકાર તે સૌને સત્કર્મ અને ભક્તિનાં બે પડ તથા જ્ઞાનના ખીલડાની ધંટી વડે દળી નાખવામાં આવે નહીં ત્યાં સુધી આત્મ સાક્ષાત્કાર થવો શક્ય નથી.

આ ઉપરથી સંત કબીર જણાવેલી વાત યાદ આવે છે. એક વખત એક બાઈને અનાજ દળતી જેઠિને કબીરજીએ પોતાના ગુરુ નિપત્તિરંજનને કહ્યું ‘આ ધંટીનાં પડ વચ્ચે દળાતા અનાજની જેમ આ સંસાર ચક્કમાં મનુષ્યો પીસાઈ જતાં હોવાથી થતા કષ્ટને અનુભવતાં મને રડવું આવે છે.’ તે સાંભળીને નિપત્તિરંજને કહ્યું ‘તું ગભરાઈશ નહીં. મારા મત પ્રમાણે તું જ્ઞાનના ખીલાને મજબૂતીથી પકડીને બેસ. તેનાથી દૂર ન જતાં મધ્યબિંદુ ઉપર જ મનને સ્થિર કરીને જે બેસીશ તો તું ચોક્કસ બચી જઈશ.’



॥ અધ્યાય ૨ ॥

કથા પ્રયોગન અને નામકરણ

(કથાનો ઉદ્દેશ્ય અને નામકરણ)

શ્રી ગણેશજીને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કુળદેવતાને વંદન,
શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રજીને વંદન અને શ્રી સદ્ગુરુ સાઈનાથ મહારાજને વંદન.

પાછળના અધ્યાયમાં મંગલાચરણ કર્યું તેમજ કુળદેવતા અને સદ્ગુરુને વંદન કર્યું. તે સાથે આ સાઈ ચરિત્રનું બીજારોપણ થયું. હવે તેને લખવાના પ્રયોગનને સવિસ્તર સમજલીને તેને કહેવાનો પ્રારંભ કરીએ. ગ્રંથકર્તાનો અધિકાર શું હોય અને ગ્રંથ વિષેની સ્પષ્ટતા કરીને તે અંગેની થોડી સ્પષ્ટતા કરીએ. જેથી શ્રોતાઓ મુશ્કેલી વિના ગ્રંથનું રસપાન કરી શકે. પહેલા અધ્યાયમાં જેયું કે બાબાએ ઘઉં દળવાનો કીભિયો કરીને કોલેરા જેવા ભયંકર રોગચાળાની બિમારીમાંથી ગામના લોકોને ઉગાર્યા. લોકોને તેનું ખૂબજ આશ્રમ થયું. આમ સાઈબાબાની અગાધ લીલાઓ સાંભળીને મારા મનમાં પ્રેમનાં પૂર ઉભરાવા લાગ્યાં તેજ કાચ્ય રૂપે પ્રગટ થયાં. માટે જ સાઈબાબાનું સ્તુતિ દ્વારા યથાશક્તિ વર્ણન કરવું જેથી તે બક્તો માટે ઉપદેશકારક અને પાપનાશક બને. તે માટે જ સાઈબાબાનું આ અતિપવિત્ર ચરિત્રનું લેખનકાર્ય હાથમાં લીધું. આ ચરિત્ર આ લોક અને પરલોકમાં સુખ આપનારા આ કથા સત્ત્રનો મેં પ્રારંભ કર્યો. સંતચરિત્રો એ કોઈ ન્યાયશાસ્કે, તર્કશાસ્કે કે અનુમાન અથવા યુક્તિવાદ પ્રમાણે લખાયેલાં હોતાં નથી. એતો સન્માર્ગ દર્શાવનારાં જીવંત ચરિત્રો છે. જેને સંતકૃપા પ્રાપ્ત થાય છે તેને માટે કશુંયે આશ્રમયકારક કે વિચિત્ર નથી હોતું. શ્રોતાગણોને મારી પ્રાર્થના છે કે તમે પણ આ આનંદના સહભાગી બનીને સત્તસંગ તથા સત્કથાનું શ્રવણ કરો અને સહાય મળ્યા બનો. જે આ પ્રમાણે મસ્ત રહે છે તે ધન્ય અને ભાગ્યશાળી જીવ છે. (ઓ. ૧ થી ૮)

જેની સાથે લાંબા સમયની ઓળખાણ અને પરિચય હોય તથા રાતદિવસનો સહવાસ હોય એવા સ્નેહિત્જનોનું રેખાચિત્ર કે શાખદિચિત્ર શાખદો દ્વારા રણ્ણ કરવું તે અશક્ય છે. તો પછી સંત ચરિત્ર વિષે હું શું લખું? જ્યાં મારું પોતાનું અંતરમન પૂર્ણપણે મને જાણી શકતું નથી ત્યાં હું સંત મનના થોડા પણ વિચારોને કેવી રીતે વર્ણવી શકું? આત્માનું નિશ્ચિત સ્વરૂપ દર્શાવવા માટે ચારે વેદો પણ થાકી ગયા. તો હે બાબા તમારું ખરું સ્વરૂપ નિશ્ચિત પણે મારા જેવા પામર માણસને કેવી રીતે સમજય? પોતે પહેલાં સંત થાય તે પછીથી જ સંતને જાણવાનો પ્રયાસ કરવો જોઈએ. ઉપરોક્ત નિયમનું પાલન કરવા જતાં હું એક સંતનું ચરિત્ર રે વર્ણન કેવી રીતે કરી શકું? આ વાતની મને પહેલેથી જ જાણ છે. સાતે સમુદ્રમાં સંઘરાયેલા પાણીનું માપ કદાચ કાઢી શકાય અને આકાશને ચાદર ઓઠાડીને ઢાકવાનું પણ કદાચ શકાય બને, પરંતુ સંતોની બુદ્ધિનું અગાધ અને અમર્યાદિત ઉડાણ કયારેય સમજતું નથી. હું તો એક નક્કામો ક્ષુદ્ર અને પામર માણસ છું. એની મને ખબર છે. તેમ છતાં શ્રી બાબાનો અમર્યાદ પ્રતાપ નિરખીને તેમનું ગાન કરવાની મને મનમાં એક લહેર ઉંડે છે. તેને હું રોકી શકતો નથી. હે સાઈ રાચા! તું દીન દુખીયાનો વિસામો છે. હે સાઈ! તારો જ્ય જ્યકાર હો તારી માયા અગાધ અને અપરંપાર છે જેનું વર્ણન

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

કરવું અશક્ય છે. તું તારા આ દાસ ઉપર કૃપા કર. તારો ઈતિહાસ કે ચરિત્ર લખવાનું હું સાહસ તો કરું છું. પણ નાના મોઢે મોટી વાતો જેવું તો નહીં થાય ને ? હે સાઈનાથ ! મારી ફજેતી ન થવા દઈશ. તું મારી લાજ રાખજે. શાનેશ્વર મહારાજે કહ્યું છે કે જે જે લોકોએ સંતોનાં ચરિત્રો લખ્યાં છે એમની ઉપર ઈશ્વરીય કૃપા ઉત્તરતી હોય છે. જે એમજ હોય તો પછી હું શા માટે ડર રાખ્યું ? ભલે હું જહબુદ્ધિનો હોઉં તેમ છઠાં ઈશ્વરે મારા મનમાં સ્કૂર્તિ પ્રગટાવી છે. તેથી મારું આ કાર્ય સિદ્ધ કરવાની જવાબદારી પણ ઈશ્વરની જ છે. ભક્તો જે પ્રકારની સેવા કરવાનું નક્કી કરે છે તે બધીજ સેવાઓ તો સંતો તેમની પાસેથી કરાવી લેતા હોય છે. માટે મારામાં પ્રગટેલી સ્કૂર્તિ તે સંતોની કૃપા છે. ભક્તો તો નિમિત્ત માત્ર હોય છે. ટૂંકમાં કહું તો સાઈબાબા પોતેજ પોતાનું ચરિત્ર મારા મુખ દ્વારા બોલાવી રહ્યા છે. તેથી આ કથાની મહત્તમા અને મહિમા આદર અને ગૌરવપૂર્વક લેવા જેવી બાબાત છે. (ઓ. ૮ થી ૨૦)

સાધુ સંતો અને શ્રી હરિ કોઈનો પણ હાથ પકડીને અને પોતાનો વરદાહસ્ત તેના મસ્તક ઉપર મૂકીને પોતાનું ચરિત્ર લખાવી લેતા હોય છે. સને ૧૭૦૦- ઈ.સ. ૧૭૭૮ની સાલમાં મહિપતિની બુદ્ધિમાં સ્કૂર્તાણ થઈ. બાબાએ એમની પાસેથી સાધુ સંતોનાં ચરિત્ર લખાવીને સેવા કરાવી. તેજ રીતે સને ૧૮૦૦- ઈ.સ. ૧૮૭૮ની સાલમાં દાસગણુ દ્વારા અગાઉના સંતોનાં ચરિત્રો લખાવી લઈને સૌને પાવન કર્યા. મહિપતિએ ભક્ત વિજ્ય, સંત વિજ્ય, ભક્ત લીલામૃત અને સંત કથામૃત આ ચાર ગ્રંથોની રચના કરી. તેજ રીતે બાબાશ્રીએ દાસગણુને હસ્તે ભક્ત લીલામૃત અને સંત કથામૃત નામના બે ગ્રંથોનું નિર્માણ કરાવ્યું. તેમાંના ભક્ત લીલામૃતના એકત્રીસ, બત્રીસ અને તેત્રીસ એમ ત્રણ અધ્યાયોમાં શ્રી સાઈનાથ મહારાજનું સુમધુર વર્ણન કર્યું છે. તેજ રીતે સંત કથામૃતના સત્તાવનમાં અધ્યાયમાં શ્રી સાઈમહારાજે પોતાના એક ભક્ત કે. નાનાસાહેબ ચાંદોલકરને મધુરો જ્ઞાનોપહેશ કર્યો છે તે વાંચવો જેઠાએ. આ સિવાય ‘રધુનાથ સાવિત્રી ભજન માળા’ નામના પુસ્તકના ઓગણત્રીસમાં અધ્યાયમાં વર્ણિતેલા સાઈ ચરિત્રને સ્વ. શ્રી રધુનાથ રાવ તથા શ્રીમતી સાવિત્રી તેંડુલકરે પોતાના સ્વાનુભવથી સાઈલીલાનું ગાન કર્યું છે. તેનું મધુરું શ્રવણ કરીને અનેક ભક્તોને ખૂબજ શાંતિ પ્રાપ્ત થઈ છે. એજ પુસ્તકમાં બાબાના એક ભક્ત શ્રી કાકાસાહેબ દિક્ષિતે પ્રસ્તાવના લખી છે. તે પ્રસ્તાવના જાણો કે કોઈ તરસ્યા ચાતક પક્ષ માટે અમૃતવર્ષા વરસાવી હોય તેવી છે. તે પણ ભક્તોએ આદરપૂર્વક વાંચવા યોગ્ય છે. તે રીતે દાસગણુ મહારાજે છૂટી છિવાઈ નાની કવિતાઓ દ્વારા બાબાની લીલાઓને અત્યંત મનોરંજક રીતે વર્ણાવી છે. તેનું વાંચન કરીને વાંચકોએ લાભ લેવા જેવો છે. ગુજરાતી સાઈભક્ત અમીદાસ ભવાની મહેતાએ પણ બાબાની અનોખી ચમત્કારિક ઘટનાઓ લખી છે. તે સિવાય અન્ય શ્રેષ્ઠ શિરોમણી ભક્તોએ પૂનાથી બાબાની ‘સાઈ પ્રભા’ નામની સંગ્રહ શ્રેણી પ્રસિદ્ધ કરી છે. આવા પ્રસિદ્ધ પામેલા ગ્રંથો દ્વારા હોવા છિતાં મારા આ ગ્રંથની તે કદ્ય જરૂરિયાત છે ? આવી અનેક શંકાઓ જે વાંચકો અને શ્રોતાઓમાં છે તે સૌ દૂર કરી રહ્યો છું. ‘સાઈ ચરિત્ર’ એ અનેક રત્નોની ખાણો ભરેલો અગાધ સાગર છે. ટીટોડી જેવો હું એ સાગરને કેવી રીતે ખાલી કરી શકું ? આમ તો શ્રી સાઈના ગૂઢ અને ગહન ચરિત્રને સંપૂર્ણ પણે કહેવું કે વર્ણવિનું શક્ય જ નથી. તેથી જેટલું શક્ય હશે તેટલું કથન કરીને સંતોષ માનીશ. (ઓ. ૨૧ થી ૩૪)

સાઈબાબાની કથા અપાર અને અપૂર્વ છે. તે સંસારમાં દુઃખોથી પીડાતા લોકો માટે સાંત્વન અપનારી છે અને શ્રવણ કરતાં આનંદદાયક છે. સાઈભક્તોને તે અંત:કરણની સ્થિરતા બક્ષે છે. બાબાએ વ્યવહારને લગતા ઉપદેશોમાં અનેક પ્રકારની કથાઓ કહી છે. બાબાએ કહેતી આ કથાઓ દ્વારા ભક્તોએ અનુભેલી મુશ્કેલીઓ અને ગુંચવણોનો ઉકલ મળી આવે છે. ઈશ્વર પ્રણીત પ્રભ્યાત વેદાંતની કથાઓ અને આખ્યાનો મશહૂર છે તે રીતે જ બાબાએ અસંખ્ય અર્થપૂર્ણ અને

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

રસાળ કથાઓ કહી છે. તેમણે કહેતી કથાઓ જે સાવધાની પૂર્વક સાંભળશો તો અન્ય વસ્તુઓ તુચ્છ લાગશે અને તેમની રસિક કથાઓ સાંભળતાં સાંભળતાં ભુખ અને તરસ સહજતાથી ચાલ્યા જશે. તેથી મનને શાંતિ અને સમાધાન પ્રાપ્ત થશે. જે કોઈ જીજાસુ બ્રહ્મ સાથે એકરૂપ થવા ઈરછશે કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન સમાધિ સભર અષ્ટાંગ યોગ સિદ્ધ કરીને સમાધિનો આનંદ પ્રાપ્ત કરવો હોય તો આ કથાઓ દ્વારા માર્ગદર્શન મળશે. આ કથાઓ કોઈ પણ પ્રકારના બેદભાવ વિના સહૃદ્ભૂતાઓના કર્મબંધન તોડી નાખશે. તથા ભક્તોની બુદ્ધિનો ઉત્કૃષ્ટ વિકાસ કરીને તેમને સર્વ સુખો પ્રાપ્ત કરાવશે. ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને મને એવી ઈરછા થઈ કે આ સહૃદ્ભૂતાઓની વ્યવસ્થિત ગોઠવણી કરીને તેની કથાનક માળા ગુંથવી જેઠાં એ. ભક્તોના કાન ઉપર આજ ઉપાસના સારા એમ ચાર શબ્દો પડશે તો જીવમાત્રના ખરાબ દિવસોનો અંત આવશે. જે જીવો આદર અને શ્રદ્ધા પૂર્વક સમગ્ર કથા વાંચશે તો આવા ભાવાર્થી ભક્તો સંસાર સાગરને સહેલાઈથી તરી જશે. બાબા મને તેમની કલમ બનાવીને મારા દ્વારા લખાવી રહ્યા છે. હું તો કેવળ નિમિત્તનો ધનિક છું. બાબા જેમ લખાવશે તેવા જ અક્ષરોના વળાંક વાળતો જઈશ. વર્ષો સુધી બાબાની લીલાઓ જેઠાં મનને એવી લગન લાગી કે ભોગા અને પ્રેમાળ ભક્તો માટે બાબાની વાતો સંગ્રહિત કરવી. બાબાનું પ્રત્યક્ષ દર્શન કરીને જેમનાં ચક્ષુઓને સંતોષ થયો નથી એવા ભક્તજનો જે બાબાનું મહાત્મ્ય શ્રવણ - પદન કરે તો તેમ કરાવીને મારે પૂર્ણ મેળવવું એમ મેં વિચાર્યું. જે કોઈ ભાગ્યશાળી જનને તેના મનથી કથા વાંચવાની ઈરછા થાય તો વાંચ્યા પછી તેને પરમાનંદ અને સંતોષ મળે એવા ભાવો મારા મનમાં ઉઠ્યા. એ ભાવોને મેં માધ્યવરાવ દેશપાંડે શ્યામાની સામે પ્રગટ કર્યા. મને મનમાં તો શંકા હતી કે મારાથી આ ગ્રંથ કેવી રીતે લખાશે? મારી ઉંમરનાં સાઈઠ વર્ષ તો પૂરાં થઈ ગયાં છે. તેથી મારી દુષ્ટ બુદ્ધિ અને કવિધ હક્કતો ઊભી કરી રહી છે. અશક્તિને કારણે પ્રયત્ન કરવાનું બાજુ ઉપર રહી જય છે. મોઢેથી ફકત બદ્ભડાટ જ સીલ્લકમાં રહ્યો છે. એ બદ્ભડાટ પણ વ્યર્થ ન જય તે માટે શ્રી સાઈનાથ મહારાજના કામે લગાડવો જેથી થોડો ઘણો તો પરમાર્થ સધાય એ માટે આ પ્રયત્નો કર્યા છે. (ઓ. ૩૫ થી ૫૦)

રાત-દિવસ શ્રી સાઈકથાનો અનુભવ કરતાં સમજયું કે એમનું વૃત્તાંત લખવું જેથી માનસિક વિશ્રાંતિ મળે. સ્વાનુભવ આધારીત બાબાએ કહેતાં સહજ સ્વાભાવિક વચનો શ્રોતાઓ માટે રજૂ કરું છું. બાબાએ જન સમુદ્દ્રાય માટે ઘણી બધી જ્ઞાન પૂર્ણ વાતો કરી અને અનેક જનોને ભજન દ્વારા આગળ વધવાનો માર્ગ બતાવ્યો. તેનો પૂરો સંગ્રહ કરવાથી બાબાની ગાથા તૈયાર થશે. જે કોઈ તેમની આ ગાથાઓ સાંભળશે અથવા ગાશે તેને મનની વિશ્રાંતિ મળશે. શ્રી સાઈ મહારાજની કથાનું શ્રવણ કરનારા ભક્તો દેહવ્યથા ભૂતીને તેમજ તેનું મનન કરવાથી સંસાર સાગર તરી જઈને મુક્તિ પામશે. શ્રી સાઈના મુખથી કહેવાયેતી આ વાતો અમૃત સ્વરૂપ છે. એની મીઠાશાનું હું કેવી રીતે વર્ણાનું કરું? તે સાંભળવાથી પરમાનંદ પ્રાપ્ત થશે. આ કથાઓ વિદ્રોહ અને ધાર્મિકતાનો આંદર રાખ્યા સિવાય ગાવામાં આવે અને બાબાશ્રીની ચરણરજ્ઝમાં આળોટવાનું મન થાય તો મોક્ષ મળશે એવું મારું માનવું છે. વાર્તા સાંભળવા માટે જેમ કાન તલ્લીન થાય અને દર્શન કરવા માટે આંખો ઉત્સુક બને તેમ જે મન તૈયાર થાય તો સહજ ધ્યાન થશે. ગુરુમાવતી આપણી જનની છે. એમની વાતો એક મુખથી બીજે મુખ કહેવાય છે તેનો આદરપૂર્વક કાનમાં સંગ્રહ કરી રાખજે. તેને સતત વાગોચ્ચા કરજે. આ વાતો જેટલી સંધરી શકાય તેટલી સંધરને. તેમને પ્રેમ બંધનથી બાંધી રાખજે અને એક બીજાને સંભળાવીને અરસપરસ લૂંટાવી દેને. (ઓ. ૫૧ થી ૬૧)

આ લેખનમાં મારુ કશુજ નથી. શ્રી સાઈનાથની પ્રેરણાથી તે બોલાયે તેમ હું બોલું છું. ‘હું બોલું છું’ એમ કહેવું તે પણ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

મારો અહંકાર છે. વાસ્તવમાં તો સાઈબાબા જ આ કથા લેખનના સૂત્રધાર છે. મારી વાણીને વહેતી રાખનાર બાબા જ તેના પ્રણેતા છે. માટે 'હું બોતનાર' છું જ નહીં. મારું 'હું' પણું અને અહંકાર બાબાના શ્રી ચરણોમાં અર્પણ કરું છું. તેનાથી મને સુખ પ્રાપ્ત થશે. અહંકારને છોડ્યા પછીથી સમગ્ર સંસાર સુખોથી છલકાઈ જશે. (ઓ. ૬૨ થી ૬૪)

આ પ્રકારની વૃત્તિ તો જન્મી પણ બાબાને પૂછવા માટે યોગ્ય અવસર મળે તેની રહ જેતો હતો. તે સાથે બાબાને પૂછવાની હિંમત ચાલતી ન હતી. એવામાં માધવરાવ-શ્યામા મને મસ્તિજ્જદના પગથિયા પાસે મળ્યા. મેં આ વાત તેમને કહી. મસ્તિજ્જદમાં બીજું કોઈ ન હોવાથી લાગ જેઠિને તેમણે પૂછ્યું, 'બાબા ! આણણાસાહેબ - કે. દાભોળકરણ ને આપનું ચરિત્ર લખવાની ઈચ્છા થઈ છે. જે આપની અનુમતિ હોય તો તે આપનું ચરિત્ર લખે.' તે સાંભળીને બાબા બોલ્યા, 'હું તો કેવળ બીજારી છું. હું તો બિક્ષા માટે ઘેર ઘેર ફરું છું અને જે લુખી સુકી બીક્ષા મળે તે ખાઉ છું. એ રીતે સમય પસાર કરું છું. એવા માણસનું ચરિત્ર શું લખવાનું હોય ? ઉલદુ હું મારું આવું ચરિત્ર લખાશે તો હું મન્જકનું સાધન બની જઈશ.' તે સાંભળીને હું મનોમન બોલ્યો, 'બાબા ! તમે આ ન બોલો. સુવર્ણમાં હીરો કે કોઈ રત્ન જીવા માટે તેનું ઘર બનાવાય તો તેમાં રત્ન જડવું પડે છે. તેમ કરવાથી રત્નનું તેજ આંખોમાં ચમકે છે. જે આપ અનુમતિ આપીને લેખનની આજા કરશો તો આપની મદદ વડે સહજતા પૂર્વક લખી શકીશા. બધાં વિધનો નિવારીને તમે જ મારી પાસે લખાવી લો. સંતોનાં આશીવચનોથી ગ્રંથની રચના કરાતી હોય છે. માટે આપની કૃપા દાખલ હોય છું. તે વિના નિવિધને લખાણ પૂરું કરવું શક્ય નથી.' (ઓ. ૬૫ થી ૭૧)

મારા મનોભાવો જાણીને શ્રી સાઈનાથના હૃદયમાં મારે માટે કૃપા જન્મી અને બોલ્યા, 'તારો મનોરથ પૂર્ણ થશે.' મેં તરત જ તેમનાં ચરણોમાં માથું મૂકી દીધું. બાબાએ મને ઉદ્દીપો પ્રસાહ આપ્યો અને મારા મસ્તક પર તેમણે તેમનો વરદ હસ્ત મૂકીને આશીર્વાદ આપ્યા. શ્રી સાઈબાબા 'સકળ ધર્મ વિશારદ' હોવાથી તેમને બધાજ ધર્મનું જ્ઞાન હતુ. શ્રી સાઈનાથ ભક્તોને સંસારના મોહ્યપાશમાંથી મુક્ત હોવાથી માધવરાવની પ્રાર્થના સાંભળીને તેમને મારી દ્વારા આવી. તેમણે મારા અધીરા મનને શાંત કરીને મને ધૈર્ય આપ્યું. બાબાએ મારા મનોભાવો જાણી લીધા હોવાથી તે સંમતિ સૂચક વાણી બોલવા લાગ્યા, 'મારી કથા વાતાંઓ તથા અનુભવોનો સાચો સંગ્રહ કરી અને તેની નોંધ કરીને તેની વ્યવસ્થિત ગોઠવણી કરો. તેમ કરવામાં તેને મારી પૂર્ણ સહાય છે. એ તો ફક્ત નિમિત્ત જ છે. હું જ મારું ચરિત્ર તેના દ્વારા લખ્યું છું. આમ તેના દ્વારા મારું ચરિત્ર લખાવીને તેની ઈચ્છા પૂર્ણ કરું છું. તેથી દાભોળકરે પોતાનો અહંકાર, મારાં ચરણોમાં અર્પણ કરવો અને પોતે લખ્યાની ઈચ્છા છોડી દેવી. જે કોઈ વ્યવહારમાં આવું વર્તન રાખે છે તેમને મારી પૂર્ણ સહાય હોય છે. તેની ઈચ્છા હોવાથી આ કથા તો લખાવું જ છું પરંતુ તેના ધરની સધળી પીડાઓનો નાશ કરું છું. જ્યારે તેનો અહંકાર મરી જય છે અને તે અહંકાર શૂન્ય થઈ જય ત્યારે તેના અહંકારમાં હું પ્રવેશ કરું છું અને હું જ લખ્યું છું. અહંકાર શૂન્ય બુદ્ધિથી સાંભળેલું, તેનું મનન કરેલું અને તેણે શરૂ કરેલા લેખન કાર્ય દ્વારા મારું કામ પૂરું કરાવું છું. આ કાર્ય માટે દાભોળકર કેવળ નિમિત્ત બનશે. તમારા નિત્યકમની ગોઠવણી વ્યવસ્થિત રાખજો. ધરમાં કે બહાર અથવા તમે ગમે ત્યાં હો પરંતુ તમે મને યાદ કરજો. તેનાથી તમને શાંતિ મળશે. મારી કથા પોતે સાંભળનાર અને બીજાને સંભળાવનાર તેમજ ચિંતન કરવામાં ભક્તિનો ઉદ્ય થશે. ત્યારે દુબુદ્ધિનો સત્ત્વરે નાશ થશે. જેની ભક્તિ શ્રદ્ધા યુક્ત હોય છે તેનો હું ગુલામ થઈ જાઉ છું. બાકીના મનુષ્યોને હું કઢી મળતો નથી. એ વિષે કોઈએ શંકા રાખવી નહીં. શ્રોતાઓ જે ખરી શ્રદ્ધાથી કથા સાંભળશે તો તેનામાં સાચી શ્રદ્ધા જન્મશે અને એવા ભક્તોને આત્મ સ્વરૂપનું જ્ઞાન થશે. તેથી જીવ અને શિવના ઐક્યનો સંતોષ પ્રાપ્ત થશે. તે સાથે પરમેશ્વરના

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

નિગુણ્ણ સ્વરૂપમાં મગ્ન થવાશે અને અખૂટ ચૈતન્યની અનુભૂતિ થશે. મારી કથામાં એવું કૌશલ્ય છે. મનુષ્યને આનાથી વધુ શું જોઈએ ? શ્રુતિ-વેદોનું આજ ધેય છે. ભક્ત તે ધેયથી સંપૂર્ણ અને સંપત્તન થશે.' (ઓ. ૭૨ થી ૮૬)

જે લોકો વાદ વિવાદમાં સતત પ્રવૃત્ત હોય છે. તેમનામાં અજ્ઞાન અને માયા સદાય વાસ કરતાં હોય છે. એ લોકોમાં પોતાની સમજદારી હોતી નથી. તેમની બુદ્ધિ સતત તર્ક કરનારી અને દુષ્ટ ભાવનાવાળી હોય છે. તેઓ કંઈ આત્મજ્ઞાન પ્રાપ્ત કરેલા હોતા નથી. આવા જનોને પૃથ્વી કે સ્વર્ગમાં સુખ મળતું નથી. તેમને સર્વ સ્થાનોમાંથી ફક્ત દુઃખ જ પ્રાપ્ત થાય છે. સુજા જને પોતાના મુદ્દાઓ સિદ્ધ કરવાનો બાલીશ પ્રયાસ કરવો નહીં અને અન્યના મુદ્દાઓમાંથી ભૂલો કાઢ્યા કરવાની ભૂલ કરવી નહીં. કોઈપણ મુદ્દે ઝીણવટ બર્યુ વિવરણ કર્યા કરવું નહીં. આવું કષ કેટલું બધું વ્યર્થ અને નિરથ્ક છે ? (ઓ. ૮૭ થી ૮૮)

'બંને પણે કોઈપણ મુદ્દે સવિસ્તાર ચર્ચા કરો નહીં.' બાબાના આ શબ્દો સાંભળીને એ વાત યાદ આવી ગઈ કે અગાઉ મેં શ્રોતાઓને વચ્ચન આપેલું કે બાબાએ મારું નામ 'હેમાડપંત' કેમ રાખ્યું તે અંગેની કથા હું સર્વ પ્રથમ જણાવીશ. મુખ્ય કથાની વચ્ચે આવેલી આ આડ કથા સાંભળવાથી શ્રોતાઓને તેની યોગ્યતા કે અયોગ્યતાની ખબર પડ્યો. તેનાથી વાચકોની જ્ઞાસાની પૂર્તિ પણ થશે. ખરેખર જેતાં જણાશે કે આ પણ સાઈબાબાની જ પ્રેરણા છે. હવે પછી અગાઉના અનુસંધાનમાં 'સાઈ ચરિત્ર' કહેવામાં આવશે. હવેથી 'સાઈ સચરિત્ર - સાઈલીલા' ગ્રંથના દેરેક અધ્યાયને અંતે 'ભક્ત હેમાડપંતે રચેલ' તેમાં 'પંત' એટલે કોણ એવી શંકા શ્રોતાગણોમાં થાય તેની પૂર્તિ માટે નામકરણ કેવી રીતે કરવામાં આવ્યું તે વિષે આદર સહિત સાંભળશો. હિંદુ ધર્મમાં જન્મથી મૃત્યુ સુધીના સમયગાળામાં કરાતા સોણ સંસ્કરો જેમ કે ગર્ભાધાન, શ્રીમંત તે પછી નામકરણ - બાળકનું નામ પાડવું તે ઉપનયન, વિવાહ અને શ્રાદ્ધ વગેરે જણાવ્યા છે. તેમાંનો એક વિદી તે નામકરણ છે જેની સૌને ખબર છે. હવે પછી 'હેમાડપંત નામકરણ'ની કથા કહેવાશે તે સૌ ધ્યાન પૂર્વક સાંભળશો. (ઓ. ૬૦ થી ૮૭)

આ લેખકની પહેલેથી જ આદત છે કે તે સ્વભાવે મજલીયો છે. તેવા સ્વભાવ સાથે તે વ્યર્થ બહબદાટ કરનારો, અન્યની મશકરી કરનારો તેમજ નીંઠા કરનારો પણ છે. તેનામાં જ્ઞાનનો સંપૂર્ણ અભાવ છે અને તેને સ્પર્શ અને ગંધની સમજણ નથી. આવી વ્યક્તિને સદ્ગુરુના મહિમાની તો કયાંથી ખબર હોય ? એ તો સાક્ષાત કુક્મી અને કુબુદ્ધિની પ્રતિમા સમાન છે. તે હમેશાં પોતાની જ મોટાઈમાં રાચે છે અને પૃથ્વી હાપણ ઇહોળે છે. આ પ્રકારે તે પાકો અહંકારી અને વાદ વિવાદમાં નિપુણ છે. તેની વાદ વિવાદની રેખા જાણે બળવાન હતી. તેવા પુરુષની દષ્ટિ શ્રી સાઈબાબાનાં ચરણોમાં પડી. (ઓ. ૮૮ થી ૧૦૦)

પ્રખર ભક્ત શિરોમણી શ્રી કાકાસાહેબ દિક્ષિત અને નાનાસાહેબ ચાંદોરકર જેઠે ઝાણાનુંધને કારણે જેડાવાના યોગ ન હોત તો આ લેખક શિરડી કેવી રીતે જઈ શકત ? કાકાસાહેબના અતી આગ્રહને કારણે મેં શિરડી જવાનું નક્કી કર્યું. પરંતુ મારા મિત્રને ત્યાં એક દુઃખ ઘટના બની તેથી મેં જવાનું માંડી વાળ્યું. મારા એક મિત્ર શુદ્ધ હવા પાણી મળે તે માટે લોનાવાલામાં રહેતા હતા. તેમને પોતાના ગુરુનો ઉપદેશ પ્રાપ્ત થયો હતો. એક હિવસ તેમનો એકનો એક પુત્ર તાવના પંજલમાં સપહાઈ ગયો. તેમણે ડૉક્ટર અને વૈદ્યની દવાઓ કરાવી. હુબતો તરણાને પકડે તેમ દોરા-ધાગા તેમજ મંત્ર, તંત્ર કરી છૂટ્યા. છેવટે તેમણે પોતાના ગુરુને બોલાવ્યા અને પુત્ર સમીપે બેસાડ્યા. પરંતુ તેનો કાંઈ અર્થ સર્યો નહીં. હિવસે મૃત્યની છાયા ફેલાતી ગઈ. અંતે તેનું મૃત્યુ થયું. આ આધાતજનક વાત સાંભળીને મને મનમાં એવો વિચાર

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

આવ્યો કે ગુરુનો રું આજ ઉપયોગ છે ? જે ગુરુ મારા ભિત્રનો એક પુત્ર બચાવી શક્યા નહીં તો હવે ગુરુ પાછળ શા માટે બટકવાનું ? જે દરેકે તેમનાં કર્મબંધન પ્રમાણે ફળ ભોગવવાનાં હોય તો ગુરુ હોય કે ન હોય તેથી કોઈ ફરક પડતો નથી. જે તે કર્મફળ બદલી શકતા નથી અને જે લલાટે લખાયું છે તે ભોગવવાનું હોય તો ગુરુ વિના કશુય અટકતું નથી. માટે ગુરુની પાછળ દોડીને સુખી જીવનમાં આગ લગાડવાની જરૂર નથી. એવું વિચારીને શિરડી જવાનું ટાળ્યું. આવી ડામાડોળ પરિસ્થિતિમાં પણ મારુ-પુણ્યબળ મને શિરડી ખેંચી લાવ્યું. વાત એમ બની હતી કે નાનાસાહેબ પ્રાંત અધિકારી હોવાથી વસાઈના પ્રવાસે ફેરી માટે નીકળ્યા હતા. ત્યાં જવા માટે તે થાણાની દાદર આવીને થોડા સમય માટે રોકાયા હતા. કારણ કે ત્યાંથી વસાઈ જવા માટેની ગાડીને આવવાની એક કલાકની વાર હતી. તેથી જે વચ્ચેનો સમય મખ્યો તેનો સદ્ગ્રાહ્યોગ કરવાનું તેમણે વિચાર્યું. એટલામાં તો દાદર સ્ટેશને ફક્ત વાંદરા સુધીની જ ગાડી આવી તેથી નાનાસાહેબ તેમાં બેસી ગયા. વાંદરામાં પોતાના રહેઠાણે પહોંચ્યા પછી તેમણે મને સંદેશો મોકલ્યો. હું તેમને મખ્યોડે તેમણે મને પૂછ્યું ‘સાઈબાબાનાં દર્શન માટે શિરડી જવા માટે કયારે જાઓ છો ? જવામાં આટલી બધી આળસ શા માટે કરો છો ? સમય લંબાવીને શા માટે આઠલું બધું મોહું કરો છો ? તમે મનથી કોઈ તારીખ નક્કી કરો અને ત્યાં પહોંચ્યી જલ. તમે રાહ શાની જેયા કરો છો ?’ આતુરતાપૂર્વક કહેતા નાનાસાહેબની આ વાતથી મને શરમ લાગી. તેમ છતાં મેં મારા મનમાં જે ગાહભાગ ચાલતી હતી તે તેમને કહી દીધી. તેમની સાથે જે વાર્તાલાપ થયો તેથી તેમની આસ્થા તથા પ્રેમાણ અને શુદ્ધ બોધવાળીથી પ્રભાવિત થઈને મારા મનમાં શિરડી જવાની તીવ્ર ઈચ્છા જાગૃત થઈ. હું તરત જ જવા માટે નીકળું છું એવું મારી પાસેથી વચ્ચેન લઈને નાનાસાહેબે પ્રયાણ કર્યું અને મેં પણ તરત જ શિરડી જવાનું મનોમન નક્કી કર્યું. (ઓ. ૧૦૧ થી ૧૨૨)

અમે જરૂરી સામાન લીધો તેમજ બીજી ગોઠવણ કરીને તેજ દિવસે સાંજે શિરડી જવા માટે પ્રસ્થાન કર્યું. મનમાદ તરફ જતો મેલ દાદર સ્ટેશને ઉભો રહે છે તેવું સમજીને અમે દાદરની ટિકિટ લીધી. આમ શરૂઆતથી જ ગરબ્દ થઈ ગઈ. પહેલા કોળીયામાં જ માખી આવે તેવું થયું. ગાડી ઉપડવાનો સમય થઈ ગયો હતો તે સમયે એક મુસલમાન સદ્ગુહસ્થએ ગાડીના ડબ્બામાં પ્રવેશ કર્યો. તેમણે અમારા સરસામાન ઉપર નજર ફેરવીને પૂછ્યું, ‘તમે કયાં જવ છો ?’ મેં કહ્યું ‘દાદર ઉત્તરીને મનમાદ મેલમાં જવું છે. તે સદ્ગુહસ્થે દાદર સ્ટેશને ન ઉત્તરતાં બોરીબંદર વી.દી. સ્ટેશને જવાનું કહ્યું. તેમણે એમ પણ જણાયું કે દાદર સ્ટેશને મેલ ઉભો રહેતો નથી. જે સમયસર સૂચના ન મળી હોત તો દાદર સ્ટેશનથી મેલ મળત નહીં.’ મારા અસ્થિર અને ચંચળ મનમાં અનેક પ્રશ્નો અને કલ્પના હતાં. પરંતુ તે દિવસે જ શિરડી જવાનો પ્રવાસ યોગ અને ચોક્કસ મુહૂર્ત હશે તેથી ઉપરોક્ત પ્રસંગ બન્યો. (ઓ. ૧૨૩ થી ૧૩૦)

શિરડીમાં ભાઉસાહેબ, કાકાસાહેબ દિક્ષિત અમારી રાહ જેતા હતા. બીજે દિવસે સવારે નવ થી દસ વચ્ચે શિરડીમાં પહોંચ્યા. આ ઘટના ઈ.સ. ૧૯૧૦માં ઘટી હતી. તે સમયે ઉતારુંઓને રહેવા માટે ફક્ત સાડેનો વાડો જ હતો. કે. રાવબહાદુર સાઠે તેના માલિક હતા. અમે જેવા ઘોડાગાડીમાંથી નીચે ઉત્તર્યાંકે તરત જ મને બાબાનાં દર્શન કરવાની ઉત્કૃષ્ટ ઈચ્છા થઈ આવી. એમ થયું કે હું કયારે તેમનાં ચરણકમળમાં મારુ મસ્તક મૂકીને નમર્સકાર કરું. મારા હૃદયમાં આનંદની લહેરો ઉઠવા માંડી. એ સમયે શ્રી સાઈના પરમ ભક્ત નુલકર મસ્નિજદમાંથી બહાર આવ્યા. આ નુલકર એટલે કે. લક્ષ્મણ કૃપણાલ નુલકર. તેઓ પંદરપુરમાં સબ જજ હતા. તેઓ પણ નાનાસાહેબ ચાંદોરકરને કારણે ઈ.સ. ૧૯૦૮ની આસપાસ બાબાના સાનિધ્યમાં રહેવા માટે શિરડીમાં કાયમી વસવાટ માટે આવ્યા હતા. બાબાની પરમકૃપાથી તેમને અનેક દૈવી અનુભવો થયા હતા. ૧૯૧૧ની શરૂઆતમાં તેમની જીવનલીલા સંકેતાઈ જવાની હતી. અંતકાળે તેમણે બાબાના ચરણોનું તીર્થ - ચરણોદક -

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

ગ્રહણ કર્યું અને શ્રી સાઈમાં ધ્યાન પરોવ્યું. આવી ધ્યાનસ્થ સ્થિતિમાં લીન થઈને તેમણે પ્રાણ છોડ્યા. એ નુલકરે માસ્ટિજફામાંથી બહાર આવીને એમણે અમને જ્ઞાનાં કરવા માટે હમણાં જ જવ. બાબા ભક્ત મંડળી સાથે આવ્યા છે અને વાડાના ખૂણા પાસે ઉભા છે. તે સાંભળીને અમને પ્રવાસનો થાક લાગ્યો હોવા છતાં અને ધૂળવાળાં કપડાં હોવા છતાં હથ પગ ઘોયા વિના અમે 'ચાલો' કહીને બાબા જ્યાં ઉભા હતા ત્યાં જઈ પહોંચ્યા. અમે બાબાને સાણંગ પ્રણામ કર્યા. મારા હૈયામાં આનંદ સમાતો ન હતો. શ્રી સાઈનાં પ્રત્યક્ષ દર્શન થતાં એમ લાગ્યું કે નાનાસાહેબ ચાંદોરકરે તેમને વિષે જે કંઈ કહ્યું હતું તેના કરતાં પ્રત્યક્ષ દર્શનમાં કંઈક વિરોષ અનુભવાતું હતું. મારી આંખોએ જાણે દર્શન કર્યાથી પારણાં કર્યા, તેથી મેં ઘન્યતા અનુભવી. બાબાના દેહધારી સ્વરૂપને મેં આ અગાઉ નીરખ્યું ન હતું. તેમનાં દર્શન માત્રથી મારી દાખિ નિરવ-પ્રગાઢ શાંત-થઈ ગઈ. મારી ભૂખ અને તરસ શરીરી ગઈ તેમજ બધી ઠંડિયો સ્થિર થઈ ગઈ. તે સમયે મને શ્રી સાઈનાં ચરણ કમળને સ્પર્શ કરવાનો દુર્લક્ષ લાભ મળી ગયો. એમણે મારી જે રીતે પૂછપરછ કરી તે મારા જીવનનો પરમોચ્ચ ઉત્કર્ષ છે એમ હું માનું છું. તે ક્ષણથી મારા જીવનને નવો વળાંક મળ્યો. કારણ કે મને આ સત્સંગનો અમૃત્યુ લાભ મળ્યો. મારાં અંગેઅંગોમાં સુખની ચેતના પ્રસરી ગઈ. બાબાએ મારી ઉપર કરેલો આ અખંડ ઉપકાર અખંડ રહે તેવી તેમને મારી પ્રાર્થના છે. તેમને કારણે મને આ પરમાર્થ પ્રાપ્ત થયો. શ્રી સાઈ જ મારા સાચા મિત્ર અને સાચા સગા છે. તેમના સિવાય કોઈ મારું સગુ વહાલું નથી એવું મેં અનુભવ્યું. તેમના મારી ઉપર કેટલા બધા ઉપકાર છે ! બાબા ! તમારો બદલો કેમ વાળાઓ તે સમજતું નથી. તેથી હું કેવળ બે હથ જોડીને મારું મસ્તક આપનાં ચરણોમાં મૂકું છું. શ્રી સાઈ મહારાજનાં દર્શન થતાં જ મારા મનની શંકાઓનું નિવારણ થયું. અને લાંબા સમય સુધી સાઈ સહવાસ મળ્યો. તેથી હૃદયમાં પરમાનંદ થયો. સાંઈ દર્શનની એજ ખૂબી છે કે તેમનાં દર્શનથી માનવમનની વૃત્તિઓ બદલાઈ જય છે. મનુષ્યનાં બાકીનાં પૂર્વ કર્મો વેરણાંદેરણ થઈ જય છે. ધીર ધીર શરણાગત ભક્તને ઠંડિય સુખો પ્રત્યે તિરસ્કાર જાગે છે. હું એમ અનુભવી રહ્યો છું કે બાબાની કૃપા દાખિને કારણે મારાં પૂર્વજન્મનાં પાપોનો નાશ થઈ રહ્યો છે. મને એવી આશા જન્મી છે કે હું તેમનાં ચરણોનો અક્ષય આનંદ પ્રાપ્ત કરી શકીશ. પ્રભુ કૃપાથી મને બાબાનાં ચરણકૃપી માનસરોવરનો લાભ મળ્યો છે. તેથી મારું કાગમાંથી હંસમાં ઝપાંતર થયું છે. શ્રી સાઈનાથ તો શ્રેષ્ઠ અને ઉત્તમ યોગી, પરમ આચાર્ય, સોડહમ - સોહમ આત્માની અનુભૂતિ કરેલા શ્રેષ્ઠ સંત ભૂષણ અને પરમહંસ છે. પાપો, દુઃખ, ગરીબી ઇત્યારીનો નાશ કરનારા શ્રી સાઈનાં દર્શનથી તેમજ પવિત્ર સહવાસથી હું પાવન થયો છું. પહેલાંના જન્મોમાં કરેલાં પુણ્યોના પરિણામે મારી સાઈબાબા સાથેની આ મુલાકાત ફળી. શ્રી સાઈબાબા એકવાર મારી નજરોમાં વસ્યા તેથી સમગ્ર સૃષ્ટિ સાઈ સ્વરૂપ લાગવા માંડી. (ઓ. ૧૩૧ થી ૧૪૬)

બાળાસાહેબ બાટે શિરડીમાં સ્થિર થતાં પહેલાં કોપરગાંવના મામલતદાર હતા. બાબાનાં દર્શન થતાં તેમને વૈરાગ્ય પ્રાપ્ત થયો. તેથી તેમણે નોકરી છોડી દીધી અને સહકૃદુંબ શિરડીમાં આવીને કાયમી વસવાટ કર્યો. હું પહેલે દિવસે શિરડીમાં આવ્યો તે સાથે મારે શ્રી ભાટે સાથે વાદ વિવાદીની શરૂઆત થઈ. મારા મત પ્રમાણે હું એમ માનતો હતો કે ગુરુની જરૂરિયાત શું છે ? વ્યક્તિએ પોતાની સ્વતંત્રતા છોડીને ગુરુની પરતંત્રતા શા માટે સ્વીકારવી જોઈએ ? જે આપણે આપણાં કર્તવ્યો પૂરાં કરવા માટે સક્ષમ હોઈએ તો પછી ગુરુની કંઈ આવશ્યકતા છે ? દરેકે જે પોતાનું કર્મ જતે જ કરવાનું હોય અને તે કર્મ તે વ્યક્તિથી ન થાય તો તે ગુરુની આશા રાખે. પરંતુ જે ગુરુ પણ તેમાં કશું જ ન કરી શકતા હોય તો તેવા ગુરુને શું કરવાનું ? જે કોઈ હથ પગ હલાવ્યા સિવાય કેવળ ઝોકાં જ ખાયા કરે તો તેવી વ્યક્તિને બીજે ગુરુ શું આપી શકે ? મારો આ પ્રમાણેનો

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

સરળ મત હતો. જ્યારે સામે પક્ષે વિરોધનો મત હતો. જિદી પણાનું જણો તે ત્રાજવું બન્યો હતો. જણો કે તે એ તોલીને જેવા માગતાં હતાં કે મારી જુદું કેટલી બધી જરૂર છે અને તે બીજા કરતાં કેટલી બધી મહત્વની છે. તેથી આ વિવાદ બસોભર જામ્યો હતો. વ્યક્તિ ખૂબજ અભિમાની હોય તો તેને કારણે જ વાદ વિવાદ જન્મે છે. એજ તો અભિમાન અને હું પણાની નિશાની છે. તેના સિવાય જગતમાં વાદ વિવાદ થવાનું કોઈ પણ કારણ હોતું નથી. (ઓ. ૧૫૦ થી ૧૫૪)

સામે પક્ષે એવો નિશ્ચિત મત પ્રવર્તતો હતો કે બલેને કોઈ વેદ પારંગત પંડિત હોય પણ એની ઉપર જે ગુરુકૃપા કે તેમનો અનુગ્રહ ન થયાં હોય તો તે ફક્ત પુસ્તકીયું જ્ઞાન જ રહે છે. તેની મુક્તિની વાતો કેવળ પુસ્તકીયું અને મર્યાદિત જ્ઞાન પૂરતી જ રહે છે. તેણે પોતે અનુભવેલી નથી હોતી. બંને પક્ષે દૈવી શક્તિ શ્રેષ્ઠ કે કાર્યશક્તિની પ્રબળતા વધારે એ પ્રશ્નો ઉપર ભયંકર વાદ વિવાદ ચાલ્યો. મારો મત હતો કે કેવળ ઈશ્વર ઉપર ભરોસો રાખવાથી કાંઈજ પ્રાપ્ત થતું નથી. તો સામા પક્ષનો જવાબ હતો કે જે ઘટના ઘટવાની હોય તેને કોઈ રોકી શકતું નથી. જે કાંઈ થવાનું છે તે થશે જ. જે કોઈ પોતાને વિષે એમ કહે છે કે ‘હું આમ છું ને તેમ છું’ તે છેવટે થાકી જય છે અથવા ભાંગી પડે છે. નસીબની ઉપર વટ તો કોણ જઈ શકે? એમ કામ ધારીને કરવા જય ત્યાં બીજું થાય તેથી મારે મારું ડહાપણ અને ચતુરાઈ બાજુ ઉપર મુકવાં જેઠાં એવો સામા પક્ષનો જવાબ હતો. મેં તેમને પૂછ્યું ‘તમે આમ કેમ કહો છો? જે કાંઈ કરે છે તેને જ બધું મળો છે. આપણું થઈને બેસી રહેનારને ઈશ્વરી શક્તિ પણ કેવી રીતે મદદ કરી શકે? ગીતાના છંઠા અધ્યાયના પાંચમાં લોકમાં ભગવાને કહ્યું છે કે ઉદ્ધરેત આત્મનાત્માનં આપણો જ આપણો પોતાનો ઉદ્ધાર કરવાનો રહે છે. આ બાબત ભારપૂર્વક કહેવામાં આવી છે. તેનો અનાદર કરવાથી સંસાર સાગર તરવો દુષ્કર છે. જે ઘટના જેવી રીતે ઘટે છે અને જેને માટે બને છે તેજ તે વ્યક્તિએ જ ભોગવાની છે. માટે જે એમ જ થવાનું હોય તો ગુરુની પાછળ દોડવાનું શું પ્રયોગન છે? આપણે જ જે જગૃત ન થઈએ તો ગુરુ હોવા છિતાં તેમનો શું ફાયદો હોઈ શકે? માનવની બુદ્ધિ જે ખરું ખરું અને સારું કે ખરાબ વિચારી શકે છે તે અને તેનું સાધન તથા ચિત્ત શુદ્ધિની સુજ જેમણે ગુમાવી દીધી છે તેવા મુર્ખ મનુષ્યને ગુરુ પોતાની સિદ્ધિ કેવી રીતે આપે? એ વાદ વિવાદ તો પત્યો નહીં તેમજ તેમાંથી કશુંયે નિષ્પન્ન પણ થયું નહીં. થયું એ કે હું મનની સ્વસ્થતા ગુમાવી બેઠો. બસ એટલું જ હું કમાયો. તેમ છિતાં ઉપરોક્ત વાદ વિવાદથી બેય પક્ષો થાક્યા નહીં. આમ પોણો કલાક વીતી ગયા પણી જેમ તેમ કરીને વિવાદનો અંત આણ્યો. (ઓ. ૧૫૫ થી ૧૬૪).

તે પછી એમ સૌ સાથે મસ્નિદ્વમાં પહોંચ્યા. તેથી બાબાએ કાકાસાહેબ દિક્ષિતને એમ પૂછ્યું કે, ‘વાડામાં શું ચાલી રહ્યું હતું? શાનો વિવાદ ચાલી રહ્યો હતો? તમે શાને માટે લડતા હતા? મારી સામે જેઠાં બાબા બોલ્યા, ‘આ ‘હેમાડપંત’ શું કહેતા હતા?’ વાડાથી મસ્નિદ્વનું અંતર ઘણું હતું. તેમ છિતાં બાબાને વાદ વિવાદની વાત અંગે કેવી રીતે ખબર પડી તેનું મને ખૂબજ આશ્વય થયું. આ રીતે બાબાના કઠોર શબ્દોથી મને ઝટકો લાગ્યો. તેથી હું નિઃશબ્દ થઈ ગયો અને મારી ગરદન શરમથી ઝૂકી ગઈ. સાઈ સાથેની આ પ્રથમ મુલાકાતમાં જ મારાથી અયોગ્ય વર્તન થયું. મને એમ લાગ્યું કે બાબાએ મને ‘હેમાડપંત’ ના ઉપનામથી સંબોધ્યો તેનું કારણ સવારે થયેલો વાદ વિવાદ જ કારણભૂત હોવો જેઠાં. બાબાએ ઉચ્ચારેલ ‘હેમાડપંત’ નામ તેરમી સદીમાં થઈ ગયેલો મંત્રી હેમાદ્રીના નામ ઉપરથી પાડ્યું હશે એમ હું માનું છું. એ વિશેની વાત કેંક આ પ્રમાણે છે. ઔરંગાબાદ પાસે આવેલું દૌલતભાદ તેરમી સદીમાં દેવગીરી તરીકે ઓળખાતું હતું. દેવગીરીના રાજ યાદવ જેમના વંશજે પાછળથી દૌલતભાદ-દેવગીરીના જન્મ તરીકે

શ્રી સાઈનું સત્ય ચારિત્ર

ઓળખાતા હતા. તેરમી સહીમાં તેમણે મહારાષ્ટ્રનું ગૌરવ વધારેલું. તે વંશમાં ‘પ્રૌઢ પ્રતાપી ચક્રવર્તી’ તરીકે ઓળખાતા રાજ મહાદેવ થઈ ગયા. તેમને વરેલી પુણ્ય કિર્તિની જેમ તેના ભવીજા રાજરામ તેમનાં પરાક્રમોથી વિખ્યાત થયા. જે યદુ વંશના મુગુટમણી - ચૂડામણી તરીકે ઓળખાયા. તે રાજઓમાં અગ્રણી ગણાતા હતા. રાજ મહાદેવ અને રાજરામનો વિશ્વાસુ તેમજ બહુ ગુણો વાળો તથા સર્વ લક્ષણ યુક્ત હેમાદ્રી નામના મંત્રી હતા. જે બ્રાહ્મણો ધર્મશાસ્કોને લગતા ગ્રંથોની રચના કરતા તેમને મદદ કરવા તથા દાન આપવા માટે તે હમેશાં તત્પર રહેતો. હેમાદ્રીએ શ્રુતિ અને સમૃતિ અનુસાર વર્તન કરવા માટેની ચોક્કસ પદ્ધતિ અપનાવી હતી. તેમણે ‘ચતુર્વર્ગ ચિંતામણી’ જેવા ગ્રંથની રચના કરી. તે ગ્રંથમાં વ્રત, દાન, તીર્થ અને મોક્ષ જેવાં ચાર પ્રકરણો વિશે સવિસ્તર વર્ણન કર્યું. આ પ્રકારના ગ્રંથોની તેમણે રચના કરી હતી. તેમની આવી શ્રેષ્ઠ કરણીથી તેમની કીર્તિ વધી હતી. સંસ્કૃત ભાષામાં જે હેમાદ્રી પંત તરીકે ઓળખાતા હતા. તે પ્રાકૃત-મરાಠી - ભાષામાં ‘હેમાડપંત’ તરીકે જાણીતા હતા. તેઓ તેના જમાનામાં કુટીલ તેમજ મુત્સદ્વી રાજકારણી તરીકે પ્રખ્યાત થયેલા હતા. શ્રી સાઈ બાબાએ મને ‘હેમાડપંત’ તરીકે સંબોધ્યો પરંતુ અમારી બંને વચ્ચે કંઈક ભેદ હતો. તેઓ ‘વત્સ’ ગોત્રના હતા જ્યારે મારું ગોત્ર ‘ભારકાજ’ હતું. એમના વંશને પાંચ પેઢી પહેલાંના હતા જ્યારે મારા ત્રણ પેઢી પહેલાંના હતા. તે ચતુર્વેદી હતા જ્યારે હું ઋગવેદી છું. તેમને ધર્મશાસ્કો જ્ઞાત હતા જ્યારે હું તો તે ક્ષેત્રમાં મુર્ખ છું. તેઓ યજુર્વેદની માધ્યંહિની શાખાના હતા જ્યારે હું ઋગવેદની શાકલ શાખાનો છું. તેઓ ધર્મશાસ્કો અને વિધિ વિધાનના નિયમોનું જીણવટ ભર્યું જ્ઞાન ધરાવનાર તેમજ ધર્મજ્ઞ હતા. હું તો ફક્ત બડબડાસ છું, તેઓ પંડિત હતા જ્યારે હું બુદ્ધિહીન મુર્ખ છું. બાબાએ મને શા માટે આવી અર્થહીન-પોકળ-પદ્ધવી આપી હશે ? તેઓ તો રાજકીય ક્ષેત્રે પ્રવિષ્ટા, ધૂર્ઘદર અને મુત્સદી હતા જ્યારે હું તો રહ્યો અલ્ય બુદ્ધિનો અજ્ઞાની-ડોબો. તેમણે રચેલું ‘રાજકારણ પ્રશસ્તિ’ નામનું સંસ્કૃત કાવ્ય પ્રસિદ્ધી પામ્યું છે. મને તો કવિતાની એક તીઠી પણ લખતાં આવડતી નથી. તેઓ લેખન કળાના નિષ્ણાત હતા અને હું તેમાંનું કશું નહીં જ્ઞાનારો પછાત છું. તેમણે ‘લેખન કલ્પતરુ’ નામનો કાવ્ય સંગ્રહ લખ્યો છે. હું તો બાબાનો એક એવો બાળક છું કે એક કાવ્ય પંક્તિ પણ લખી શકતો નથી. તેમના જમાનામાં ગોરા કુંભાર, ચોખા મહાર, સાવંત માળી, નિવૃત્તિ નાથ અને નામદેવ જેવા ભાગવત પુરુસ્કાર પામનારા મહાનુભાવોનો ઉદ્ય થયો હતો. તેમાં પંડિત બોપ્દેવ નામના વિદ્વાન રત્નદ્રો ચેમકતા હતા. તેવા ગુણીજનો વચ્ચે ‘રાજકારણી હેમાડપંત’ સુપ્રસિદ્ધ થયા હતા. સમય જતાં આ પ્રદેશોમાં ઉત્તર તરફથી મુસલમાનોની ફોનેનાં ધાડેધાડાં ઉત્તરી આવતાં દક્ષિણાની સત્તા ધીમે ધીમે અસ્ત થઈ ગઈ. બાબાએ મારી ચતુરાઈનું સન્માન કરવા માટે કાંઈ અમસ્તી આ પદ્ધવી ન હતી આપી. મારી વાદ વિવાદ પટૃતાના ગર્વને હણવા માટેનાં આ શબ્દ બાળો હતાં. અલ્ય યશથી કુલાઈ જઈને અને મારી યોગ્યતા વિનાનો બડબડાટ કરવાની સામે બાબાએ જ્ઞાનનું આંજણ આંજુને મારી આંખો ખોલી દીધી.

(ઓ. ૧૬૫ થી ૧૮૫)

કારણ ગમે તે હશે પરંતુ બાબાના શ્રી મુખેથી ઉપર જણાવેલા વિલક્ષણ અને અર્થપૂર્ણ તેમજ સૂચક શબ્દો મારા ઉપનામને શોભા અર્પતા અલંકાર સમજુને તેનો મેં સ્વીકાર કર્યો. મેં જાણ્યુ હતું પરંતુ મને સમજયું કે વાદ વિવાદ અત્યંત હાનિકારક છે અને કુલક્ષણ પણ ગણાય છે. તેનો એક ક્ષણનો સ્પર્શ પણ મારે માટે નકામો છે. તેથી વાદ વિવાદ કરીને જે ગર્વ મજબૂત બને છે તે નષ્ટ થવો જોઈએ અને મૃત્યુ પર્યત વિના રહેવાનું ભાન હોવું જોઈએ. હું તે ભૂલી ગયો હોવાથી મને આ પદ્ધવી મળી હતી. દશરથ પુત્ર શ્રી રામ પૂર્ણજ્ઞાની હતા અને સમસ્ત વિશ્વને સંકટોમાંથી મુક્ત કરનારા ઈશ્વરનો અવતાર

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

હતા. ઋષિ મુનિઓ સહાય તેમના ધ્યાનમાં ભગ્ન રહેતા હતા. તે અવતારી રામ પણ તેમના ગુરુ શ્રી વશિષ્ઠ ઋષિનાં ચરણોમાં રિશા ઝુકાવતા હતા. પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રએ પણ સાંદિપની ઋષિને ગુરુ માન્ય હતા. તેમના આશ્રમમાં ગુરુની આજ્ઞા પ્રમાણે તેમણે લાકડાં કાપી લાવવા જેવાં કાર્યો કર્યા હતાં અને સંકોચથી મળી તે જગામાં રહેવાનું સ્વીકાર્ય હતું. તેથી મને સમજનું કે દેવોની સામે હું કઈ વિસાતમાં છું ? મારી મોટાઈનું જગતમાં શું મહત્ત્વ છે ? દેવોએ જે કર્યું તેનાથી વિશેષ હું શું કરી શકવાનો છું ? માટે ઓટો વાદ વિવાદ કરવો તે અર્થહીન છે. શાસ્ત્રોએ જે કહ્યું છે કે ગુરુ વિના જ્ઞાન અને પરમાર્થ પ્રાપ્ત કરવાં શક્ય નથી. વાદ વિવાદ વખાણવા જેવી બાબત નથી. તેજ રીતે કોઈ સાથે બરાબરી કરવી તે પણ યોગ્ય નથી. શ્રદ્ધા અને સભુરી સિવાય પરમાર્થ સધાતો નથી. તેમ પાછળથી અનુભવ્યં છે. તે વાતો મનમાં દ્રદ થઈ ગઈ. તેથી મેં આ નામ ગૌરવનો મેં પ્રેમ પૂર્વક અને નિષ્પાપ વૃત્તિથી સ્વિકાર કર્યો. (ઓ. ૧૮૬ થી ૧૮૭)

હવે તો આપણો પક્ષ અને બીજનો પક્ષ એવો બેદ કાઢીને વાદ વિવાદ અટકાવનારો સૌને બોધ મળે તેવો મત રહેવા દઈએ. આ અધ્યાયમાં આ ગ્રંથનું પ્રયોજન, તેનો અધિકાર કોણ પ્રાપ્ત કરે તે અને અનુભંધ જણાવ્યો. તે સાથે આ ગ્રંથના ગ્રંથકારના ઉપનામ-નામકરણ વિષેનું વર્ણન પણ વર્ણિતું. આ અધ્યાયનો વિસ્તાર ધણો થઈ ગયો હોવાથી આ હેમાદ હવે પછી વધુ વાતો યથા સ્થાને સાઈ ચરણોમાં રજૂ કરશે. સાંચ જ આપણી સુખ સંપત્તિ છે અને તેજ આપણાં સુખોનું જ્ઞાન કરાવે છે. સાંચ જ સાંસારિક ઉપાધિમાંથી મુક્તિ દેનાર મુક્તિ દાતા છે અને તેજ અંતિમ ગતિ છે. ‘શ્રી સાઈ ચરિત્ર’ નું હમેશાં શ્રાવણ કરવું અને સાઈ કૃપાથી સંસારના ભયમાંથી છુટકારો મેળવી લેવો. તેમના ચરિત્ર શ્રવણથી આ કળિયુગની દુષ્ટ વાસનાઓનો જડમૂળથી નાશ કરી નાંખવો.

સર્વનું કલ્યાણ થાઓ. આ પ્રકારે સંત અને સજજનોની પ્રેરણા પાખેલા ભક્ત હેમાદપંત રચિત શ્રી સાઈ સર્વથના ‘કથા પ્રયોજન નામકરણ’ નામનો બીજો અધ્યાય સમાપ્ત થયો.

શ્રી સદગુરુ સાઈનાથને અર્પણા.



॥ અધ્યાય ૩ ॥

ગ્રંથ પ્રયોગન સંમતિ

(ગ્રંથનો હેતુ અને ગ્રંથ લખવા માટે બાબાની સંમતિ.)

શ્રી ગણેશજીને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કુળહેવતાને વંદન,
શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રજીને વંદન અને શ્રી સદગુરુ સાઈનાથ મહારાજને વંદન.

હું હવે પહેલા કહેવાયેલી કથાની સાથે અનુસંધાન કરું છું. શ્રી સાઈબાબાએ મને પૂર્ણ આશ્વાસન આપીને કહ્યું,
'ચિહ્ન લખવા માટે મારી તમને પૂર્ણ સંમતિ છે. તમે તમારું કામ કરો અને મનની ધીરજ જરા પણ ગુમાવશો નહીં. મારા
શબ્દો ઉપર વિશ્વાસ રાખીને પાકો નિર્ધાર કરો. મારી લીલાઓનું લેખન કર્શો તો અન્નણતાં કરેલાં પાપોનો નાશ થશે. જે
તમે ભક્તિભાવથી તેમને સાંભળશો તો તમને કૌદુર્બિક જવાબદારીઓ, કાળજી-ફીકર તેમજ સતત થથી અવરજવરની
યાદ સુદ્ધાં આવશે નહીં. શ્રવણદૃપી સાગર ઉપર ભક્તિ અને પ્રેમદૃપી અમૃતનાં મોનંની લહેરો ઉઠશે. જે તેમાં દુબકી
મારશો તો ઉપદેશ રૂપી બોધરતનો તમારે હાથ લાગશે.' આ સાંભળીને મારા મનના ભય અને શંકાનું સમાધાન થયું. તેથી
મેં શ્રી સાઈ ચરણમાં હર્ષપૂર્વક વંદન કર્યા. ત્યારબાદ મને જેમ જેમ યાદ આવતું ગયું તેમ તેમ મેં યથા સ્મરણ ચિહ્ન
લખવાની શરૂઆત કરી. બાબાના હોઠ ઉપર જ્યારે આ શબ્દો આવ્યા કે લેખન ચોક્કસ જ પાર પડશે ત્યારે મેં એક બાબત
ધ્યાનથી સમજી લીધી કે હું માત્ર મહેનતાણાં વગરનો મારી શક્તિ કામે લગાડેલો કેવળ એક હમાલ જ છું. આ લેખનની
પ્રેરણા કે કૌશાલ્ય મારાં નથી. (ઓ. ૧ થી ૬)

હવે જુઓ કે શ્રી હરિની લીલા કેટલી અગમ્ય છે ? તેમના સિવાય બીજુ કોઈ તેને જાણી શકતું નથી. શ્રુતિ, ધર્મશાસ્ત્રો
તથા વેદોને પણ તેની ખબર પડી નહીં અને તે મુંગા થઈ ગયા. શાસ્ત્રવેત્તાઓ તથા વેદોમાં સદા મળન રહેનારા પંડીઓ તેમજ
કોઈ એકાદ વિષય ઉપર સિદ્ધિ પ્રાપ્ત કરેતા અને દશાંતો દ્વારા નકામી માથાકૂટ કરીને ઉકલ બતાવનારા મહાનુભાવોના નાદે
પડવું નહીં. શ્રી હરિ પોતાના ભક્તો માટે ખેલ કરે છે. તે ભક્તો નચાવે તેમ નાચે છે. પ્રભુ ભલા, ભોળા અને ખૂબજ ખૂખ્યા
માણસોની ઉત્સુકતા પૂર્વક રાહ જુઓ છે. તે ભક્તને આધીન છે અને સેવકની જેમ વર્તે છે. પ્રેમથી તે વેચાઈ જય છે-તેનો
થઈ જય છે. પરંતુ ઢોંગ તેમજ દંબ આચરનારાને તે કદી પ્રાપ્ત થતો નથી. (ઓ. ૭ થી ૮)

બાબાએ કહ્યું, 'આમાંજ તમારું કલ્યાણ છે અને મારા અવતાર કાર્યની સફળતા પણ છે. જુઓ ! મારું પણ વારંવાર એજ
કહેવું છે. મને એની જ ચિંતા છે.' બાબાકે. માધવરાવ દેશપાંડેને શામાના લાડકા નામથી જ બોલાવતા હતા. તેમને સંબોધતા
કહ્યું, 'શામા ! આ સિવાય પણ બીજી એક વાત કહુ છું. જે કોઈ મારું નામ પ્રેમથી લેશે તેની સર્વ ઈચ્છાઓ હું પૂર્ણ કરીશ અને
મારી તરફનો તેનો ભક્તિરસ અને પ્રેમનો વધારો કરીશ. જે કોઈ ઉત્કંઠાથી મારું ચિત્ર કે મારો મહિમા ગાશે તેમની ચાર બાજુ
ઉભો રહીને હું તેમને મદદ કરીશ. જે જે ભક્તો મારામાં તેમનો જીવ પરોવશે તેમજ મારામાં જ રમતા રહેશે તેઓને આ કથાનું
પાન કરીને સરળતાથી આનંદ પ્રાપ્ત થશે.' તે સિવાય પણ જે કોઈ મારું કિર્તન કરશે તેમને પણ આનંદ્ધી ધનથી ભરી દઈશ.
અને કાયમને માટે સુખ અને સંતોષ આપીશ. આ મારા સત્ય વચ્ચન છે તેમાં તમે સદા વિશ્વાસ રાખનો. જે કોઈ અનન્ય થઈને

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

મારે શરણે આવશે અને સંપૂર્ણ વિશ્વાસપૂર્વક સદા મારું ભજન, ચિત્તન અને સ્મરણ કરશે તેનો ઉદ્ઘાર કરવાનો મારો દદ નિર્ધાર છે. જેના હથય અને ચિત્તમાં અખંડ મારું જ નામ, મારી જ ભક્તિ અને મારો જ લેખ સંગ્રહ-મારી જ પોથી છે તેમજ મારામાં જ ધ્યાન પરેવાયેલું છે તેમને વિષય લોલુપતા અને ઈન્દ્રિય સુખની યાદ પણ ક્યાંથી આવશે? જે કોઈ મારી કથાઓનું ફક્ત શાંતિથી શ્રવણ કરશે તેમના વ્યાધી મટી જશે. હું મારા એવા ભક્તાને મૃત્યુના મુખમાંથી પાછો બેચી લાવીશ. મારી કથાને બહુજ ધ્યાનથી સાંભળજો અને તેની ઉપર પૂર્ણ પણ ચિત્તન અને મનન કરશો. તે બાદ તેની ઉપર ફરી ફરીન જે ઊંડાણપૂર્વક વિચાર કરશો તો જરૂરથી સમાધાન પામશો. ‘અહંમ સોહલમ્’ અજપા જપ અર્થહીન થઈ જશે. તેની જરૂરિયાત પણ નહીં કરે. શ્રોતાઓનું મન એક નિષ્ઠ થઈને પરિપૂર્ણ શ્રદ્ધાથી પરમેશ્વરના ચિત્તનમાં મળન થશે અને ચિત્ત ચૈતન્યથી છલકાઈ જશે. ‘સાઈ સાઈ’ એવું નામ સ્મરણ કલિયુગમાં ઉત્પન્ન થતી સર્વ દૃષ્ટ વાસનાઓને બાળીને ભર્સીભૂત કરી નાખશે. સાણંગ નમસ્કાર કરવાથી બોલીને કે સાંભળીને જીવનમાં થયેતાં પાપોનો પણ નાશ થશે. (ઓવી ૧૦ થી ૨૦)

આ ગ્રંથ લખવાનું કાર્ય કંઈ સરળ ન હતું. તે ધારું જ અધરું હતું. તેમ છતાં મેં નમ્રપણે બાબાની આજા શિરોધાર્ય રાખી. બાબા જેવા ઉદ્ઘાર દાતા જો મારી સાથે છે તો પછી મને શાની ઓટ પહોંચો? સાઈબાબાએ કોકની પાસે મંદિરો બનાવડાવ્યાં તો કેટલાકને પ્રભુ કીર્તિના પ્રચાર અર્થે રંગાઈ જવાનું કહ્યું. કોકને તીર્થયાત્રા કરવા માટે મોકલ્યા અને મને આ સાઈચરિત્ર લખવા બેસાડી દીઘો. દેરેક કરતાં હું પામર જીવ ઉત્તરતો હતો છતાં અત્યંત દ્વારા બાબાએ મારી પરંદગી શા માટે કરી હશે? તે મારી ઉપર શા કારણે પ્રસન્ન થયા હશે? તે વાત મને સમજતી નથી. ગુરુકૃપાનો મહિમા એજ છે કે જ્યાં લેશમાત્ર બેજ હોતો નથી ત્યાં આડનાં દુંધાં હોવા છતાં તેમની ઉપર ફૂલોની વસંતને મહેંકાવે છે. તે દુંધાં પર વગર પ્રયત્ને સુંદર સાણ ફળો પણ લાગી જાય છે. સમય જતાં દેવાલયો તથા નદી ઉપર ધાર કોણ બાંધશે તે સાઈ જાણો. આપણે તો આ ચરિત્ર પાઠને વાંચવાનો સરળ માર્ગ સ્વીકારી લઈએ. કેટલાક બાબાની સન્ભાન પૂર્વક સેવા કરે છે તો કેટલાક ધીરિથી પગ ઉપર હાથ ફેરવે છે. મને તો એમ લાગે છે કે આપણે તો બાબાના ગુણગાન ગાઈને કીર્તિન કરવું. જે ફળ સત્યયુગમાં પરમેશ્વરનું ધ્યાન ધરીને અને ત્રેતાયુગમાં યજા એટલે કે ભજન કરવાથી તેમજ દ્વાપર યુગમાં પૂજન અર્થન કરવાથી મળતું હતું. તેજ ફળ કળીયુગમાં ગુરુભજન, ગુરુસેવા અને ઈશ્વરના નામ સ્મરણથી થાય છે. મારી પાસે પોટલું ભરીને કપડાંની ચીંદરડીઓ છે પરંતુ અંગ ઢાંકવા માટે ખાવા પુરતું એક પણ સારુ વખ્ત નથી. અર્થાત્ મારી પાસે ધણા વિષયોની થોડી ધણી માહિતી છે પરંતુ તેમાંના એક પણ વિષયની પૂર્ણ માહિતી નથી. તો પછી આવું ન મેળવી શકાય તેવું કાર્ય શા માટે કરવું જોઈએ? પ્રયત્ન ન કરાય અને સ્વસ્થ ચિત્ત બેસી રહેવાથી તો આજાના ઉલ્લંઘનું પાપ લાગે અને આજા પાલન કરવા જતાં તે કાર્ય કેવી રીતે પાર પડશે તેનો ભય મને ખાઈ જાય છે. સમર્થ સાઈ પોતાની નીજ સ્થિતિમાં રહેતા હતા તે સ્થિતિનું વર્ણન કરવું તે કોઈના હાથની વાત નથી. બાબા ફક્ત ભક્તાને માટે તેની ઉપર કૃપા કરીને પોતેજ તેને લખાવી લે તોજ તે શક્ય બને. વાણી જ્યાં પહોંચી શકતી નથી ત્યાં વહોંચવા માટે કે ખોડી આશા શા માટે રાખું? પરંતુ આ પ્રમાણે લખાવવા માટે મેં કોઈને પણ નિમિત્ત બનાવવા માટેની જગા છોડી નથી. મેં જેવી કલમ હાથમાં પકડી કે બાબાએ મારા હું પણાનો નાશ કર્યો અને પોતેજ પોતાની કથા લખાવવાનું કાર્ય કર્યું. તેથી આ કથાની શોભા અને ભૂષણ પણ તેમનાં જ હોય. આ સંત ચરિત્ર કહેવાય. તેને સંત સિવાય બીજુ કોણ લખી શકે? બાબાના અકલ્ય ગુણોને સમજવા એટલે આકાશને આલીંગન કરવા જેવું છે. તેમનું માહાત્મ્ય અતિગાહન છે. તેનું વર્ણન કરવા માટે મારામાં બુદ્ધિ અને શક્તિ નથી. બાબા પોતેજ પોતાના કાર્યને સ્વીકારી લઈને વચ્ચન મુક્ત થાય તેજ બરાબર કહેવાશે. (ઓવી ૨૧ થી ૩૪)

શ્રી સાઈનું સત્ય ચારિત્ર

હે બાબા ! ભલે હું જન્મે બ્રાહ્મણ છું છતાં મારી પાસે વેદ અને પુરાણાની બે ચક્ષુઓ નથી અને મારી પાસે તે વિશેની માહિતી પણ નથી. આ મારો જન્મનો દોષ હોવા છતાં તમારે કારણે મારી શોભામાં અભિવૃદ્ધિ થઈ છે. શૃંતિ અને સ્મૃતિ બ્રાહ્મણની બે આંખો કહી શકાય. જે તે બેમાંથી એક આંખ ન હોય તો તે કાળો કહેવાય અને બંને આંખોન હોય તો તે આંધળો કહેવાય. હું તે બે ચક્ષુઓ વિનાનો અંધ છું. પરંતુ મારે માટે આપ આંધળાની લાકડી હોવાથી મને શેનો ત્રાસ સહેવો પડે ? હું આપ સરખી લાકડીને ટેકે ટેકે આપની પાછળ પાછળ તમે ચીધેલા સરળ માર્ગે ચાલતો રહીશ. આગળ શું કરવું જેઠિએ તે સમજતું ન હોવાથી તમેજ બુદ્ધિ અર્પો અને આપે મને ચીધેલું આપનું કામ પૂર્ણ કરો. તમારી કૃપાથી મુંગા બોલતા થાય છે અને લૂલા લંગડા ચાલતા થાય છે, તથા મેરુ પર્વક ઓળંગી જય છે. તમારી શક્તિ અકલ્ય છે, તમારી યુક્તિઓ તેમજ જાણો. હું તો આપના ચરણનો દાસ છું. તમે મને નિરાશ ન કરતા. જ્યાં સુધી મારા દેહમાં શાસ ચાલે છે તે સમય દરમિયાન આપ આ ગ્રંથ લેખનનું કર્ય સિદ્ધ કરાવી લો. વાંચકો ! હવે આપ સૌને મારા દ્વારા થતા આ ગ્રંથ લેખનનો હેતુ સમજયો. શ્રી સાઈ પોતે જ પોતાના ભક્તોના કલ્યાણ માટે લખનારા અને મારી દ્વારા લખાવનારા છે. બંસરી અને વાજપેટીને પોતે કેવી વાગે છે તેની ચિંતા તેમને નથી. એની માથાકૂટ તો વગાડનારાએ કરવાની હોય છે. તે તેમની ઉપર આધાર રાખે છે. આપણે શા માટે અમસ્તા ઉંચાનીયા થવું જેઠિએ. ચંદ્રકાંત મણીમાંથી ચંદ્રના કીરણોનો સ્પર્શ થતાં તેમાંથી જે ચ્વાવ વહે છે તે મણીમાંથી સ્વરતું અમૃત મણીનું કેવી રીતે કહી શકાય ? એ તો ચંદ્રની જ લીલા કહી શકાય. ચંદ્રોહૃદ સમયે તે અમૃત ચંદ્રથી જ થાય છે. તેજ રીતે સમુદ્રમાં આવતી ભરતી ચંદ્રને કારણે જ છે, ભરતી લાવવાનું કૃત્ય સમુદ્ર દ્વારા થતું નથી. (ઓવી ઉપ થી ૪૪)

સમુદ્રમાં ફરતી હોડીઓને વમળ અને ખડકોથી બચવા માટે ભયની અગમચેતીની જાણ માટે લાલ દીવાઢાડીઓ લાગડવામાં આવે છે. તે પ્રમાણે મધુરતામાં સર્વશ્રેષ્ઠ અમૃત ગણાય છે. તેનાથી પણ શ્રેષ્ઠ શ્રી સાઈનાથની કથાઓ છે જે સંસારના ઉબડાબદ માર્ગોને એકદમ સરળ કરી હેલે છે. તે સંતોની કથાઓ ઘન્ય છે. તેનું કાન દ્વારા શ્રવણ થતાંની સાથે જ દેહાભિમાનનો નાશ થાય છે અને સુખ દુઃખના દંદ્રો બાકી રહેતાં નથી. તેથી જ્ઞાનના મોન્નાંઓનો સંગ્રહ વધતો જય છે. શુદ્ધ મનથી બાબાની યશગાથાનું ગાન ગવાય અથવા તેનું પ્રેમથી શ્રવણ કરાય તો પણ ભક્તોનાં પાપોનો નાશ થાય છે. આવી બાબતો પરમાર્થ પ્રાપ્તિનું સરળ સાધન ગાડી શકાય. જે મુખુકોને એવા પ્રક્રો ઉદ્ભબતા હોય કે માયાની પેદે પાર બ્રહ્મ છે તે બ્રહ્મ કયું ? માયાને પાર કરીને તરી જવાનો ઉપાય કયો હોઈ શકે ? ધર્મ કર્મનું કેવું આચરણ કરવાથી શ્રી હરિ પોતાના ભક્તો ઉપર પ્રસન્ન થાય ? સર્વ શ્રેષ્ઠ અંતિમ શાશ્વત સુખ કયું ? તેમજ ભક્તિ, મુક્તિ અને વૈરાગ્ય કેને કહેવાય ? બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય તેમજ શુદ્ધ એ ચારે વળોના નિયમ તથા બ્રહ્મચર્ય, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સન્યસ્ત આશ્રમના નિયમોનું પાલન કરવા માટેનો ધર્મ કયો ? તેમજ પરબ્રહ્મ એટલે શું ? અને જીવાત્મા તથા પરમાત્માનું એક્ય સમજનવતો અદ્વૈત મત એટલે કયો મત ? આ બધા અતિગણ વિષયો છે. આ પ્રકારના વિષયોની જાણકારી ચાહતા જ્ઞાન પીપાસુઓ દુર્ઘટે તો જ્ઞાનેશ્વર મહારાજ તથા એકનાથ મહારાજની રચનાઓ તથા વિવિધ ગ્રંથોનો અભ્યાસ કરીને પ્રવિષ્ટા તેમજ સુખ પ્રાપ્ત કરી શકે છે. સત્યુગમાં શામ-દમ દ્વારા ઈંદ્રિયનિગ્રહ કરવાથી તેતા યુગમાં યજો કરવાથી અને દ્વાપરયુગમાં પૂજન કરવાથી પરમાર્થ સાધી શકાતા હતા. પરંતુ કાળીયુગમાં પ્રભુનું નામસ્મરણ તેમજ ભજન કીર્તન તે સરળ ઉપાયો છે. તેમના દ્વારા સહેલાઠી પરમાર્થ-દિશ્વર પ્રાપ્તી થઈ શકે છે. બ્રાહ્મણ સહિત ચારે વળોની વ્યક્તિઓને ગુરુ કથા સાંભળવાનો અધિકાર છે. બ્રાહ્મણ, ચાંડાળ કે મહિલા સૌને માટેનું આ એકજ ઉત્તમ સાધન છે. જેમણે પૂર્ય પ્રાપ્ત કર્ય હશે તેઓજ આ કથાનું પાન કરી શકશે.

કથા શ્રવણ કરતાં કરતાં જે કોઇને નિંદા આવી જય તો શ્રી હરિ તેમને જગાડી દેશો. જેમને સતત વિષય ભોગની

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

લાલસા રહેતી હોય અને તે ન મળતાં તે દુઃખી થયા કરતા હોય તેમને પણ તેવા દુઃખમાંથી આ ‘સંત કથામૃત’ છોડાવે છે. યોગ તેમજ યજ્ઞ અને ધ્યાન કરવા માટે ઘણું કષ્ટ ભોગવવું પડે છે. પરંતુ કથા સાંભળવા માટે ધ્યાન આપવું જરૂરી છે. તે સિવાય બીજું કોઈ કષ્ટ નથી પડતું. તેથી પવિત્ર પ્રેમાળ અને સજજન ભક્તોએ આ કથાનું શ્રવણ કરવું. તેનું શ્રવણ કરવાથી લોકોનાં પાંચ મહાપાપો બ્રહ્મ હત્યા, નશીલાં દાઢ જેવાં દ્રવ્યોનું સેવન, ચોરી તથા ગુરુભક્તિ સાથે સંભોગ કરવો અથવા આવાં પાપો આચરનારાઓ સાથે સંબંધ રાખવો વગેરે બળીને ખાખ થઈ જય છે. સામાન્ય રીતે ઘણા લોકો આવા બંધનોથી જકડાયેલા હોવાથી તેમને પોતાના સ્વરૂપને જાણવા માટે વલખાં મારવાં પડે છે. આ કથાના શ્રવણ કે પઠનથી તે લોકો બંધનમુક્ત થશે અને પોતાના મૂળ રૂપનું દર્શન કરી શકશે. તેથી આ કથા જીવનની અંતિમ ક્ષણો સુધી યાદ રહે અને તેના સતત પઠનથી કે યાદ રાખવાથી જીવન પરિવર્તન થાય તેમજ સંસારના દાવાનીથી દાઢેલાઓ તથા જગ્મી થયેલા સૌ મનુષ્યોને મનની શાંતિ અને સમાધાન થાય તેવી ઈચ્છા છે. શ્રી સાઈબાબાને વિનંતી કરવાની કે આ કથા સાંભળવાથી ભક્તનું ધ્યાન આપનામાં આપોઆપ જ લાગી જય, આપના સગુણ સ્વરૂપનું દર્શન થાય અને તે ભક્ત હૃદયમાં પ્રવેશી જય. તેમ થતાં ભક્તની મતિ સદ્ગુરુમથ બને સંસારમાંથી વિરક્તી જગે અને નિર્મળ બુદ્ધિ બનીને સદ્ગુરુનું સ્મરણ કરવાની મુમુક્ષા જગે એવી શ્રી સાઈને પ્રાર્થના. (ઓવી ૪૫ થી ૬૨)

શ્રી સાઈનાથ મહારાજે મારી ઉપર કૃપા કરી અને મને નિમિત્ત ભનાવ્યો. હું તો નિમિત્ત માત્ર છું. પરંતુ બાબાએ મને પોતાનો જીવન ગ્રંથ લખવા માટે પ્રેર્યો. ગાય દૂધથી તસતસ થતા પોતાના આંચળ દ્વારા પોતાના વાછરડાને જ વાત્સલ્યભાવે પોતાનું દૂધ પીવડાવે છે. તેની આ જન્મનિત સ્વભાવની જેમ શ્રી સાઈનાથનો પણ એવો જ સ્વભાવ છે. તેમની પણ એવીજ પદ્ધતિ છે. શ્રી સાઈ માઉલી મારા જેવા ચાતક પક્ષી ઉપર તેમની કૃપાનાં અમી છાંટણાં કરશે અને મારી ઉત્કૃષ્ટ ઈચ્છા પૂરી કરતાં કરતાં અન્ય ભક્તોના મનનું પણ આ કથા દ્વારા મન: સમાધાન કરશે. ભક્તિ અને પ્રેમની અન્યબીજાનું શી રીતે વર્ણન થઈ શકે ? માતા પોતાના શિશુના મુખમાં પોતાના સ્તન મૂકીને સ્તનપાન કરાવે છે. બાળકનો પયપાન કરીને સુખ મેળવે છે. પરંતુ માતા શા માટે દુઃખ વહેરી લે છે ? આ બાબતની ખબર ન તો સંતાનને કે અન્ય બીજાઓને હોય છે. મા સિવાય કષ્ટ સહન કરીને યોગ્ય સમયે માતા જ પોતાનું દૂધ પીવડાવીને સંતાનને તૃપ્ત કરે છે. તે બાબતની સંતાનને ખબર હોતી નથી. સદ્ગુરુ સાઈનાથ મહારાજ પણ આ પ્રમાણે કરે છે. મારા જેવા બાળકની જીવ તથા સુખ સાહ્યબી કોણ પૂરી કરશે ? મા સિવાય આ રીતની લાગણી કોને થશો ? એના જેવી માયા-વાત્સલ્ય ભાગ્યે જ બીજાને થશે. સુસંસ્કરારી અને સુદ્રદ માતાની કૃપે જન્મ મળવો તે મહદ્ભાગ્ય તથા ઈશ્વરની પરમ કરુણા ગણાય. મા અનેક દુઃખો વેદીને સંતાનને જન્મ આપે છે તેની તે બાળકને કશીય ખબર હોતી નથી. (ઓવી ૬૩ થી ૭૦)

આ અંગે બાબાએ કંઈક વધારે કહ્યું હતું તે હું તમને કહીશ. હે સજજનો ! સન ૧૯૧૬માં મારી સરકારી નોકરી પૂરી થઈ. મને મળવા પાત્ર યોગ્ય પેન્શન નક્કી થયું. તે પછીથી મારે શિરડી જવાનો યોગ ઊભો થયો. તે ગુરુપુરિભાનો દિવસ હતો. તેથી ગુરુ પુજન માટે સહુ ભક્તો ભેગા થયા હતા. એ પ્રસંગે દામોદર ધનશ્યામ દાદરે કે જે આણણા ચીચણીકર તરીકે ઓળખાતા હતા તેમણે સ્વયં સ્કુરીત થઈને મારે માટે બાબાને આજીજ કરી. તેમણે બાબાને મારે માટે વિનંતી કરતાં કહ્યું, બાબા ! એની નોકરી પૂરી થઈ હોવાથી મળતાં પેન્શનમાં બહોળા કુંભનો ગુજારો થઈ શકે તેમ નથી. માટે એને અન્ય જગ્યાએ નોકરી મળે તેવી વ્યવસ્થા કરી આપો. જેથી તેમની ચિંતા મટે. તે સાંભળીને બાબાએ કહ્યું, સારી નોકરી તો એને

શ્રી સાઈનું સત્ય ચારિત્ર

મળશે પણ તેનો કોઈ અર્થ સરશે નહીં. એણે મારી સેવા કરવી જેઠાએ જેથી તેને સંસારમાં સુખ પ્રાપ્ત થશે. એના ઘરમાં અન્નનો ભંડાર ભરેલા જ રહેશે તે જીવન પર્યત ખાતી થશે નહીં. જે તે ભાવ ભક્તિથી મારું શરણું લેશે તો તેનાં દરેક સંકટો કાયમને માટે નાશ પામશે. પરંતુ જે લોકો એમ સમજે છે કે હું મનજ્ઞાવે તેવું વર્તન કરું તો તેથી શું બગડી જવાનું છે? એવા જે બહેકી ગયેલા મુર્ખાઓ ધર્મ શાસ્ત્ર પ્રમાણે વર્તતા નથી તેમને સવેળા જ ટાળી દેવા જેઠાએ. આવા દૂરાચારીઓ જે સામે મળે તો તેમના પડછાયાથી પણ દૂર રહેવું અને બાજુએથી પસાર થઈ જવું, જરૂર પડયે મોં ફેરવી લેવું કારણ કે તેવા માણસો મહાભયંકર હોય છે. જે વ્યક્તિ પોતેજ અધીત વર્તન કરે, આચારહીન અને ચારિત્ય ભષ હોય તેમજ સારાસારનો નિર્ણય કરવામાં અસમર્થ હોય તો તે શું કામનો? જે વ્યવસ્થિત અભ્યાસ ન કરે, ધર્મનું પાતન ન કરે તેવો માણસ પોતાનું શ્રેય સાધી શકતો નથી તો અન્યનું શ્રેય કેવી રીતે કરી શકશે? આપણી પાસે આવનારી કોઈપણ વ્યક્તિ ખાસ મુણાનુંબંધ વિના મળતી નથી. આપણી પાસે જે ફૂતરુ, ઝુક્કર કે લેંસ આવે તેમને ઘૂંઠકરશો નહીં. હવેથી હેમાઉપંતે મારી ભક્તિ ભાવથી ફીકત સેવાજ કરવાની રહેશે. તેથી દેવાધિદેવ રીતાં તેને ધનનો અક્ષય અન્નનો પ્રાપ્ત થશે. (ઓવી ૭૧ થી ૮૨)

મનમાં એવો પ્રશ્ન ઉદ્ભબે કે આ પૂજન કેવી રીતે થઈ શકે? ‘હું કોણા’ એનો ઉત્તર આત્મિપૂર્વક કેવી રીતે મેળવી શકાય? બ્રહ્મ તો નાશ ન પામનારું અવીનાશી તત્ત્વ છે જે પૂજવા યોગ્ય છે. તે વિષે ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં સાતમાં અધ્યાયના ચોથા શ્લોકમાં જણાવ્યું છે કે ‘(હું) પૃથ્વી, જલ, અગ્નિ-તેજ, વાયુ અને આકાશ તથા મન, બુદ્ધિ અને અહંકાર એમ આઠ પ્રકારની પ્રકૃતિ રૂપે ચારે બાજુ વિસ્તરેતો છું.’ આ યમતકારી કૃતિ મારું જ સર્જન છે. તે સર્વને એક અક્ષરમાં સમજલવનારો પ્રણાવ મંત્ર-ઝાં મારા જ અસ્તિત્વને દર્શાવનારો શબ્દ છે. બાહ્ય વિશ્વમાં પણ દરેક આણુમાં હું જ વ્યાપી રહ્યો છું. હું અને અંદર બહારનું વિશ્વ તેમાં કોઈ ભીન્નતા ન હોવાથી ઈચ્છા અને વાસનાનું સ્વતંત્ર અસ્તિત્વ રહેતું નથી. તેથી ‘હું’ અને ‘મારું’ નો ભાવ રહેતો નથી. ઈચ્છા અને વાસના તો માનવ મન અને બુદ્ધિની ઉપજ છે. આત્મા વાસનાઓથી લેપાતો ન હોવાથી અને તે વ્યાપક તત્ત્વ હોવાથી આત્મા કે પરબ્રહ્મ વ્યાપક તત્ત્વ છે. તે દસ્તિએ શ્રી સાઈનાથ મહારાજ પણ વાસનાઓના ગુલામ ન હોવાથી તેમને કારણે ઝેંચાવું પડતું નથી. કામનાઓ તો તેમની ગુલામ છે. માટે શ્રી સાઈનાથ મહારાજ પરબ્રહ્મ સ્વરૂપ છે. માટે મનુષ્યમાં રહેતી કામનાઓ તેમનું સ્મરણ કરતાની સાથે જ જેમ કમોસમે પડેલા બરફના કરા સૂર્યનાં કિરણો પડવાથી પીગળી જથ્ય છે તેમ તેમનો નાશ થાય છે.

હું મન, બુદ્ધિ અને સ્થુળ કે વિરાટ સ્વરૂપ નથી. તે રીતે સુફ્કમ કે હિરણ્યગર્ભ પણ નથી. હું તો અનાદી છું અને સાક્ષી ભાવે નીરખનારો છું. તેથી મને ઈદ્રિયોના વિષય પ્રાચ્ય કોઈ આસક્તિ નથી. વળી કર્તા અકર્તા પણ હું નથી. એ ધ્યાનમાં રાખવું જેઠાએ કે જ્યાં મન, બુદ્ધિ અને ઈદ્રિય સમૂહ જડ છે એવી સમજણા જન્મે ત્યારે તેની પ્રાચ્ય વિરક્તી ઉભી થાય છે. તે માટે જ્ઞાન પ્રાપ્ત કરવું જેઠાએ. દેહભાન પ્રાચ્ય જગૃત મનુષ્યોને માયા પજવે છે. તેવા ઈશ્વરની માયારૂપી શક્તિનો આવા મનુષ્યો માટે જ જન્મ થાય છે. જ્યારે મનુષ્ય એમ સમજે કે હું કેવળ ‘ચૈતન્ય સ્વરૂપ’ છું ત્યારે તેનામાં પૂર્ણ આનંદ પ્રગટે છે. જે માનવ મારું ધ્યાન ધરે છે તેજ મારી સેવા અને ભક્તિ કરે છે. હું ચિદાનંદ સ્વરૂપ છું એવી જેને અનુભૂતિ થાય છે તેને જ્ઞાન કહેવાય છે.

‘અધ્યાત્મા બ્રહ્મ’ અને ‘પ્રજ્ઞાનમાનંદ બ્રહ્મ’ એટલેકે ‘આ આત્મા જ બ્રહ્મ છે અને જ્ઞાન અને આનંદ પણ બ્રહ્મ છે. આ દ્શ્ય જગત સાચું નથી પણ એ મિથ્યા છે. તેથી દ્શ્ય જગત વિષયોમાંથી ઉત્પન્ન થયું હોવાથી તે વિષયી બ્રહ્મ કહી શકાય. હું તો પરમતત્ત્વ રૂપે પ્રકારણારું બ્રહ્મ છું.’ આ બાબતો સમજલવતાં ભગવાન શ્રી કૃષ્ણ વધુમાં કહે છે હું નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

અને સત્ય સ્વરૂપે સાક્ષાત વાસુદેવ છું. બ્રહ્મનું દર્શન કરાવનાર અંધે પણ હું જ છું. મારું આ પ્રકારનું સ્વરૂપ સમજને ભક્તે મારું ભક્તિભાવ પૂર્વક પૂજન કર્યું જોઈએ. તે તેને માટે કલ્યાણકારી હશે. ‘હું કોણ છું’ એ તત્ત્વનો બરોબર સમજનાર મારે શરણે આવે તો મારામાં એકરૂપ થઈ જય છે. શું નહીં સમુદ્રમાં ભળી ગયા પાછી ફરી શકે છે? સમુદ્રને આલિંગન આપતી સરિતાનું તે પછીથી અલગ સ્વરૂપ રહે છે. ખું? તેમનથી થતું. તેલથી ભૌલયેલી દીવેટ જે દીપ જ્યોતિને બેટે તો તે સ્વયં જ્યોત બની જય છે. સંત સમાગમથી ભક્તોની પણ તેવી જ સ્થિતિ થાય છે. (ઓવી ૮૭ થી ૧૦૦)

પૂર્ણ ચૈતન્ય ક્રોત પરમેશ્વર અથવા અલ્લાહ માલિકનું જે સતત ચિંતન કરે છે તે શાંત અને સમદર્શી બને છે. તેનામાં અહંકાર શૂન્યતા એટલે હું પણ ન હોય, નિર્મત્વ એટલે આસક્તિનો અભાવ હોવો, નિરહંકૃતિ એટલે જ્ઞાન કે કર્મનો અહંકાર ન હોવો. અને નિર્દ્દિષ્ટ અર્થાત્ સુખ-દુઃખ, લાભ હાની જેવા પરસ્પર વિરોધી મનોવિકારોથી અલીપત રહેવું આ ચાર ગુણો હોય તો અહંકારવાળી અહંકારી સ્થિતિ હોઈ શકતી નથી. શ્રી સાઈમાં ઉપરોક્ત સહૃદગુણો હોવાથી તેમનામાં હું પણ જેવા અહંકારની સ્થિતિ ન હતી. શ્રી સાઈનાથનો ‘હું’ અહં બ્રહ્માસમી-હું જ બ્રહ્મ છું પ્રમાણે બ્રહ્મ જેવો વિરાટ છે. તેની સરખામણીમાં મારો લેખકનો હું ઘણો નાનો છે. જે સાઈના વિરાટ હું નો નાનકડો અંશ છે. હું મારો ‘અહં-હું’ શ્રી સાઈનાં ચરણોમાં સમર્પિત કરું છું. તેજ મારી સાઈ સેવા છે. શ્રીમદ્ ભાગવત પુરાણમાં ભગવાન શ્રીકૃષ્ણ પ્રભુએ વચન ઉચ્ચાર્યા છે કે ‘જે મારી સેવા તથા ભજન કરે છે અને અનન્ય ભાવે મારે શરણો આવે છે તે મારામાં જ એકરૂપ થઈ જય છે. તેથી તેને મુક્તિ પ્રાપ્ત થાય છે.’ કીડો ભમરાનાં દંશના ડરને કારણે ભમરાનું ધ્યાન કરે છે. છેવટે તે પોતેજ ભમરો થઈ જય છે. તેજ રીતે શિષ્ય પણ ગુરુભક્તિ કરતાં કરતાં ગુરુ સમાન બની જય છે. ‘ગુરુ સમાન’ આ શાષ્ટ્રમાંનો સમાનના જેવો – જેટલો અલગતાનો ભાવ ગુરુથી સહન થતો નથી. તેથી એમ કહી શકાય કે ગુરુને શિષ્ય સિવાય ગુરુત્વ નથી. અને શિષ્ય ભાવ ગુરુ ભાવથી અલગ થઈ શકતો નથી. તે બંને એકજ છે. (ઓવી ૧૦૧ થી ૧૦૭)

સાઈ પૂજા માટે જે આજા થઈ તે સાઈ કોણ છે એની વિશાદ વ્યાખ્યા કરી. તે ભાવને દ્રદ કરવા માટે મને જે એક વાત યાદ આવી તે હું તમને કહું છું. એક સમયે રોહિલ ખંડમાંનો એક રોહિલા જાટ મુસલમાન શિરડીમાં આવીને ઘણા દિવસો સુધી ત્યાં રોકાયો. તે બાબાના સંપર્કમાં આવતાં તેમના ગુણોથી મોહિત થયો અને બાબાને ચાહવા લાગ્યો. તે આખતાની જેમ હશ્ચપુષ્ટ અને શરીરિ કદાવર હતો. તે સ્વરૂપંહી વર્તન કરતો હોવાથી કોઈનેય ગાંઠાં નહતો. તે લાંબી ઘેરાવાવાળી અને પગ સુધી પહુંચતી લાંબી કફની પહેરતો હતો. રાત દિવસની પરવા કર્યા વિના તે મસ્જિદમાં હોય કે ચાવડીમાં હોય પરંતુ આવેશમાં આવી જઈને જેર જેરથી કુરાનના કલમા પદતો હતો. આમ તો તે મસ્જિદમાં બાબાની સાથેજ રહેતો હતો. તેની આવી હરકતો હોવા છિતાં ભાબા તેને કશુંજ કહેતાન નહીં. સાઈ તો શાંતિ દૂત હતા. તે મધ્યરાત્રીએ પણ બૂમો પાડતો હોવાથી અને બડભડાઈ કરતો હોવાથી તથા તેના અભદ્ર વર્તનથી ગ્રામજનાં કંટાળી ગયા હતા. આખા દિવસની સર્ખત ગરમી અને પાણી પણ ન મળતું હોવા છિતાં મહેનતકશ લોકોને રાત્રે નીરાંતે ઉંઘ પણ ન મળવાથી તેઓ ત્રાસી ગયા હતા. બાબાને ત્રાસ થતો હોય કે ન થતો હોય તે તો સહન કરી લેતા.

પરંતુ રોહિલા ગ્રામજનો માટે મોહી ત્રાસ રૂપ બની ગયો હતો. ગામ લોકોની દશા એક બાજુ વાડ અને બીજુ કૂવો તેવી થઈ હતી. બાબા તેને કાંઈ કહેતા ન હોવાથી તે માથાભારે તત્ત્વ બની ગયો હતો. તેણે બેશરમીની હદ્દ વટાવી દીધી હતી. તેથી કોષે ભરાયેલા ગામ લોકો બાબાને વિનંતી કરવા માટે પહુંચ્યા. પરંતુ બાબાએ એમની વાતનું કંઈ પણ ધ્યાન આપ્યું નહીં. તેમણે તો વળી એમ કહ્યું છે ‘રોહિલાને સતાવશો નહીં એ મારો માણસ છે.’ રોહિલાની સ્વી તેને છોડીને બીજા પુરુષ સાથે ચાલી ગઈ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

છે. તેને રોહિલા સાથે સંસાર કરવાનું ગમતું નથી. તે બાએ એને છેતરીને મારી પાસે આવવા માટે ઉત્સુક થઈ છે. તે રંડને લાજ મલાને કે પડદો-બુરખો વગેરેની શરમ ત્યલુ દીધી છે. રોહિલો તેને બળજબરીથી ઘર બહાર કાઢી મૂકે તો તે બળપૂર્વક ઘરમાં ધુસવાનો પ્રયાસ કરે છે. જે રોહિલો બૂમાભૂમ બંધ કરી દે તો તે મારા ઘરમાં આવવાનો પ્રયાસ કરે છે. રોહિલો જે બૂમાભૂમ કરે તો તે તરત જ ભાગી જય છે. માટે તેને બૂમાભૂમ કરવા દો અને તેને શેકશો નહીં. તેની બૂમાભૂમ મારે માટે હિતકારી અને કલ્યાણકારી છે. રોહિલો મારે માટે તો કલ્યાણકારી છે. તેની બૂમાભૂમ બંધ થશે તો તે દૃષ્ટિ-રોહિલી મને ત્રાસ આપ્યા કરશે. તે મારાથી પણ દૂર થઈ શકશે નહીં. તે જ્યારે થાકશે ત્યારે પોતાની જને જ શાંતિથી બેસશે. ત્યારબાદ જ તમારું કાર્ય થઈ શકશે. બાબાનાં આવાં વચનો સાંભળીને ગ્રામજનોએ વિચાર્યું જે બાબા તેનાથી હેરાન થતાં ન હોય તો હવે કશું થઈ શકશે નહીં. તેથી તેમણે બધાજ પ્રત્યનો પડતાં મૂક્યાં. આમ તો રોહિલાને બૂમાભૂમ કરવાની આદત અને શોખ તેમાં ફાગણ માસ અને હોળીના તહેવારોને કારણે રોહિલાને બૂમો પાડવા માટેનું મોકણું મેદાન મળી ગયું. તે ગણું સુકાઈ જાય ત્યાં સુધી કોઈપણ તાત્ત્વમેળ વિનાના કુરાનના કલમા બોલવા માંડ્યો. લોકોને એ વાતનું આશ્રય થયું કે આવા બૂમ બરાડાથી કંયાળી જવાય તેમ છતાં બાબા તો તલ્લીન થઈ જાય છે ! બાબા કેટલા મોટા ક્ષમાવાન ગણાય ! દેખાવમાં સાવ ગાંડા ઝંડ-ઝંદ-જેવા રોહિલા માટે બાબા એમ કહેતા કે તેને કોઈએ ઘાકધમકી આપવાં નહીં. રોહિલો ગમે તેવો હોય પરંતુ તેને બાબા માટે પ્રેમ અને આદર હતો. તે પોતાના ધર્મમાં જણાવ્યા પ્રમાણે કુરાનની કલમા પઢતો હોત. વાણી મુદ્દુતા કે કર્કશતા તે કોઈ ભક્તના વરણની વાત નથી. સૌ પોતપોતાની સ્કુરણા અનુસાર જે તે નામનું ઉચ્ચારણ કરતા હોય છે. રોહિલો હેશાં તેના ઘોધરા કર્કશ અવાજથી ‘અત્સાહો અકબર’ એવો ઘોષ કરતો હતો. અને આનંદમાં આવી જઈને કલમા બોલતો હતો. જે કોઈને હરિનામ સ્મરણનો કંટાળો આવે તો તેવા અપવિત્ર માણસોના સ્પર્શનો બાબાને બય લાગતો. તેથી બાબા એમ કહેતા, ‘જેને હરિ બજનની ધૂન લાગી છે તેને કાઢી મુકવાની વાત શું કામ કરો છો ? જ્યાં મારા ભક્તો મારું ભજન કરે છે ત્યાં હું નિદ્રાધીન થયા સિવાય નિવાસ કરું છું.’ આમ કહીને બાબાએ ભગવાનનાં વચનોની પ્રતિતિ કરાવી. રોહિલો વધેલો સૂકો રોટલો ખાતો હતો ત્યાં પડી રહેતો હતો તેને વળી પત્ની કયાં હતી? રોહિલા પાસે ફૂટી કોડી ન હતી તો તેનાં લગ્ન થવાની સંભાવના કયાંથી હોય ? જેની પત્ની જ ન હતી તે સ્વી બાબા પાસે કેવી રીતે જાય ? બાબા તો અખંડ બ્રહ્મચારી હતા. આ વાર્તા ઉપજલી કાઢેલી હતી. બાબાને તેના બૂમ બરાડા કરતાં તે કુરાનના કલમા પઢતો હતો તેનાથી બાબાને સંતોષ થતો હતો. બાબા રાત હિવસ જગીને તેના કલમા સાંભળતા હતા. બાબાને રોહિલાના કલમાની ઉદ્દેશ્ય પૂર્ણ વાતમાં રસ હતો. તેમને ગામ લોકોની અર્થહીન વાતોમાં જરાય રૂચી ન હતી. ગ્રામજનોની શાન કેઠાણે લાવવા માટે બાબાએ આવું નાટક કર્યું હતું. તે દ્વારા એમણે લોકોને સમજન્યું કે નામ સ્મરણ કરનાર રોહિલાનો સંગ મને ગમે છે. તેનો લોકોને અનુભવ કરાવીને વાત સમજવી. જેને દર્શન જેવાતી વસ્તુ, દશા જેનાર વ્યક્તિ અને દર્શન જેવાની કિયા આ ત્રણેમાં ચૈતન્ય સભર લાગે તે ભલે બ્રાહ્મણ કે પઢાણ હોય પણ બાબા માટે સહુ સમાન હતાં. (ઓવી ૧૦૮ થી ૧૪૧)

એક દિવસ મધ્યાહન સમયે ભક્તજનો આરતી ઉતારીને પોતાને ઘેર જવા નીકબ્યા તે સમયે બાબાના શ્રી મુખેથી જે વચનો બોલાયા તે સાંભળવા જેવાં છે. ‘તમે ઘરમાં હો, કોઈ સ્થળે હો કાંઈ પણ કાર્ય કરતા હો પરંતુ એટલું યાદ રાખજો તમારાં કાર્યોની રહેરનાની ખબર મને સતત મળ્યા જ કરતી હોય છે. તમને મારો પણ એવોજ અનુભવ થતો હશે કે હું સર્વેનાં હદ્યોમાં વાસ કરી રહ્યો છું. હું સધળે વિચરનારો સર્વગામી છું અને સર્વનો સ્વામી છું. હું સળવ હોય કે નિર્જવ સકળ સૂચિનાં આણુંએ આણુમાં વ્યાપી રહ્યો હોવા છતાં તેનાથી વિશેષ છું. દિશ્યરે અગાઉથી ઘડેલી યોજનાનો હું જ મુખ્ય સુત્રધાર અને સમગ્ર સૂચિનો સર્જનહાર છું. હું સત્ય, રજસ અને તમસ એ ત્રણે ગુણોની સપ્રમાણ વ્યવસ્થા કરનારો

શ્રી સાઈનું સત્ય ચટિત્ર

વ્યવસ્થાપક છું. હું જ પાંચજાનેન્દ્રીય, પાંચ કર્મેન્દ્રીય અને મન એમ સધળી ઠંડીઓનો ચાલક છું. હું સર્જક, પાલક અને વિસર્જન કરનારો છું. જોણે પોતાનું ચિત્ત મારામાં સ્થિર કર્યું હોય તેને કોઈ પણ પ્રકારનું વિધન નહતું નથી. પરંતુ જે મને વિસરી જય છે અને ઈશ્વરથી મોહિત કરનારી શક્તિ માયા ચાબખા મારે છે અને તેને છેતરે છે. ભગવાન શ્રી કૃષ્ણો અર્જુનને ગીતાજીમાં આવોજ ઉપદેશ આપ્યો છે.'

ઇશ્વર: સર્વભૂતાનાં હૃદેશેર્જુન તિષ્ઠતિ ।

ભ્રામયન્સર્વભૂતાનિ યંત્રઋદ્વાનિ માયયા ॥૬૧॥ અ. ૧૮

(હે અર્જુન ! ઇશ્વર સધળાં પ્રાણીઓનાં હૃદયમાં વાસ કરે છે. તેની માયા દ્વારા બધાં પ્રાણીઓ યંત્રની જેમ ફરતાં રહે છે.)

તમેવ શરણ ગચ્છ સર્વ ભાવેન ભારત ।

તર્ચસાદાતપરાં શાંતિ સ્થાન પ્રાપ્યયસિ શાશ્વતમ् ॥૬૨॥ અ. ૧૮

(હે ભારત તું સર્વ ભાવથી તે પરમેશ્વરને જ શરણો જી, તેની કૃપાથી તું પરમશાંતિ અને સનાતન સ્થાન મોક્ષ પદ પામીશ.)

તે પ્રમાણે ભૂતી સબાહ્યાભ્યંતરી । ભરુનિ ઉરેલા ચરાચરી । આ વિધાનની પુષ્ટિ માટે પુરુષ સૂક્તનો પ્રથમ મંત્ર સરખાવી જુવો:-

સ ભૂર્મિ વિશ્વતો વૃત્ત્વાડત્યતિષ્ઠત્ દશાંગુલમ ।

આ પુરુષ સમગ્ર વિશ્વને પોતાનામાં આવરી લઈને દ્વારા આંગળાં જેટલો મોટો રહીને સ્થિર થયો છે. આ જગતમાં જે કંઈ દેખાય છે તે માઝું જ સ્વર્ણપ છે. કીડી, કીટક, ભીખારી કે રાજ હોય અથવા સમગ્ર અમાપ સ્થાવર જંગમ વિશ્વ હોય તે સધળું તે આ સાઈનું જ સ્વર્ણપ છે. (ઓવી ૧૪૨ થી ૧૪૮)

આ કેવો સુંદર અને સૂચક દીશારો છે. સંત અને ઈશ્વર બંને અતિગ નથી પણ એક અને અભેદ છે. સમગ્ર જગતના દરેક સ્વર્ણપના ઉદ્ઘાર કરવાને માટે ઈશ્વર અવતાર ધારણ કરે છે. ગુરુ ચરણોમાં લીન થવા માટે ગુરુના ગુરુણા ગાવા, ગુરુ કથાનું ભક્તિપૂર્વક શ્રવણ કરવું અને તેમનું કીર્તન કરવું. આ પ્રકારે કથા સાંભળવાથી શ્રોતા અને શ્રવણ કરેલા વિષય વચ્ચેથી જુદાઈ સહજપૂર્વક દૂર થઈ જય છે. તેમનાં હૃદયમાં ચૈતન્યનું પ્રાકટય થતાં સાધકોનું મન પરમેશ્વરમાં લીન થઈ જય છે. સંસારમાં ગરકાવ થયેલા જનોથી થોડો પણ પ્રયાસ થયો ન હોય તેમ છીતાં ફક્ત સંત કથા જે સાંભળવાની મળે તો પણ આવા માનવીનું કુદરતી રીતે જ કલ્યાણ થાય છે. જે એ કથા ભક્તિભાવ પૂર્વક શ્રવણ કરાય તો તેનું કેટલું બધું શ્રેય મળે ? શ્રોતાઓએ આ બાબતનો હૃદયપૂર્વક વિચાર કરવો જેઠિએ. ભક્તિપૂર્વકના શ્રવણથી ગુરુચરણ પ્રિતિ પ્રાપ્ત થશે અને ધીરે ધીરે પરમ સુખની પ્રાપ્તિ થશે. તેને માટે બીજા નિયમો, નિષા કે ધર્મની જરૂરિયાત નહીં રહે અને પરમહિત સધારણો. મનથી નિશ્ચય પૂર્વક કરેલા કથા શ્રવણથી પરમ આનંદની વૃદ્ધિ થાય છે અને વિષયનાં બંધનો તૂરી જતાં લાલસામાંથી સરળતાપૂર્વક મુક્ત થવાય છે. (ઓવી. ૧૪૮-૧૫૫)

પરમ શ્રદ્ધેય બાબાની ઉપરોક્ત વાણી સાંભળીને મેં નિર્ધાર કર્યો કે હવેથી નર સેવાને બદલે ગુરુ સેવા જ કરવી. પરંતુ મનમાં દ્વિધા થઈ કે જેમ આણણા ચીંચણીકરની વિનંતીનો જવાબ આપતાં બાબાએ કહ્યું હતું કે ‘મળશે સાલી નોકરી’ તે રીતે ખરેખર તેવું મારાથી અનુભવાશે ખરું ? બાબાના શર્ષ્ટો વ્યર્થ ગયા હોય તેવું આજ સુધી બન્યું તો નથી. નર સેવાનો મોક્ષો તો મળશે પણ તેથી કોઈ ખાસ હિત સધારય તેમ લાગતું નથી. આણણાનું બાબાને પૂછીવું તે તેમની રીતે બરાબર હતું અને એવું ન હતું કે મારી ઈશ્વરા ન હોય. તેજ રીતે નસીબમાં હશે તેમ થશે અને તે બોગવી લેવાશે તેવું પણ ન હતું. હું

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

વિચારતો હતો કે મને નોકરી મળવી જેઠે સંસાર નિર્વાહ થઈ શકે. શ્રી સાઈબાબાએ મને આંગળીએ ગોળ બતાવીને કડવું ઔષધ પીવડાવી દીધું. હું ગોળની આશાએ તે ઔષધ પી ગયો. હું સંતોષ પામ્યો અને તૃપ્ત થયો. પેન્શન શરૂ થયા પછી પાંચ વર્ષ બાદ મને સેકેટરીએટમાં છ માસ માટેની હંગામી નોકરી મળી. જે વાત મારી કલ્પના બહારની હતી. પરંતુ તે જે રીતે મળી હતી તેજ રીતે છૂટી પણ ગઈ. ત્યારબાદ બાબાએ મને કદી નાશ ન પામે તેવી સુખ પ્રાપ્તિ માટે ગ્રંથનું લેખનકાર્ય કરવા માટે તેની તૈયારીમાં જેતરી દીધો. (ઓવી ૧૫૬-૧૬૩)

આ સંપૂર્ણ જગત ભગવાનનું સ્વરૂપ છે. તેમ છતાં તે ભગવાન જગતથી પણ પર એવો પરમેશ્વર છે. ઇશ્વર જગતથી અલગ નથી પણ જગત ઇશ્વરથી જુડું છે. જગતની ઉત્પત્તિ થઈ ત્યારથી સળવ અને નર્જવ વસ્તુઓની હ્યાતી છે. તેમનો મૂળ આધાર ઇશ્વર જ છે. એ પરમેશ્વરની પૂજનાં આઠ પ્રકારનાં સ્થાનો છે. મૂર્તિ, યજ્ઞ માટેનો કુંડ, અર્દ્ધિ, તેજ, સૂર્ય મંડળ, પાણી, બ્રાહ્મણ અને માર્ગદર્શક ગુરુદેવ. આ વિવિધ પૂજલ સ્થાનોની સરખામણીમાં ગુરુદેવ સર્વશ્રેષ્ઠ પૂજલ સ્થાન છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ પોતાના ગુરુ સાંદિપનીનાં ચરણોમાં મસ્તક મુક્કિને એમ કહેતા કે ‘સદ્ગુરુનું સ્મરણ કરવાથી હું નારાયણ સંતુષ્ટ થાઉં છું. મારા કરતાં સદ્ગુરુની સ્તુતી વધુ પસંદ કરે છે.’ આ રીતે ગુરુનું મહન્ત્વ શ્રેષ્ઠ અને ગહન છે. સદ્ગુરુનું ભજન કરવું જેને ન ગમતું હોય તેવો મનુષ્ય કમનસીબ છે. તે જન્મ-મરણના ચક્રવામાં પડીને પોતાનો નાશ નોંટરે છે. જન્મ અને મરણના ચક્રવામાંથી મુક્ત થવા માટે કથા શ્રવણ કરવાથી પોતાનો ઉદ્વાર થાય છે. સંતો દ્વારા સહજ રીતે કહેવાયેલી વાતો ઘણીવાર અજ્ઞાનતાનો ગુંચવાડો દૂર કરે છે. તેથી ભયંકર સંકટોમાંથી ઉગરી જવાય છે. આ વાતો યાદ રાખવા જેવી છે. આબનાર સમય કેવો આવશે તેની કોઈને પણ જાણ નથી. આ તો બધા ‘અલ્લામિયાના’ ખેલ છે. પ્રેમાળ ભક્તોએ તો સારા પ્રેક્ષક બનવું. મારામાં કુશાગ્ર બુદ્ધિન હોવા છતાં શ્રી સાઈબાબા જેવા સમર્થ ગુરુ પ્રાપ્ત થયા તે મારું સદ્ગનસીબ કહેવાય. જે એમ ન હોય તો પછી તે પણ ‘અલ્લામિયા’નો ખેલ છે. (ઓવી ૧૬૪ થી ૧૭૩)

આ રીતે ગ્રંથનું પ્રયોગન પૂર્ણ થયું. મને બાબા દ્વારા જે પ્રોત્સાહન અને આશ્વાસન મળ્યાં તે વાત પણ કહી. તેના અનુસંધાનમાં હું બ્રહ્મ છું ની સમજણ તથા બ્રહ્મ પૂજનની વિધી કઈ રીતે થાય તે. પણ સમજાવ્યું. હવે આગલા અધ્યાયમાં બાબાના શિરડીમાં પ્રાક્તયની કથા કહેવાશે. તમે ભલે નાના ભક્ત હો પરંતુ ભોળા ભક્ત છો. તમે એક ક્ષણ સંસારથી દૂર થઈ જઈને અને તેની માથાકૂટ અને ચિંતા વીસરી જઈને આ નિરાળા ચરિત્રનું શ્રવણ કરો. સાઈબાબા ભલે કામ કોઇ આદીથી પર એવા નિર્વિકારી હતા. તેમ છતાં અનેકવિધ નાટકીય અને ચમત્કારિક ખેલ કરનારા હતા. તે પરમેશ્વરનો અવતાર હોવા છતાં પોતાનું અદ્ભુત કાર્ય કરવા માટે સામાન્ય માનવ જેવું વર્તન કરતા હતા. તેમનાં પવિત્ર ચરણકમળમાં ‘સમર્થ સાઈ’ એ નાનકડા નામનો મંત્ર જ્યોતિરાય છે. આ મંત્ર ભક્તો માટે સંસાર મુક્કિન માટેની ચાવી સમાન છે. એમની આ કથા જે સાઈ ચરિત્ર ઝેણે તે અદ્ભુત ચરિત્ર ખૂબજ પવિત્ર છે. તેને જે કોઈ વાંચશે તે પૂર્ણ પવિત્ર થઈ જશે. તેમનાં દુઃખોનો નાશ થશે. કથા સાંભળતી વખતે ઊંઘ આવશે, મન ન ચોટે, ચિત્ત પાગળની જેમ ભટક્યા કરે અને ત્રણે ગુણોના મિશ્રણને કારણે પ્રભુનું સગુણ કે નિર્ગુણ સ્વરૂપ ન હેખાય તેમજ કથામાં બેઠેલી સ્ત્રીઓની શુંગારિક ચેષ્ટાઓ જેવાથી કથાનું ફળ પ્રાપ્ત થતું નથી. એકનાથી ભાગવતના અગીયારમાં અધ્યાયમાં ૭૦૬ થી ૭૧૧ સુધીની પંક્તિઓ આ અંગે જેવી જેઠેએ. આવા અંતરાયો દૂર થાયથી શ્રવણ સુખદ થશે. આ કથા શ્રવણ માટે કોઈ વ્રત, કે વિધિની જરૂરીયાત નથી. કષ્ટદાયક ઉપવાસો કે યાત્રાઓની પણ જરૂર નથી. આ ચરિત્ર સાંભળવું તેજ મૂરતું છે. સાચો પ્રેમ હોય અને ભક્તિનું રહસ્ય જાણી લીધું હોય એરલે શ્રેષ્ઠ પરમાર્થ-મોક્ષ-પ્રાપ્ત થશે. આ કથા શ્રવણથી ત્રાસદાયક અને અશુભ અજ્ઞાનનો નાશ થશે. બીજુ થકવી નાખે તેવી સાધનાઓની જરૂર

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

નથી. આ સાઈ ચરિત્રની કથા સાંભળવાથી થતા પુછ્યનો સંચય કરવો જેઠાએ. ગયા જન્મમાં સુખ દુઃખ ઇથી ફળોનું નિવારણ કરીએ. એજ રીતે આ જન્મનાં ખરાબ કે સારાં ફૂલ્યોને સિલકમાં ન રાખીએ. કંજુસ માણસ કોઈપણ ગામમાં કાંઈ પણ કામ કરતો હોય તો તેને ધનનો દગલો જણાય છે. તે રીતે ભક્તોને સાઈ જ દેખાવા જેઠાએ. (ઓવી ૧૭૪ થી ૧૮૫)

સર્વનું કલ્યાણ થાવ. આ પ્રકારે સંત અને સહજનોની પ્રેરણા પામેલા, ભક્ત હેમાડપંત રચિત શ્રી સાઈ

સમર્થના સત્ય ચરિત્ર ગ્રંથ પ્રયોજન અનુષ્ણાપન નામનો વીજે અધ્યાય આહીં સમાપ્ત થાય છે.

શ્રી સદ્ગુરુ સાઈનાથને અર્પણ.



અધ્યાય વીજનું અર્થ વિવરણ

સામાન્ય રીતે જેતાં આ અધ્યાયમાં ગ્રંથનું પ્રયોજન, શ્રી હેમાડપંતને ગ્રંથ લખવાની આજ્ઞા અને રોહિલાની અભિનય કથાનું વર્ણન એટલું જ જેવા મળે છે પરંતુ આ અધ્યાયને જીણવટ ભરી દસ્તિ જેવામાં આવે તો તેનું અર્થ ગાંભીર્ય સમજય છે.

આ અધ્યાયની ૧૮૫ ઓવીઓ-પંક્તિઓમાંથી ઓગણપચાસ ઓવીઓ તો ખૂદ બાબાના મહામુલા શબ્દો દ્વારા લખાઈ છે. મને એમ લાગે છે કે વાંચકોએ એનું વારંવાર પુનરાવર્તન કર્ણો કે પારાયણ કરવું જેઠાએ.

પહેલી અગ્રીયાર ઓવીઓમાં બાબા પોતાની ભક્તિ અને કથા શ્રવણના મહાત્મ્ય અને મહત્વનું વર્ણન કરતાં કહે છે-

શ્વામા હવે કહું તે સાંભળ | પ્રેમે લેતાં મારું નામ |

પૂર્ણ સહુનાં સંઘળાં કામ | કરું પ્રેમ ભક્તિ પ્રગટાવવા ||૧૧||

જે ગાયે સ્નેહ ભાવથી | ચરિત્ર સ્તુતિ મારાં પ્રેમથી |

આગળ પાછળ ઉલ્લો દું હું | તેની ચારે બાજુએ |

યમરાજના મુખમાંથી | મારા ભક્તને હું ઉગારીશ |

કેવળ મારી કથા સાંભળતાં | રોગ નિર્ભુળ જરૂર થશે ||૧૭||

કરજો કથા સાદર શ્રવણ | કરવું તેનું સદા મનન |

મનન બાદ નિહિદ્યા સન | કરતાં સંતોષ પામશે ||૧૮||

બીજી બત્તીસ પંક્તિઓ, ઓવી છોસેરથી એકસો સાતમાં ધર્માચરણ અને નીતિથી વર્તવાનું માહાત્મ્ય કહેવાયું છે. તે પછી પોતે સર્વવ્યાપી અને ઓમકારના પ્રતિક સમા અવ્યક્ત બ્રહ્મ છે તેમ સમજલીને પોતાનું પૂજન કેવી રીતે કરવું તે સમજયું છે. એમાનાં થોડાંક વચ્ચનો આ પ્રમાણે છે.

જ્યાં સુધી નામ ઇપ આકાશ | છે જગતમાં સ્થાવર જંગમ |

મેં જ કીધો આ ચમત્કાર | સંઘળો અષ્ટધા પ્રકૃતિનો ||૧૯||

શ્રી સાઈનું સત્ય ચારિત્ર

ઉં પણવ એ મારો વાચક । વાચ્ય તેનો છું હું એકજા ।
 વિશ્વાકરે વસ્તુ અનેક । સર્વેમાં હું એક સમાયો ॥૮૬॥
 મન બુદ્ધિ ઈન્ડ્રિયો સકળ । નથી હું વિરાટ કે સ્થુળ ।
 નથી હું હિરણ્યગર્ભ અપ્રકટ । હું સનાતન છું અનાહી સાક્ષી ॥૮૭॥
 સ્વરૂપનું જે વિસ્મરણ । તેજ માયાનું અવતરણ ।
 શુદ્ધ પરમાનંદનું સમરણ । તેજ હું ચૈતન્યધન ॥૮૮॥
 મારી તરફ વાળવી વૃત્તિ । તેજ સેવા ને મહલક્તિ ।
 ચિદાનંદ હું છું તે પ્રતિતિ । થતાં શાનની શુદ્ધ સ્થિતિ ॥૮૯॥
 એમ સમજુ હું કોણ । કરવું મારું યથાર્થ પૂજન ।
 ઉપરાંત થજો અનન્ય શરણ । સમરસ થઈ ભજો મુજ મહી ॥૯૦॥
 કીટકનું ભરમ ધ્યાન । તેવો થતો ભરમ બધમ ।
 શિષ્ય જે કરે નિજ ગુરુ ભજન । ગુરુ સમાજો તે બને ॥૯૦૬॥
 આ ઉપદેશથી સંતોષ ન થયો હોય તેમ અધ્યાયની પૂર્ણાહૃતિ થતા પહેલાં બાબાએ કહ્યું.
 ગમે ત્યાં હશો ગમે તે આચરણી । એટલું રાખજો યાદ કે ।
 અથ થી ઈતિ થતી સર્વકૃતિઓ । નિરંતર જાળ થાતી મને ॥૧૪૩॥
 તેથી હું તે સુચયનું । હું તો સર્વ અંતરયામી હું ।
 હદ્યે રહ્યો છતાં સર્વવ્યાપી । સ્વામી આ સર્વનો છું ॥૧૪૪॥
 સર્વ ભૂતે અંદર બહાર । વ્યાપી રહ્યો હું સચરાચર ।
 સઘળાં સૂત્રો ઈશ્વરીય । હું તેનો છું સુત્રધાર ॥૧૪૫॥
 હું માતા છું સર્વભૂતોની । સાભ્યાવસ્યા નિર્ગુણ તણી ।
 હું જ સકળ ઈન્ડ્રિય પ્રવૃત્તિ । કર્તા ધતાને સુંદરતા ॥૧૪૬॥
 જે મારું ધ્યાન ધરતા । તેને કંઈના ઓટ છે ।
 જે મને વિસરી જતા । મિથ્યા માયા મહી ફસાય છે ॥૧૪૭॥
 સારાંશ : મસ્તિષ્ઠમાં રહેનારા, શરીરે કફીની અને માથે કાપડનો ફડકો બાંધનારા અને ધૂળી પાસે બેસીને ‘અલ્તાહ માલિક’ બોલનારા તે દેહધારી અને વિનાશી સાઈ છે એમ ન સમજતાં હું અવિનાશી, અનાદિ, સર્વવ્યાપી અને ચૈતન્યધન પરમેશ્વર હું એવું માનીને જે મારી પાસે આવશે અને પૂજન કરશે તે મારા જેવા થશે. એમ બાબાએ કહ્યું છે. માટે અંતમાં હેમાઇપંત લખે છે કે—
 ગમે તે ગામે કૃપણ હોય । પણ ચિત્ત એનું રહે ધને ।
 અહનિશ તેને તે જુવે । સાઈમાં મન તેમ રાખવું ।



॥ અધ્યાય ૪ ॥

શ્રી સાઈસમર્થ અવતરણ

(શ્રી સાઈ સમર્થનો પૃથ્વી ઉપર મનુષ્યકુપે જન્મ લેવો)

શ્રી ગણેશજીને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કુળદેવતાને વંદન,
શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રજીને વંદન અને શ્રી સદગુરુ સાઈનાથ મહારાજને વંદન.

આગાઉ જણાવેલા બે અધ્યાયોમાં મંગલાચરણ અને ગ્રંથ પ્રયોજન કહ્યાં. તે સાથે ગ્રંથ કર્તાના અધિકારનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું. આ અધ્યાયમાં શ્રી સાઈનાથને આ પૃથ્વી ઉપર કયાં કઠીન કાર્યો કરવા માટે અવતરણ પડ્યું તે અંગે હું કહું છું તે સાંભળો. હે શ્રોતાગણો-શ્રોતા મહારાજ ! હું તો તમારી ચરણરઙ્ગ સમાન છું. હું આ ગ્રંથ તમને સંભળાવવા માટે તમારી કૃપા યાચું છું. તે યાચના મેળવવા માટે મને વળી શરમ શાની ? સંત ચરિત્ર તો અતિશય મધુર હોય છે. તેમાંથી આ તો સાઈ કથામૃત છે. માટે સાઈ ભક્તોએ કથામૃત પાન કરીને આનંદ મસ્ત થઈ જવું જોઈએ. (ઓવી ૧ થી ૪)

સંતો દિવ્ય આત્માઓનું પ્રાકદ્વય નીચે જણાવેલા સંજોગમાં થાય છે. જ્યારે ખ્રાલણ શાક્રે જણાવેલા વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવાનું છોડી હે છે અથવા પોતે અને અન્ય વળ્ણો ધર્મના પાલન પ્રત્યે આંખ આડા કાન કરે છે ત્યારે શુદ્ધ જલતિના લોકો ખ્રાલણ હોવાનો દાવો કરે છે અને ધર્મચાર્યોનું અપમાન અને હંડ કરે છે ત્યારે સંત પ્રગટે છે. ધર્મશાક્રોનાં વચનોનું પાલન કરાતું ન હોય અને ઘેરે ઘેરે ખુણામાં બેઠેલા લોકો પોતાને ડાઢ્યા સમજુને ગમે તે અર્થધટન કરતા હોય અને પોતાનું વર્ચસ્વ સ્થાપવા મથતા હોય ત્યારે સંત જન્મ ધારણ કરે છે. ખ્રાલણ જ્યારે કોઈ વસ્તુ ઉપયોગમાં લઈ શકાય કે ન લઈ શકાય તે વિચારે નહીં, ભક્ષ્ય કે અભક્ષ્ય ભોજન માટે યોગ્ય હોય કે અયોગ્ય હોય, આચાર-વિચાર સામે દુર્લક્ષ સેવાતું હોય અને ખ્રાલણ જલેરમાં રોટ ટોક વિના દાડ જેવાં નશીલા દ્વાર્યોનું સેવન કરતો હોય કે માંસ ભક્ષણ કરતો હોય ત્યારે દેવ સંત સ્વરૂપે પ્રગટે છે. તે રીતે ખ્રાલણ અને અન્ય જનો ધર્મના અંચળા હેઠળ ચૂપકીદીથી જુલ્મો આચરે છે અને ધાર્મિક સંપ્રદાયોમાં વેરબાવ ફેલાય છે ત્યારે લોકો કંટાળી જાય છે તે સમયે સંત પ્રગટ થાય છે. ખ્રાલણ સહિત યજોપવિત ધારીઓ સ્નાન સંદ્યા જેવા હેવી કાર્યમાં આળસ કરે છે, અનુષ્ઠાનો કરવામાં નિરસતા બતાવે છે અને યોગીઓ જ્યાપ-તપ અને ધ્યાન છોડી હે છે ત્યારે સંતનું પૃથ્વી ઉપર પ્રાગટય થાય છે. જન સમુદ્દ્રાય ધન, સંપત્તિ, ક્રી અને માનપાનને સર્વ સુખોનું કારણ સમજે છે અને પરમાર્થના વિચારોથી મો ફેરવી હે છે ત્યારે સંત અવતરણ થાય છે.

ધર્મ પ્રત્યે ગ્લાની-અઙ્ગચી ઉત્પન્ન થાય અને શાશ્વત મુલ્યોનો હાસ થાય. માનવ સમુદ્દ્રાય અલ્પ આયુષ્યવાળા અને રોગીએ બને તેમજ પેટ ખાતર જીવે અને વિષય સુખમાં રચ્યાપચ્યા રહે તથા તેનેજ સર્વશ્રેષ્ઠ આનંદ માને ત્યારે તેમાંથી જગૃત કરવા માટે પ્રભુ પદ્ધારે છે. મનુષ્યો નીતિભષ્ટ બને, પોતાના વર્ણાશ્રમ ધર્મો ચૂકે, ત્યારે ભગવાન ધર્મની સ્થાપના માટે અને અધર્મના નાશ માટે તથા દીન દુઃખીઓના ઉદ્ધાર માટે અને ભક્તો તથા દુર્ભળોના સંરક્ષણ માટે અવતાર ધારણ કરે છે. સંતો પોતે તો પૂર્ણ પણે મુક્તાત્માઓ છે પરંતુ નીતિ, ધર્મ, ભક્તોના જતન માટે અને બીજાઓના ઉત્કર્ષ માટે જ

શ્રી સાઈનું સત્ય ચિત્ર

ભૂમિ ઉપર અવતરે છે. સંસારે રચેલાં આસક્તિના પાયા ઉપર રચેલાં ઊંચા મકાનો જે હાલી ઉઠ્યાં છે તેમને સંતો નિવૃત્તિના પાયા ઉપર ઊભા કરે છે, જેનાથી સાંસારિક ઉપાધિમાંથી મુક્ત કરી શકાય. આમ કરીને તે પરમાર્થના મંદિરનું સર્જન કરે છે. આ રીતે ધર્મકાર્ય અને ધર્મજલગૃહી પ્રગટાવીને પોતાનું અવતારકાર્ય સિદ્ધ કરે છે. જ્યારે પોતાનું અવતાર કાર્ય પૂરું થાય ત્યારે તે પોતાની અવતારલીલાને સંકેતી લે છે. (ઓવી ૫ થી ૧૬)

અંતરાત્મા સમગ્ર જગતને આનંદ આપનારો પરમેશ્વર છે. તે કલ્યાણ કરનારો અને સુખનો માર્ગ ચિંધનારો ગુરુ પણ છે. તે અંતરાત્મા પ્રેમની પરાકાષ્ઠાનું સ્થાન છે. વળી તે અવિનાશી, અખંડ અને અવિભાજિત છે. મનુષ્યની વાણી ચાર પ્રકારે પ્રગટ થાય છે. તે જ્યારે મુખ દ્વારા પ્રગટ થાય ત્યારે ‘વૈખરી’ કહેવાય છે. તે કંદમાંથી પ્રગટે તો ‘મધ્યમ’ કહેવાય છે. હૃદયની નજીકથી પ્રગટતી વાણી ‘પણ્યંતી’ તરીકે ઓળખાય છે તો નાભી-દૂઢી પાસેથી જન્મેલી વાણી ‘પરા’ તરીકે જણીતી છે. વાણીના કોઈ પણ પ્રકારથી પરમાત્માનું વર્ણન થઈ શક્યું નથી. વેદો પણ નેતિ, નેતિ- ન ઈતિ, ન ઈતિ એટલે કે તત્ત્વ આમ નથી કે આ રીતનું નથી એમ કહે છે. તેજ રીતે શિક્ષા, ઇંદ્ર, બ્યાકરણ, નિરુક્ત, જ્યોતિષ અને કલ્ય એમ છ શાસ્કો તથા ચાર વેદ અને અદાર પુરાણો. આત્મ તત્ત્વ સમજની થંભી ગયા છે. કીર્તનો ગાવાશી પણ તે પરમ તત્ત્વ સમજનું નથી. આ સંજ્ઞેગોમાં મન, વચન અને કાયા દ્વારા કેવળ નમસ્કાર થઈ શકે એટલું જ સાધન બાકી રહ્યું છે. (ઓવી ૧૭ થી ૨૦)

શ્રી સાઈનું એવું આશ્ર્વયકારક અને પવિત્ર ચિત્ર વિચિત્ર લીલા સભર તેમજ પવિત્ર ચરિત્ર સાંભળીને કાન પવિત્ર કરવા જેઈએ. તેજ સર્વ ઈંદ્રીયોના ચાલક છે. તેમજ તેમણે જ બુદ્ધિ આપી છે. તેમના ચરિત્રને યથા કમ ગોઠવી આપનાર સર્વ અંતર્યામી સાઠી ગ્રંથ રચના માટેના કારણભૂત હોવાથી મારે શા માટે ચિંતા કરવી જોઈએ ? એમનો એક એક ગુણ યાદ આવતાની સાથે જ મન અને બુદ્ધિ ચકિત થઈ જય છે. આ સ્થિતિમાં વાણીથી શું વર્ણન થઈ શકે ? શાંત રહેવું તેજ તેમનું વર્ણન કરવા જેવું છે. નાકથી ફૂલોની સુવાસ પામવી, ચામડીથી ઢંડી ગરમીનો અનુભવ કરવો, આંખથી સૌંદર્ય માણવું અને જીબ દ્વારા સાકરનો સ્વાદ લેવો તે દ્વારા પોતે સુખનો અનુભવ કરવાનો હોય છે. બધીજ ઈંદ્રીયો પોત-પોતાનો આનંદ માણે છે-અનુભવે છે. તેમનો અનુભવ શાબ્દો દ્વારા થોડો જ વ્યક્ત થાય છે ? એતો કેવળ સ્વયંનો અનુભવ-અનુભૂતિ છે. તેજ રીતે મને પણ સદ્ગુરુનું વર્ણન અને તેમના અંગેની સ્પષ્ટતાઓ કરવાનું નથી આવડતું. સદ્ગુરુ પોતેજ પોતાની નજીકના માણસ દ્વારા ન ધારેલી બાબાતો અને વર્ણન કરાવે છે. આ વાતો કેવળ શિષ્ટાચાર પુરતી નથી પરંતુ મારા હૃદયના ઉદ્ગારો છે. માટે આદરપૂર્વક ધ્યાન દેવાની પ્રાર્થના કરું છું. (ઓવી ૨૧-૨૮)

ગાણગાપુર, નૃસિંહલ્વાડી કે જે નરસોભાની વાડી તરીકી જણીતી છે તે, ઔરુંબર અને લીલવાડી આ સો દત્તક્ષેત્રો છે. તેવું જ ગોદાવરી નદી કિનારે વસેલું શિરડી ક્ષેત્ર પણ પ્રસિદ્ધ છે. ગોદાવરીનાં પવિત્ર જળ અને તેમની ઉપરથી વહેતો શિતળ વાયુ સૌના અજ્ઞાનના અંધકારનો નાશ કરનારા છે. ગોદાવરીનો મહિમા શ્રેષ્ઠ છે અને તેનું વર્ણન રુચીકર છે, તે જગપ્રસિદ્ધ વાત છે. ગોદાવરી મૈયાને કિનારે પ્રસિદ્ધ સંત શિરોમણી વસતા હતા. તેને કિનારે વસેલાં અનેક તીર્થો પ્રસિદ્ધ છે. ગોદાવરીના જલમાં સ્નાન કરવાથી અને તેનું પાન કરવાથી અગણીત પાપોનો નાશ થાય છે એ વાત પુરાણ પ્રસિદ્ધ છે. આવા મહાત્મ્ય વાળી ગોદાવરી નદી પાસે અહેમદનગર જીલ્લાના કોપરગાંબ તાલુકામાં શિરડી ક્ષેત્ર આવેલું છે. કોપરગાંબથી શિરડી જવાય છે. ગોદાવરી ઓળંગા પદ્ધી સામેના કઠિ ઘોડાગાડી ગ્રાવેરો ત્યારે નિમગાંવની નજીક શિરડીનું દર્શન થાય છે. ગોદાવરીના કઠિથી નિમગાંવ થઈને શિરડી જતાં સાડાનવ કિલોમીટરનું અંતર કાપવું પડે છે. નિવૃત્તિનાથ,

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

જ્ઞાનહેવ, મુક્તાબાઈ, જનાબાઈ અને ગોરાંકુંભાર તેમજ નામહેવ તથા તેમનાં માતા ગોણાઈની યાદ આવી જય છે. ‘ગોણાઈ’ને બદલે ‘ગોમાઈ’ શબ્દ પણ હોઈ શકે. ભહિપતિ બુઅા રચીત શ્રી ભક્તિ વિજયમાં ગોમાઈ નામની વિધવા સતીનું વર્ણન આવે છે. ચંદ્રભાગા નદીમાં એક સમયે ભયંકર પૂર આવ્યું. તે સમયે કોઈપણ હોડીવાળાએ તે સતીને વિષ્ટલનાથજીનાં દર્શન માટે સામે પાર લઈ જવાની તૈયારી બતાવી નહીં. તે સમયે ભગવાન પોતેજ હોડીવાળો બનીને આવ્યા અને ગોમાઈ સતીને સામે પાર ઉતાર્યા તેમજ પોતે પોતાના મૂળ સ્વરૂપ ‘વિષ્ટલનાથજી’ થઈને પ્રગટ્યા અને સતીને દર્શન દીધાં.

આ પ્રમાણે સંત તુકારામ, નરહરિ સોની, ગુજરાતના નરસિંહ મહેતા તથા સજન કસાઈ અને સાવંતા માળી જેવા સંતો થઈ ગયા. તે સૌ સંતો સાત્ત્વિક વૃત્તિના તેમજ સમગ્ર વિશ્વ તે પોતાનું જ કુદુંબ છે તેવું માનનારા હતા. તેઓ સંસારથી ત્રાસી ગયેલાઓ માટે આધાર સમાન હતા. સંતવર્ય શ્રી રામદાસ સમર્થ જગત કલ્યાણ માટે ગોદાવરીનો કિનારો છોડીને કૃષ્ણનદીને તરિ પ્રગટ થયા. તેજ રીતે યોગેશ્વર શ્રી સાઈ સૌના કલ્યાણ માટે ગોદાવરી નદી મૈયાની પાસે આવેલા શિરડીમાં અવતર્યા. સંતોને એવી ઉપમા અપાય છે કે તેઓ પારસમણીની જેમ લોખંડને સુવર્ણમાં બદલી નાખે છે. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે તેઓ તેમના ભક્તોને પોતાની જેમ બનાવી દે છે. અર્થાત્ લોખંડને પણ લોખંડના ટુકડાને સોનાનો બનાવવાની શક્તિ પ્રગટાવે છે. (ઓવી ૨૮ થી ૩૮)

સધણી સજ્જાવ અને નિર્જીવ વસ્તુઓ બ્રહ્મ સ્વરૂપ જ છે. આ સમગ્ર દશ્ય જગત તે બ્રહ્માજનો અખંડ વૈભવ છે. સમગ્ર વિશ્વનો હું જ છું અથવા સમગ્ર વિશ્વ મારામાં છે તેવી હું જ વિશ્વ છું આવું અદ્વૈત સાધતી ક્ષણોનું જ્ઞાન થાય ત્યારે જે પરમસુખની મીઠારાની પ્રાપ્તિ થાય છે તેને વિરો શું કહેવું તે સમજનું નથી. આ સ્થિતિએ પહોંચ્યા પદીથી જ્યારે અલૌકિક પોતાપણું પ્રાપ્ત થાય છે ત્યારે પારકાપણું રહેતું નથી. તેથી વૈરભાવ કોની સાથે રાખવાનો હોય ? (ઓવી ૪૦ થી ૪૨)

પંદ્રપુર પાસેના મંગળવેઢીમાં સંત દામોજપંત થયા, તે રીતે સતારા પાસે આવેલા સજજન ગઢમાં સમર્થ શ્રી રામદાસ થયા. ગુરુ ચરિત્રમાં વર્ણવેલા ભગવાન દત્તાત્રેયના બીજ અવતાર શ્રીમન નૃસિંહ સરસ્વતી જે નરસોભાની વાડીમાં થઈ ગયા. તે પ્રમાણે શિરડીમાં શ્રી સાઈનાથનું પ્રાગટ્ય થયું. શ્રી સાઈએ કઠીન સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે તેમજ જે સંસાર પાર ઉત્તરવો કઠીન છે તેને પણ જીતી લીધો છે. પરમશાંતિ તે સાઈનું ભુષણ છે અને તેઓ જ્ઞાનના મૂર્તિમંત ભંડાર છે. સુખની આરામદાયક પળો વિતાવવા માટેનું આ સ્થળ વૈષ્ણવોનું પિયર છે. શ્રી સાઈનાથ ઉદાર વ્યક્તિઓમાં સૌથી મહાન ઉદાર છે તો દાનવીર કર્ણની જેમ મહાન દાનેશ્વરી છે. શ્રી સાઈ સંસારનો ઉત્તમ સાર છે. નાશવંત વસ્તુઓમાં તેમને પ્રિતિ નથી. તેમની વૃત્તિ સદાય આત્મ સ્વરૂપમાં રમ્યા કરે છે. તેમનું લક્ષ્ય પરમ પ્રાપ્તિને મેળવવાનું રહ્યું છે. તે સ્થિતિમાં રમતા સાઈનાથનું શી રીતે વર્ણન થઈ શકે ? જેમને આ લોકમાં પોતાનો ઉત્કર્ષ થાય કે અપકર્ષ-પતન થઈ જય તેની કશીજ ચિંતા નથી. તથા પરલોકમાં સુખ અને આનંદ મેળવવાનો કોઈ અભરણો નથી. શ્રી સાઈનું મન તો અરીસા જેવું નિર્લેપ છે. તેમની વાણી સદાય અમૃતવર્ષી વરસાવી રહી છે. બાબાની નજરમાં તો રાજ કે રંક, સુખી કે દુઃખી, તવંગર કે કંગાળ, દરિદ્ર બધાજ સમાન ન છે. તેમને પોતાના માન અપમાનનો ભય નથી. એ તો સર્વ પ્રાણીઓમાં વ્યાપી રહેલા પરમેશ્વર પોતેજ છે. શ્રી સાઈનાથ લોકો સાથે વાતચીત કરતા હોય, ખંડોબાને અર્પણ થયેલી સ્ત્રીઓ દ્વારા થતાં નાચગાન અને ચેનચાળા નિહાળતા હોય અથવા ગજલ કે ગીતોનો આસ્વાદ માણસી ડોલતા હોય તેમ છતાં તેમની સમાધિમાં જરા

શ્રી સાઈનું સત્ય ચારિત્ર

સરખો પણ ભંગ પડતો નથી. ‘અલ્લાહ’નું નામ સ્મરણ તેમની પોતાની આગવી ઓળખની નિશાની છે.

શ્રી સાઈનાથ પણ ઉપરોક્ત ગીતા કથન પ્રમાણે જવે છે. તે બહારથી અસ્વસ્થ લાગતા હોય તેમ છતાં તેમનું અંત:કરણ શાંત સમુદ્ર જેવું હોય છે. તે બ્રહ્મયર્થાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ કે સંન્યસ્ત આશ્રમ તેમાના કયા આશ્રમના છે તે જાણી શકતું નથી. સાઈ કોઈ નિશ્ચિત આચારધર્મોનું પાતન કરતા હોય તેમ જણાતું નથી. તે પોતાની જગ્યા છોડીને ક્યાંય જતા નથી. તેમ છતાં તેમને દ્વેકે કરેલા વ્યવહારની જાણ છે. એમનો દરબાર ઠાઠમાઠથી ભરપુર હોવા છતાં તેમજ વણસો સાઠ-અનેક-વાતો થતી હોવા છતાં તેમનું મૌન તૂટ્યું નથી. તેમ મસ્જુદની દિવાલને ટેકે ઊભા હોય કે સવારે અને બપોરે બિક્ષા માગવા માટે ગ્રામ્ફેરીમાં જતા હોય અથવા લેંડીબાગ કે ચાકડીમાં ગયા હોય પરંતુ તેવા સમયમાં પણ તેઓ તો તેમની આત્મસ્થિતિમાં જ મળ રહેતા. (ઓવી ૪૩ થી ૫૩)

પૂર્વ જન્મોમાં તેમાંય કયા જન્મ, કાળ અને પ્રસંગે મેં દેવોને પ્રસન્ન કરવા માટે કેવા જ્યા તપ કર્યા હશે કે તેને કરણે શ્રી સાઈનાથ મહારાજે મને આ જન્મમાં તેમનો આશ્રય આપ્યો હશે તે હું સમજું શક્યો નથી. પરંતુ મને એમ પણ લાગે છે કે આ મારા તપનું ફળ નથી કારણ કે હું તો જન્મથી જ દુષ્ટ અને ખલ પુરુષ છું. શ્રી સાઈ તો સર્વ પ્રપંચોથી અને તેમનાં બંધનોથી મુક્ત થઈને પરબ્રહ્મમાં તીન થયા હોય તેવા અને અષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલા સિદ્ધ પુરુષ હોવા છતાં તેમનું વર્તન એક સાધક જેવું હતું. સાધક જેમ જ્યા, તપ, પ્રત, વૈકલ્પ વગેરે આચરતો હોય છે તેવું જ બાબા વર્તતા હતા. તેઓ અહંકાર વિનાના તેમજ અતિવિનભ્ર સ્વભાવના હતા. તેઓ સહુના મન સાચવવા માટે કોઈને પણ હુઃખી થવા દેતા ન હતા. જેમ એકનાથ મહારાજે પૈઠણને અને જ્ઞાનહેલ મહારાજે આંદ્રાનો મહિમા વધાર્યો તેજ રીતે શ્રી સાઈનાથ મહારાજે શિરડીનો મહિમા વધાર્યો. શિરડીના ઘાસને અને તણાખલાને તેમજ પથ્થરોને ધન્ય છે કે તેમને બાબાનાં ચરણોનું ચુંબન મળ્યું. તેમને બાબાનાં ચરણોની ઘૂળ પોતાનાં મસ્તક ઉપર ઘારણ કરવાની તક મળી. મારે માટે તો શિરડી જ માટું પંદરપુર અને શિરડી જ માટું જગ્નાથપુરી. શિરડી જ મારી દ્વારિકાપુરી અને શિરડી જ મારાં ગયા અને કાશી. શિરડી જ મારાં રામેશ્વરમ, બ્રદ્રીનાથ, કેદારનાથ અને નાસિક અંબકેશ્વર અને મહાકાલેશ્વર. શિરડી જ માટું મહાબળેશ્વર અને કણાટકમાં કારવારથી છાપન કિલોમીટરમાં વ્યાપેલું ગોકર્ણ ક્ષેત્ર. શિરડીમાં થતો સાઈનો સમાગમ તેજ અમારે મન વેદ અને ધર્મશાસ્ત્રો છે. તેમના સંપર્કથી સંસારના વ્યવહારો ધીરે ધીરે ઘટતા જય છે અને પરમાર્થનો માર્ગ સરળ બની જય છે. શિરડી સ્થાને સાઈનાં દર્શન તેજ અમારી યોગસાધના છે. તેમણે કરેલાં સંભાષણો અમારાં પાપોને ઘોષી નાખે છે. એમનાં નાજુક ચરણસ્પર્શદી ગંગા, યમુના અને સરસ્વતીના નિવેણી સંગમ સ્થાન સેવન કર્યાની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. તેમના ચરણ તીર્થના સેવનથી લોકેષણા, વિતેષણા અને પુત્રેષણા જેવી વાસનાઓનો ક્ષય થાય છે. એમનો ઉપદેશ અને આજ્ઞાઓ તે અમારે માટે વેદ વચન છે તો બાબાએ આપેલી ઉદ્દીનો પ્રસાદ તેજ અમારે મન પુણ્ય પાવન સાધન છે. સાઈજ અમારા પરબ્રહ્મ અને પરમશ્રેષ્ઠ પરમાર્થ છે. (ઓવી ૫૪ થી ૬૬)

શિરડી સ્થાન તો કેન્દ્ર બિંદુ છે. પરંતુ બાબાના કાર્યના વિસ્તાર ક્ષેત્રો તો ગુજરાત, પંજાબ, કલકત્તા તેમજ ઉત્તર પ્રદેશ, કણાટક અને દક્ષિણ ભારત છે. શિરડીની સાઈ સમાધિ એ તો સધળા સંતોનો મેળાવડો છે. ત્યાંના માર્ગ જતાં દ્વેક મનુષ્યની મુક્તિની દિશા તરફનું પ્રયાણ શરૂ થઈ જય છે. એકાદ વખત જે માણસ જાણું અન્યાંથે પણ સમાધિનું દર્શન કરે તો તેનો જન્મ સાર્થક થઈ જય છે. તો જે સદ્ગ્રામી વ્યક્તિઓએ પોતાનું જીવન બાબા સદેહે પ્રત્યક્ષ હતા ત્યારે તેમની સેવામાં ખર્ચી નાખ્યું હોય તેમના સદ્ગ્રામી વિશે શું કહેવું છે? મસ્જુદ તથા અગાઉનો બુદ્ધીનો વાડો કે જે હાલમાં સમાધિ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

મંદિર છે તેમની ઉપર ખાસ નિશાનીઓવાળી ઘજાઓ હારબંધ ફરફરી રહી છે. તે જાણો કે ભક્તોને બોલાવતી હોય તેમ લાગે છે. શ્રી સાઈબાબાની આસપાસનાં ગામોમાં સંત, મહંત કે સાધુ તરીકેની પ્રસિદ્ધ થઈ અને તેમની મહત્તમાનું પ્રસારણ થયું. ઘણા લોકો એમની બાધા રાખે છે તો કેટલાક તેમનાં દર્શન માત્રથી સંતુષ્ટ થઈ જય છે. દર્શનાર્થીના મનમાં જે સારા નરસા વિચારો હોય અથવા પાપી કે નિષ્પાપ બૃદ્ધિ હોય પરંતુ તેમનાં દર્શન માત્રથી ચિત્ત શાંત થઈ જય છે. તે અનુભવથી મનુષ્યો આશ્ર્વર્ય અનુભવે છે. (ઓવી ૬૭ થી ૭૨)

પંદરપુરમાં વિઠ્ઠલ રખુમાઈનાં જે દર્શન થાય છે તેવાંજ વિઠ્ઠલ દર્શન સાઈબાબાએ શિરડીમાં વિઠ્ઠલ ભક્તને આપેલાં. જે કોઈને આ બાબતે અતિશ્યોક્તિ લાગે તો વિઠ્ઠલ ભગવાનની દદ ભક્તિ કરનારા ગૌળીબુવાના શબ્દો સાંભળવા જેવા છે. તેઓ પંદરીનાથના વારકરી એટલે કે દિવસ નક્કી કર્યો હોય તે દિવસે નિશ્ચિત સમયે જનારા ભક્ત હતા. તેમનો શ્રી સાઈબાબા પ્રત્યે ખૂબજ પ્રેમ હતો. તે જ્યારે પંદરપુરની ફેરીએ જતા ત્યારે શિરડીમાં પણ જતા. તે પોતાની સાથે ભાર વહન માટે ગધેડું અને એક શિષ્ય રાખતા હતા. તે હમેશાં ‘શ્રી રામકૃષ્ણ હરિ’નો જપ કરતા હતા. ચાતુમાસમાં ગંગા નદીને તીરે તથા બાકીના આઠમાસ પંદરપુરમાં રહેવાનો તેમનો ક્રમ હતો. તે દુરમિયાનની મુસાફરીમાં તે શિરડી જતા અને બાબાને મળતા. તે હમેશાં બાબાને સંબોધીને એમ કહેતા કે ‘અનાથોનો નાથ અને દ્વાવાન પંદરીનાથ તે આજ છે’. રેશમી ડિનારીવાળાં ઘોતીયાં પહેરિને કાંઈ સંત નથી થવાતું. સંતને તો હાડકાંના મણકા તથા લોહીનું પાણી કરવું પડે છે. અમસ્તુ દેવત્વ પ્રગટતું નથી. આ બાબા જ પ્રત્યક્ષ પંદરીનાથ વિઠ્ઠલ છે. ગાંડા રે ગાંડા ! તેમને પૂર્ણ પણ જાણીને તેમનું દેવત્વ પીછાણો. જે પંદરીનાથના પરમભક્ત ગૌળીબુવા આવા વચ્ચનો ઉચ્ચારે તો મારા જેવા પામર મનુષ્યનું મહત્વ કેટલું હોઈ શકે ? ભક્તજનોએ પોતેજ અનુભવ કરીને ખાત્રી કરવી જેઠાએ તે વધુ યોગ્ય છે. (ઓવી ૭૩ થી ૮૧)

શ્રી સાઈબાબાને નામસ્મરણ પ્રત્યે ખૂબજ પ્રેમ હતો. તેઓ સદાય ‘અલ્લા માલિક’ એમ રટ્યા કરતા હતા. ઘણીવાર તે ભક્તજનોને પોતાની સન્મુખ સાત દિવસ સુધી અખંડ નામ જપ કરાવતા હતા. સાઈભક્ત ‘દાસગણુ’ પાસે બાબાશ્રીએ નામ જપ કરાવીને વિઠ્ઠલનાથજીનાં દર્શન કરાવ્યાં તે વાત જાણવા જેવી છે. તે પૂર્વે ‘દાસગણુ’ વિષે જાણવું આનંદપ્રદ રહેશે. ‘દાસગણુ’ મહારાજનું મૂળનામ ગણેશ હતાત્રેય સહસ્રબુદ્ધે હતું. વ્યવસાયે તે પોલીસ વિભાગમાં નોકરી કરતા હતા. તેમ છાતાં તેમને ભવાઈ અને તમાશાનો શોખ હતો. પોતે લાવણીનાં ગીતો પણ લખતા હતા. ઈ.સ. ૧૮૮૪નો સમય હતો. તે સમયે અહેમદનગરના કલેક્ટરના ચીટનીસ તરીકે સ્વ. નાનાસાહેબ ચાંદોરકર હતા. તેમની સાથે સહસ્રબુદ્ધે પ્રથમવાર શિરડીમાં આવ્યા. તેમની આ પ્રથમ મુલાકાત વખતે જ બાબાએ સહસ્રબુદ્ધેને ભવાઈ-તમારાની આદત અને પોલીસ ખાતાની નોકરી છોડવા માટે જણાવ્યું. પરંતુ સહસ્રબુદ્ધેને ફોજદારની પાયરી મેળવવાની દિચ્છા હતી. ભવાઈ અને તમાશો એ બંને તેમને ગમતા વિષયો હતા. તે બંને બાબતો છોડવા માટે તૈયાર ન હતા. અંતે બાબાએ પોતાની દેવી શક્તિઓ દ્વારા અતૌકિક કીમિયો કર્યો કે સહસ્રબુદ્ધેએ ઉપરોક્ત બંને વાતો છોડી દીધી અને તે અનન્ય ભાવથી બાબાનાં ચરણોમાં સમર્પિત થયા. બાબાએ તેમને અનેક ચ્યમતકારો દ્વારા હિંય અનુભૂતિ કરાવીને ફૂપા કરી. તેથી સહસ્રબુદ્ધેની બાબા પ્રત્યેની ભક્તિમાં વૃદ્ધિ થઈ. બાબાએ ફૂપા કરીને તેમની પાસેથી સંત ચરિત્રો અને ભજનો લખાવ્યાં અને તેમની કાવ્યશક્તિને સત્કાર્ય માટે પ્રેરણા આપી. સહસ્રબુદ્ધેએ અર્વાચીન સંતોનાં ચરિત્રો ‘ભક્ત લીતામૃત’ અને ‘સંત કથામૃત’ એમ બે ગ્રંથો લખ્યા છે. તે રીતે તેમણે શોગાંવના પ્રસિદ્ધ સંત ગજનન મહારાજ વિષેની એકવીસ અદ્યાયો વાળી એક પ્રાસાદિક પોથીનું પણ લેખન કર્યું. તેમણે રચેલાં પદો જેવાં કે ‘શિરડી માઝે પંદરપુર’, સાઈબાબા રમાવર, ‘સાઈ રહેમ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

નજર કરના' તમેજ 'રહમ નજર કરો અબ મેરે સાઈ' શિરડીમાં બાબાશ્રીની આરતી સમયે ગવાતાં હોવાથી ભક્તોને મુખપાઠ થઈ ગયાં છે.

એક તમસ્સું પ્રકૃતિના હવાલદારને ભક્તિનો માર્ગ દર્શાવ્યો અને તેમની પાસેથી સંત ચરિત્રો લખાવ્યાં. બાબાએ તેમને પંચાણું વર્ષનું આયુષ્ય બક્ષ્યું અને તેમને સંત તરીકેની પ્રતિષ્ઠા અપી. દાસગણું મહારાજે ઈ.સ. ૧૯૬૨માં દેહ છોડ્યો. દાસગણું મહારાજનું સ્થાન નાંદે જીલ્લાના ગોરકે ગામમાં આવેલું છે. તેમના અનેક શિષ્યો આજે પણ મહારાજું મહારાજના વારસદાર શ્રી અનંતરાવ આઠવલેએ શ્રી દાસગણું મહારાજના બધાજ સાહિત્ય ગ્રંથોનું પ્રકાશન કર્યું છે.

બાબાશ્રીએ દાસગણું મહારાજને નામ સપ્તાહનો પ્રારંભ કરવા માટે સર્વ તૈયારી કરવા માટે જણાવ્યું. તે સાંભળીને દાસગણું બાબાને જણાવ્યું કે 'હું તૈયારી તો કરું છું પરંતુ તે સમયે વિષ્ટલ પ્રગટ થવા જોઈએ.' તે સાંભળીને બાબાએ પોતાની છાતી ઉપર હાથ મૂક્યો અને કહ્યું 'હા... હા... સાક્ષાત વિષ્ટલ પ્રગટ થશે જ. પરંતુ ભક્તમાં ભાવ પ્રગટેલો હોવો જોઈએ.' આ શિરડી તો ડાકોરનાથ શ્રી રણછોડરાયની ઊંક પુરી, પંદ્રીનાથની પંદ્રી-પંદ્રેપુર અને શ્રી કૃષ્ણની દ્વારીકા નગરી છે. તેમને નીરખવા માટે દૂર જવાની જરૂર નથી. શું વિષ્ટલ કોઈ ગુપ્ત જગ્યાએથી થોડાજ આવવાના છે ? ના એ તો ભક્તોના પ્રેમને વશ થઈને અહીંયાં પણ પ્રગટ થશે. પુંડલિક માતા પિતાની સેવા કરીને દેવાધી દેવ શ્રી કૃષ્ણને મોહિત કર્યા. પ્રભુએ તેનો પ્રેમ સ્વીકાર્યો અને કાયમ માટે ઈટ ઉપર ઊભા રહ્યા અને તે સ્થિતિમાં ત્યાં વિસામો લીધો.' તે પછીથી સપ્તાહની શરૂઆત થઈ અને તેની પુરણી મહારાજને વિષ્ટલનાં દર્શન થયાં એમ કહેવાય છે.

બાબાની વચનસિદ્ધિનો બીજો પ્રસંગ જોઈએ. એક દિવસ કાકાસાહેબ દીક્ષિત તેમના નિત્ય નિયમ પ્રમાણે વહેલી સવારે ધ્યાનમાં બેઠા હતા. તે સમયે ભગવાન વિષ્ટલનાથજીએ તેમને દર્શન આપ્યાં. આશ્ર્વય તો એ વાતનું છે કે તે દિવસે દીક્ષિતજી બાબાનાં દર્શન કરવા માટે ગયા ત્યારે બાબાએ પૂછ્યું "વિષ્ટલ" પાટીલ આવ્યા હતા ને ? તારી એમની સાથે મુલાકાત થઈ ને ? એ બહુ મોટો ભાગેડું છે. માટે તું રોકી રાખજે. સમજ્યો ને ? તે એના સ્થાન ઉપરથી સહેજ પણ હાલે નહીં તેવી સ્થિતિ ઊભી કર. જે તુ એકદાણ પણ ચૂકી જઈશ તો તે ભાગી છૂટશે.' આ ઘટના સવારમાં બની. બપોરે એમ બન્યું કે બહારગામથી કોઈ અન્નાંયો માણસ પંદરપુરના વિષ્ટોબાની પાંચ-પચ્ચીસ છબીઓ લઈને વેચવા માટે આવ્યો. દીક્ષિત સાહેબે તે છબી જોઈ. વિષ્ટલનાથજીની તે છબી જોતાં જ દીક્ષિતજીએ અનુભવ્યું કે તેમને વિષ્ટોબાના જે સ્વરૂપમાં દર્શન થયા હતા તે સ્વરૂપ તે છબી પ્રમાણેનું જ હતું. તે જોઈને દીક્ષિત સાહેબને મનમાં આશ્ર્વય થયું. સવારે પૂજય બાબા જે બોલેલા તે વચનો તેમને યાદ આવ્યાં. તેમણે છબી વેચનારા પાસેથી તેની કિંમત આપીને એક છબી ખરીદી અને તેને ભક્તિભાવપૂર્વક પૂજનમાં મૂકી. (ઓવી ૮૨ થી ૮૫)

શ્રી સાઈનો વિષ્ટલ પૂજન પ્રત્યેનો આદર અને મધુર કથાનું પાન કરો. ભગવંતરાવ ક્ષીરસાગરના પિતા શ્રેષ્ઠ વિષ્ટલ ભક્ત હતા. તેઓ વારંવાર પંદરપુરની યાત્રા કરતા હતા. ભગવંતરાવના પિતાનું મૃત્યુ થયું તેથી સુતકને કારણે ઘરની વિષ્ટલનાથજીની મૂર્તિનું પૂજન તથા નૈવેદ્ય થઈ શક્યા નહીં. વળી શ્રાદ્ધ કરવાનું પણ રહી ગયું. તે સાથે પંદરપુરની યાત્રા અને કથા-વાર્તા પણ બંધ થઈ ગયા. એક દિવસ ભગવંતરાવ શિરડી આવ્યા. તેમને જોઈને બાબાએ ભગવંતરાવના પિતાને યાદ કર્યા અને બાબા બોલ્યા 'એ તો મારો મિત્ર હતો પરંતુ ભગવંત તો મારા મિત્રનો મુત્ર છે. એ કારણથી જ હું તેને અહીં ખેંચી લાવ્યો છું. તે કોઈ દિવસ નૈવેદ્ય ધરાવતો નથી. તે મને અને વિષ્ટલને ભૂખ્યા રાખે છે. હું તે યાદ કરાવીને પૂજન કરાવીશ. તે માટે જ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

મેં એને અહીં બોલાવ્યો છે.' (ઓવી ૮૬ થી ૧૦૧)

ગ્રહણ, પૂર્ણિમા વગેરે સમયમાં દાન અને પુણ્ય કરવાથી તેમનું અધિક ફળ મળે છે એવું શાખોમાં જડાવ્યું છે. એ વાતને અનુસરીને દાસગણુ મહારાજે અલહાબાદ-પ્રયાગના ગંગા, યમુના અને સરસ્વતીનું મિલન થતાં સર્જતા સંગમ સ્થળે જવાનું વિચાર્યુ. ત્યાં જવા માટે તે પુણ્ય બાબાની આજા લેવા માટે તેમની પાસે આવ્યા. દાસગણુ મહારાજની સંગમતીર્થ જવાની વાત સાંભળીને બાબા બોલ્યા 'અરે ! તેને માટે એટલે બધે દૂર જવાની શું જરૂર છે ? આપણું તીર્થ તો આજ શ્રી ચરણો છે.' દાસગણુ મહારાજે બાબાના ચરણોમાં મસ્તક મૂક્યું. તે સમયે બાબાનાં શ્રી ચરણોના અંગુઠામાંથી ગંગા અને યમુનાના જળ વહેવા લાગ્યા. દાસગણુ મહારાજ આ ચમત્કાર જોઈને ભાવ વિભોર થઈ ગયા. તે પાવન થઈ ગયા. બાબાની આટલી મોટી કૃપાને અનુભવતાં તેમની આંખોમાંથી અશ્વધારા વહેવા લાગી. તેમની વાણીમાં સ્કુરણા વધી અને બાબા પ્રત્યેનો પ્રેમ છલકવા લાગ્યો. બાબાની અગણિત શક્તિઓ અને લીલાઓ ગાવાથી તેમને સંતોષ થયો. તેમના પદો ખૂબજ મધુર છે. શ્રોતાઓને માટે તેમનું આ પ્રાસાદીક પદ રજૂ કરીને દરછા પુરી કરું છું.

અગાધ શક્તિ અધિંટ લીલા તવ સદગુરુચાયા ॥

૭૯ જીવાતે ભાવિ તારાચા તું નૌકા સદયા ॥૪૨॥

હે સદગુરુ રાય ! તારી શક્તિ અગાધ છે અને તારી લીલા વિસ્મયકારક છે તું એવો દ્વારા હૃતું કે ૭૯ અને અજ્ઞાનીજનોને તારનારી નૌકા બન્યો છે.

વેણી માધવ આપણ હોઉનિ પ્રયાગ પદ કેલે ॥

ગંગા યમુના દ્વારા અંગુષ્ઠિ પ્રવાહ દાખવિલે ॥૧॥

તેં વેણી માધવ-વિષણુ ભગવાન-થઈને પોતાનાં ચરણોને પ્રયાગ બનાવ્યાં અને બંને અંગુઠામાંથી ગંગા યમુનાનો પ્રવાહ પ્રગટ કર્યો.

(દાસગણુજીએ અહીં વિષણુ ભગવાન માટે 'વેણી માધવ' શબ્દ પ્રયોગ્યો છે જે ઘણો જ અર્થસભર છે. 'વેણી'નો અર્થ 'પાણીનો પ્રવાહ' થાય છે. પ્રયાગમાં ગંગા યમુના અને સરસ્વતીનો પ્રવાહ અર્થાત્ વેણી સંગમ રૂપે ભેગા થઈને વહે છે. તે સ્થાભ વેણીના અધિષ્ઠાતા દેવ વિષણુ ભગવાન હોવાથી 'વેણી' અને વિષણુ એટલે કે 'માધવ' એ બંને શબ્દો જેડાતાં અહીં 'વેણી માધવ' શબ્દ કહેવાયો છે. પ્રયાગમાં વેણીમાધવનું મંદિર પણ આવેલું છે. સ્વીઓ વાળ ઓળિને જે ચોટલો ગુંધે છે તેને પણ 'વેણી' કહેવામાં આવે છે. પ્રયાગના સંગમ સ્થાને સ્નાન કરવા આવેલાં યાત્રાણું દંપત્તિ 'વેણી દાન' કહે છે. પતિ પોતાની પત્નીના ચોટલા-વેણીમાંથી થોડાક વાળ કાપીને સંગમમાં પદરાવે છે જેથી પોતાનું આયુષ્ય અને પત્નીનું સૌભાગ્ય વધે.)

કમલોદ્ભવ કમલાવર શિવહર ત્રિગુણાત્મક મૂર્તિ ॥

તૂંચી હોઉની સાઈ સમર્થા વિચરસી ભૂવરતી ॥૨॥

કમળમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્મદેવ, લક્ષ્મીના પતિ વિષણુ અને શિવજી આ ત્રણે દેવની એકજ ત્રિગુણાત્મક મૂર્તિ રૂપે હે સાઈ તું વિચરી રહ્યો છે.

પ્રહુર દિસાલા બ્રહ્માસમ તેં શાન મુખે વહચી ॥

તમો ગુણાલા ધરુનિ રુક્રદ્રપ કધિં કધિં દાખવસી ॥૩॥

શ્રી સાઈનું સત્ય ચારિત્ર

તું દિવસના એક પ્રહરમાં બ્રહ્મદેવની જેમ તારા શ્રી મુખથી જ્ઞાનવાણી વહે છે. તો કોઈવાર તમોગુણ ધારણ કરીને શંકર ભગવાનનું રૈદ્ર રૂપ પણ દર્શાવે છે.

કથી કથી શ્રીકૃષ્ણ સમ બાળલીલા કરીશ ॥

ભક્તમનાસી સરસ કરુની મરણ તું બનીશ ॥૪॥

કોઈક વાર તું શ્રીકૃષ્ણની જેમ બાળ લીલાઓ કરે છે તો કોઈ કોઈ વખત ભક્તોના મન રૂપી સરોવર હંસ પક્ષીની માફક વિહાર કરે છે.

યવન મહણાવેં તરી ડેવિસી ગંધાવર પ્રેમા ॥

હિંદુ મહણું તરી સદૈવ વસસી મશિદિતનું સુઅધામા ॥૫॥

જે તને મુસલમાન કહેવામાં આવે તો તારો અષ્ટગંધ ઉપર પ્રેમ છે. (હે સાંદી ! તને હિંદુઓની જેમ ચંદ્ર લગાડવાનું ગમે છે.) પરંતુ તને હિંદુ ગણવામાં આવે તો હમેશાં સુખેથી મસ્નિજદમાં વસે છે.

ધનીક મહણાવેં જરી તુલા તરી ભિક્ષાટણ કરીશી ॥

ફકીર મહણાવેં તરી કુબેરા દાનેં લાજવિસી ॥૬॥

તને જે ધનવાન ગણીએ તો તું ભિક્ષા માગવા માટે ઘેર ઘેર જય છે. જે તને ફકીર કહીએ તો તું એટલું બધું દાન કરે છે કે તે જેઠને ધન કુબેર શરમાઈ જય છે.

તવૌકસાતેં મસ્નિજદ મહણું તરી વન્હી તે ઠાયા ॥

ધુનીત સદા પ્રજ્વલિત રહે ઉઠી લોકાદ્યાથા ॥૭॥

તારા નિવાસસ્થાનને જે મસ્નિજદ ગણવામાં આવે તો ત્યાં સદાય અંની પ્રજ્વલિત રહે છે અને તેની ઉદ્દી સૌને આપવામાં આવે છે.

સકળપાસુનિ ભક્ત સાબ્ડે પૂજન તવ કરીતી ॥

મધ્યાનહીલા દિનકર યેતાં હોત અસે આરતી ॥૮॥

ભલા ભોળા ભક્તો સવારે તારું પૂજન કરે છે અને સૂર્ય જ્યારે મધ્યાહને આવે ત્યારે બપોરે તે સહુ તારી આરતી ઉતારે છે.

ચાહુ બાજુના પાર્ષ્ટગણસમ ઉલે રાહતી ॥

ચૌરિ ચામરેં કરીં ધરુની તુજ્ઝવર ઢાણતી ॥૯॥

ભક્તો ચારે બાજુ દેવના સેવકની જેમ ઉભા રહે છે અને તને ચામર ઢાળે છે.

શિંગ કડ્યાણેં સૂર સત્ત્રયા દણ દણ તે ઘંટા ॥

ચોપદાર લલકારતી દ્વારી ધાલુનિયા પણ ॥૧૦॥

શિંગાના આકાર અર્ધગોળાકારવાળું વાદ્ય રણશિંગુ મોટા અવાજથી ઝૂકાય છે અને તેની સાથે પિપૂડીના તીણા સૂર અને ઘંટરાવ થાય છે. હાથમાં દંડ અને કમલ અને ખલે પણો બાંધેલા ચોપદાર તારા દ્વારે છડી પોકારે છે.

આરતી સમયી દિવ્યાસની તું કમલાકર દિસસી ॥

પ્રદોશકાળે બસુનિ ધુનિ પુછે મદન દણન હોસી ॥૧૧॥

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

આરતી સમયે તું દિવ્યાસન ઉપર બીરાજથો હોય છે ત્યારે તું લક્ષ્મીપતિ વિષણુ ભગવાન જેવો દેખાય છે. સંધ્યા સમયે જ્યારે તું ઘૂણીની પાસે બિરાજે છે ત્યારે તું કામદહન કરનારા શિવજી જેવો લાગે છે.

અશા લીલા ત્યાં નય દેવાચ્યા પ્રત્યાહિ તવ ઢાર્યી ॥

પ્રચીનીસ યેતાતી અમુચ્યા હે બાબા સાઈ ॥૧૨॥

હે સાઈ ! તારા સ્થાનમાં તરે દેવોની લીલાઓ અને વિવિધ અનુભવોની પ્રતીતિ થાય છે.

એસે અસતાં ઊરીચ મન્મન ભટકત હે ફિરતે ॥

આતાં વિનંતી હીચ તુલા બા સ્થિર કરી ત્યાતે ॥૧૩॥

આમ અકારણ મારું મન અર્થ વીનાનું આમતેમ ભટક્યા કરે છે. તેને તું એક સ્થાને-તારા ચરણોમાં સ્થિર કર એવી મારી વિનંતી છે.

અધમાધમ મી મહાપાતકી ચરણ તુજ્યા પાયાં ॥

આલો નિવારા દાસગણુંએ નિતાપ ગુરુરાયા ॥૧૪॥

હું દાસગણું અધમમાં અધમ અને મોટા પાપો કરનારો મહાપાતકી છું. હે ગુરુરાયા હું તારે શરણે આવ્યો છું. તું મારા નિતાપનું નિવારણ કર.

મનુષ્યો પોતાના પાપ ધોવા માટે ગંગામાં નહાવા માટે જય છે. પરંતુ સાંભળ્યુ છે કે ગંગા પોતાના પાપો ધોવાને માટે સંત ચરણનું શરણું લે છે. જે એમ જ હોય તો ગંગા કે ગોદાવરીની યાત્રા કરવાને બદલે ભક્તિભાવથી આ સંત સ્તોત્ર ગાઈને અને શ્રી સાઈનું મધુર ચરિત્ર સાંભળવામાં આવે તો તેટલું જ પૂજ્ય મળે. (ઓવી. ૧૦૨-૧૦૮)

જેમ નામદેવજીના માતુશ્રી ગોમાઈને નામદેવજી નદીમાંથી મખ્યા અને તમાત નામના વણકરને કબીરજી ભાગીરથી ગંગામાંથી માટી છીપમાંથી મખ્યા તે પ્રમાણે શ્રી સાઈનાથ મહારાજ તેમની આશરે સોળ વર્ષની ઉંમરે શિરડીઘામમાં લીમડાના વૃક્ષ નીચે પ્રગટ્યા. તેઓ જ્યારથી પ્રગટ થયા ત્યારથી જ જગતના સર્જનનું મૂળ તત્ત્વ તેવા બ્રહ્મને જાણનારા બ્રહ્મજ્ઞાની હતા. તેમને સ્વખનમાં પણ વિષય વાસના કે હિંદ્રીય સુખ ભોગવવાની લેશમાત્ર ઈચ્છા ન હતી. તેમણે મોહમાયાને લાત મારીને તગેડી મૂકી હતી. મોક્ષ તો તેમના ચરણોમાં આપોટો હતો. શ્રી સાઈબાબાનો જન્મ કયા દેશમાં, કયા પવિત્ર વંશમાં થયેલો અને તેમનાં માતા પિતા કોણ તેની કોઈનેય ખબર ન હતી. બધા લોકો આ અંગે તેમને પૂછી પૂછીને થાકી ગયા પણ તે વિશે તેમણે કોઈનેય કરી પણ જણાડારી આપી નહીં. તેઓ માતા, પિતા, સગા સંબંધી અને જલત ભાઈઓનો ત્યાગ કરીને લોક કલ્યાણ માટે શિરડી મુકામે પ્રગટ થયા હતા. શિરડીમાં નાના ચોપદારની વૃદ્ધ માતાએ સાઈબાબાના પ્રાક્ત્ય સમયનું વર્ણન કરતાં આશ્ર્વય પ્રગટ કરેલું. તે કહેતાં કે જ્યારે શક્તિઅતના દિવસોમાં તે બાળક સ્વર્ગપે પ્રગટ થયો ત્યારે તે ગૌરવર્ણ વાળો અને ખૂબજ સુંદર હતો. તે લીમડાના વૃક્ષ નીચે પલાઠી વાળીને બેઠો હતો. તેની ઉંમર તો નાની હતી છતાં તે હંડી અને ગરમીને સહન કરતો. જણે તેની ઉપર હંડી ગરમીની કોઈ અસર જ થતી ન હતી. તેનો આશ્ર્વયકરક વર્તાવ જેઠિને સૌ ગ્રામવાસીઓ તેમજ આસપાસના ગામોમાંથી લોકો તેને જેવા આવતા હતા. તે બાળક દિવસે કોઈને મળતો નહીં અને રાત્રીના અંધકારની તેને બીક ન હતી. સૌ કોઈને આશ્ર્વય તો એ વાતનું થતું હતું કે આ બાળમૂર્તિ કયાંથી આવી હુશે ? બાળકના દેહનો સુંદર બાંધો જેઠિને સૌના અંત:કરણમાં પ્રેમ પ્રગટ થતો હતો. તે કોઈને ઘેર જતો નહીં. એ તો રાત દિવસ લીમડાના વૃક્ષ નીચે બેસી રહેતો. સૌને એ આશ્ર્વય થતું કે આ મનમોહક બાળક રાત દિવસ ખુલ્લામાં કેવી રીતે

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

રહી શકતો હશે? સૌને નવાઈ તો એ લાગતી હતી કે બાળક જેવો દેખાતો હોવા છતાં તે વૈરાગ્યનો પૂર્ણ અવતાર લાગતો હોવાથી સૌને તેની નવાઈ લાગતી હતી. (ઓવી ૧૧૦-૧૨૩)

એક દિવસ એક આશ્રમકારક ઘટના બની. બે-ચાર જણાના શરીરમાં ખંડોભાએ પ્રવેશ કર્યો. તેથી તેઓ નાચવા કુદ્વા લાગ્યા અને ધૂણવા લાગ્યા. એક જણે પૂછ્યું કે ‘હે ખંડોભા દેવ આ ક્યા ભાગ્યવંત દેવનું બાળક હશે? તે અહીં ક્યાંથી આવી પહોંચ્યું છે? તમે એની શોધ કરો.’ ખંડોભાએ જવાબ આપ્યો ‘તમે કોદાળી અને પાવડો લઈ આવો અને હું કહું ત્યાં જઈને ખોદો. તમને ત્યાંથી બાળકની માહિતી પ્રાપ્ત થરો.’ જ્યાં તે મનોહર બાળક શ્રી સાઈબાબા બેસતા હતા તે લીમડાના વૃક્ષ નીચે કોદાળી વડે ખોદતાં તે ઢિઠો સાથે અથડાઈ. ઢિઠોનો થર ખોદતાં તેની નીચે એક ભોંયુરુ જણાયું. તે ચૂનાથી બનાવેલા ભોંયરામાં ચાર દીવા પ્રગટેલા હતા. વળી ત્યાં એક પાટલો અને જ્યાં કરવા માટેની ગોમુખી તથા સુંદર જપમાળા હતી. ખંડોભા દેવે જણાયું કે આ સ્થળે તે બાળકે બાર વર્ષ સુધી તપ કર્યું હતું. ત્યારબાદ ઉત્સુક લોકો બાળ સાઈ પાસે જઈને આશ્રમ સાથે અનેક સવાલો પૂછ્યવા લાગ્યા. તે સાંભળીને બાળકે મજલ મશકરી કરતાં કંઈક અલગ જ વાત કહી. તેણે જણાયું ‘તે મારા ગુરુનું સ્થાન છે. મારા પવિત્ર વતનની મને બક્ષીશ રૂપે મળેલી આ જગ્યા છે. તમે સૌ તેનું કાળજીપૂર્વક જતન કરો એટલું જ મારે કહેવું છે.’ બાળકે એ જે આ રીતે કહ્યું તે સૌઅં સાંભળ્યું. પરંતુ બાબા આવી વાત વકોડિત બોલ્યા હશે તેવું મારાથી કેવી રીતે બોલાય? મારી આ ભાષાનું મને જ ખૂબ આશ્રમ થયું. મને એમ પણ લાગ્યું કે મારી આ તે કેવી સમજણ છે? પણ મને એમ પણ લાગે છે કે બાબાનો વિનોદી સ્વભાવ હોવાથી તે તેમનો વિનોદ પણ હોય. ભોંયુરુ તેમનું રહેવાનું સ્થાન પણ હોઈ શકે તેમ છતાં ગુરુસ્થાન કહ્યું તેમાં ખોદું શું થઈ ગયું? શું બાબાને એવું નહીં લાગતું હોય? (ઓવી ૧૨૪ થી ૧૩૪)

બાબાની આજાથી ગામ લોકોએ ભોંયરાને પૂર્વવત્ત બંધ કરી દીધું કે જેને બાબા પોતાના ગુરુનું સ્થાન ગણાવતા હતા. પીપળો અને ઔદુંબર વૃક્ષો જેમ પવિત્ર અને શ્રેષ્ઠ ગણાય છે તેમ બાબાને મન લીમડાનું વૃક્ષ શ્રેષ્ઠ અને પવિત્ર ગણાતું હતું. તે વૃક્ષ પર તેમનો ખૂબજ પ્રેમ હતો. તેથી બાબા તેને આદરપૂર્વક જેતા હતા. મહાણસાપત્રિ, કાશીરામ શિંગ્પી તથા આપ્પા ભગલે જેવા બાબાના સમયના મહાનુભાવો અને તે સમયના શિરડીના નિવાસીઓ તે લીમડાના વૃક્ષવાળા સ્થાનને ગુરુસ્થાન ગણતા હતા. આજે પણ શિરડીના ગ્રામવાસીઓ ગુરુસ્થાન સમજણે તેને ભાવપૂર્વક વંદન કરે છે. મહાણસાપત્રિ વિષે સંક્ષિપ્તમાં કહીએ તો તેમનું આખું નામ મહાણસાપત્રિ ચીમણાજ નાગરે હતું. તે દેવજી હતા અને ખંડોભાના ભક્ત હતા. તેમની કેટલીએ પેઢીઓથી ખંડોભાની વારી ચાલતી હતી. જ્યારે ચાંદભાઈ પાટીલના સગાની જનમાં બાળ ફકીર આવ્યા ત્યારે મહાણસાપત્રિ એ જ ‘આવો સાઈ’ કહીને તેમને આવકાર્યા હતા. ત્યારબાદ સૌ બાળ ફકીરને ‘સાઈ’ તરીકે બોલાવતા હતા. દરણ કાશીરામ શિંગ્પી, આપ્પા જગલે અને મહાણસાપત્રિ એકબીજને સહકાર આપીને શિરડીમાં આવતા સાધુ, સંતો, ફકીરો અને વૈરાગીઓનો આદર સત્કાર કરતા. ઉપરોક્ત સમાધિ સ્થાન અંગે એવી લોકવાયક પ્રસિદ્ધ છે કે સાઈબાબાએ આ સ્થાને મૌન રહીને બાર વર્ષ સુધી તપશ્ચર્યા કરી હતી. બાબાશ્રીના એક ભક્ત સ્વ. રાવબહદુર હરિવિનાયક સાઠે, જે સાઠે સાહેબ તરીકે ઓળખાતું હતું અને શક્તાતના વર્ષોમાં ત્યાં આવનારા યાત્રિકોનું નિવાસસ્થાન બની રહ્યું હતું. તે પછીથી સમય જતાં ઉત્તર અને દક્ષિણ તરફ ઉપરના માળ બાંદ્યા. જ્યારે ઉપર જવા માટે દાદર બંધાતો હતો ત્યારે નીચેની બાજુએ એક ભોંયુરુ દેખાયું. ગુરુસ્થાનવાળા લીમડાના વૃક્ષની આજુબાજુ ચોતરો પણ બનાવ્યો. દાદર નીચે

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

દક્ષિણ દિશામાં એક સુંદર ગોખલો છે. તેની સામે આવેલા ગુરુસ્થાન લીમડાના ચોતરા ઉપર ઉત્તર દિશામાં મુખ કરીને લોકો બેસતા હતા. ગુરુવાર અને શુક્રવારે સૂર્યાસ્ત થયા પછીથી આ સ્થાનને છાણ વડે લીંપીને તેમજ પાણીના છાંટા નાખીને તથા ધૂપ કરીને જે પ્રાર્થના કરવામાં આવે તો તેમને શ્રી હરિ સુખી કરશે. આ વાત જાણીને વાંચકોને અતિશ્યોક્તિ લાગે. કોકને વળી એમ થાય કે તે અતિશ્યોક્તિ તો નહીં હોય ને ? આ વાતમાં સત્ય કેટલું હશે ? આવા કેંક વિચારો આવે. પરંતુ આ વાત સાચી છે. એમા શંકા કરશો નહીં. આ ઉપજલી કાઢેલી વાત નથી. સાઈબાબાએ પોતે ઉચ્ચારેલા આ શાફ્ફો છે અને તેમને સાંભળનારા આજે પણ હ્યાત છે. (ઓવી ૧૩૫ થી ૧૪૫)

સમય જતાં મુંબઈના એલ.એલ.બી. સોલીસીટર સ્વ. હરિસીતારામ દીક્ષિતજીએ આરામથી રહી શકાય તેવો વાડો બાંધ્યો. તેમાં ભાડેથી રહી શકાય તેવી વ્યવસ્થા કરાઈ. ત્યારબાદ થોડા સમય પછીથી નાગપુરના ઘનિક સ્વ. બાપુસાહેબ બુઝીએ પણ ત્યાં વાડો બાંધ્યો. દીક્ષિતસાહેબ તેમનાં પુણ્ય કર્મથી જાણીતા હતા. તેઓ ભાવનાશીલ, શ્રદ્ધાળું અને નિષ્પત્વવૃત્તિવાળા ભક્ત હતા. જ્યારે તે ઈંગ્લેના પ્રવાસે ગયા હતા ત્યારથી તેમનામાં આધ્યાત્મિકતા તરફ આકર્ષણ વધવા લાગ્યું હતું. શ્રોતાઓને એવી શંકા થાય કે કાશી, મથુરા કે દ્વારીકા જેવા નીર્થધામોમાં એમણે પરમાર્થ કેવી રીતે સાધ્યો હશે ? તે અંગેની શંકાનું સમાધાન હવે પછીથી થશે તે બદલ હું શ્રોતાઓની ક્ષમા યાચુ છું. દીક્ષિતજી કાશી, પ્રયાગ, બદ્રીકદાર, મથુરા અને વૃંદાવન તથા દ્વારીકા જેવા તીર્થધામોની યાત્રા અગાઉ કરી ચૂક્યા હતા. તે ઉપરાંત તેમના પૂર્વજીનાં પૂણ્યકર્મોનું બળ અને પૂર્વજનમાં કરેલાં સંતકાર્યોનું ફળ તે બધાના પરિપાક ફેફે તેમને શ્રી સાઈબાબાના દર્શન થયા. પોતાના સ્વ પ્રયત્નો નહીં પરંતુ પ્રારંભને કારણે મળેલો યોગ તે જાણે અંગેનેના શાસનમાં પણ હોવા છતાં પોતાને પગ ઘસડીને ચાલવું પડે તેવું અપંગ પણું હોય તેવું લાગતું હતું. આ તો ઉપર ઉપરથી લાગતો અશુભ યોગ કહેવાય. પરંતુ જેમ પુષ્યનક્ષત્રમાં ગુરુનો યોગ થતાં તે ગુરુપુષ્યામૃત જેવું શુભ નક્ષત્ર બને છે તેમ તેમના શુભ કર્મોને કારણે સાઈ દર્શનનો શુભ યોગ પ્રાપ્ત થયો. તેમને ચાંદોરકર સાથે ઓળખાઈ થઈ અને તેથી સાઈની કીર્તિ સંભળાઈ. તેમણે સાઈને નીરખતાં જણાવ્યું કે ‘સાઈ દર્શનનું મહાત્મ્ય તો જુઓ ! દર્શન થતાં જ લંગડાપણું મટી જશે.’ તે પોતાના પગના લંગડાપણાને લઈને ઉણાપ અનુભવતા ન હતા. પરંતુ તે બાબાને કહેતા, ‘ખુલું લંગડાપણું તો મનનું છે. ઓ સાઈ ! તેનાથી મને મુક્ત કરો.’ તેમણે સાઈને એમ કહ્યું ‘માણસના દેહનું પીજારું ચામડી, લોહી, માંસ અને હાડકાંનો સમુહ છે. વળી સંસારની પ્રપંચ ખટપટો અને વહેવારો તો ક્ષણભંગુર છે. પગ લંગડો રહે તેથી કશું બગડતું નથી.’ (ઓવી ૧૪૬ થી ૧૫૬)

દીક્ષિત સાહેબને શ્રી સાઈબાબાનું પ્રથમ પૂણ્યપાવન દર્શન ઠ. સ. ૨-૧૧-૧૯૦૮ના દિવસે થયું. તેજ વર્ષે તે પૂજય બાબાના ફરીવાર દર્શન કરવા માટે ગયા ત્યારે તેમને ત્યાં રહી જવાનું મન થયું. પહેલાં તો તેમને એવો વિચાર આવ્યો કે પોતાની પાસે કંપનીના જે પચીસ શેર છે તે વેચીને તેના પૈસાથી પતરાનું એક છાપડું બનાવવું જેથી યાત્રિકોને સગવડ મળી રહે. પરંતુ ત્યારબાદ તેમણે નિશ્ચય કર્યો કે પાકું મકાન જ બાંધવું. બીજે વર્ષે નવમી ડિસેમ્બરના દિવસે બાબાની સંમતિ મેળવીને તેમણે બાંધકામ માટેનું શુભ મુહૂર્ત કર્યું. નાગપુરના રાજરામ ઉદ્ધ ભાઈજી જે દીક્ષિતજીના ભાઈ થાય તે માટે અગાઉથી જ આવી ગયા હતા. તે સમયથી લેજસ્ટેટીવ એસેમ્બલી-વિધાનસભાના અધ્યક્ષ તેમજ પ્રસિદ્ધ વકીલ દાહાસાહેબ ખાપડે ત્યાં પહોંચી ગયા હતા. તેમને પોતાને ઘેર જવા માટે બાબાની પરવાનગી મેળવવા માટે ધારી અડચણો આવી હતી. પરંતુ બાબાએ ખાપડેને તેમને ઘેર જવાની અને દીક્ષિતજીને મકાનનો પાયો ખોદવાની આજા દશ ડિસેમ્બરની મળી. આ દિવસનું બીજુ મહત્વ એ કે તે દિવસથી ચાવડીમાં આંતરે દિવસે બાબાશ્રીની રત્રી

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

આરતી ઉતારવાની શરૂઆત થઈ. ઈ.સ. ૧૯૧૧ના મધ્યમાં આવતી રામનવમીના શુભ હિન્દુનું શુભ મુહૂર્ત પ્રાપ્ત થતાં ગૃહપ્રવેશ પણ કર્યો. તે ‘દીક્ષિતનો વાડો’ એ નામથી પ્રસિદ્ધ છે. હાતમાં ગુરુસ્થાન અને સમાધિ મંદિર પાસે આ વાડો આવેલો છે. (ઓવી ૧૫૭ થી ૧૬૬)

ત્યારખાદ ખાસ્સુ ઘન ખર્ચને શ્રીમંતુ બુદ્ધીસાહેબે ‘બુદ્ધીનો વાડો’ બાંધ્યો. તે વાડામાં જ બાબાનો નશ્વર દેહ લાવવામાં આવ્યો. જ્યાં સમાધિ મંદિર બાંધવામાં આવ્યું. તેથી બુદ્ધીસાહેબે ખર્ચેલા પૈસા સાર્થક થયા. જે સ્થાનમાં એક પણ વાડો ન હતો ત્યાં ત્રણ ત્રણ વાડા સર્જયા. શરૂઆતમાં સાહેના વાડાનો સૌથી વધુ પ્રમાણમાં ઉપયોગ થયો. ત્યારખાદ મુંબઠના વક્તિલ કે. આર. એસ. નવલકર તા. ૨૦ સપ્ટેમ્બર ૧૯૨૪ના દિવસે આ વાડો વેચાતો લીધો અને તેમના વારસદારોએ ઈ.સ. ૧૯૩૮માં શિરડી સંસ્થાનને અર્પણ કર્યો. સંસ્થાનનું મુખ્ય કાર્યાલય હાલમાં તે સ્થળે આવેલું છે અને પાસે જ ગુરુસ્થાન આવેલું છે. સંસ્થાને પાછળથી તે કાર્યાલય ઉપર બે માળ બાંધ્યા. આ વાડાની બીજી મહત્ત્વા એ છે કે પૂજ્ય બાબાએ ફૂલજાડ રોપીને બનાવેલો બગીચો આ જગ્યાએ હતો. આ બાગ અંગેની એક નાની વાત હવે પછીના અધ્યાયમાં કહેવાશે. તેજ પ્રમાણે હવે પછીના અધ્યાયોમાં શ્રોતાગણો સાથે હેમાડપંતનું શ્રી સાઈચરણોમાં મસ્તક મૂકું, માટીના વાસણો ઘડનાર તાત્યા વિષેની વાત તેમજ રેતાળ અને ખડકોવાળી જીમનમાં શ્રી સાઈબાબા દ્વારા બગીચાનું સર્જન કરવું અને તે પછીથી અદશ્ય થવું. બાબાની ચાંદ પાટીલ સાથેની ઔરંગાબાદ નજીકના સ્થળે મુલાકાત તેમજ તેના ઘરના લગ્ન પ્રસંગે જન સાથે પુનઃ શિરડીમાં પદ્ધારવું. દેવીદાસ સાથેની મુલાકાત તેમજ જનકીદાસ સાથેની મૈત્રી તેમજ ગંગાગીરનું તેમની સાથેનું મિલન અને તે ત્રીપુટીનું શિરડીમાં મિલન અને મોહયુદ્ધીન સાથે બાબાએ કરેલી કુસ્તી, મસ્નિદ્રમાં વાસ, નીમગાવના સ્વ. બાબાસાહેબ ડેંગળો સાથેનો બાબાનો સ્નેહ સંબંધ તથા અનેક ભક્તો સાથે મેળાપ આ બધા જ પ્રસંગોનું વિવરણ કરવામાં આવશે. હેમાડપંત હવે શ્રી સાઈના ચરણોમાં અનન્ય ભાવે નમસ્કાર કરીને આ અધ્યાય પૂર્ણ કરે છે. (ઓવી ૧૬૭ થી ૧૭૫)

સર્વનું કલ્યાણ થાઓ. સંત, સજજનોની પ્રેરણાથી હેમાડપંત દ્વારા રચિત

‘શ્રી સમર્થ અવતરણ’ નામનો ચોથો અધ્યાય સમાપ્ત થાય છે.

શ્રી સદગુરુ સાઈનાથને અર્પણા.



॥ અદ્યાય ૫ ॥

શ્રી સાઈનું પુનઃ પ્રાગટ્ય

(શ્રી સાઈ શિરડીમાં પુનઃ પ્રગટ થયા)

શ્રી ગણેશજીને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કુળદેવતાને વંદન,
શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રજીને વંદન અને શ્રી સદગુરુ સાઈનાથ મહારાજને વંદન.

હવે બાબા અદશ્ય થઈને શિરડીમાં પાછા ચાંદપાઠીલ સાથે કેવી રીતે આવ્યા એની કથા અગાઉની કથાના અનુસંધાનમાં સાંભળો. બાબાએ પોતે માટીના ઘડા દ્વારા તેમાંથી પાણી રેલાવીને કેવા સરસ ભાગનું નિર્માણ કર્યું તથા ગંગાધીર વગેરે સંતો કેવી રીતે બેગા થયા આ બધી વાતો પર લક્ષ કેન્દ્રિત કરીને તે પાવન અને પવિત્ર કથાઓ સાંભળો. ત્યારબાદ કેટલાક સમય પછીથી અદશ્ય થયેલા બાબા શિરડીમાં એક મુસલમાન લગ્નની જનમાં પાછા પદ્ધાર્ય. એમના પહેલાં દેવીદાસે શિરડીમાં આવીને વાસ કર્યો હતો. એમની આગળ જનકીદાસ નામના ગોસાઈ શિરડીમાં રહેવા માટે આવ્યા હતા. એ બધું કયા પ્રકારે બન્યું તે હું તમને સવિસ્તર કરું છું. (ઓ. ૧-૫)

ઔરંગાબાદ જિલ્લામાં ધૂપખેડા ગામના ચાંદપાઠીલ નામના એક ભાગ્યવાન મુસલમાન ઔરંગાબાદનો પ્રવાસ કરતા હતા, તે વખતે તેમની એક ઘોડી ખોવાઈ ગઈ અને બે-બે મહિના વીતી ગયા છતાં એની કોઈ ભાળ મળી નહીં. હવે તે પાછી મળણે નહીં એવું સમજુને પાઠીલ પૂર્ણપણે નિરાશ થઈ ગયા. તે ઘોડી ન મળવાથી ઊંચા નીચા થઈ ગયા. છેવટે ઘોડા ઉપર બેસવાનું જુન ખલે નાખી જે રસ્તે આવેલા તે રસ્તે પાછા ફર્યા. ઔરંગાબાદ પાછળ રહી ગયું. તે સાડાચાર કોસ એટલે કે ચૌદ કિલોમિટર આગળ નીકળી ગયા. માર્ગમાં આંબાવાડી આવી તેમાં જાડ નીચે બાબા ઝડ્પી રત્ન દેખાયું. તેમણે માથા ઉપર ટોપી, શરીર પર કફ્ફની અને બગલમાં ઢંડ રાખ્યો હતો. તેમણે તામકુ ચોળીને ચલમભૂમાં નાંખીને અના પર અંગારો મૂકવાની તૈયારી કરતા હતા. ત્યાં જ એક આશ્ર્યજનક બીના બની. ચાંદપાઠીલ રસ્તેથી પસાર થતા હતા, તે સમયે તે ફકીરને ભૂમો મારતા સાંભળ્યા. ‘આવ.... રે અહિ આવ જરા; છાંયડે બેસ અને ચલમ બલમ પી ને પછી જ.’ ફકીર પૂછ્યું ‘આ જુન શા માટે ખલે નાંખ્યુ છે ?’ ત્યારે પાઠીલે કહ્યું કે મારી ઘોડી ખોવાઈ ગઈ છે. તેથી ફકીર બોલ્યા ‘જ ત્યાં નાળા પાસે શોધ અને તે નાળા પાસે ઘોડી તરત જ મળી ગઈ. આથી ચાંદપાઠીલ ખૂબ આશ્ર્યચકિત થઈ ગયા, અને કહેવા લાગ્યા ‘આ જે ઓલિયો મખ્યો, તેની લીલાનો કંઈ અંત નથી. ઓણે સાધારણ માણસ કેવી રીતે કહી શકાય ?’ પછી તે પાઠીલ ઘોડી લઈને પાછો પોતાની જગ્યાએ આવ્યો. ફકીર તેને પોતાની પાસે બેસાડ્યો. પોતાના હાથમાં ચીપિયો ઊંચક્યો અને તેને જમીનમાં ખોસી દીધો. તેમણે તેમાંથી ધગધગતો અંગારો કાઢ્યો અને હાથથી ઊંચકીને ચલમ પર મૂક્યો. તેમણે ચલમને વીટાળવા કપડું લીધુ અને તેને ભીનું કરવા માટે તેમણે ઢંડો ઊંચક્યો. આસપાસમાં કયાંય પાણી ન હતું. તેથી તે ઢંડાને તેમણે જેરથી જમીન પર પછાડ્યો. તે સાથે જમીનમાંથી પાણી નીકળવા લાગ્યું. તેમાં પેલો કાપડનો દુકડો ભીજવીને ચલમને વીટી ચલમ પીવા માટે તૈયાર કરી. પોતે ચલમ પીવા લાગ્યા અને પાઠીલને પણ ચલમ પીવડાવી.

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

ચાંદપાટીલ સામે કરેલો આ ચમત્કાર બાબાના સંપર્કમાં આવનારા લોડોની યાદ પ્રમાણે તેમના જીવનનો આ પહેલો ચમત્કાર કહી શકાય. ચાંદપાટીલની ખોવાયેલી ઘોડી કયાંથી ભળશે. એ દ્વારા પોતાની સર્વજ્ઞતાનું અને ચલમ પીવા માટે બળતો અંગારો અને પાણીની ધાર ઉત્પન્ન કરીને પંચમહાબૂત ઉપર પોતાની સત્તાની સરસાઈ બાબાએ બતાવી દીધી. તેમના શિરડીમાં બેસીને સર્વ જગની ઉથલપાથલની ખબર પડતી. અગિન અને પાણી ઉપર એમની સત્તા તથા આગળ કહેલા ૧૧મા અદ્યાયનાં ઉદાહરણો વિષે આપણને જણકારી છે. આ ચમત્કાર લેઈને પાટીલની મતિ બહેર મારી ગઈ. એમણે ફરીરને પોતાના ઘરે પદ્ધારી ઘર પાવન કરવા આમંત્રણ આપ્યું. અને સ્વેચ્છાએ દેહ ધારણ કરનારા બાબાએ પાટીલની વિનંતીને માન આપી કૃપા કરી. બીજે દિવસે તેઓ ગામમાં ગયા, અને પાટીલના ઘરે રોકાયા. બાબા થોડો સમય ત્યાં રહી પાછા શિરડી આવ્યા. આ ચાંદપાટીલ ધૂપખેડા ગામનો અધિકારી હતો. એની પત્નીના ભત્રીજના વિવાહ શિરડી મુકામે નક્કી થયા હતા. ચાંદપાટીલની પત્નીના ભત્રીજનો લગ્નયોગ આવ્યો તેથી શિરડીની કન્યાનો સાંસારિક સંબંધનો સુયોગ ઘડાયો. એની જન સાથે બધાં ગાડાં, ઘોડી વગેરે લઈને શિરડી જવા નીકળ્યાં અને બાબા પણ એ ચાંદભાઈના પ્રેમથી આકર્ષાઈને જનમાં સામેલ થઈ ગયા. લગ્ન પત્યા પછી જન પાછી ફરી, પણ બાબા એકલા પાછળ રહ્યા અને શિરડીમાં જ રોકાઈ ગયા તેથી શિરડીનો ભાગ્યોદ્ય થયો. (ઓ. ૬-૨૩)

શ્રી સાઈબાબા ! એ તો અવિનાશી અને પુરાતન છે. તેઓ હિંદુ પણ નથી, કે મુસલમાન પણ નથી. તેઓ જત, પાત, કુળ, ગોત્ર સિવાયના છે. આત્મજ્ઞાન તે એમનું સ્વાભાવિક સ્વરૂપ છે. લોકો જે ‘સાઈ સાઈ’ કરે છે. એ કંઈ એમનું નક્કી કરેલું નામ થોડું હતું ? ‘આવો સાઈ’ કહીને બહુમાન કરીને એમને જે સંબોધન કરવામાં આવ્યું તે આ નામ છે. આ સંબોધન આરંભમાં જનની સાથે આવ્યા ત્યારે બાબા ખંડોબાના મંદિર પાસે જે સંબોધન કરવામાં આવ્યું, તે આ નામ છે. બાબા આરંભમાં જનની સાથે ખંડોબાના મંદિર પાસે આવ્યા. ખંડોબા મહારાષ્ટ્રના લોકદેવ હોવાથી અનેક કુદુંબના કુળદેવતા તરીકે તે પૂજાય છે. એમને ભગવાન શંકરનો અવતાર માનવમાં આવે છે. એમને મહાળસા અને બાળાઈ અને મહિલ નામના બે દેત્યોનો એમણે સંહાર કર્યો હતો. મહાળસાપત્રિના આંગણામાં બાબા જે દિવસે ઉત્તર્યા, તે દિવસે જ ‘સાઈ’ નામ પડ્યું. શરૂઆતમાં એ ભગત મહાળસાપત્રિના તાબામાં હતું. પછી તે અમીનભાઈનું થયું. લગ્નની જે જન આવી હતી ત્યાં જ તે પટાંગણમાં વહના ઝાડ નીચે મુકામ કરેલો. ખંડોબા મંદિરનાં પટાંગણમાં બધાં ગાડાં છોડવામાં આવ્યાં અને બાબા પણ ત્યાં બધાંની સાથે જ ઉત્તર્યા. જેવા આ બાળફકીર ગાડામાંથી ઉત્તર્યા કે પ્રથમવાર ભગત મહાળસાપત્રિની દાણી તેમની ઉપર પડી ત્યારે આવો ‘સાઈ’ કહીને તેમની સામે ગયા, અને ત્યારથી જ આ નામ પડ્યું. અને ત્યારબાદ લોકો એમને ‘સાઈ’ કહીને બોલાવા લાગ્યા. તે પછી એ નામ પ્રખ્યાત બન્યું. પછી બાબાએ મહાળસાપત્રિની સાથે ત્યાં ચલમ પીધી, અને મસ્તિદમાં રહેવા ગયા. બાબાને દેવીદાસના સહવાસમાં ફાવી ગયું. દેવીદાસ વૈરાગી હતા અને દશ-બાર વર્ષથી મારુતી મંદિરમાં રહેતા હતા. ત્યારબાદ બાબા શિરડીમાં જ રહી પડ્યા. બાબાની બેઠક કઢી ચાવડીમાં તો કઢી દેવીદાસની સંગતમાં, અથવા તો કોઈવાર મારુતીના મંદિરમાં થતી. આશ્વર્ય એ છે કે આ મંદિરમાં બે મારુતીની મૂર્તિઓની પાસે પાસે સ્થાપના કરવામાં આવી છે. આગળ સભામંડળની ખુલ્લી જગ્યા છે. ત્યાં જ સાઈબાબા, દેવીદાસ અને જનકીદાસ એક બીજી સાથે વાતો કરતા અને ત્યાં બેસતા હતા. આમ તેઓ લહેર આવે તેવી રીતે સ્વરંધરપણાથી રહેતા હતા. દેવીદાસ શિરડી ગામમાં બાબાની પહેલાં આવીને વસ્ત્યા હતા. ત્યારબાદ જનકીદાસ નામના મહાનુભાવ કે જે વિદ્યાવાન બુદ્ધિમાન હતા તે ગોસાઈ શિરડીમાં આવ્યા. જનકીદાસ સાથે પણ સાઈ મહારાજ વાતો કરતા

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

હતા. તેમને બંને સાથીઓ સાથે ખૂબજ પ્રેમ હતો. એમની બેઠકનું નિયમિત આયોજન થતું હતું. એમનો આ સમાગમ સૌને માટે અત્યંત સુખદાયક હતો. (ઓ. ૨૪-૩૫)

તેવા જ એક ગંગાજીર બુવા નામના એક પુણતાંબે ગૃહસ્થાશ્રમી અને પાકા વૈષ્ણવ વારંવાર શિરડીમાં આવતા હતા. શરૂઆતમાં ગંગાજીરને બાબા બંને હાથમાં માટીના ઘડા તે કુવા ઉપરથી ઊંચકીને પાણી લાવતા હતા તે જેઠને ખૂબજ આશ્રમ્ય થતું. પરંતુ તેઓની અને સાઈબાબાની નજર સામસામે મળતાં તેઓએ કહ્યું, ‘ધન્ય છે શિરડીના ભાગ્યને કે આવું શ્રેષ્ઠ રત્ન તેને મળ્યું.’ આજે એ ખબા ઉપર પાણી ઊંચકી લાવી રહ્યા છે, પણ આ મૂર્તિ કંઈ સામાન્ય નથી. આ ભૂમિના કોઈ પુણ્ય હશે, તેથી જ આ મૂર્તિ અહીં આવી પહોંચી છે.’ (ઓ. ૩૬-૩૭)

તેવા જ બીજા એક આનંદનાથ નામના વિખ્યાત સંતે પણ ‘આ અદ્ભુત અને અપૂર્વ કાર્ય કરવાવાળા છે’ એવી ભવિષ્યવાણી કરી હતી. આ મહાપ્રસિદ્ધ આનંદનાથનો યેવલા ગામમાં આશ્રમ આવેલો છે. તેઓ માધવરાવ દેશપાંડી, નંદુરામ, મારવાડી વગેરે શિરડીવાસીઓ કે જે આનંદનાથના દર્શને ‘યેવલા’ ગયા હતા તેમની સાથે બળદગાડામાં બેસીને શિરડીમાં આવ્યા. આનંદનાથ અક્કલકોટ સ્વામીના શિષ્ય હતા. સાઈબાબાની સામે જેતાં જ તે બોલ્યા, ‘અરે આ તો પ્રત્યક્ષ હીરો છે. આ હીરો ભલેને આજે ઉકરડા પર પડેલો છે, છતાં પણ હીરો એટલે હીરો. એ કોઈ સર્કાર પથ્થર નથી.’ આનંદનાથના મુખેથી આ ઉદ્ગાર જ્યારે નીકળ્યા, તે વખતે બાબાની બાલ્યાવસ્થા હતી. આનંદનાથે ફરીથી કહ્યું હતું. ‘મારા શરૂદો ધ્યાનમાં રાખજો આગળ પાછળથી તમને તેમની યાદ આવશે.’ આવું ભવિષ્ય કહીને આનંદનાથ યેવલા પાછા ગયા. (ઓ. ૪૦-૪૪)

સાઈ તરુણ અવસ્થામાં હતા, ત્યારે માથા ઉપર લાંબા વાળ રાખતા. કદી માથાનું મુંડન કરાવતાન હતા. તે પહેલવાનની જેમ પહેરવેશ ધારણ કરતા હતા. બાબા જ્યારે રાહતા જતા ત્યારે ગલગોટા, જઈ, જૂઠ વગેરેના રોપા લઈ આવતા અને પોતાના હાથે જ ઉજઘળ જગ્યામાં રોપતા હતા. અને નિયમિત્કૃપે પાણી સિંચતા હતા. એમના ભક્ત વામન તાત્યા બાબા માટે દરરોજ માટીના બે કાચા ઘડા લાવી આપતા અને બાબા તેમના વડે પોતાના હાથથી પાણી છાંટતા. તેઓ કુવામાંથી કાચા ઘડા વડે પાણી કાઢીને ખલે ઊંચકીને લાવતા અને સાંજના સમયે તે ઘડા લીમડાના ઝાડ નીચે મૂકી આવતા. ત્યાં મૂકવાનું કારણ એ કે તે જગ્યા પર ઘડા ત્યાં ને ત્યાં જ ફૂટી જતા. વામન તાત્યા બીજે દિવસે પ્રાતઃકાળે બાબા માટે નવા ઘડા લઈ આવતો. ખરેખર તો પકવેલા ઘડા વધારે ટકાઉ અને સારા હોય છે. પરંતુ બાબા પક્ષ્યા વીનાના કાચા અને ઝોરા ઘડા જ પસંદ કરતા. ત્રણ વર્ષ સુધી પોતાના પરિશ્રમ દ્વારા ખુલ્લી જગ્યામાં બાબાએ બગીયો બનાવ્યો. આજે એજ જગ્યાએ સુયોગથી સાહેના વાડાનો લોકો ઉપયોગ કરે છે. (ઓ. ૪૫-૫૧)

તે જગ્યાએ લીમડાના ઝાડ નીચે એક ભાઈ નામના એક ભક્તને અક્કલકોટ સ્વામીની પૂજન કરવાની તીવ્ર ઈચ્છા થવાને કારણે તેણે તેમની પાદુકાઓની સ્થાપના કરી. ભાઈના આરાધ્ય દેવ અક્કલકોટ સ્વામી સમર્થ હતા. અને તે તેમની છભીનું પૂજન તે નિષ્ઠા અને નિયમથી નિયમિત રીતે કરતા હતા. એક દિવસ એમને એવું લાગ્યું કે આપણે અક્કલકોટ જવું અને ભાવપૂર્વક પાદુકાના દર્શન કરવાં તથા પૂજન કરવું. તેમણે મુંબદીથી જવા માટેની બધી જ તૈયારીઓ કરી. પરંતુ દિવસે નીકળીશું, તે તેમના મનની વાત મનમાં જ રહી ગઈ. એમણે શિરડીની વાટ પકડી. તે બીજે દિવસે જવાનો હતો પરંતુ આગતી રતે સ્વામી સમર્થે સ્વર્ણમાં આજ્ઞા કરી કે હાલમાં મારો નિવાસ શિરડીમાં છે માટે તું ત્યાં જ. આવી આજ્ઞા માથે ચઢાવી અને વંદન કરીને ભાઈ મુંબદીથી નીકળ્યા અને શિરડીમાં છ મહિનાનો મુકામ કરીને આનંદવિભોર થઈ ગયા.

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

બાઈ ખૂબ જ નિષાવાન સજજન હતા. આદેશ પ્રમાણેના સ્વભની યાદ રહી જય માટે એમણે લીમડાના જાડ નીચે અક્કલકોટ સ્વામીની પાદુકાઓની સ્થાપના કરી. તેમણે શકે ૧૮૩૪ સન ૧૯૧૨ શ્રાવણ માસના શુક્લ પક્ષના પુણ્યકાળે ભજન અને પૂજન સહિત પ્રેમપૂર્વક લીમડાના જાડ નીચે તે પાદુકાઓની સ્થાપના કરી. સાંચું મુહૂર્ત જેઠને સ્વ. દાદા ગણેશ દામોદર કેઢકર કે જે રાવ બહાદુર સાઠેના સસરા થતા હતા તેમના હસ્તે પાદુકાની સ્થાપના થઈ. ત્યારબાદ સાકોરીના ઉપાસની મહારાજે સર્વ શાસ્ત્રોક્ત વિવિધ કરી. ત્યારબાદ ત્યાંની વ્યવસ્થા ભાઈજીએ વિવિધ મહાનુભાવોને આ પ્રમાણે સૌંઘી દીધી. દીક્ષિત નામના બ્રાહ્મણે પૂજન કરવી અને સગુણ નામના ભક્તે બીજી બધી વ્યવસ્થાઓનું ધ્યાન રાખવું. એ પ્રમાણેની પાદુકાઓની કહાની છે. આ અંગે શ્રી સાઈલીલા માસિક વર્ષ ૧૧, અંક ૧ પાન નંબર ૨૫માં આ પાદુકા વિશેની સવિસ્તાર માહિતી આપેલી છે. ફરીથી તે શ્રીસાઈલીલા જુલાઈ ૧૯૮૧ના અંકમાં ‘શ્રી સાઈબાબાનું ગુરુસ્થાન’ એ લેખમાં પાન ૨૦ થી ૨૧ ઉપર ફરીથી છાપેલ છે. તે ઉપરાંત હેમાંડપટે, ઓવી ક્રમાંક ૫૨ થી ૫૮ની વચ્ચે આ પાદુકાઓ અક્કલકોટ સ્વામી સમર્થની છે એવો સ્પષ્ટપણે ઉત્સેખ કરેલો છે. જ્યારે શ્રી સાઈલીલામાંની હકીકિતને આધારે એ પાદુકાઓ સાઈબાબાની છે એવું કહેવામાં આવ્યું છે. (ઓ. પર-૬૧)

ઇશ્વરના પ્રત્યક્ષસમા અવતાર આ સંતો જાતે જ નિર્વિકારી અને વાસના રહીત પુનર્જન્મ સિવાયના હોવાથી કારણ જગતના ઉદ્ધાર અને કલ્યાણ માટે પૃથ્વી ઉપર વારંવાર જન્મ ધારણ કરે છે. થોડા દિવસ બાદ ફરી એક આશ્ર્વયકારક ઘટના બની. એ જે શ્રોતાઓ સાંભળશે તો એમને જરૂર નવાઈ લાગશે. મોહિદીન નામના એક તંબોળી જેઠે શ્રી સાઈબાબાને કંઈક આણબનાવથી તે બંને વચ્ચે કુસ્તી શકું થઈ. તેઓ એક બીજી સામે દાવ પેચ લડાવવા લાગ્યા. બંને મજૂબત પહેલવાનો પરંતુ નસીબ આગળ જેર ચાલતું નથી. મોહિદીન બળશાળી હોવાથી અને બાબા થાકેલા હોવાથી તેમની શક્તિ ઘટવાથી મોહિદીને બાબા ઉપર જીત મેળવી. તે દિવસથી બાબાએ નિશ્ચય કર્યો અને પોતાનો સર્વ પોશાક જ બદલી કાઢ્યો. શરીર પર પગ સુધી લાંબી અને પહોળી કફ્ફની પહેરીને, લંગોટ ધારણ કરીને માથા ઉપર ફટકો બાંધવા લાગ્યા. કોથળા બેગા કરીને તેમણે બેસવાનું આસન તૈયાર કર્યું તથા એની જ પથારી પણ બનાવી અને ફિટેલાં તૂટેલાં કપડાં પહેરીને એમાં જ સંતોષ માનવા લાગ્યા. તેઓ સદાય કહેતા ‘ગરીબ એટલે અવ્યાલ બાદશાહી અને તે શ્રીમંતાઈ કરતાં લાઘખો ગણો શ્રેષ્ઠ છે. તે જ ગરીબોનો અલ્લાહ કે પરમેશ્વર તેમનો બાઈ અને સખો હોય છે.’ શ્રી દાસગણુ મહારાજે એમના ભક્તિસારામૃતના અધ્યાય ૨૬ ઓ. ૨૦૦ થી ૨૦૧ માં કહ્યું છે કે બાબાના ગુરુ શેલુના ગોપાલરાવ દેશમુખે પદ્ધિમાં ગોદાવરીના દક્ષિણ કિનારે એટલે કે શિરડી તરફ જવાની આજા કરી હતી અને પોતાના માથા ઉપરનો કટકો છોડીને બાબા માથે બાંધ્યો હતો. તેમણે કહ્યું હતું, ‘આ કટકાની સાથે હું મારું સર્વસ્વ તને અર્પણ કરું છું.’ આ વાત કેટલા અંશે વિશ્વસનીય છે એ તો કોને ખબર ? પરંતુ બબાએ કુસ્તીમાં હાર ખાદ્ય પણી એમને પોતાનો પોશાક બદલ્યો અને શરીર ઉપર કફ્ફની ધારણ કરી તથા પોતાના માથે કટકો બાંધ્યો એ બાબત બરોબર સમજાતી નથી. ચાંદપાટીલ બાબાને પ્રથમવાર મળ્યા ત્યારે અને લગ્નની જન સાથે તેઓ કયારે શિરડીમાં આવ્યા ત્યારે મહાળસાપત્રિએ તેમને સૌથી પહેલા જેયા હતા, તે સમયે પણ બાબાનો વેશ એક મુસલમાન ફક્કિર જેવો જ હતો. એ વાત ઉપરના વર્ણન પરથી ચોક્કસ પણે સમજય છે. તે પ્રમાણે બાબાનું સતત ‘અલ્લા માલિક’ બોલવું અથવા તો મસ્જિદમાં રહેવું એ કંઈક કુસ્તીમાં હારવાથી કે પોષાક બદલવાથી થોડું જ નક્કી થયું હો ? આ બધું તો શિરડીમાં આવ્યા તે પહેલાનું જ હોવું જેઠાએ. ગંગાગીરની પણ આવી સ્થિતિ હતી. એમને પણ પહેલવાનગીરીનો બહુ શોખ હતો. એક વખતે કુસ્તી રમતા હતા ત્યારે વૈરાગ્ય ઉત્પન્ન

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

થયો. યોગ્ય સમયે તેમને એક જટકો લાગ્યો અને એક સિદ્ધ પુરુષની વાળી બોલી ઉઠી, ‘ઇશ્વર સાથે જ ખેલ ખેલીને શરીરને ખપાવી દેવું જેઠાંચે. કુસ્તી રમતાં રમતાં ગંગાગીરના કાન પર આ અનુગ્રહદ્વારી શબ્દો સંભળાયા અને સંસારના નામ પર પાણી મૂક્યું, તેઓ પરમાર્થના માર્ગ જવા માટે પ્રભુ ભજનના માર્ગ વળી ગયા. પુણતાંબે પાસે ગોદાવરી નરીના બે પ્રવાહ વચ્ચે બેટ ઉપર ગંગાગીર બુવાનો મઠ છે. તેમજ સેવા માટે શિષ્યો પણ છે. (ઓ. ૬૨-૭૨)

સાઈનાથ ત્યારબાદ ફક્ત પૂછેલાનો જ જવાબ આપતા. તેઓ કોઈની સાથે વધારે બોલતા નહિ. દિવસ દરમ્યાન તેમની બેઠક કોઈકવાર લીમડાના ઝાડ નીચે અને કોઈકવાર ગામના સિમાડે આવેલા ઓટલા પાસે બાવળના ઝાડની આડી ફંટાયેલી ડાળી નીચે છાંયડામાં બેસી રહેતા હતા. કોઈવાર ત્યાંથી એક માછિલ દૂર નિમગાંવ તરફ ફરવા જતા. આ નિમગાંવની જગીરદારી પ્રસિદ્ધ ઘ્યબંક ડેગળે ધરાણા પાસે હતી. સાઈબાબાના બાબાસાહેબ ડેગળે પર ઘણો પ્રેમ હતો. બાબા જે નિમગાંવની ફેરી ઉપર જથ્ય તો તે એમના ઘેર જડર જતા અને દિવસભર ખૂબ પ્રેમથી તેમની સાથે વાતો કરતા. તેમને નાનાસાહેબ નામનો એક નાનો ભાઈ હતો. તેને ઘેર સંતાન ન હોવાથી તે ખૂબજ હૃદ્દી હતો. તેની પહેલી સ્ત્રીથી સંતતિનો યોગ ન લાગતાં તેણે બીજા લગ્ન કર્યા હતાં. તેમ છતાં ઋણાનુંધં ને કારણે તેમ થયું હતું એમ કહેવાય. ઘરેખર પ્રારંભના નિયમો સમજવા ઘણા કઠીન છે. ડેગળેએ પોતાના લધુબંધુને સાઈબાબા દર્શને મોકલ્યો. તેથી તેને બાબાનો આશીર્વાદ મળ્યો અને પુત્ર પ્રસાદ પ્રાપ્ત થયો. આ કારણે સાઈબાબાનો મહિમા વધતો ગયો. એમના દર્શન માટે જનસમુદ્દરાય ઉમટવા લાગ્યો. આ વાત જિલ્લાઓમાં અને ડેક્ટેકાણે છેક અહેમદનગર સુધી પ્રસરી. ત્યાં સરકારી દરબારમાં નાનાસાહેબનું આવવા જવાનું ખૂબ રહેતું હતું. ત્યાં જિલ્લા કચેરીમાં ચિહ્નબર કેશવ ગાડગિલ નામનો ચિટનીશ હતો. એમને નાનાસાહેબે એક પત્ર લખ્યો કે, શિરડીના સાઈસમર્થના દર્શન કરવા યોગ્ય છે માટે આપ આપના કુદુરુંબકબીલા સાથે અને પોતાના નજીકના મિત્રોને લઈને દર્શન માટે જડરથી આવો. આ પ્રમાણે એકની પાછિલ બીજાએ એમ અનેક નામાંકીત લોકો શિરડીમાં આવવા લાગ્યા. જેમ જેમ બાબાની પ્રસિદ્ધ વધતી ગઈ તેમ તેમ એમનાં દર્શન માટેનો પરિવાર વધવા લાગ્યો. (ઓ. ૭૩-૮૪)

સાઈબાબા જે કે કોઈની સોબતનું વળગણ લાગતું નહીં. તેમ છતાં દિવસ દરમ્યાન તેઓ ભક્ત સમુદ્દરથી ઘેરાયેલા જ રહેતા. સૂર્યાસ્ત થતો કે બાબા શિરડી ગામમાં આવેલી તે તૂટીકૂટી મસ્નિફામાં આવીને સૂર્ય રહેતા. એમની પાસે સદ્ગુરી ચલમ, તમાકુ એક ટમ્બલર તથા હાથમાં એક સટકો રહેતો. એમના શરીર ઉપર પગ સુધી પહોંચતી લાંબી અને પહોળી કફીની તથા માથા પર એક સફેદ કહડો બાંધેલો રહેતો. તેઓ ધોયેલું સફેદ વસ્ત્ર માથા ઉપર બાંધતા અને ડાબા કાનની પાછળ જટાની માફક ગોળ વીટાળી દેતા. એમની શરીરને ઢાંકવાની આવી પદ્ધતિ હતી. ઘણીવાર તો તેઓ આઠઆઠ દિવસ સુધી સ્નાન પણ ન કરતાં, પગમાં જેડા કે ચંપલ પણ પહેરતા નહીં. તેમની પાસે બેસવા માટે ફક્ત કોથળાનું જ આસન હતું. આવા એક કોથળાના ડુકડા પર જ એમની કાયમની બેઠક રહેતી. શરીર ટેકવવા માટે વળી તકિયો કેવો હોય છે તેની એમને ખબર ન હતી. તેમને દરેક વાતનો સંતોષ રહેતો. આવી લુર્ણ આસનવાળી ગમતી બેઠક પર શાંતિપૂર્વક દિવસભર પલાઠી મારીને બેસી રહેતા. આ પ્રકારે બેસવા માટે તેમજ પાથરવા માટે એક જર્નિરિત કોથળા અને કેદે ફક્ત એક લંગોટી હતાં. બીજા ખાસ કોઈ વસ્ત્ર પરિવાન કરતા ન હતા. હંડીથી રક્ષણ કરવા માટે એક અર્જિની ઘૂણી હતી. કોથળાના આસન પર બેઠેલા બાબા દક્ષિણ દિશા તરફ મોઢું કરીને તથા ડાબો હાથ કઠેરા પર મૂકીને સામેની ઘૂણી તરફ જેતા. તથા તેઓ દક્ષિણ દિશા તરફ મોઢું રાખીને કાયમ બેસતા. જાણે કે અહંકાર અને વાસના સહિત અને પ્રકારની

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

મનોવ્યથાઓની આહૂતિ માટે તેમજ જલતજીતની પ્રપંચવૃત્તિઓનું દુનન ધૂળીમાં નાખીને તેઓ અનેક પ્રકારની આહૂતિઓ થુક્તિથી કરતા હતા. આમ તેઓએ જ્ઞાનથી ઉત્પન્ન થતાં અભિમાનનાં બીભાંઓને અનિન્કૃદમાં નાખીને ભસ્મીભૂત કરી નાખ્યાં હતાં. એમને મોઢે સદૈવ ‘અત્લા માલિક’ પરમેશ્વર સર્વાધિપતિ છે. એમ તેઓ પરમેશ્વરનો ઝંડો ફરકાવતા અને ગુણગાન ગાતા ફરતા હતા. મસ્નિજ પણ કેટલી મોઠી ? ફક્ત બે નાની ઓરડીઓ વાળી. તેમાં જ બાબા ઉઠતા બેસતા અને સર્વને મળતા. ગાઢી તકિયા તો હવે થયા. તેમજ અસંઘ્ય ભક્ત સમુદ્દ્રાય તો હવે જેવા મળે છે. શરૂઆતમાં તેમની પાસે જનારાને બીક લાગતી હતી. સને ૧૯૧૨ થી આ બધો નવો પ્રકાર શરૂ થયો, અને મસ્નિજનું સમારકામ કરવાની શરૂઆત થઈ. મસ્નિજની જમીનમાં અનેક ખાડા પડી ગયા હતા. ભક્તોએ તેની જમીન ભાવપૂર્વક એક રાતમાં જ પથ્થર દીપીને બનાવેલી હતી. બાબા આ મસ્નિજમાં રહેવા આવ્યા તે પહેલાં બાબા તકિયામાં ફકીરોનું વિશ્રાંતિ સ્થાન રહેતા હતા અને ત્યાં ઘણાં લાંબા સમય સુધી રહ્યા હતા. ત્યાં જ બાબા પગમાં ધૂધરું ઘારણ કરીને ખંજરીના તાલે અતિ સુંદર નાચતા અને પ્રેમથી મધુર ગીતો પણ ગાતા હતા. (ઓ. ૮૫-૧૦૦)

શરૂ શરૂમાં શ્રી સાઈસમર્થને દીવા પ્રગટાવવાની તથા ઉત્સવ અને રોશની કરવાની ખૂબ જ હોંસ થતી હતી. એને માટે તેઓ દુકાનદારો પાસે તેલ માગવા જતા. એભલર હાથમાં લઈને તેતી વાણિયાઓની દુકાન તે તેલની બિક્ષા માગવા જતા અને કોડિયામાં દીવેટ મૂકીને તેમાં તેલ પુરતા. અને મસ્નિજમાં તેમજ મંદિરોમાં જગમગતા દીવા પ્રગટાવતા. આવું ઘણા દિવસો સુધી ચાલ્યું. દીપ આરાધના કરવાનો બાબાને બહુ શોખ હતો. દિવાણીમાં રોશની પણ તેઓ કરતા. ચિંદીઓ કાઢીને તેમાંથી દીવેટ બનાવતા અને મસ્નિજમાં દીવા પ્રગટાવતા હતા. તેઓ દરરોજ તેલ મફક્ત લાવતા હતા. એક દિવસે વાણિયાઓના મનમાં કપટ થયું અને બધાએ નક્કી કર્યું કે આજે તેલ માંગવા આવે તો આપણે બધાએ આપવું નહિ, જેથી કાયમની કટકટ મટી જય. દરરોજના નિયમ પ્રમાણે બાબા તેલ માંગવા ગયા ત્યારે દ્વેકે ના પાડી હેતાં, બાબાને આશ્રમ થયું. એક પણ શબ્દ બોલ્યા વગર બાબા પાછા મસ્નિજ તરફ ગયા અને કોડિયાઓમાં કોરી દીવેટો મૂકી. તેલ તો હતું નહીં. હવે તે દીવા કેવી રીતે પ્રગટાવશે તેમ વિચારીને વાણિયાઓ ખેલ જેવા લાગ્યા. બાબાએ મસ્નિજના ચોતરા પરથી એભલર ઊંચકયું. તેમાં તળીયે થોડું વધેલું તેલ હતું. જેનાથી સંદ્યકાળે ભગવાનનો એકાદ દીવો પ્રગટે એટલું જ તેલ હતું. એ તેલમાં બાબાએ પાણી રેડચું અને તે બધું જ પોતે પી ગયા. આ પ્રકારે તેલ પરમેશ્વરને અર્પણ કર્યું. ત્યારબાદ તેમણે તેમાંથી ફક્ત પાણી જ લીધું. તે પાણી કોડિયામાં રેડીને તેમાં જૂકી દીવેટો ભીજવીને દીવાસળીથી દીવા પ્રગટાયા. આમ દીવા પાણીથી પ્રગટેલા જેઠેને વાણિયાઓએ આશ્રમથી મોઢામાં આંગળા નાંખી દીધા. તેઓ મનમાં કહેવા લાગ્યા કે, આપણે બાબા પાસે ઓટું બોલ્યા તે સારું કર્યું નથી. બીજુબાજુ જેમાં અણુમત્ર તેલ ન હતું એવા દીવા આખી રાત સળગ્યા. બધાં લોકો કહેવા લાગ્યા કે, વાણિયાઓ શ્રી સાઈબાબાની દ્યાના અધિકારી નથી. તેમને શિક્ષા થવી જ જેઠાએ. વાણિયાઓને બાબાનું સામર્થ્ય જેઠેને પ્રશ્નાતાપ થવા લાગ્યો. તેમને લાગ્યું કે આપણે વ્યર્થ દુઃખ દીધું અને ખોટું બોલીને પાપના ભાગીદાર થયા છીએ. પરંતુ બાબાએ એ બાબત જરા પણ ધ્યાનમાં લીધું નહીં. બાબા લોકોની ઇચ્છા પ્રમાણે ગુસ્સો કે ઈર્ષા કર્યા નહીં. તેમને કોઈ પણ શત્રુ કે મિત્ર ન હતા. તેમને મન પ્રાણી માત્ર સમાન હતાં. (ઓ. ૧૦૧-૧૧૪)

પૂર્વના અનુસંધાનમાં મોહિદીન કુસ્તીમાં યશસ્વી થયો. તે પહેલાંનો મહિમા ધ્યાન દઈને સાંભળો. કુસ્તીના પાંચ વર્ષ બાદ અહમદનગરમાં રહેતો એ ‘જહનરાખલી’ નામે ફકીર તેના શિષ્યો સાથે શિરડીથી દોઢ માઈલ દૂર આવેલા રાહતામાં

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

રહેવા માટે આવ્યો. એક ખુલ્લી વિશાળ જગ્યા જેઠિને વીરભદ્રના મંદિર પાસે પેલા ફીરી મુકામ કર્યો. આ ફીરી ખેખર ભાગ્યવાન હતો. જે તેમ ન હોત તો સર્વત્ર પ્રસિદ્ધ પામેલા સાઈ જેવા મોળ્લા શિષ્ય તેને કયાંથી મળ્યા હોત ? ગામમાં પુષ્કળ લોકો હતા. એમાંના અમુક તો ક્ષત્રિય મરાઠા હતા. એમાંનો એક ભગૂસહાફળ નામનો માણસ એમનો સેવક થયો. ફીરી ખેખર વિદ્રોહ હતો. ‘કુરાન શરીફ’ ઉપર તેનું પ્રબુત્વ હતું, અને તે તેને મોઢે હતું. સ્વાથી, પરમાર્થી અને ભાવિક એવા અનેક લોકો તેના ચરણે આવવા લાગ્યા. ફીરી ત્યાં ઈદગાહ બાંધવાની શરૂઆત કરી. પરંતુ થોડા દિવસ બાદ ત્યાંના લોકોએ તેની ઉપર વીરભદ્રને વટલાવાનો આરોપ મૂક્યો. તેથી ઈદગાહ બાંધવાનું કામકાજ રોકાઈ ગયું. ગામના લોકોએ ફીરિને ગામમાંથી બહાર ભગાડ્યો. પછી તે શિરડી આવ્યો અને બાબા સાથે મસ્જિદમાં રહેવા લાગ્યો. ફીરી બડો મૂદુભાઈ હતો. શિરડી ગામને તેણે ઘેલું લગાવ્યું. બાબા ઉપર પણ તેને જન્મ ટોણા કરીને કોઈ મોહિની નાંખી છે. એવી વાતો લોકોમાં થવા લાગી. એણે એક દિવસ બાબાને કહ્યું ‘તું મારો શિષ્ય છે.’ બાબા સ્વભાવે વિનોદી અને રંગીલા હતા તેથી એમણે કહ્યું સાચી વાત છે. આવું સાંભળીને ફીરિને બાબા ઉપર ખૂબજ સ્નેહ થયો. તે બાબાને સાથે લઈને બહાર નીકલ્યો. બાબા જેવા તેના શિષ્ય થયા અને જવહારઅલ્લી તેમના ગુરુ થઈ ગયા. બંનેને રાહતામાં રહેવાનો વિચાર આવ્યો. ગુરુને શિષ્યની ચતુરાઈ ભરેલી યોજનાની કલ્પના ન હતી. પરંતુ શિષ્યને ગુરુની આણસમજ અને ઓછી બુદ્ધિની કલ્પના હતી. શિષ્ય સાઈબાબાએ એનો કદાપિ અનાદર કર્યો નહીં અને પોતાનો શિષ્ય ધર્મ પાબ્યો. ગુરુમુખેથી જે જે શર્ષદ્વો સાંભળવા મળ્યા તેની યોગ્યતા કે અયોગ્યતાનો વિચાર કર્યા વગર તથા કોઈ પણ જતની શંકા કે તકરાર કર્યા વગર આજ્ઞાઓ જીવીને ગુરુના ઘેર તેમણે પાણી ભર્યું. (ઓ. ૧૧૫-૧૨૭)

આ પ્રકારે બાબાએ ગુરુસેવા કરવાનું ચાલુ રાખ્યું. શિરડીમાં લોકો કોઈક વાર જ આવવા લાગ્યા. આવું જ્યારે વારંવાર થવા લાગ્યું તેથી તે પછી શું બન્યુ તે જુઓ. બાબા રાહતામાં જ રહેવા લાગ્યા અને ફીરિના નાદમાં લાગી રહ્યા. તેથી એ લાગવા માંડયું કે બાબા હવે શિરડી છોડીને જતા રહ્યા છે. ગામલોકોમાં એવી અફ્વા ફેલાઈ કે જવહારઅલ્લીએ પોતાના યોગસામર્થ્યથી સાઈબાબાને બાંધી રાખ્યા છે. પરંતુ સાઈબાબાની યોજના કંઈક જુદી જ હતી. તેઓ પોતે દેહનું અભિમાન નષ્ટ કરી રહ્યા હતા. શ્રોતાઓ સહેજ એવું અનુમાન કરે કે સાઈબાબાને વળી અભિમાન કયાંથી આવ્યું ? પણ એમનું આ પ્રકારનું વર્તન લોકોએ તથા ભક્તોએ આચારભાઈ થવું નહીં. તેવું સમજવવા માટે પોતાની ઈચ્છા ન હોવા છતાં અથવા પોતાને એની કોઈ આવશ્યકતા ન હોવા છતાં અમુક આચરણો બાબાએ સ્વીકાર કર્યા હતા. અસલમાં એમનું અવતાર ધારણા કરવાનું મુખ્ય કારણ એજ હતું. શિરડીમાં જે બાબાના પ્રેમી ભક્તો હતા. તેમનો બાબા પ્રત્યે અતિરાય પ્રેમ અને શ્રદ્ધા હતાં. એવા લોકોના બાબાથી દૂર રહેવાનું અસહ્ય અયોગ્ય લાગવા માંડયુ. બાબાને જવહારઅલ્લીને સંપૂર્ણ પણે આધિન થયેલા જેઠિને ગામલોકો ચિંતામાં પડ્યા અને એમણે બાબાનું પોતાની ઈચ્છા મુજબ વર્તન થયા તે માટે શું કરવું જેઠાએ એ વિચારમાં સૌ મગન થઈ ગયા. જેમ સોનું અને તેની ચમક અથવા દીવો અને તેનો પ્રકાશ એક સાથે જ હોય તો આ ગુરુ શિષ્યની સ્થિતિ હતી. બંનેને એકબીજ પ્રત્યેનો એવો જ અનુભવ થયા કરતો હતો. ત્યારબાદ શિરડીની ભક્ત મંડળી રાહતાની ઈદગાહ પાસે ગઈ. એ બધાએ વિચાર કર્યો કે એક સધન પ્રયત્ન કરી જેઠાએ અને પછી બાબાની જોડે જ પાછા શિરડી જઈએ. પરંતુ બાબાએ એમને ઊલટી જ બુદ્ધિ સુઝાડી. તેમણે કહ્યું, ‘આ ફીરી મહાકોથી છે, એના નાદે કદી ચઢતા નહીં. એ મને કદી છોડવાનો નથી. તમે અહીંથી લાગી જતું. એ ગામમાં ગયો છે. તે હમણાં જ પાછો અવરો અને તમારું સત્યાનાશ કરી નાખશે. એનો કોધ વિચિત્ર છે, તથા તે કડક સ્વભાવનો છે. તે આવતાની સાથે જ લાલપીળો

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

થઈ જશે. તમે તાબડતોબ અહીંથી નીકળી જવ અને શિરડીના વાટ પકડો.' ભકતો અંદર અંદર વાતો કરવા લાગ્યા કે હવે આપણે શું કરીએ? બાબા પણ આવી ઊંધી વાત કેમ કરે છે! એટલામાં અચાનક મેલો ફીડીર આવ્યો. અને પૂછવા લાગ્યો, 'બાળક માટે આવ્યા છો? તમે શેની વાતો કરતા હતા? તમે તેને શિરડી લઈ જવાના કષમાં પડતા નહિએ.' તે પહેલાં તે આવું બોલ્યો તેમ છતાં ગમના લોકોની સામે ગમશરી અને ઢીલો પડ્યો. બોલ્યો કે 'ચાલો છોકરાને તથા મને શિરડી લઈ જાઓ.' આ રીતે તે ફીડીર બધા લોકોની સાથે પાછો શિરડી ગયો. તે બાબાને છોડી શકતો ન હતો, અને બાબા તેનાથી દૂર રહી શકતા ન હતા. ત્યારે આ કેવી રીતે હવે શક્ય છે તે કોઈને સમજનું ન હતું. (ઓ. ૧૨૮-૧૪૨)

સાઈ સાક્ષાત પરબ્રહ્મની પ્રતિમા છે જ્યારે જીવારચલ્લી ખોટા ભ્રમનું કોળું છે. દેવીદાસે જીવારચલ્લીની પરીક્ષા લીધી અને તેનો શિરડીમાં જ બંડો ફીડ્યો. દેવીદાસનો બાંધો સુંદર તથા આંખો સતેજ અને રૂપ મોહિત કરે તેવું હતું. તેમની ઉમર દરશ-અગિયાર વર્ષની હતી, ત્યારથી શિરડીમાં પહેલી વખત આવ્યા હતા. તે વખતે એમની ઉમર નાની હતી અને કેદે કેવળ એક લંગઠો ધારણ કરી હતી. તે મારુતિના મંદિરમાં ઉત્તરેલા હતા. અપ્યા ભીત અને મહાણસાપત્રિ તેમની પાસે આવતાં જતાં હતાં. દરળ કાશીરામ શિંપી તથા અન્ય મહાનુભાવો એમને સીધુ સામગ્રી પહોંચાડતા. આમ આસ્તે આસ્તે તેમનું મહૃત્વ વધ્યું. બાબા લગ્નની જન સાથે આવ્યા તેના બાર વર્ષ પહેલાં જ દેવીદાસ શિરડીમાં આવીને વસ્યા હતા. અપ્યા ભીતને સ્લેટેપેન લઈ તેઓ ભણાવતા હતા. મરાઈ ભાષાનું પ્રમાણભૂત અને પ્રભાવી સ્તોત્ર વ્યક્તેશ સ્તોત્ર ૧૦૮ ઓવીનું ભગવાન વિષણુનું સ્તોત્ર છે. આ કરુણા-સ્તવન દેવીદાસ નામના જ એક ચૈતન્ય સંપ્રદાયી પુરુષે રચેલું છે. તે સ્તોત્ર સૌને મુખપાઠ કરાવતા હતા અને નિત્ય નિયમ પ્રમાણે ગવડાવતા હતા. દેવીદાસ મોટા જ્ઞાની પુરુષ હતા. તાત્યા ગણપત કોતે પાટીલે તેમને ગુરુ તરીકે માન્યા હતા. કાશીરામ શિંપી તથા અન્ય લોકો તેમના અથણી શિષ્ય બનીને એમનું શરણું લીધું હતું. લોકોએ એમની સામે પેલા ફીડીને તેડાવ્યો, અને શાસ્ત્રાર્થ શરૂ કરાવ્યો. વૈરાગી દેવીદાસથી જીવારચલ્લી હારી ગયો. તેની શિરડીમાંથી હાલકાપણી થઈ. તે શિરડી છોડીને ઔરંગાબાદ નજીકના વૈજ્ઞાનિક રહ્યો. પોતે ગુરુ અને સાઈ પોતાનો ચેલો એવો જે તેને ભ્રમ હતો તે દૂર થયો. તે પશ્વાતાપની આગમાં શુદ્ધ થયો. કેટલાક વર્ષો પછી તે શિરડીમાં આવ્યો અને શ્રી સાઈનાથ મહારાજને નમ્રતાપૂર્વક નમસ્કાર કરતો રહ્યો. બાબાએ પણ પહેલાની માફક જ તેનું સન્માન અને સત્કાર કર્યા. (ઓ. ૧૪૩-૧૫૧)

બાબાની આવી અગાધ લીલા છે. નિર્ણયનો નિવેદો જે સમયે થવાનો હતો તે સમયે થયો પણ ત્યાં સુધી તે ગુરુ અને પોતે ચેલા એવી ભાવના બાબાએ ચાલુ રાખી. એનું ગુરુપણું એની પાસે અને પોતાનું ચેલાપણું પોતાની પાસે, એવો ઉપદેશ સાઈમહારાજે પોતાના આચરણમાં સ્વીકાર્યો. આપણે કોઈના થઈને રહેવું તેમજ કોઈને આપણા બનાવી દેવા એ સિવાય બીજી કોઈ સુંદર વસ્તુ નથી. તે સિવાય મોક્ષ પ્રાપ્ત કરવો પણ સહેલો નથી. બાબાના વર્તનમાંથી આ પ્રમાણેનો બોધ મળે છે. જેનો નિશ્ચય કદાપિ ન હગમગ તેમ ન હોય તે જ, નિરાભિમાનદ્વારી ગઢ ઉપર ચઢી શકે છે. પોતાની બુદ્ધિ ઉપજલી કાઢેલું હણપણ કે ચતુરાઈ અહીંથાં કામ લાગતી નથી. જેણે પોતાનું કલ્યાણ કે હિત સાધવું છે એને અભિમાન છોડીને વર્તવું જેઠાએ. જેણે દેહ અભિમાન છોડ્યું છે તેણે જ દેહ સાર્થક કર્યો છે. ભલેને પછી તે પરમાર્થ સાધવા માટે કોઈનો પણ શિષ્ય થઈ જય. બાબાની કોઈપણ વિષય પરની આસક્તિ વિનાની સ્થિતિ જેઠાને સર્વ નાના મોટા લોકો આશ્રય ચકિત થઈને એ તેમના ગૌરવ કરવા લાગ્યા. (ઓ. ૧૫૨-૧૫૬)

જાની લોકોનો શારીરિક વ્યવહાર પૂર્વજન્મમાં કરેલાં કર્મ અનુસાર હોય છે. લીધેલાં કામોની જવાબદારી નથી હોતી.

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

કર્માના ફળ તેમને સ્વીકારતા નથી હોતા. જે સૂર્યને અંધારામાં પ્રવેશ મળી શકે તો જ જ્ઞાની પુરુષને દ્વૈતભાવમાં હોઈ શકે. જેઓને આખું વિશ્વ પોતાનું સ્વરૂપ લાગે છે, એમને જ અદ્વૈતનું ઠેકાળું ગ્રાપ્ત થાય છે. (ઓ. ૧૬૦-૧૬૧)

આ ગુરુશિષ્યનું આચરણ સાઈનાથના પરમ ભક્ત મહાણસાપ્તિએ કહેલું. એવું જ મેં સંપૂર્ણ કથન કહેલું છે. હવે આ આખ્યાન પૂરું કરું છું. હવે પદ્ધીનું ચરિત્ર આ કરતાં પણ ગહન અને ગૂઢ છે તે વિગતવાર અનુકૂળે કહેવાશે. તે સાંભળવા માટે સાવધ રહો. મસ્નિજદ પહેલાં કેવી હતી કેટલા પ્રયત્નો બાદ એનું બોંયતળિયું નવું કરવામાં આવ્યું, સાઈ હિન્દુ હતા કે મુસલમાન તે કોઈ જ નકી કરી શક્યું નહીં. ધોતીપોતી જેવી હઠ્યોગ સાધના, પેટનાં આંતરડાં શુદ્ધ કરવાનો પ્રકાર તથા હઠ્યોગની સાધના દ્વારા શરીરનાં અંગો છૂટાં પાડીને અવયવો પાછા જેડવાનો પ્રકાર જે ખંડ્યોગ કહેવાય છે તે સાઈ કરતા હતા. ભક્તોના નસિબના બોગ, રોગ અને પીડા તેઓ પોતે લઈ લેતા હતા. આ બધાનું નિવેદન યથાશક્તિ સારી રીતે આગળ ઉપર થશે. હવે હેમાદ્વારં સાઈબાબાના શરણે જય છે. આ કથાનું વર્ણન તેમનાં ચરણનો પ્રસાદ છે. આ પુણ્યશાળી કથા શ્રવણથી ભક્તોનાં સંકટ ટળશે. (ઓ. ૧૬૨-૧૬૩)

સર્વેનું કલ્યાણ થાઓ. આ પ્રકારે સંત અને સજ્જનોની પ્રેરણા મેળવેલા ભક્ત હેમાદ્વારં રચિત

શ્રી સાઈસમર્થના સત્યચરિત્રના ‘શ્રી સાઈનું પુનઃ પ્રાગટ્ય’ નામનો પાંચમો અધ્યાય

અહીયાં સમાપ્ત થાય છે.

શ્રી સદ્ગુરુ સાઈનાથને અર્પણા.



॥ અદ્યાય ૬ ॥

રામજન્મ ઉત્સવનું કથન

(શ્રી રામજન્મ ઉત્સવ વગેરેનું વર્ણન)

શ્રી ગણેશજીને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કૃષ્ણદેવતાને વંદન,
શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રજીને વંદન અને શ્રી સદગુરુ સાઈનાથ મહારાજને વંદન.

પરમાર્થની ઈચ્છા કરવાવાળો પરમાર્થી હોય કે સંસારની સર્વ સુખસંપત્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળો સંસારી હોય પોતે જીવન નૈકાનો સુકાની સદગુરુ જ એ જ નાવ તારીને પરમાર્થ સંસાર કે પરમાર્થના બીજા કઠિ ઉતારશે. સદગુરુના નામની મનમાં ભાવના જગૃત થતાં શ્રી સાઈબાબાની જ પહેલી યાદ આવે છે. તેઓ સામે જ આવીને ઊભા રહે છે, અને પોતાનો વરદ્ધકસ્ત માથા ઉપર મૂકે છે. બાબાનો ઉદ્દી સાથેનો આશીર્વાદ્યુક્ત હાથ જ્યારે મસ્તક ઉપર મૂકાય છે ત્યારે અંત: કરણ આનંદથી ઊભરાઈ જય છે તથા આંખોમાંથી પ્રેમાશ્રુત વહેવા લાગે છે. ગુરુના હાથના સ્પર્શનું આશ્રૂર્ય એવું હોય છે કે, પ્રલયરૂપી અજિનમાં જે બજતો નથી, એવા એ સૂક્ષ્મ દેહને (લિંગદેહ, વાસનાયુક્ત શરીર, મન, પોતાના હાથના સ્પર્શથી બાળીને ભસ્મીભૂત કરી નાખે છે). ઈશ્વરની કથાવાર્તા સાંભળવામાં જેમની આંખો વેદનાથી ભરાઈ જય અથવા તો જેમના મુખથી બડબડ શરૂ થાય તેમને સ્થિરતા અને શાંતિ મળે છે. બાબાનો માથા ઉપર હસ્તકમળ મુક્તાની સાથે જ અનેક જન્મોનાં પાકેલાં પાપો ઘોવાઈ જય છે અને સાઈના પ્રેમાળ ભક્તો પાવન થઈ જતાં હોય છે. બાબાના એ સૌભ્ય રૂપને જેઠિને કંઠ અત્યંત આનંદથી રુંધાઈ જય છે, આંખોમાંથી આનંદનાં ઝરણાં ફૂટે છે. અને હદ્યમાંથી પ્રગટ થતા અષ્ટભાવો જેવા કે પરસેવો છૂટવો, સ્તર્ય થવું, અંગેઅંગમાં રોમાંચ અનુભવવો તથા અવાજ બગડવો, શરીરમાં કંપ છૂટવો, શરીરનો રંગ પલટાઈ જવો અને આંખોમાંથી અશ્રુ વહેવાં તેમજ હોશ ગુમાવવો તે પ્રગટ થાય છે. હું જ પરમેશ્વર છું એવી વૃત્તિ જગૃત થાય છે. સ્વચ્છાનંદ ઉત્પન્ન થાય છે અને હું અને તું પણું મટીને અદ્દેત સંધાય છે. પોથીપુરાણ જેમ જેમ વાંચતા જઈએ તેમ તેમ ડગલે ને પગલે સદગુરુનું સ્મરણ થાય છે. શ્રી રામ અથવા શ્રી કૃષ્ણના રૂપે શ્રી સાઈબાબા પ્રગટ થાય છે, અને પોતાનું ચરિત્ર સંભળાવે છે તેવું લાગે છે. ‘એકનાથી ભાગવત’ સાંભળતી વખતે શ્રી સાઈ નખશીખ સુધી શ્રી કૃષ્ણ બનીને ભક્તોનું હિત સાધવા માટે ઉદ્ધવગીત ગવાતું હોય તેવું લાગે છે. સાધારણ વાત કરતી વખતે પણ યોગ્ય દંધાંત આપવા માટે અચાનક સાઈનાથ મહારાજની કથા યાદ આવે છે. કાગળ લઈને લખ્યું એવું ધારીને અક્ષરથી અક્ષર મેળવાતા નથી, પરંતુ એ જ જ્યારે સાઈ પોતાના સામર્થ્યથી લખાવે છે ત્યારે જે લખી શકાય છે જ્યારે અહુમ્ભાવ પ્રગટ થઈને બહાર આવવા માટે પ્રયત્ન કરતો હોય છે, ત્યારે ત્યારે સાઈબાબા તેને દ્વારાવીને શિષ્યમાં શક્તિપાતા કરે છે અને તેને કૃતાર્થ કરે છે. કાયા, વાચા અને મનથી સાઈ સમર્થને સાણાંગ નમસ્કાર કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપોઆપ હાથ લાગી જય છે. ભક્તને કર્મજ્ઞાન, યોગ અને ભક્તિ આ ચાર માર્ગો વડે ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. આ ચારે માર્ગ ચાર જુદી બાજુએથી નીકળતાં હોવા છિતાં તે સર્વે ભક્તને પરમપદે પહોંચાડે છે. જેમાં વિચિત્ર

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

અને કઠીનાઈ પણ ભક્તિ સીધી અને સરખી પગદી છે. જે ઈશ્વર તરફ આસાનીથી લઈ જય છે. તેમ છતાં માર્ગમાં આવતો કાંટાઓને ટાળીને પગ મૂકવો એ જ સહેલો ઉપાય છે. આ પ્રમાણે કરતાં આપણું દ્યેય સુરક્ષિતપણે સાધી શકાય છે એવું ગુરુમાવલીએ સ્પષ્ટ કહ્યું છે. મનુષી મળ ઉપર જે ભક્તિઝીપી પાણીનો છંટકાવ કરવામાં આવે તો વૈરાગ્ય ઊગી નીકળે છે, અને જ્ઞાનરૂપી ફૂલોની મોસમ ભીલે છે. તેનાથી મોક્ષ મળે છે. તેમજ જ્ઞાનમય આનંદ ઉભરાઈ આવે છે. તેથી જન્મ મરણનો ફેરો ચોકક્સ ટળી જય છે. (ઓ. ૧-૧૮)

પરમાત્મા સ્વયંસિદ્ધ છે. એ જ સત્ય, જ્ઞાનને આનંદધુક્ત એવાં ત્રણ સ્વરૂપોવાળા છે. કારણ નિમિત્તથી એ ભક્તોને બોધ આપવા માટે પૂર્ણપણે જગૃત થઈ પ્રગટ થયા છે. જેવા સત્ય, ૨૪, તમ એ ત્રણ ગુણો વ્યક્ત થયા, તેવી જ માયા સૂદ્ધિનું નિર્માણ કરવા માટે સાધનભૂત ઈશ્વરીય શક્તિ માયા પોતાના ગુણોને સારી રીતે પ્રગટ કરે છે. માટીના વિશિષ્ટ બનાવેલા આકારને ઘડો એવું નામ આપવામાં આવે છે. પરંતુ ઘડો ફૂટયો કે, પદાર્થનું ઢપાંતર થઈને બધું જ બદલાઈ જય છે. આ બધું જ માયામાંથી જ ઉત્પન્ન થયેલું છે. એનો કાર્ય કારણભાવ છે. ખરેખર તો માયા પ્રત્યક્ષ રૂપે સાકાર થઈને વિશ્વરૂપે ઉદ્ભબેલી છે. જગત પહેલાં જે માયાની સ્થિતિ જોઈએ તો એને આકાર ન હતો. પરમાત્માના સ્વરૂપમાં લીન થયેલ હતી અને પરમ શ્રેષ્ઠ અવ્યક્તમાં ભેગી થયેલી હતી જે વ્યક્ત થઈ, છતાં પણ પરમાત્માના ઢપમાં ભવે અવ્યક્ત હોય તેમ છતાં તે પરમાત્માનું જ ઢપ છે. પરમાત્માના ઢપ સાથેની આ માયા પરમાત્માના ઢપથી જરા પણ બિજ્ઞ નથી. (ઓ. ૧૯-૨૪)

માયાએ તમોગુણથી પદાર્થ નિર્માણ કર્યો. આ પ્રથમ કિયા પૂર્ણ થઈ ત્યારપણી માયાના રજે ગુણમાં પરમાત્માના ચૈતન્યથી એનો મેળ થાય એટલે સમજાવું કે તમ અને રજ આ બંને ગુણો દ્વારા સ્વાભાવિક ધર્મમાં ચૈતન્યની ખાલી જ ઉધી જય છે. એટલે કે અનેક પ્રકારનાં ચાર પ્રાણીઓ ઉત્પન્ન થાય છે. પછી માયાના સત્ત્વગુણથી બુદ્ધિતત્ત્વ નિર્માણ થઈ અને તેમાં પરમાત્માનો આનંદગુણ સમાઈ જતાં ખેલને સંપૂર્ણતા પ્રાપ્ત થાય છે. (ઓ. ૨૫-૨૭)

આમ આ માયા મહાવિકારી હોય છે. પરંતુ જ્યાં સુધી એ ઢપાંતર થવાની પ્રક્રિયા સ્વીકારતી નથી અને ઉપર જણાવેલા પદાર્થ ઉત્પન્ન કરતી નથી, ત્યાં સુધી એ ત્રિગુણો અવ્યક્ત રહે છે. ગુણોને અનુરૂપ એવી કિયા કર્યા વિના માયા વ્યક્ત થતી નથી. જ્યાં લગી એ કોઈપણ જતની કિયા કરતી નથી ત્યાં સુધી તે અવ્યક્ત રહી શકે છે. માયાનું પ્રગટ થવું એ પણ ઈશ્વરનું જ કાર્ય છે. ઈશ્વરમાંથી જ ઉત્પન્ન થયેલી છે. ‘સર્વ ખલીદ પ્રભુ’ જે દેખાય છે એ બધું જ પ્રભુ છે. આ તત્ત્વ અને ત્રણોનું જે એકરૂપપણું છે તે ઓજ અથવા તેજ છે. એવી એકરૂપતાનો અનુભવ નિશ્ચિત પ્રાપ્ત કેવી રીતે થાય એવી જેને ચિત્તમાં ઉત્કંઠ ઈચ્છા હોય છે એવાઓએ વેદશાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ. આ વેદશાસ્ત્રો અને શ્રુતિ-સ્મૃતિના સારાસારની વિચાર કરવાની શક્તિ અને ગુરુ અને વેદાંતનાં વચ્ચેનો તથા તેની ઉપરનો ભરોસો પરમાનંદ આપતાં હોય છે. (ઓ. ૨૮-૩૨)

‘મારા ભક્તોને ઘેર અન્ન અને વસ્ત્રોની કમી રહેશે નહીં, તે અંગે શ્રી સાઈ ખાતી આપતા હતા. તે અંગે તેમના ભક્તોને તેની ખર્બર છે. મને જે અનન્યપણે જે ભજે છે, મારી જે સેવા કરે છે તથા નિત્ય યોગયુક્ત રહે છે તેના ઉદ્દર નિર્વાહની તજવીજ કરવી અને જેઠીએ તે મેળવી આપવું. તે વ્રત ‘વ્રત છે જ્ઞાણો એ મારું’ આ જ ભાવ શ્રીમદ્ ભગવદ્ ગીતાનાં આ વચ્ચેનો અનન્યાશ્વિન્યાસનો માં યે જનાઃ પર્યુપાસતો । તેખાં નિત્યાભિયુત્કાળા યોગદ્વારે વહુમ્યહુમ્ || (અ. ૬ શ્લોક ૨૨) માં જણાયું છે તેને તમે માનો એવું શ્રી સાઈ કહેતા હતા. તમને ભક્તોને અન્ન વસ્ત્રની અછત પડવાની નથી. એને માટે પ્રાણ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

ખર્ચી નાખતા નહીં. પ્રપંચમાં ફસાઈને માન અપમાનની વાતો છોડી દેવી જોઈએ. ઈશ્વરના ધામમાં જે માન મેળવું તે અને તેની સામે જ ઝોળી ફેલાવવી તથા દેવના પ્રસાદનો જ અનુગ્રહ કરવો. લોકોની વાહ વાહ સાંભળીને તમે પોતાને જ ભૂતી ગયા કે ? અરે ધર્મનો આરાધ્ય દેવતા અથવા તો ગુરુના દેહના અંત:કરણથી જરણ ફૂટીને તેના પરસેવાથી ભીજ્ઞવો જોઈએ. આ ધ્યેય જ મધુર લાગવું જોઈએ. માનવની બધી ઈન્દ્રિયોને ભક્તિનું ગાંડપણ લાગવું જોઈએ અને ઈન્દ્રિયોના વિકારોને ભક્તિના અંકુર ફૂટવા જોઈએ પછી જુવો એની નવાઈ ? સહા સર્વદા આવું જ ભજન કરો કે બાકીની બીજી કોઈ વસ્તુ ગમે નહીં. માનું મન શ્રી સાઈના નામ સમરણમાં જ રહે, અને બીજી બધી વસ્તુઓ જેવી કે શરીર, ધરબાર, સંપત્તિ વગેરેનું ભાન ન રહેતાં તે ભૂલાઈ જય. ચિત્ત પરમાનંદ પામશો, અને મન ખાત્રીથી તટસ્થ અને એકદમ શાંત થઈને તૃપ્ત થઈ જશે. (ઓ. ૩૩-૪૦)

સત્તસંગ કર્યો એની નિશાની એટલે કે વૃત્તિઓનું સમાધાન થવું જોઈએ. અનેક ડેકાણે જે મન ભટક્ટું હોય છે, એને ખરેખર તલ્લીન થયેલું કહી શકાય ? ત્યારે શ્રોતાઓએ ધ્યાન આપીને અને શ્રદ્ધાથી આગળ ઉપરનું વર્ણન સાંભળવું જોઈએ. આ ‘સાઈ-ચરિત્ર’નું શ્રવણ કરવાથી મનની વૃત્તિ ભક્તિ તરફ વળે છે, અને કથાના સાંનિધ્યમાં પ્રસન્નતા પ્રાપ્ત થશે. તથા ચંચળ અને વિશ્રાંતિ મળશે. જીવનની બેચેની નિવૃત્ત થશે અને પરમસુખની પ્રાપ્તિ થશે. (ઓ. ૪૧-૪૩)

હવે પહેલાના મસ્ઠિજદના લુણોદ્વારના અનુસંધાનથી, રામજન્મ અને કથાકિર્તન વિષેનું વર્ણન આગળ ચલાવીએ. એક ભક્ત, ગોપાલરાવ ગુંડ જે મોજણી ખાતાના સર્વેઅર હતા. તેમને બાબા પર અતિશય ભક્તિભાવ હતો. તે બાબાનું અખંડ નામસમરણ કરતા અને પોતાનો સમય પસાર કરતા હતા. એમને ત્રણ પત્નીઓ હોવા છતાં પણ સંતાનસુખ ન હતું. આગળ ઉપર સાઈબાબાના પ્રસાદથી એમને ત્યાં પુત્રરત્ન પ્રાપ્ત થયું. તેથી તેમનું મન પ્રસન્ન થયું. એક વખત ગોપાલરાવ ગુંડના મનમાં વિચાર આવ્યો કે શિરડી ગામમાં દર વર્ષે એક મેળો અથવા ઉર્સનું આવ્યોજન કરાવીએ એટલે સર્વને આનંદ થશે. તાત્યા કોતે પાટીલ, રામચંદ્ર દાદા કોતે પાટીલ, માધવરાવ દેશપાંડે વગેરે સર્વે મુખ્ય મંડળીને આ વિચાર ગમ્યો અને તેઓ તૈયારીએ લાગ્યા, પણ આવા વાર્ષિક ઉત્સવ કરવા માટે એક નિયમનું બંધન હતું. એ કરવા માટે જિલ્લા અધિકારીની સંમતિ મેળવવી આવશ્યક હતી. પરંતુ એને માટે જ્યારે પ્રયત્નો થઈ રહ્યા હતા ત્યારે ગામનો એક અધિકારી કે જેને સરકારે પોતાની વસૂલી માટે અને હિસાબ માટે નિમેલો હતો તે કુલકણી કંઈક ખરાબ ભાવથી વિરોધ કરવાની ગાડમથલમાં પડ્યો હતો. એના પરિણામે તે વિરુદ્ધ જવાથી વિઘ્ન ઉણું થયું અને એનું શું પરિણામ આવ્યું તે હવે જોઈએ. જિલ્લામાંથી હુકમ આવ્યો કે આ મેળો શિરડીમાં ભરવો નહીં. પરંતુ આ મેળો અને ઉર્સ શિરડીમાં જ ભરાય એવી બાબાની અંગત ઠચ્છા હતી, અને તે માટે એમની પૂર્ણ આશીર્વાદ્યુક્ત આજ્ઞા પણ થઈ હતી. ગામ લોકોએ પીછો છોડ્યો નહિં, ખૂબ ધમ-પછાડા કરીને પણ અધિકારીનો હુકમ ફેરવી નંખાવ્યો, અને બધાનું માન રહ્યું. તે ઘટના રીતે ૧૮૯૮ સન ૧૮૯૭માં બની ત્યારથી બાબાની સંમતિથી રામનવમીના દિવસે મેળો ભરવાનું નક્કી થયું. તાત્યા કોતે વ્યવસ્થામાં લાગી ગયા અને પુષ્કળ લોકો તેમાં જોડાવા લાગ્યા. આ રામનવમીના દિવસે ભજન પૂજના સમારંભમાં ઢોલ, ત્રાસાં અને વાંજિત્રો વગાડનારા સહિત ચારે બાજુથી ખૂબજ જનમેદની ભેગી થવા લાગી. દર વર્ષે બે નવી ધવજ-પતાકા સમારંભપૂર્વક સરધસમાં ફેરવી, મસ્ઠિજદના દ્વારે છેલ્લે ધવજ આરોહણ થતું. સ્વ. શંકરરાવ રધુનાથ દેશપાંડે ઉદ્ઘાટનારા નિમોણકર ને માધવરાવ દેશપાંડેના મોટા કાકાના દીકરા થાય તેમણે ત્યાંથી એક ધજન અને બીજી પતાકા દામુ આણણા તરફથી આવી બે ધજનાઓ ઠાઠમાઠથી

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

શિરડીમાં સરધસમાં ફેરવવામાં આવતી અને ત્યારબાદ મસ્ઝિદના આગળના ભાગે ફરકાવતી. (ઓ. ૪૪-૫૭)

આગળ ઉપર વળી પાછો ઉર્સની જેડે રામનવમીનો ઉત્સવ કેવી રીતે ઉદ્ભબ્યો એ આશ્ર્યકારક કથની હવે સાંભળો. આ રામનવમીનો ઉત્સવ એટલે શિરડી માટે આત્માનંદ આપનારા માન અને સન્માન છે. શકે ૧૮૩૩ સન ૧૯૧૧ની સાતમાં પહેલી રામનવમી અને ઉર્સને કારણે તેની ઉજવણી થઈ, ત્યારથી અખંડ ચાલતી આવી છે. પ્રસિદ્ધ સ્વ. કૃષ્ણ જેગેશ્વર ભીજ્મ જે શ્રી સાઈનાથ સગુણોપાસના આરતીના પુસ્તક કર્તા, એમને લીધે જ આ ઉત્સવની કલ્પના ઉદ્ભબી. એમને એવું લાગ્યું કે રામજન્મ ઉત્સવ ઉજવવો જેઠાએ, જે સર્વ માટે ખૂબ હિતકારક થશે. એના પહેલાં ફક્ત ‘ઉર્સ’ યાત્રા જ વધારે પ્રમાણમાં ઉજવાતી હતી. એમાંથી તે વર્ષથી રામજન્મના સુંદર ઉત્સવનો ઉદ્ઘાટન થયો. એક દિવસ ભીજ્મ સાહેના વાડામાં સ્વસ્થ ચિત્ત બેઠેલા હતા તે વખતે કાકા સ્વ. લક્ષ્મણ ગણેશ ઉર્ફ કાકામહાજની પૂજાપો લઈને પૂજા સમારંભ માટે મસ્ઝિદમાં જવા તૈયાર થયા. મનમાં સાઈ દર્શનની છિંદ્ધા તો હતી જ તે ઉપરાંત ઉર્સની મોજમજ મળે તેથી કાકા ઉત્સવ માટે એક દિવસ વહેલા જ શિરડીમાં હાજર થયા હતા. યોગ્ય સમય જેઠાએ ભીજ્મે કાકાને પૂછ્યું, ‘મારા મનમાં એક સુંદર વિચાર આવ્યો છે. મને એમાં મહદું કરશો ? અહીંયાં દર વર્ષે ઉર્સ ભરાય છે. વળી રામજન્મનો પણ આ દિવસ છે. ત્યારે રામ જન્મોત્સવને સંપાદન કરવાની તક અચાનક જ મળી છે. માટે મને લાગે છે કે, એનો ઉપયોગ કરી લેવો જેઠાએ. કાકા મહાજનીને આ વિચાર ગમ્યો, અને તેઓ બોલ્યા કે ‘બાબાની આજ્ઞા મેળવો એમની આજ્ઞા ઉપર જ બધું નિર્ભર છે. પછી કામે લાગતાં વાર લાગશે નહીં.’ પરંતુ ઉત્સવ માટે કીર્તનની જરૂર પડશે તેથી તે પ્રશ્ન ઊભો થયો. ગામડામાં વળી કીર્તનકાર કયાંથી શોધવો ? આ એક મોટી અહુચુણ ઊભી થઈ, ત્યાં ભીજ્મ બોલ્યા, ‘હું કીર્તન કરીશ તમે પેટી વગાડજે અને સાથ આપજો. રાધાકૃષ્ણબાઈ સૂંધની વડીઓ તૈયાર કરશો. ચાલો તો પછી બાબા પાસે જઈએ. શુભકાર્યમાં વિલંબ કરવાથી ઘણી અહુચુણો ઊભી થાય છે. શુભ કાર્યને જલદી પતાવવાથી તે આપોઆપ સધાય છે. ચાલો હવે કીર્તન કરવાની આજ્ઞા લેવા માટે આપણે જઈએ.’ એમ બોલીને તેઓ બંને તે સમયે મસ્ઝિદમાં જઈ પહોંચ્યા. કાકાએ પૂજનો આરંભ જ કર્યો હતો અને બાબાએ સામે પ્રશ્ન કર્યો કે, ‘વાડામાં શું ચાલ્યું હતું ?’ પણ કાકાને રામજન્મોત્સવ બદલ પૂછવાનું સૂક્ષ્યું નહીં. એટલે તરત જ બાબાએ એ જ પ્રશ્ન બાજુમાં ઊભેલા ભીજ્મને પૂછ્યો, ‘કેમ શું ? બુવા શું કહેતા હતા ?’ ત્યારે જ કાકાને યાદ આવ્યું અને એમણે મનમાં નક્કી કરેલો હેતુ કહી સંભળાવ્યો. બાબાના મનને એ વિચાર ગમ્યો, અને ઉત્સવ ઉજવવાનું નક્કી થયું. બીજે દિવસે સવારે બાબા લેંડીબાગમાં ગયેતા છે તેમ જાણીને સભામંડપમાં પારણું બાંધ્યું અને કીર્તનનો ઢાઠ કર્યો. સમયસર ભક્તો પણ બેગા થયા. અને એ જ અરસામાં બાબા લેંડીબાગથી પાછા ફર્યા. કાકા વાળપેટી વગાડવા બેસી ગયા. એટલામાં બાબાએ એમને બોલાવા માટે કોઈકને મોકલ્યો. ‘બાબા તમને બોલાવે છે’ આ શબ્દો કાને પડતાં જ કાકાના પેટમાં ધ્રાસકો પડ્યો. ‘શું થયું મનને સમજતું નથી. કથાના ઉત્સાહમાં રંગમાં ભંગ તો ન જ પડવો જેઠાએ.’ બાબાનું નિમંત્રણ સાંભળીને કાકા મૂંજાયા. ‘બાબાના મનમાં શું સંદેહ થયો હશે ? બાબાએ શું વિચાર્યું હશે ? કીર્તન નિર્વિધને પાર પડશે ને ?’ કાકા આગળ ચાલતાં ચાલતાં છતાં પાછળ જેતા બીકના માર્યા મસ્ઝિદનાં પગથિયાં ચઢવા લાગ્યા. તેમના પગલાં ધીરિધીરે પડતાં હતાં, અને તે ચિંતાતુર થઈ ગયા હતા. બાબાએ એમને પૂછ્યું, ‘આ પારણું અહિ શા માટે બાંધ્યું છે ? કાકાએ કથાનું તાત્પર્ય અને ઉત્સાહથી કરેલ આયોજનની જાણ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

કરી. તે સાંભળીને બાબાને આનંદ થયો. તે પછી બાબાએ ત્યાં પાસે જ ખૂણામાં પડેલ એક સુંદર હાર ઉંચકી કાકાના ગળામાં નાખ્યો. અને બીજે એક ભીજમને પણ આપ્યો. પારણાંનો પ્રક્રિયા ઉઠતાં જે મોટી ચિંતા થઈ હતી, તે ગળામાં હાર પડતાની સાથે દૂર થઈ. (ઓ. ૪૮-૪૯)

ભીજ પહેલેથી જ ધણા વિષયાનું જ્ઞાન ધરાવનાર અને વિવિધ કથાઓ કહેવામાં પારંગત હતા તેથી કીર્તન રસમય અને મનોરંજનથી ભરપુર બન્યું. અને શ્રોતાઓને ખૂબજ આનંદ થયો. બાબાના ચહેરા પર પણ પ્રસન્નતા દેખાઈ. સંમતિ આપી તે પ્રમાણે ભજન અને કીર્તનનો સમારોહ પૂર્ણ થયો. રામજન્મના અવસરે બાબાની આંખમાં ગુલાલ પડ્યો તેથી બાબાએ અચાનક નરસિંહરૂપ ધારણ કર્યું. ગુલાલ તો કેવળ નિમિત્ત હતું, એ તો રામજન્મનો આવેશ હતો. હવે અહંકારઢીપી રાવણનો નાશ થશે, અને દુરાચરણઢીપી રાક્ષસોનો વધ થશે. બાબાને એકાએક કોઘ આવ્યો, જાણે કે પ્રત્યેક નરસિંહનો અવતાર પ્રગટ્યા. તેમણે ગાળોનો તથા શ્રાપોનો વરસાદ શક્ક કર્યો. રાધાકૃષ્ણાબાઈ ઘોડિયાના ટુકડા થઈ જશે એ વિચારથી ડગી ગયાં, ઘોડિયાને કેવી રીતે સુરક્ષિત રાખવું તેની ચિંતા થઈ. ‘છોડો છોડો જલ્દીથી છોડો’ એવો એમની પીઠ પાછળનો આગ્રહ સાંભળી કાકા પારણું છોડવા માટે જરા આગળ સરક્યા. તેથી બાબા અત્યંત ગુસ્સામાં ઉછબ્યા અને કાકાની સામે ઘસીને આવ્યા. પછી ઘોડિયું છોડવાનું તો બાજુ પર રહ્યું. પણ બાબા થોડા શાંત થયા. ત્યારખાદ બપોરે ઘોડિયું છોડવાની આજા માંગી ત્યારે બાબાએ કહ્યું ‘ઘોડિયું હમણા શાનું છોડો છો ? હજુ તેની જરૂર છે કે !’ આ વળી આવશ્યકતા કઈ ? સાઈબાબાના શરૂઆતો કદમ્પિ ખોટા કે અર્થહીન હોઈ જ ન શકે. વિચાર કરતાં સમજન્યું કે ઉત્સવની સર્વ વિધિ યથાસ્થિતિ સંપૂર્ણ થઈ ન હતી. ઉત્સવ તો થયો, પરંતુ બીજે દિવસ જ્યાં સુધી ઊગે નહિ, અને ગોપાલકલા એટલે કે ગોકુલ અષ્ટમીના ઉત્સવમાં અથવા શ્રી કૃષ્ણાના બીજા કોઈ ઉત્સવને અંતે દર્હી ભરેલી હંડી ફોડવી, કુંદી ફરવી, નાચવું ઇત્યાદિ વગેરે મજનોનો સમારંભ કરાય છે તે પ્રમાણે પૂર્ણાહૃતિ ન થાય ત્યાં સુધી ઉત્સવ સમાપ્ત થયો એમ કહ્યા શકાય નહીં. આ પ્રકારે બીજા દિવસે ગોપાલકલા અને કીર્તન થયા બાદ પારણું છોડવાની આજા બાબાએ આપી. (ઓ. ૮૨-૮૩)

બીજ વર્ષે ભીજ ન હતા. એટલે બાળાબુઆ સતારકરને કીર્તન માટે બોલાવવાના હતા પરંતુ તેમને સંગતી જલ્દાના એક ગામ એને કવઠેમાં રામનવમીના ઉત્સવ માટે વર્ષો પહેલાં નક્કી થયા મુજબ જવાનું હતું. માટે કાકામહાજનીએ બાળાબુઆ નામના બીજા એક ભક્તિમાન ભજનિકને કે જેમની અવર્દ્યાની તુકારામ નામથી પ્રસિદ્ધ હતી, એમને લઈ આવ્યા, અને એમના હાથે ઉત્સવ ઉજવાયો. તેઓ પણ જે ન મજ્યા હોત તો કાકા મહાજની પોતે જ કીર્તન માટે ઊભા રહ્યા હોત. દાસગણ મહારાજનું રામનવમીનું આખ્યાન એમને મોઢે હતું. ત્રીજ વર્ષે સને ૧૯૧૩માં બાળાબુઆ સતારકરનું શિરડી સમયસર આવવાનું કેવી રીતે થયું તે ધ્યાનથી સાંભળો. શ્રી બાબાની ફેલાયેલી કીર્તિ સાંભળીને બાળાબુઆ સતારકરના મનમાં એમના દર્શનની ઇચ્છા ઉત્પન્ન થઈ. પરંતુ રસ્તે જતાં સંગાથ જોઈએ તે કેવી રીતે મળશે એની એમને ચિંતા હતી. બાળાબુઆ પોતે કીર્તનકાર હતા. એમનું મૂળ વતન સતારા પાસે હતું. પરંતુ એ વખતે એમનો મુકામ મુંબઈમાં પરેલમાં હતો. સત્તારા કિલ્લામાં બિંહાડ સિદ્ધકવઠે નામનું ખૂબ જૂનું અને પવિત્ર દેવસ્થાન છે. બાળાબુઆને ત્યાંની રામનવમીના કીર્તન માટે વાર્ષિક નિમણૂક કરવામાં આવેલ હતી. અખાડી એકાદશી અને ચૈત્ર મહિનામાં રામનવમી આ બે વાર્ષિક ઉત્સવો જેઠે બાળાબુઆને સંબંધ હતો. અકબર બાદશાહની સનત જેતાં બદે બાબા ઈશ્વરના ખર્ચ કરવાના એકસો ચોવીસ રૂપિયાની સરકાર તરફથી મૂળ વ્યવસ્થા હતી. આ બે દિવસ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

માટે બાળાબુઅની દેણગી ત્રીસ ડિપિયા હતી. પરંતુ એ વર્ષ કવઠે ગામમાં જાડા ઉલટીની બીમારી ફેલાયેલી હતી અને ગામના માણસો કઠીન પરિસ્થિતિમાં મૂકાયા હતા. રામનવમી તો બાજુ ઉપર રહી પણ ત્યાંથી બુઅા પર પત્ર આવ્યો કે ભાઈ હવે આવતે વર્ષે જ આવવું. ગામ આખું ખાલી થયેલું છે. દુંકાણમાં રામની સેવા બાકાત રહી. જેમાંથી જે પૈસાની આવક થવાની હતી તે ગઠ પરંતુ તેને બદલે તેમને શિરડી જવાનો મોકો મબ્બો. બાળાબુઅાએ કાકાસાહેબ દીક્ષિતની મુલાકાત લીધી. દીક્ષિત બાબાના પરમ ભક્ત છે. તેઓ જો ધ્યાન ઉપર વાત લે તો આપણી શિરડી જવાની મરણ પૂર્ણ થશે અને સ્વાર્થ અને પરમાર્થ બંને સધાય. આમ વિચાર કરી, તેઓએ દીક્ષિતને કહ્યું, ‘જે અમારું વર્ષસન દેરવવામાં આવે તો ત્યાં આવીને બાબાના દર્શન કરવા અને કીર્તન કરવાનું મન થાય છે.’ તે સાંભળતા ભાઉસાહેબ બોલ્યા, ‘વિદ્યાયગીરીની ખાતરી નહીં, આપવી કે ન આપવી એ બાબાના હાથમાં છે. કીર્તન માટે પણ એમની સંમતિની જરૂર પડશે.’ આ સંભાષણ ચાલતું હતું એવામાં કાકા મહાજની આવી પહોંચ્યા. અને શિરડીનો પ્રસાદ અને ઉદ્દી વહેંચવા લાગ્યા. બુઅાને આ એક શુભ શુકનનો ભાસ થયો. કાકા મહાજની હાલમાં જ શિરડીથી પાછા આવ્યા હતા. કુશળ મંગળની વાતો કહીને પછી તેઓ તેમના ઘરે પાછા ફર્યા. પછી દીક્ષિતે ઘણા પ્રેમથી બાળાબુઅાને કહ્યું, ‘હું બાબાની સંમતિ લઈશ અને તે મળતાં જ તે હું નક્કી કરી જણાવીશ. મારો પત્ર મળતાં જ શિરડી પદ્ધારને. આવવા જવાના ખર્યની ચિંતા ન કરતા.’ આ બાબતે મનમાં શંકા કે ચિંતા કરશો નહીં. પછી દીક્ષિત શિરડી ગયા. બાબાએ સંમતિ આપી ત્યાર પછી બાળાબુઅા શિરડી આવ્યા અને એમની ઈચ્છા અનુસાર બાબાનાં દર્શન પણ થયાં. શ્રી સાઈબાબાએ પણ રામનવમીનો ઉત્સવ તેમની હાજરીમાં મનાવ્યો અને બાળાબુઅાના હાથે ખૂબ પ્રેમ અને ઉત્સાહથી પૂર્ણ કરાવ્યો. બાળાબુઅાના મનમાં પણ સંતોષ થયો કે ઘારેલું કામ પાર પડી ગયું. સાઈબાબા પણ પ્રસન્ન થયા, અને બધાના મનોરથ પરિપૂર્ણ થયા. બાળાબુઅાની વિદ્યાયગીરી પણ પ્રેમથી થઈ. દોઢસો ડિપિયા દક્ષિણા પેટે મબ્બો. બુવાને ખૂબજ સંતોષ થયો. પાંચ વર્ષની કમાણીની રકમ બાબાએ એ એક જ ઉત્સવમાં અપાવી. પછી બાળાબુઅા ખુશ કેમ ન થાય ? એમણે બાબાનો આભાર માન્યો. ત્યારબાદ સન ૧૯૧૩ બાદ દાસગણુ મહારાજ શિરડીમાં આવ્યા હતા. ત્યારે કાકાસાહેબ દીક્ષિતે બાબાને વિનંતી કરીને આગલા દશ વર્ષનો ઉત્સવ દાસગણુને અપાવડાવ્યો. ત્યારથી માંડીને અત્યાર સુધી અનેક વાદોના એકત્રિત અવાજમાં નામસ્મરણનો જ્યયદોષ ઉજવવામાં આવે છે, તેમજ બાળકોને, ગરીબોને પેટ ભરીને જમાડવામાં આવે છે. ગામના ગરીબ લોકોના આનંદનો પાર રહેતો નથી. સમાધિ મંદિરના મહાદ્વારે મંગળવાદોના ગુંજરવમાં સાઈનામનો ઘોષ મોટા અવાજે હર્ષભેર આકાશમાં ઘૂમી ઉઠ છે. (ઓ. ૬૪-૧૨૦)

ગોપાલરાવ ગુંડને જેવી મેળા અને ઉર્સની પ્રેરણા થઈ તેવી જ રીતે જીજા થયેતી પડું પડું થતી પુરાણી મસ્નિદને ઘાટીતી અને સરસ બનાવવી અને વ્યવસ્થિત ડ્રપ આપવું એવી તીવ્ર ઈચ્છા થઈ. મસ્નિદનો જીર્ણોદ્વાર ખરેખર પોતાના હાથે થાય એવો ભક્ત ગોપાલરાવ ગુંડે નિર્ધાર કર્યો અને એ માટે પથ્થરો પણ મંગાવ્યા. પરંતુ આ જીર્ણોદ્વારનો યોગ આ ગુંડના નસીબમાં ન હતો. કારણ કે બાબાએ એ બધા પથ્થરો શિરડીમાના ગણપતિ, શનિ અને મહાદેવના મંદિરના જીર્ણોદ્વાર માટે અપાવ્યા. મસ્નિદના એ વિશિષ્ટ કાર્ય માટે થોડા સમય બાદ મનમાં ઘારેલો એવો યોગ આવ્યો. બાબાના મનમાં આ કાર્ય નાનાસાહેબ ચાંદોરકરે કરવું અને એના પછી, લાદીઓ બેસાડવાનું કામ કાકાસાહેબ દીક્ષિતે કરાવવું એમ હતું અને એજ પ્રમાણે આગળ ઉપર થયું. પહેલાં તે સૌ આશા માંગતા થાક્યા. પરંતુ જ્યારે મહાણસાપત્રને મધ્યસ્થી તરીકે રાખ્યા, ત્યારે જ બાબાએ પરવાનગી આપી. ત્યારબાદ મસ્નિદનમાં એક જ રાતમાં

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

પથથરો બેસાડી ભોયતળિયું તૈયાર થયું. અને તેમાં બીજા જ દિવસથી બાબા કોથળા ઉપર બેસવાનું છોડીને ગાહી ઉપર બેઠા. સને ૧૯૧૧માં સભામંડપ થયો. પણ અને માટે કેટલી પ્રચંડ ઘટપટો અને મગજમારી કરવી પડી? બધા જ હેરાન પરેશાન થઈ ગયા. એ કાર્ય પણ આવી જ રીતે વિપરીત પરિસ્થિતિ હોવા છતાં ભક્તોએ એક જ રાતમાં ધાણી તકલીફો વેઠીને પૂર્ણ કર્યું. રાતભર અથગ પ્રયત્નપૂર્વક થાંભલા દાટવામાં આવતા અને બાબા સવારે બધા હૃદમચાવીને ઉખાડી નાખતા. પણ ભક્તો એ મોકો જેઠીને પથથરો નાખીને ચણીને ઊભા કર્યા. આ પ્રકારે બધા થાકી જતાં, તેમજ બધાએ આ કાર્ય માટે કમર બાંધીને કામે લાગી જવું પડતું. રાત અને દિવસ એક કરવા પડતા. અતશિય કષ્ટથી સહન કરી મનની ધારેતી ઠચછા પૂરી કરતા પહેલાં ત્યાં ખુલ્લું આંગણું હતું અને એટલી જ ખુલ્લી જગ્યા હતી. કાકાસાહેબ દીક્ષિતને લાગ્યું કે સભામંડપ માટે આ જગ્યા યોગ્ય છે. જેટલો ખર્ચ થાય એટલો કરીને લોંઘંડના થાંભલાઓ અને પટાઓથી ઉપરનું ત્રિકોણ છાપું બનાવી રાખ્યું. બાબા ચાવડીમાં જતા રહ્યા છે તેવું જેઠીને બનાવડાવ્યું. ભક્તો રાત દિવસ એક કરીને ખૂબ પ્રયત્નોથી થાંભલા જમીનમાં નાંખીને ચણાવતા. અને ચાવડીથી પાછા આવતાં બાબા તે ઉખાડી નાંખવાનો પ્રયત્ન કરતા. (ઓ. ૧૨૧-૧૩૩)

એક દિવસ બાબા અતિશય કોધે ભરાયા. એક હાથથી એમણે તાત્યાની ગરદન પકડી અને બીજા હાથે એક થાંભલો હલાવી હૃદમચાવીને ઉખાડવા લાગ્યા. હલાવી હલાવીને તેને ઢીલો કરી નાંખ્યો. તાત્યાના માથાનો સાફો કઢાવીને દીવાસળી ચાંપીને સળગાવ્યો અને ગુસ્સાથી ખાડામાં ફેંકી દીધો. તે વેળાએ એમની આંખો જ્વાણે અંગારા જેવી ચમકતી હતી. બાબાની સામે કોઈ જેઠ શું શકે? દરેકનું વૈર્ય ઘટવા લાગ્યું. પછી તરત બાબાએ બિસ્સામાં હાથ નાંખ્યો અને એક ડિપિયાનો સિક્કો બહાર કાઢ્યો અને તે સિક્કાને પણ ખાડામાં નાંખ્યો, જ્વાણે કે શુભ મુહૂર્ત કર્યું. ગાળો અને શ્રાપોનો વરસાદ થયો. તાત્યા પણ એ જેઠીને મનથી ખૂબ ગભરાયો કે કપરો પ્રસંગ આવ્યો છે. આ કયો પ્રકાર તે કોઈને સમજયું નહીં! ગામના લોકો વિસ્મય પામ્યા. આજે કેમ આવાં અશુભ લક્ષણા. તાત્યા પાટીલ ઉપર આવેલ આ સંકટ કેવી રીતે દૂર થશે? એમના સિવાય બાબાને ‘અરે અને તુરે’ કરવાની મજલ બીજા કોઈના તકદીરમાં ન હતી. તે પણ બાબાની નજરમાં આવી ચઢ્યો અને ઝેઠોનો પ્રસાદ પામ્યો. જે પણ મધ્યસ્થી કરવા વચ્ચે પડ્યા તે બધાને તરત જ બાબા તરફથી મારનો પ્રસાદ મળ્યો. હવે બાબાની સામે જય કોણ? તાત્યાનો છુટકારો કેવી રીતે કરાવવો? જેતનેતામાં બાબાનો ગુસ્સો ઠંડો પડ્યો, અને શાંત થઈ ગયા. તરત જ બાબાએ એક દુકાનદારને બોલાવ્યો. જરીથી ડિનારી ભરેલો ફેંટો મંગાવ્યો, અને જલે જ તાત્યાના માથે બાંધ્યો, જ્વાણે કે એનું બહુમાન થયું. લોકોના આશ્રયનો પાર ન રહ્યો કે આ ગુસ્સાનું કારણ શું? અને એના ઉપર આ હલ્લો અને બાબાની બૂમાબૂમ શા માટે? આટલો બધો ગુસ્સો શા કારણથી બાબાએ કર્યો અને જેતનેતામાં પાછા પ્રસન્નચિત્ત પણ થઈ ગયા. આની જરા પણ કોઈને ખબર પડી નહીં. બાબા કોઈવાર એકદમ શાંત અને પ્રેમથી બોલતા હોય અને ધાણીવાર એક ક્ષણનો વિલંબ ન કરતા તથા કારણ વગરનો અચાનક ગુસ્સો કરતા. (ઓ. ૧૩૪-૧૪૬)

આવી છે, બાબાની વાતો. એક કહેવા જાઉં છું અને બીજી યાદ આવે છે. કઈ પહેલા કહેવી અને કઈ પાછળથી કહેવી એ સમજાતું નથી. આવો પક્ષપાત કરવો એ સારો નથી. મને પણ આવું ગમવું ન ગમવું ગમતું નથી. જેવી રીતે જે કથા કહેવાની વ્યવસ્થા થશે, તેવી જ રીતે તે શ્રોતાઓની હોંસ અને સાંભળવાની ઠચછા પૂર્ણ કરશે. વૃદ્ધો પાસેથી સાંભળેલી પહેલાંની વાતો, સાઈબાબા હિંદુ હતા કે મુસલમાન એ વિષયનું સવિસ્તર વર્ણન આવતા અધ્યાયમાં યથારાકિત મારી

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

બુદ્ધિ પ્રમાણે કરીશ. દક્ષિણાના નિભિતે ઉધરાવેલા પૈસા બાબાએ ત્યાંના મંદિરોના લાણોદ્વારમાં કેવી રીતે ખર્ચ્યા, ઘોતીપોતી હઠયોગની સાધના પૈકી પેટમાંથી બહાર કાઢી ચાંતરડાઓની શુદ્ધિકરણનો એક પ્રકાર તથા ખંડયોગ હઠયોગની સાધના પૈકીનો શરીરના અવયવો છુટા કરી પાછા જેડવાનો એક પ્રકાર બતાવીને શરીર ઉપર કેવી રીતે તે દમન કરતા તથા બીજાઓ માટે કેવી રીતે કષ વેઠતા અને ભક્તોનાં સંકટ દૂર કરવાં એ વિષે આગળના અધ્યાયમાં સ્પષ્ટતા થશે અને શ્રોતાઓને સંતોષ થશે. (ઓ. ૧૪૭-૧૫૧)

સર્વનું કલ્યાણ થાઓ. આ પ્રકારે સંત અને સજજનોની પ્રેરણા પામેલા, ભક્ત હેમાદ્પંત રચિત

શ્રી સાઈસમર્થના સત્યચરિત્રના ‘રામજન્મ ઉત્સવનું કથન’ નામનો છઠો અધ્યાય અહીં પૂરો થાય છે.

શ્રી સદ્ગુરુ સાઈનાથને અર્પણ.



॥ અદ્યાય ૭ ॥

વિવિધ કથા નિર્ણય

(અનેક પ્રકારની કથાઓનું વર્ણન)

શ્રી ગણેશજીને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કૃષ્ણદેવતાને વંદન,
શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રજીને વંદન અને શ્રી સદગુરુ સાઈનાથ મહારાજને વંદન.

હવે પહેલાં કહી ગયેલી કથાનું અનુસંધાન યાદ કરીને ધ્યાન કરીએ. મંદિરોના લુણોદ્વાર કરવા માટે બાબાને કેવું ગમતું હતું? તે પરોપકાર માટે કેટલું કષ વેઠતા હતા? પોતાના ભક્તોને તે કેવી રીતે સંભાળી લેતા હતા અને ભક્તોનાં દુઃખ પોતે સહન કરીને પોતના દેહ ઉપર સહન કરતા હતા? શ્રી સાઈ સમાધિ સહિત એની સાથે ખંડયોગ અને ઘોતીપોતી વગેરે પ્રયોગો કરતા હતા. કોઈકવાર હાથ, પગ અને મસ્તક છૂટું કરતા. વળી કોઈકવાર પહેલાની જેમ જેડી પણ દેતા હતા. હિન્દુ કહીએ તો તે મુસલમાન દેખાતા અને મુસલમાન સમજુએ તો સુંદર ગુણોથી યુક્ત હિન્દુ દેખાતા એવા આ અસામાન્ય અવતારનું કયો વિદ્ધાન વર્ણન કરી શકે? બાબા જલથી હિન્દુ હતા કે મુસલમાન એનો સહેજ પણ આણસાર કોઈને પણ છેક સુધી આપ્યો નહીં. એમનું વર્તન બંને પક્ષો સાથે હંમેશા એક સરખું રહેતું. હિન્દુ ધર્મનો રામનવમીનો ઉત્સવ હોય ત્યારે સભામંડપમાં પારણું બંધાવતા અને પોતે કથા કીર્તન કરાવતા. તેઓ ચોકમાં પારણું બંધાવીને રામનું કીર્તન કરાવતા. એ જ રાતે મુસલમાનોના સંદલમાં ધસેલું ચેંદન તથા તેના નાના નાના ટુકડા એક મોટા થાળમાં મૂકીને એનું વાજતે ગાજતે સરધસ નીકળતું. પછી બાબા મસ્જિદમાં આવી એના એક ખૂણામાં અને ભીત પર એનો છંટકાવ કરતા. બાબાના એક પ્રતિષ્ઠિત મુસલમાન ભક્ત અમીર શક્કરે ઉર્સનો દિવસ ચાલુ કરાવ્યો હતો. રામનવમીનો દિવસ આજદીન સુધી શિરડીમાં રાતે ઉત્સવ તરીકે ઉજવાય છે. સરધસ કાઢવાની પરવાનગી આપતાં જેટલા બેગા થાય તેટલા મુસલમાનો સાથે રહીને, સમારંભ સંદલનું સરધસ કાઢતા. આમ બંને ઉત્સવ આનંદ ઉલ્લાસ સાથે પક્ષપાત વગર કરાવતા હતા. રામનવમીનો દિવસ આવે એટલે પહેલવાનોની કુસ્તી અને ઘોડાની ડોકમાં શરગાર પહેરવાતા. બાબાને પાદઠી તથા સાફાની બક્ષિસ આપવાની ખૂખજ હોંશ હતી. ગોકૃણઅષ્ટમીનો તહેવાર આવે એટલે ગોપાલકલા કરાવતા. તે જ રીતે મુસલમાનોની ઈદને દિવસે નમાજ પઢવા માટે કોઈને મનાઈ ન હતી. એક વખતે મહોરમનો તહેવાર આવ્યો. કેટલાક મુસલમાનો મસ્જિદમાં આવીને કહેવા લાગ્યા કે એક તાજ્યા-તાબુત બનાવીને ગામભાં સરધસ કાઢીએ? તેવી બાબાની આજ્ઞા થતાં જ તાબુત તૈયાર કરવામાં આવ્યું અને ચાર દિવસ તાજ્યા રાખ્યા. પાંચમે દિવસે લોકોએ તાજ્યા નીચે ઉતારતાં બાબાના મનમાં ન કોઈ સુખ કે ન કોઈ દુઃખ જાણ્યા. મુસલમાનના કાન વિંધ્યા વગરના હોય છે પરંતુ બાબાના કાન વિંધેલા હતા. અને હિન્દુ કહીએ તો સુન્નત કરાવી હતી. તેના પુરાવા અને પ્રમાણ હતાં. આ રીતે બાબાનો ન હિન્દુ કે ન મુસલમાન એવો બાબાનો પવિત્ર અવતાર હતો. એમને જે હિન્દુ કહેવામાં આવે તો તેઓ સદાય મસ્જિદમાં રહેતા હતા અને મુસલમાન કહીએ તો મસ્જિદમાં રાત અને દિવસ અનિન્દ્ય પ્રગટાવેલો રહેતો હતો. મસ્જિદમાં હાથની ઘંઠીથી દળવુ, મસ્જિદમાં શંખનાદ અને

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

ધંટનાદ કરાવવો. મસ્ઝિદમાં અનિદેવને અપ્રની આહુતિ આપવી પછી એ મુસલમાન કેવી રીતે કહી શકાય ? મસ્ઝિદમાં ભજન સુદ્ધાં થતાં હતા. લોકોને પેટ ભરીને મસ્ઝિદમાં જ જમાડતા. મસ્ઝિદમાં હિન્દુ ભક્તો અર્દ્ધ આપતા તેમજ બાબા પોતાનાં ચરણોનું પૂજન કરવા હેતા. પછી એ કેવા મુસલમાન ? જે એમને મ્લેચ્છ કે મુસલમાન જતિના ગણવામાં આવે તો ઉત્તમમાં ઉત્તમ બાસ્તણો એમનું પૂજન કરતા હતા એટલું જ નહિ. અનિહોનીઓ પિતાંબર પહેરાનું છોડીને સાષંગ દંડવત્ત પ્રણામ કરતા હતા. એ જોઈને આશ્વર્યચક્તિ થયેલા લોકો જત અનુભવ લેવા માટે ત્યાં આવીને બાબાના દંડવત્ત પ્રણામ કરતા, અને દર્શન કર્યા બાદ મોઢામાં મગ ભર્યા હોય તેમ ચૂંપચાપ બેસી રહેતા. અરે ! જે સદાને માટે શ્રી હરિના શરણમાં છે તેને હિન્દુ કે મુસલમાન કેવી રીતે કહેવો ? એ શૂદ્ધ હોય કે અતિ શૂદ્ધ હોય અથવા કોઈપણ જતપાત વિનાનો હોય તેમાં શું ફરક પડે છે ? એમની યોગ્યતાને ઠેરવવા માટેનો જત પાત અંગેનો અણુમાત્ર પણ માપદંડ ન હતો. જેને દેહાભિમાન નથી, જેને માટે હિન્દુ કે મુસલમાન સરખા છે, એને કોઈ જતિ બેદ નથી હોતો. તેઓ મુસલમાન ફકીરની જેઠે પંગતમાં બેસી માંસાહાર પણ કરતા, અથવા પ્રસંગને અનુરૂપ ઠચ્છા પ્રમાણે માછિલાં પણ આતા, અને ત્યાં જ તે વખતે ફૂતનું પણ મોઢું નાખ્યતું તો એનો પણ તિરસ્કાર કરતા નહીં. (ઓ. ૧-૨૨)

આવતે વર્ષે દુઃ્ખાળ પડશે તે વિચારથી આ વર્ષે ભરવા માટે ઘેરૂનો ધાન્ય તથા ધાસના પૂળાઓનો સંગ્રહ કરતા. તેઓ પૂળાની ગંજુ કરી રાખતા. એ જ પ્રમાણે બાબા પણ સંગ્રહ કરેલા અથવા તો ભેગા કરેલા ઘઉંના પૂળા જેવા જ હતા. મસ્ઝિદમાં ધાન્ય દળવા માટેની ઘંટી હતી. ધાન્યને સૂપડા વડે કર્યા બહાર ફેંકવા માટે વાંસનું સૂપડું હતું. એમ લાગતું હતું કે સંસાર ચલાવવા માટે જણે કશાની કમી ન હતી. સભામંડપમાં સુંદર મજનું એક તુલશીનું વૃંદાવન હતું. વળી ત્યાં જ એક શુભ ચિહ્નન્યુકૃત લાકડી હતી. અને શુભ ચિહ્નન્યુકૃત સરસ મજનો એક રથ પણ હતો. આ રથ ઇન્દોરના એક પ્રેમાળ ભક્ત બાળાસાહેબ રેગે તથા દાળુસાહેબ અવસ્થિ વગેરેએ ઉત્સવમાં સરઘસ કાઢવા માટે સંસ્થાનને અર્પણ કરેલ હતો. (ઓ. ૨૩-૨૪)

કેટલું પુણ્ય ગાઠે બંધાયેલું હતુ માટે જ સાક્ષાત્ પરમેશ્વરની મુલાકાત થઈ છે. માટે એને હૃદયકૃપી કરંડિયામાં અથવા તો પેટીમાં એ રીતે સંભાળીને મૂકી હો, કે મરતા સુધી એનો તોટો પડે નહીં. કેટલાય પૂર્વ જન્મ દ્વારા કમાયેલું તે ઉત્તમ ભાગ્ય હતું માટે જ સાઈ ચરણ સાંપદ્યા અને મનને શાંતિ પ્રાપ્ત થઈ અને સંસારની ચિંતામંથી મુકૃતિ મળી. આગળ ઉપર ગમે તેટલો સુખી સંપત્ત થાડું તો પણ આ શ્રી સાઈસર્વર્થના સહવાસથી મળેલું સુખ કરીએ ફરીથી મળવાનું નથી. હું આ સુખ ભોગવીને ખરેખર ધન્ય થયો છું. આત્માનો આનંદ અને એકાગ્રતાથી પરિપૂર્ણ એવા સાઈ હું કેટલા વખાણ કરું ! જે કોઈ તેમને શરણે ગયા એવા દેરકને એમણે પોતાની પાસે કાયમી સ્થાન આપ્યું. (ઓ. ૨૫-૨૮)

આસનની જગ્યાએ હરણનું ચર્મ ધારણ કરનારા અને હાથમાં સંન્યાસીનો દંડ ધારણ કરનારા તથા તપશ્ચર્યા કરનારા, હરિદ્વાર જેવું તીર્થ સ્થાનોમાં જઈને રહેનારા ભીક્ષા દ્વારા પેટ ભરનારા ગોસાઈ, સર્વસ્વનો ત્યાગ કરેલા સંન્યાસીઓ, સંસાર બંધનોને છોડી ગયેલા ત્યાણીઓ, ઉદાસીઓ આવા ધણા બધા લોકો બાબા પાસે આવતા હતા. બાબા આવા લોકો જેઠે, છુસી ખુશીથી ભાતભાતની વાતો કરતા. એમની જીબ ઉપર હંમેશને માટે અખંડ ‘અલ્લા માલિક’ (પરમેશ્વર સર્વાધિપતિ છે) એવો શબ્દ રહેતો. એમને વાદવિવાદ જરાપણ ગમતો ન હતો. તેઓ પોતાની પાસે એક દંડ રાખતા જે બે અઢી ફૂટ લાંબો અને પગના અંગુઠા જેવો જઠો હતો તથા મજબૂત લાકડાનો સટકો પણ તેમની પાસે હંમેશા રહેતો. એમને કડક વ્રતોનું આચરણ ગમતું. તેઓ શાંતિ, ક્ષમા, સુલેહ, સમાધાની અને સૌભ્ય વૃત્તિના હતા અને સ્થિરવૃત્તિના હતા. એમની

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

વાણી પૂર્ણ, વેદાંત અને બ્રહ્મજ્ઞાનથી ભરેલી હતી. અંત સુધી બાબાની પુરી માહિતી કોઈનેથી લાગી નહીં. રાજ હોય કે રંક હોય પરંતુ તેમનું વર્તન દેરક સાથે એક સરખું જ રહેતું. ઘનવાનનો પુત્ર હોય કે પછી બિખારી એ બંનેને માટે એમની યોગ્યતા માપવા માટે એમના માપદંડ એક સરખા જ હતા. કોઈના પણ સારાં નરસાં ફૃત્ય અને તેમના મનમાં રહસ્યોની એમને જાણ રહેતી હતી. તેઓ તેની નિશાની અથવા તો ગૂઢાર્થ કહીને ભક્તોને ખૂબ જ આશ્રય ચકિત કરી નાખતા. જ્ઞાનના તેઓ બંડાર હતા. અને અજ્ઞાનને તેઓ હંમેશા ઢાંકી દેતા હતા. માન પાન લેવા મેળવવા માટે ખટપટ કરવી એ એમને માટે ખૂબજ કંટાળાજનક લાગતું હતું. આ પ્રકારનાં સાઈબાબાનાં લક્ષ્ણો હતાં. કાયા ભલે માનવીની ધારણ કરેલી હતી, પણ એમની કરણી અપૂર્વ દૈવી હતી. શિરડીના પ્રત્યક્ષ દેવ એટલે આ જ એવી ત્યાંના લોકોની અપૂર્વ શ્રદ્ધા તથા ભાવના હતી. (ઓ. ૨૮-૩૫)

બાબાના ચ્યામતકારોનું હું પામર ક્ષુદ્ર એનું કેટલું વર્ણિન કરું? દેવાલયોના જીણોદ્વાર બાબાએ દેવાલયોના જીણોદ્વાર ખૂબજ કરાવડાવ્યા. શિરડી સ્થિત તાત્યા પાટીલને હાથે ગણાપતિ, શનિ, શંકરપાર્વતી તથા મારુતિ અને ગ્રામહેવતા ખંડોબાના મંદિરોનો જીણોદ્વાર કરાવ્યો. લોકોની પાસેથી બાબા દક્ષિણાના નિમિત્તે જે પૈસા ઉધરાવતા હતા. તેમાંથી થોડા ધાર્મિક કાર્ય માટે આપતા અને બીજા વિનાકારણ ઈચ્છા પ્રમાણે આપી દેતા. કોઈને રોજના ત્રીસ ઇપિયા તો કોકને દશ, પંદર અને પચાસ ઇપિયા એમ મનને યોગ્ય લાગે તે પ્રમાણે ખૂબ જ આનંદથી વહેંચતા. આ પણ સર્વ ધર્મનો દાનધર્મ માટેનો જ પૈસો હતો. એ લેનારાઓને પણ એટલો જ વિશ્વાસ હતો. અને બાબાની પણ એવી જ ઈચ્છા હતી કે આવા પૈસાનો સદ્ગુરૂપ્રથમાં થાય. (ઓ. ૩૬-૪૦)

બાબાના દર્શન માત્રથી કેટલાય લોકો નિરોગી અને તુંદરસ્ત થયા તથા કેટલાય દુરાચારી સહાચારી બન્યા. કેટલાકના કુષ્ટ રોગો કોઢ તેમજ રક્તપિત મટી ગયા અને કેટલાયનું કલ્યાણ થયું. બાબાની ફૂપાથી અનેક લોકોની આંખમાં અંજન કે આડના પાંદડાનો પાલાનો રસ નાખ્યા વગર અંધોને દટ્ઠી સાંપડી. બાબાનો ચરણ સ્પર્શ થતાં એ અનેક ખોડ-ખાંપણ વાળાઓ હરતા ફરતા થઈ ગયા. બાબાનો મહિમા તો અપરંપાર છે. એનો પાર પામી શકાય તેમ નથી. એમના દર્શન માટે અનેક જતના લોકો ચારેબાજુથી આવવા લાગ્યા હતા. (ઓ. ૪૧-૪૪)

બાબા ધૂણી પાસે એક જ જગ્યા પર મળામૂત્રનું વિસર્જન કરતાં અને કોઈ વખત નાહ્યા ધોયા વગર તો કોઈકવાર નાહીને ધ્યાનસ્થ થઈને બેસતા. એમનો શરૂ શરૂનો પહેરવેશ માથા ઉપર સુંદર મજાનો ફિટકો તથા કમર ઉપર સ્વચ્છ ધોતિયું અને શરીર ઉપર પહેરણા વાળો હતો. (ઓ. ૪૫-૪૬)

શરૂ શરૂમાં બાબા ગામભમાં વૈદ્ય તરીકનું કામ કરતા અને દરર્દીને તેને યોગ્ય દવા આપતા. એમના હાથમાં સારો યશ હતો. માટે ત્યાંના પ્રભ્યાત હુકીમ તરીકી નામના મેળવી હતી. એક દિવસે એક ભક્તની આંખો સુજુને લાલચોળ થઈ ગઈ, અને કીકીઓમાં લોહી આવી ગયું. શિરડીમાં કોઈ ડૉક્ટર કે વૈદ્ય મળે નહીં. શ્રદ્ધાળું ભક્તો બિચારા ભાવના ભૂખ્યા, એણે બાબાને આંખો બતાવી. તરત જ બાબાએ બિલાઓ જેવી વનસ્પતિને છુંદીને કૂર્ચો તૈયાર કર્યો. આંખોના દુઃખાભાવ માટે કેટલાક લોકો સળીથી ગરમ સુરમો લગાવતા. તો કોઈ ગાયના દૂધમાં પોતાં પલાળીને મૂકતા. કોઈ લોકો વળી ઢંડા પાણીનાં પોતાં પણ મૂકતા. જ્યારે કેટલાક જણ કાજળ લગાવતા. પણ બાબાનો તો ઉપાય તદ્દન જુદ્દો હતો. એમણે પેલા મિશ્રાણની એક એક ગોળીઓ વારાફરતી બંને આંખોમાં દાખીને બરી દીધી, અને પાઠો બાંધી દીધો. બીજા દિવસે આંખો પરની પછી છોડી નાંખી તેના ઉપર પાણીની ધાર છોડી અને જેયું કે બધો જ સોને ઉત્તરી ગયો હતો. અને આંખો

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

નિર્મણ થઈ હતી. આંખો જેવું નાજુક અંગ હોવા છતાં બિલામાંથી જરાપણ બળતરા થઈ નહીં. ઉલ્ટાનો એનાથી નેત્રરોગ જતો રહ્યો. આવા બાબાના આ પ્રકારના અનેક અનુભવો ભક્તોને થતા હતા. (ઓ. ૪૭-૫૨)

બાબાને ઘોતીપોતી જેવા હઠયોગોની પૂર્ણ જણકારી હતી. લોકોની નજર ચૂકાવી તેઓ એકાંતમાં ચાલ્યા જતા. અને સ્નાન કર્તી વખતે પેટનાં આંતરડાં ઓકીને બહાર કાઢતા. તેમજ તે ઘોંઠને સુકવવા માટે નાખતા હતા. મસ્તિષ્ઠથી જેટલો કૂવો દૂર હતો એટલું જ આગળ એક વડનું જાડ હતું. એનીયે આગળ બીજો એક કૂવો આવેલો છે. બાબા ત્યાં દર બે દિવસને આંતરે જતા. ભરબપોરે સખત તડકો હોથ ત્યારે બાબા જુએ કે કોઈ ત્યાં નથી ત્યારે જતે જ કુવામાંથી પાણી કાઢી મોઢું ઘોંઠ, હાથ પગ ઘોતા હતા. આવા એક પ્રસંગે તેઓ સ્નાન કરવા બેઠા હતા, તે વખતે ઉતાવળે આંતરડાં બહાર કાઢીને ત્યાં ઘોવા લાગ્યા. બકરાને કાચ્યા પછી ખાટકી આંતરડાં બહાર કાઢી સાફ કરે છે અને એની ઘડી ગોઠવે છે તે જ પ્રમાણે બાબા પોતાનાં આંતરડાં અંદર અને બહારથી સ્વચ્છ કરીને જંબુ કે જમફણના જાડ ઉપર સુકવતા હતા, જે જોઈને લોકોને બહુ આશ્રય થતું. એમની આવી સ્થિતિ નજરોનજર જેનારા લોકોને બહુજ આશ્રય થતું. એમની આવી સ્થિતિ નજરોનજર જેનારા કેટલાક લોકો શિરડીમાં હૃદાત છે. તેઓનું કહેવું છે કે, ‘ખરેખર તો બાબા એક અજબ અને અપૂર્વ વ્યક્તિ હતા. તેઓ કોઈ કોઈ વખત ખંડયોગ પણ કરતા અને હાથ, પગ છૂટા કરી દેતા. પછી મસ્તિષ્ઠમાં ડેકેટકાણો તે અવયવો છૂટાં પડી રહેતાં. બાબાના શરીરના આવા ટુકડે ટુકડા થયેલા જોઈને, આવો બધંકર દેખાવ જેવા માટે પુષ્કળ લોકો દોડીને આવતા. પણ જ્યારે તે બાબાને જેતા ત્યારે અંગે અંગથી જોડાયેલા સંપૂર્ણ જ નજરે પડતા. એક દિવસે આ પ્રકારનું દર્શય જોઈને એક ગૃહસ્થ ઘણો જ ગભરાયો. ‘મસ્તિષ્ઠમાં ચારેખૂણે બાબાના શરીરના ટુકડા પડેલા દેખાતા હતા, અદ્ધી રાત થઈ હતી અને પાસે કોઈ પણ નહીં, કોઈ દુષ્ટે બાબાની હત્યા કરી હોય એવું લાગ્યું. કોણે અત્યાચાર અને જુલમ કર્યો હશે ? જે કોઈને ખખર આપીશ તો ગુનેગાર ડેરવી મને જ ફાંસીએ લટકાવવામાં આવશે.’ આમ મનથી વિચાર કરીને તે ગૃહસ્થ મસ્તિષ્ઠની બહાર નીકળી ગયો. બાબાની આ કોઈ યોગ-સાધના હશે તેવી તેને કલ્પના ન હતી. બાબાના શરીરના છિન્ન બિન્ન ટુકડાઓ જોઈને એનું હૃદય ઉર્થી ઘડકવા લાગ્યું. કોઈક ને તો આ વસ્તુની જણ કરવી જ જોઈએ એવું તેમના મનમાં આવ્યું. પરંતુ પહેલી બાતમી આપનારા ને જ ગુનહેગાર ડેરવાશે એવું વિચારીને બીજા કોઈને કહેવાની એમણે હિંમત કરી નહીં. મનમાં અસંખ્ય વિચારો આવવા લાગ્યા. તેથી તે વહેલી સવારે મસ્તિષ્ઠમાં ગયા અને જેયું તો તેમના આશ્રયનો પાર રહ્યો નહીં. પહેલી નજરે જેયેલા એ દેખાવ સહંતર અદર્શ થઈ ગયો હતો, અને બાબા પોતાની જગ્યાએ આનંદથી સ્વસ્થ બેઠેલા હતા. તેમને થયું કે આ સ્વાભન્તો નહીં હોય ને ? આવા યોગ અને ઘોતીપોતી શ્રીબાબા બાળપણથી જ કરતા આવ્યા હતા. એમની આ યોગ સ્થિતિ અને અગમ્યગતિને કોઈ પણ જાણી કે સમજ શક્તિ ન હતું. (ઓ. ૫૩-૬૬)

બાબા પોતાના વૈદ્યકીય ગુણોથી જ્યાતિ પામ્યા અને નબળા વર્ણની સેવા કરીને આરોગ્ય આપ્યું. પરંતુ કોઈની પાસે તેમણે કુટી કોડી લીધી નહીં. તેઓ ત્યાંના પ્રાંતના એક હકીમ તરીકે પુષ્કળ પ્રસિદ્ધ પામ્યા. તેઓ બીજાને માટે જ હકીમ હતા. પરંતુ અંગત સ્વાર્થ માટે તેઓ હુમેશા બેપરવા અને ઉદાસ રહેતા. પારકાને લાભ થાય તે માટે પોતે ગમે તેવા સંકટો પણ સહન કરી લેતા. આ અંગેના એક વિચિત્ર અનુભવનું હું શ્રોતાઓને કથાડ્યે વર્ણિન કરું છું. જેનાથી બાબાની વ્યાપકતા અને કરુણાનો અંદાજ આવે. સને ૧૯૧૦ની દિવાળીમાં ધનતેરસના દિવસે બાબા ધૂણી પાસે સહજ રીતે લાકડાં સળગાવીને બેઠા હતા. ધૂણી ભડભડ સળગતી હતી. એટલામાં એકાએક એ સળગતી ધૂણીમાં

શ્રી સાઈનું સત્ય ચટિત્ર

બાબાએ પોતાનો એક હાથ ખોસી દીધો. તેથી હાથ બળી ગયો. તેમ છતાં તે સ્વસ્થ હતા. માધવ ફસલે નામનો એક સેવક તેમની પાસે જ બેઠો હતો. અનું ધ્યાન સહજ રીતે તે તરફ ગયું. માધવરાવ દેશપાંડે પણ ત્યાં જ બાજુમાં બેઠા હતા. તેઓ તરત દોડીને બાબા પાસે ગયા અને બાબાની કર્મર પકડીને અને બાથ ભીડીને બાબાને ત્યાંથી પાછા જેંચી લીધા. પછી તેમણે બાબાને શું પૂછ્યું તે જુઓ દેશપાંડે પૂછ્યું કે, ‘અરે.... અરે ! દેવા, તમે આ શું કર્યુ ?’ એટલામાં બાબા હોંશમાં આવ્યા અને બોલ્યા, ‘અરે બગલમાં પકડેલું છોકરું છટકીને લુહારની ભષીમાં જઈને પડ્યું. તે લુહારની ઝી પોતાના વરની બૂમ સાંભળીને બીકની મારી બાળકને બગલમાં વળગાડી ભષીને વધારે સળગાવવા માટે ધમણ ચલાવવા લાગી. ધમણ ચલાવતાં ચલાવતાં બગલમાં તેનું બાળક છે, તે ધ્યાન રહ્યું નહીં. બાળક ચંચળ હોય છે. તે બગલમાંથી ભષીમાં પડવાનું હતું પરંતુ તે પહેલા જ મેં એને ઉચ્ચકી લીધું તેથી આમ બન્યું. ભલે બળતો સાલો મારો હાથ, પણ બાળકના પ્રાણ તો બચી ગયા ને !’ (ઓ. ૭૦-૮૦)

આ દાઝેલા હાથના દુઃખાવા માટે કોની પાસે ઉપાય કરાવવો એ માટે માધવરાવે ચાંદોરકરને સવિસ્તાર પત્ર લખ્યો. અથી તરત જ ચાંદોરકર મુંબઈના પ્રસિદ્ધ ડૉ. પરમાનંદને લઈને શિરડી આવ્યા. બળતરા માટે એવી મૌંદી ઔષધીઓ અને ડૉક્ટર પરમાનંદને સાથે લઈને નાનાસાહેબ સાઈબાબાના શરણમાં આવી પહોંચ્યા. બાબાને નમસ્કાર કરી અભિવાદન કર્યા અને ખબરચંતર પૂછ્યા. ત્યારબાદ આગમનનું પ્રયોજન કરીને હાથ બતાવવા માટે બાબાને વિનંતી કરી. હાથ દાજ્યો તે દિવસથી ભાગોળ શિંદે ધી ચોળીને ઝાડનાં પાન મૂકી કચકચાવીને પાટો બાંધતો હતો. એ છોડીને હાથ ડૉ. પરમાનંદને બતાવવો અને ઔષધ ઉપચાર શરૂ કરવા જેથી બાબાને સારું થઈ જય એવી ઈરછા મનમાં રાખીને નાનાસાહેબે બાબાને ખૂબજ વિનંતી કરી. ડૉ. પરમાનંદ પણ પાટો છોડીને જેવા માટે પ્રયત્ન કર્યો પણ બાબાએ ‘આજે નહીં કાલે’, એમ વાયદા કર્યા. તેમણે ‘આપણો વૈધ તો અલ્લા છે’ એમ જણાવીને હાથ જેવા દીધો નહીં. બાબાના મનમાં હાથ દાજી ગયાનો જરા પણ બેદ કે દુઃખ જણાતા ન હતા. ડૉ. પરમાનંદ જે દવાઓ સાથે લાવ્યા હતા એને શિરડીની હવા પણ લાગી નહીં. પરંતુ આ નિભિતે સાઈદર્શનનો આનંદદાયક યોગ પ્રાપ્ત થયો. ભાગોળ દરરોજ સેવા ચાકરી કરતા અને હાથ ચોળતા. એનાથી અમુક દિવસો પછી હાથ સારો થયો તેથી બધાને આનંદ થયો. આમ હાથ સારો થયો છતાં પણ બાબાને મનમાં કંઈ અતૃપ્તિ લાગી કે કેમ પણ દરરોજ વહેલી સવારે પછી સમારંભ ચાલુ જ રહ્યો. હાથને કોઈપણ પ્રકારની વેદના રહી ન હતી છતાં દરરોજ વિનાકારણે તે દુઃખતો ન હોવા છતાં દરરોજ ધી ચોળાવવાનું આમરણાંત ચાલુ રાખ્યું. ભાગોળની આ સેવાની અને જેને અષટસિદ્ધિ પ્રાપ્ત થયેલા શ્રી બાબાને ભાગોળની આ પ્રકારની સેવાની જરા પણ જરૂર ન હતી. પરંતુ ભક્તાનું કલ્યાણ કરવા માટેનો અને એના મનને સાચવવા માટે ભાગોળ પાસે એ નિત્ય સેવા કરાવતા હતા. ભાગોળના પ્રારંધમાં પૂર્વ જન્મના મહાપાપો ને કારણે રક્તપિત્ત જેવા મહારોગનું દુઃખ લખાયું હતું. પરંતુ તે ખૂબજ ભાગ્યશાળી કે એમને સાઈબાબા જેવા મહાપુરુષનો સહવાસ મળ્યો. બાબાની લેંડીબાગની ફેરી નીકળે એટલે ભાગોળ છત્ર ધરીને સાથે સાથે પાછળ ચાલતા જ હોય. ભાગોળનું શરીર રક્તપિત્તથી ભરેલું હતું. પરંતુ બાબાની સેવા કરવામાં તેમનો નંબર પહેલો હતો. દરરોજ વહેલી સવારે ઉઠીને જેવા બાબા ધૂળાની બાજુના સ્થંભને ટેકો લઈને આરામથી બેસતા કે તરત જ ભાગોળ જેને બાબા ‘ભાગ્યા’ કહીને બોલાવતાં તે સેવા કરવા માટે હાજર થઈ જતો. તેમનું કામ હતું કે હાથ પગના પાટા છોડવા તથા તે જગ્યાના માંસલ ભાગોને માલિશ કરવું અને એ જગ્યા ઉપર ચોળ્યું ધી ચોપડવું. પૂર્વજન્મના મહાપાપી ભાગોળ શિંદેનું આખું શરીર ચીડ ચેવું હતું. આવું જેનું દુર્ભાગ્ય હતું છતાંથ એના નસીબે બાબાની સેવા કરવાનો ઉત્તમ મોકો

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

તેને હાથ લાગ્યો હતો. સેવા કરવા માટે કોઈ પણ આવે પરંતુ સાઈબાબાએ ક્યારેય કોઈનીય સાથે અયોગ્ય વ્યવહાર કર્યો ન હતો. ઉલટાનું તેઓ સાથે ખૂબ પ્રેમથી વર્તતા. આ વિષય ઉપર ભીમબાઇ અને દગ્ધુલાઉના બે ઉદાહરણો વિષે સંસ્થાએ પ્રકાશિત કરેલ પોથીમાં સવિસ્તર વર્ણન કરેલું છે. (ઓ. ૮૧-૮૮)

શ્રી સાઈબાબાની અગાધ લીલાઓનું હું શું વર્ણન કરું ! શિરડી ગામમાં એકવાર ગાંઠિયો જવર-પ્લેગનો વાવર ચાલ્યો. એ વખતે જે ચમત્કાર બન્યો તે સાંભળો. દાદાસાહેબ ખાપડેનો નાની ઉંમરનો છોકરો બળવંત પોતાની માતા સાથે સાઈબાબાનો સહવાસ માણતો હતો. એક તો કુમળું બાળક અને તેમાં તાવ ચહ્યો. માનું હદ્ય દ્રવી ઉઠ્યું. અને તેમનું મન અસ્વસ્થ થયું. રહેવાનું ટેકાણું તો છેક અમરાવતી હતું. તેમને થયું કે પાછા અમરાવતી ચાલ્યા જવું. સાંજનો સમય જેઠિને તે સ્વી બાબાની આજ્ઞા લેવા માટે આવી. સાંજની લેંડીબાગની ફેરી પતાવીને બાબા વાડા પાસે આવ્યા હતા. ત્યારે તે સ્વીએ બાબા પાસે જઈને તેમના પગ પકડ્યા. અને બનેલી સર્વ બાબતનું નિવેદન કર્યું. મૂળમાં સ્વી સ્વભાવે જ ડરપોક અને તેમાં વળી પોતાના કુમળા બાળકના શરીરની ધૂનજરીથી થરથર કાંપતું શરીર જેની ધૂનજરી રોકી શકાતી નહોતી. પ્લેગની બીમારીનો ડર પણ ખૂબજ હતો. તે કારણે બનેલી સર્વ ઘટના તે વારંવાર બાબાને કહેવા લાગી. એ સાંભળી શ્રી બાબાએ સૌચ્ય મૂઢુ શબ્દોમાં જવાબ આપ્યો અને કહ્યું ‘આકાશમાં વાદળો ચઢ્યાં છે, (સંકટ આવ્યું છે) વરસાદ પડશે, ધાન્ય ઉગશે, પાકશે અને વાદળ વિઘેરાઈ જશે. માટે ગભરાશો નહીં તેનો અર્થ એક સંકટ જેમ આવ્યું છે તેવું ચાલ્યું જશે. આવું કહીને પોતાની કફની કમર લગી ચઢાવી પોતાના શરીર પર તાજુ તસ્તસતી ગાંઠો બતાવી. મરધીના ઠંડા જેટલી ચાર ગાંઠો ચારેબાજુએ હતી. બાબા બોલ્યા, ‘આ જુઓ ! તમારા માટે મને આવું સંકટ બોગવવું પડે છે.’ બાબાનું આવું હિંદ્ય અને આતોડિક કૃથ જેઠિને સહુ વિચાર કરતા થઈ ગયા. પોતાના ભક્તોના આતર સંત પુરુષો કેવાદુઃખો બોગવે છે એ સમજવું જરૂરી છે. સંતોનું હદ્ય મીણ કરતા પણ વધારે પોચું હોય છે. અંદર અને બહારથી જાણે કે તાજુ માખણ ન હોય ! તેમનો ભક્તો ઉપરનો પ્રેમ પણ નિઃસ્વાર્થ હોય છે. ભક્તો જ એમનાં અને ગુણગોત્ર હોય છે. (ઓ. ૧૦૦-૧૧૦)

એક દિવસે એવું બન્યું કે, નાનાસાહેબ ચાંદોરકર નંદુરબાર છોડીને પંદરપુર જવા માટે નીકલ્યા. નાનાસાહેબ ખૂબ બાળયશાળી હતા. સાઈની અનન્ય સેવાઓ એમને ફળી. પૃથ્વી ઉપરના વૈકુંઠની એટલે કે શ્રીકૃષ્ણ નિવાસી સ્થાનની પ્રાપ્તિ થઈ. એટલું જ નહિ પણ ત્યાં એમની માભલતદારના હોદા ઉપર નિમણૂક થઈ. નંદુરબારમાં હુકમ મળતાં જ સત્વરે હાજર થવાનું હોવાને કારણે ત્યાં જવાની તે તડાભાર તૈયારી કરવા લાગ્યા. તેમને મનમાં વિઠોબાના દર્શનની તીવ્ચ ઠંચા હતી. એટલામાં વિચાર આવ્યો કે સહકુટુંબ સહપરિવાર શિરડી જઈ આવું. શિરડી જ મારું પ્રથમ પંદરપુર છે. શ્રી બાબાને નમસ્કાર કરવાં અને પછી જ આગળ જવું. કોઈને ન પત્ર લખ્યો કે કોઈને સંદેશો પણ ન પાઠવ્યો. બધો સામાન બાંધીને ઉતાવળે ગાડીમાં બેઠા. આવી રીતે જે નાનાસાહેબ નીકલ્યા એની ખબર શિરડીમાં કોઈને ન હતી. પરંતુ શ્રી સાઈબાબા બધું જ જાણતા હતા. એમની તો નજર સર્વ સ્થાને હોય છે. નાનાસાહેબ જેવા નિમગ્નાવની સીમમાં પ્રવેશ્યા તેવામાં શિરડીમાં એક મોટો ચમત્કાર થયો. બાબા મસ્ઝિદમાં મહાળસાપત્રિ, અપ્પા શિંદે અને કારણીરામ દરજી જેવા ભક્તો સાથે વાતો કરતા હતા. એટલામાં બાબા બોલ્યા, ‘આપણે ચારે મળીને ભજન કરીએ.’ પંદરપુર મંદિરના દરવાજી ખૂલી ગયા છે. ભજન આનંદથી ચાલુ રાખીએ. શ્રી સાઈબાબા ત્રિકાળજ્ઞાની હતા. નાનાસાહેબ પંદરપુર જવા માટે નીકલ્યા હતા, એ વાતની બાબાને જાણ હતી. નાનાસાહેબ જેવા સીમમાં ‘ઓટલા’ પાસે આવ્યા તે સમયે બાબાને પણ ભજન કરી આનંદ લૂંટવાનો ઉલ્લાસ જાગ્યો.

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

ભજન

પંદ્રપુરલા જયાયે જયાયે | તિથેચ મજલા રાહ્યાયે ||

તિથેચ મજલા રાહ્યાયે | ધર તે માજ્યા રાયાયે ||

(મારે પંદ્રપુર જવું છે જવું છે | ત્યાં જ મારે રહેવું છે - જ્યાં મારા પ્રભનું ધામ છે.)

બાબા જાતે ભજન ગાવા લાગ્યા અને પાસે બેઠેતા ભક્તો તેમને ગાવામાં સાથ આપવા લાગ્યા અને સહુ પંદરીનાથ વિઠોબાના રંગમાં રંગાઈ ગયા. એટલામાં નાનાસાહેબ આવી પહોંચ્યા. સહુકુંબ પગે લાગીને બોલ્યા, 'મહારાજ' હવે આપ અમારી સાથે પંદ્રપુર પદ્ધારો અને ત્યાં જ રહો. પરંતુ આ વિનંતીમાં જરૂર ન હતી. બાબાની પહેલેથી જ પંદ્રપુર જવા માટેની મનઃસ્થિતિનું ભક્તોએ નાનાને ઉલ્લાસપૂર્વક વર્ણન કર્યું હતું. બાબાની આ લીલા જેઠિને નાનાસાહેબ દંગ થઈ ગયા. અને એમણે ગદ્ગાહીત થઈને બાબાના ચરણકમળ ઉપર પોતાનું મસ્તક ટેકવી હીધું, ત્યારબાદ બાબાના આશિવર્યન અને 'ઉદ્દી' પ્રસાદ ભક્તિ તથા પ્રેમથી માથે ચઢાવી તેઓ પંદ્રપુર તરફ જવા રવાના થયા. (ઓ. ૧૧૧-૧૨૫)

આવી અનેક વાતો કહેતાં ગ્રંથનો વિસ્તાર વધશે માટે આ પરદૃઃખ નિવૃત્તિનો વિષય આ સાથે સમેટી લઈએ. બાબાના ચરિત્રોનો તો કોઈ અંત જ નથી. આગળના અધ્યાયમાં બાકીના બીજી બધા વિષયોની કથા મારા પોતાના કલ્યાણ માટે કહીશ. મારાથી આ 'હું' પણાની અહુમ્ વૃત્તિ મનમાં જરૂરાતી નથી. પરંતુ આ હું કોણ? એ ખાતરીપૂર્વક સમજનું નથી. સાઈબાબા જાતે જ પોતાનું ચરિત્ર કહેશો, મનુષ્ય જન્મનું મહત્વ સમજવશે. પોતાની બિક્ષાના વર્તન કમનું પણ વર્ણન કરશો, બાખજબાઈની ભક્તિ અને પોતાની બોજન કરવાની રીતની નવાઈ સંભળાવશે. મહાણસાપત્ર અને તાત્યા કોતે પાટીલ જેઠે બાબા મસ્જિદમાં બધાની સાથે કેવી રીતે સૂતા હતા તે પણ વાત કહેવાશે. હેમાડપંત સાઈબાબાના શરણે આવેલા છે. 'હું ભક્તોના પગની જૂતી છે.' એવું તેઓ બોલે છે. એમને માટે સાઈબાબાની આજ્ઞા એ જ આધાર અને પ્રમાણ છે. તેને આધારીત તથા યોગ્ય વર્ણન કર્યું છે. (ઓ. ૧૨૬-૧૩૧)

સર્વનું કલ્યાણ થાઓ. આ પ્રકારે સંત અને સજજનોની પ્રેરણા થયેલા ભક્ત હેમાડપંત રવિત.

શ્રી સદ્ગુરુ સાઈનાથને અર્પણા.



॥ અધ્યાય ૮ ॥

નરજન્મ મહિમા, બિક્ષાન્ સેવન, બાયજબાઈનું ભક્તિ વર્ણન તથા તાત્યા

મહાણસાપતિનું મસ્નિદમાં શયન

(નરજન્મનો મહિમા, બાબાનું બિક્ષા માંગીને ખાવું, બાયજબાઈની ભક્તિનું વર્ણન અને તાત્યા કોટે પાટીલ
અને મહાણસાપતિનું બાબા સાથે મસ્નિદમાં શયન.)

શ્રી ગણેશજીને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કુળદેવતાને વંદન,

શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રજીને વંદન અને શ્રી સદગુરુ સાઈનાથ મહારાજને વંદન.

(મૂળ પોથીમાં આ અધ્યાયને અંતે અધ્યાયનો વિષય સમજીને ‘શ્રી સાઈસમર્થવિતરણ’ આવું લખેલું છે, પરંતુ આ અધ્યાયમાં શ્રી સાઈબાબાનો આ જગતમાં પ્રગટ થયા અંગેનો કોઈ ઉલ્લેખ નથી, એ વિષય આગળ ઉપર ચોથા અધ્યાયમાં આવી ગયેલો છે અને તે અધ્યાયના અંતમાં એવું હેમાદપંતે દર્શાવ્યું છે. અહીં તે ફરીથી ભૂલથી દર્શાવવામાં આવ્યું છે.)

પાછળના અધ્યાયમાં કહેવામાં આવ્યું છે કે, સાઈબાબાની જાતી કઈ હતી ? તે હિન્દુ હતા કે મુસ્લિમાન હતા ? શિરડીનું ભાગ્ય કેટલું ગહન છે કે જ્યાં બાબાનું પોતાનું સ્થાન થયું ! આરંભમાં બાબા બાલ્યાવસ્થામાં હતા અને આગળ જઈ કેવા પાગલ ફરીર થયા ? પડતર અને રેતાળ જમીન પર એમણે કેવો સુંદર બાગ ઉગાડ્યો અને અમુક સમયબાદ એ જ જગ્યા ઉપર આગળ કેવો સાડેનો વાડો બંધાયો ? તેમજ ધોતી, ખંડયોગ વગેરે બાબાના અપ્રતિમ ને ગહન ન સમજન્ય તેવા હઠ યોગોનું વર્ણન પણ થયું. બાબા પોતાના દેહ પર ભક્તોનાં દુઃખ કેટલી બધી જહેમત ઉઠાવી સહન કરતા હતા તે પણ કહ્યું. ભક્તોના રક્ષક સાધીરાય. એમનું કેટેટલું વર્ણન કરું ? (ઓ. ૧-૪)

હવે સાંભળો નરજન્મનો મહિમા, સાઈબાબાની બિક્ષાવૃત્તિનું વર્ણન તથા બાયજબાઈની સંત સેવા અને બાબાની ભોજન કરવાની આશ્ર્યકારક પદ્ધતિ તેવી જ રીતે તાત્યા કોટે પાટીલ, શ્રી બાબા અને મહાણસાપતિ એ ત્રણેય કેવી રીતે મસ્નિદમાં સૂતા હતા અને કેવી રીતે બાબા રાહતાના ખુશાલચંદ મારવાડીને ત્યાં ઘરે જતા હતા તે બધી સવિસ્તાર વાતો. (ઓ. ૫-૮)

દ્વિંદ્ર રોજ ઉંગે છે અને આથમે છે અને વર્ષોનાં વર્ષો આમને આમ નીકળી જતાં હોય છે. અડધો જન્મ તો ઊંઘવામાં જ પસાર થઈ જય છે અને બાકી રહેલો સમય સારી રીતે ભોગવી શકાતો નથી. બાળપણમાં બાળકીડા અને રમત ગમતમાં ધ્યાન હોય છે અને તરુણ અવસ્થામાં જુવાન ખીનો આશક્ત હોય છે. ઘડપણમાં અશક્ત અને રોગોથી સદાય ત્રાસેલો એવો આ મનુષ્યજન્મ હોય છે. જન્મ લીધા બાદ શરીર વધારવું, શાસોશ્વાસ લેતાં રહેવું અને ખૂબ લાંબુ જીવનું એ કંઈ જન્મની સાર્થકતા ન કહેવાય. પરમાત્માની પ્રાપ્તિ કરવી એ જ નરજન્મની સાચી શ્રેષ્ઠતમ કૃતિ ગણાય છે. ફૂતરાઓ પણ પોતાનું પેટ બરી લેતાં હોય છે, અને બચ્ચાં પણ પેટ કરતાં હોય છે. તો પછી નરદેહનું મહત્વ શું છે ? શું

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

પશુ અને માનવની અવસ્થા સરખી જ સમજવાની ? જો એમ જ હોય તો આ નરજન્મ અર્થ વિનાનો છે. મનુષ્ય પ્રાણી મુક્ત છે, તે સ્વતંત્ર હોવા છીતાં તેને કોઈ પણ પ્રકારની બીક નથી તે શાશ્વત અને અવિનાશી છે એવી સમજણ કેળવવી એ જ આ જન્મની સફળતા છે. ‘હું કયાંથી આવ્યો, હું કોણ છું નરજન્મનું ધ્યેય શું છે ?’ આ સર્વનો જે મર્મ જાગતો થાય છે, એ જ ડાખ્યો માણસ છે. તે સિવાયનો બધો પરિશ્રમ અર્થહીન છે. (ઓ. ૮-૧૬)

અખંડદીપની જ્યોત પ્રગટાવ્યા પછી તે છેક બુઝાઈ જય ત્યાં સુધી એક જ સરખી દેખાય છે, પણ દ્વેક ક્ષણે જુદી દેખાય છે. તેવી જ આપણા દેહની સ્થિતિ હોય છે. બાળપણ, તરુણ અવસ્થા અને ઘડપણ એ સર્વે પ્રકટ પણે દેખાય છે, પરંતુ સમજન્ય તે પહેલાં આવીને જતા રહે છે. જ્યોત દેખાય છે, તે જ ક્ષણે નાશ પામે છે. તેની સ્થિતિમાં સતત ફેરફાર થતો હોવા છીતાં પણ તે એક જ દેખાય છે. તે જ પ્રમાણે આપણો આ દેહ એક ક્ષણે છે, અને બીજી ક્ષણે નથી તેમ છીતાં એક સરખો જ જણાય છે. આ દેહ મળમૂત્રની નાળી જેવો અને ગંઢા કફ, પડું અને લાળ જેવા પદાર્થોથી ખદબદતો છે. મરણની દ્વેક પળે રાહ જુએ છે. એવો મનુષ્યના શરીરમાં ફૂમિ અને સૂક્ષ્મ કીડાઓનું ધર છે, લોહી, સ્નાયુઓ, હાડકાં અને ચામડાનું બનેલું હાડપીજર છે. જેને લીધે આ શરીરને કોઈ આકાર છે. મળ અને મૂત્ર જેવી ગંઢી વસ્તુઓથી ગંધાતો ખાડો છે. ખરેખરમાં હર એક જીવ માત્ર માટે એક સંકંને અથવા તો ગળામાં લટકાવેલું ગાળીયું છે. ચામડી, માંસ, લોહી, સ્નાયુ, ચરબી, મજજીન, અસ્થિ, વાયુ અને જનનેન્દ્રિય જેવાં અપવિત્ર અંગો સાથેનું મળેલું અત્ય આયુષ્ય એ જ આ માનવશરીર છે. આવો આ નરદેહ ભલેને નશ્વર અને ક્ષણભંગુર હોય છીતાં પણ ‘મંગલ-ધામ’ પરમેશ્વર કહેવાય આ જ શરીરથી પ્રાપ્ત થાય છે. (ઓ. ૧૭-૨૪)

કેવળ કલ્પના કરવાથી ભયંકર બીક લાગે છે, એવો આ જન્મ મરણનો ફેરો સહાને માટે પાછળ પડ્યો છે. કોઈને ખબર પણ પડી નહીં તે રીતે એકાએક પ્રાણ નીકળી જય છે. કેટલાય રાત દિવસ આવે છે, અને જય છે પરંતુ તેનું ધ્યાન કોણ રાખે છે ? માર્કિડ ઋષિએ ખૂબ જ લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરેલું તેમને પણ કાળ છોડતો નથી. એવા ક્ષણભંગુર નરદેહને સંતોની કથાવાર્તા સાંભળવાથી એને બાંધી શકાય છે. બાકીનો સમય વ્યર્થ જય છે. આવી જાણકારી જેને થઈ તે જ જન્મ લઈને પોતાનું હિત સાધી શકે છે. પરંતુ સ્વયંનો અનુભવ થયા વીના વિશ્વાસ બેસતો નથી. આ પ્રકારના અનુભવો મેળવવા માટે ઘણો પ્રયત્ન કરવો પડે છે. તેમ છીતાં શાશ્વત સુખોની દૃઢાયા રાખનારા જીવોએ આ વૈભવ અને ઔષ્ઠર્ય પ્રાપ્ત કરવો જોઈએ. સંતતિ, વૈભવ અને પૈસો વગેરે વસ્તુઓ સમુદ્રની માફિક મનુષ્યની ચારે બાજુએ ઘેરાયેલો હોય અથવા પૃથ્વી ઉપરનું અમર્યાદિત રણય પણ દીશ્વર ફૂપાથી પ્રાપ્ત થયું હોય તેમ છીતાં માણસ મનથી અસંતુષ્ટ અને અતૃપ્ત જ રહે છે. શાશ્વત સુખ અને શાંતિ પ્રાપ્ત કરવાનું ધ્યેય ચિત્તમાં રાખીને તથા સર્વ પ્રાણી માત્રમાં પરમેશ્વરના દર્શન કરવા તેવી ઉપાસના પરમ પદની પ્રાપ્તિ કરાવે છે. ચામડી, માંસ, લોહી અને હાડકાં એને જોડીને આ મનુષ્યદેહનું હાડપીજર તૈયાર થયેલું છે. એને પરમાર્થ પ્રાપ્તિ માટે મોટી અહયણ હોય છે. એનું હાડમાંસના શરીરમાંથી મમત્વ છોડી દો. તેને ફીકત તમારો સેવક જ સમજો. તેનું વધારે મહત્ત્વ આંકશો નહીં અને સતત લાડ પણ કરશો નહીં. તે સાથે એને નરકનું દ્વાર પણ બનાવશો નહીં. એનું નિર્વાહ પૂરતું અન્ન, વસ્ત્ર આપો તથા તેનું પાતન પોષણ કરીને જન્મ મરણના ફેરામાંથી છોડાવવા માટે તેને આધ્યાત્મિક પ્રગતિ તરફ વાળો. જન્મ મરણના સંકટ જેવો અને દ્વેક ક્ષણે વિનાશ તરફ વળેલો તેમજ નિરતર દુઃખી નરજન્મ જણાય છે તેનાથી મળેલું ક્ષણિક સુખ શું કામનું ? વીજળીને જુઓ તે હમણાં છે અને તરત જ ગાયબ થઈ જય છે. સમુદ્રનાં મોનને જુઓ તે ક્ષણ પૂરતા જ ટકે છે. તેવી જ રીતે આ દેહસુખ ક્ષણિક અને

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

અત્ય સમય પૂરતો છે. માટે તે વિષે થોડો વિચાર કરવો જેઠાં દેહ, ધરબાર, બાળબચ્ચાં, પત્ની અને જતપાતના લોકો આ બધું જ નાશવંત છે એવું સમજતો હોવા છતાં અને સગાં મા-બાપને અંતે ખાંધો આપીને સ્મરણાને લઈ જતો હોવા છતાં માણસ પોતે જગૃત થતો નથી. ભરનારની જેમ તે પોતે પણ એક સમયે મરે છે અને જન્મ મરણના ફેરા ફર્યા કરે છે. પરંતુ તે ફેરામાં કયા માર્ગે જવાથી તેનો સુધારો થશે તેનો ક્ષણભર પણ વિચાર કરતો નથી. પોતાના કુટુંબની દેખભાળ પાછળ અને ભરણપોષણ કરતાં કરતાં તેનું આયુષ્ય ઝટપટ વીતી જાય છે. કાળ આ આયુષ્યની માપણી કરવા માટે તત્પર બેઠેલો હોય છે. પોતાના કર્તવ્યને એ કદી પણ ભુલતો નથી. છેલ્લી ઘડી આવી એટલે તે એક ક્ષણ પણ કોઈને માટે રોકાતો નથી. જેવી રીતે એક માછીમાર માછલાં પકડવા માટે દરિયામાં જળ ફેંકતો હોય છે, તેવી જ રીતે કાળ પણ જળ ફેલાવે છે. અને જીવાત્મા એમાં માછલાંની માફક તરફડીને મૃત્યુનાં મુખમાં પડે છે. (ઓ. ૨૫-૪૦)

સહભાગ્યે સારો સમય પ્રાપ્ત થવાથી અને કોટિ કોટિ પુણ્યો બેગાં થવાથી આ નરદેહ સંજોગો પ્રમાણે જેડાય છે. માટે યોગ્ય તક પ્રાપ્ત થઈ છે. તેમ સમજુને આપણે પોતાનું ધ્યેય સાધી લેવું. રાજ ભગીરથની જેમ કેવળ કઠીન પ્રયત્નો કર્યા છતાં નરદેહની પ્રાપ્તિ થતી નથી. તે પ્રબુ કૃપા અને પ્રારબ્ધને કારણે મળે છે. માટે એને વ્યર્થ માટીમાં મળવા ન હેવો. આગલા જન્મમાં દેવી પ્રયાસ કરીશું એવું સમજશો તો જાણને કે એક વખત આ મોકો હાથમાંથી સરી જશે તો ફરી પાછો મળશે, એવું માનવું મુર્ખતા છે. કેટલાં પાપી મનુષ્યો, પુરુષનાં બિજણુંઓમાં બેગા થઈને સ્ત્રીના ૨૪ દ્વારા તેમના કર્મોથી શરીર ધારણ કરવા માટે પ્રવેશ કરે છે. કેટલાક એના કરતાંય હલકા અને જંગમ વર્ગના હરીફરી શકે તેવાં તેમજ યોનિયોમાં જન્મે છે. તો વળી કેટલાક જીવો પોતાના કર્મ અનુસાર સ્થાવર ભાવમાં હરીફરી ન શકનારા વૃક્ષ, વેલા જેવી યોનિને પ્રાપ્ત થાય છે. જેણે જેવી રીતે જ્ઞાન મળેલ્યું હોય અને જેવાં જેનાં કર્મો હોય તેને તે પ્રમાણે દેહ પ્રાપ્તિનો યોગ સર્જય છે. તે બાબત શ્રુતિને પણ માન્ય છે. વેદો કહે છે, ‘યથાપ્રકં હિ સંભવા’ એટલે પોતાના જ્ઞાનને અનુસરીને જન્મ પ્રાપ્ત થાય છે. જેનામાં જે રીતે જ્ઞાનનો વિકાસ થાય તે પ્રમાણે તેવા જીવને પછીનો જન્મ પ્રાપ્ત થતો હોય છે. ઈશ્વરની લીલા એ તો કલ્પનાની બહારની વસ્તુ છે. એનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું અશક્ય છે. જે કોઈ એકાદ વ્યક્તિને તે અંશમાત્ર પ્રાપ્ત થાય તો તે નરદેહ ધન્ય થાય છે. શ્રેષ્ઠ પુણ્યથી નરદેહ પ્રાપ્ત થાય છે. તેનાથી મહદ પુણ્યથી બ્રાહ્મણના જન્મ થાય છે તથા ઈશ્વર કૃપાથી સાઈનાં ચરણ પ્રાપ્ત થાય છે. તેથી જેને સાઈ ચરણ મખ્યું તેને અલભ્ય લાભ મખ્યો છે એમ સમજવું. અનેક પ્રકારની યોનિઓમાં મનુષ્ય યોનિ સર્વશ્રેષ્ઠ ગણાય છે. આપણે કયાંથી આવ્યા અને આપણું સર્જન કોણે કર્યું એવા વિચારો મનુષ્ય યોનિમાં જ આવવા શક્ય છે. બીજુ યોનિઓમાં આ વિષેની જાણકારી હોતી નથી. અન્ય જીવો જન્મે છે અને નાશ પામે છે. તેમને પોતાની પાછળનો ભૂતકાળ તથા આગળનો ભવિષ્યેકાળ અને ચાલુ વર્તમાન પરિસ્થિતિ વિષે તેમજ ઈશ્વરના અસ્તિત્વ વિષે તેમને કંઈ પણ કલ્પના હોતી નથી. (ઓ. ૪૧-૫૧)

આ નરદેહનું નિર્માણ કરીને ભગવાન આનંદિત થયા. તેમને થયું કે વિવેક અને વૈરાગ્ય વડે મનુષ્ય મારું ભજન કરશે. વળી તે મોક્ષ પ્રાપ્તિ માટે વ્રત, તપ, મંત્ર-તંત્ર તથા દાનધર્મ જેવી સાધના કરશે તો તે અવિનાશી નારાયણ થશે. નરદેહ દ્વારા મોક્ષ પ્રાપ્તિનું સાધન આ જગતમાં બીજું કોઈ નથી. જન્મગર ખૂબ જ ચતુર હોય છે. તે કોઈ દિવસ ગમાર માણસ સામે ખેલ કરતો નથી. પોતાની કુશળતાનો મર્મ અથવા તો સાર જે જ્ઞાની શકે એવાં જ પ્રેક્ષક ગણોની તેને અપેક્ષા હોય છે. ઈશ્વરે પશુ, પક્ષી, વૃક્ષ અને અસંખ્ય જીવન્તુંઓનું નિર્માણ તો કર્યું પરંતુ તેને સખેદ આશ્રય થયું, કારણ કે તેમના કોઈ તેના સર્જનનો અર્થ સમજ શક્યા નહીં. તેથી પ્રબુને પોતાની કૃતિ અર્થહીન લાગી. ઈશ્વરને થયું ‘મેં આ બ્રહ્માંડનો

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

વિસ્તાર કર્યો. એમાં ચંદ્ર, સૂર્ય અને તારાઓના અનેક સમૂહ નિર્માણ કર્યા. મારા આ કૌતુક વિષે આ પ્રાણી સૃષ્ટિ જરાપણ કોઈ વિચાર કરતું નથી. આ મારી વૈભવ સમૃદ્ધિ જાણી શકે એવું કુશાગ્ર બુદ્ધિવાળું સર્જન જ્યાં સુધી ઉત્પન્ન નહિ થાય ત્યાં સુધી મારું આ કાર્ય ખરેખર જ નિર્થક છે.' આમ સમજુને પરમેશ્વરે મનુષ્યદ્વારા પ્રાણીનું નિર્માણ કર્યું. 'જે સારમાં સારી બુદ્ધિના હિસાબે મારું સામર્થ્ય જાણી શકે છે. મારો અગાધ વૈભવ મારી અપૂર્વ શક્તિ તેમજ આ સર્વ માયાના ખેલ છે એવું જે બધું આશ્રયપૂર્વક જાણી શકશે, તેને જ શાન પ્રાપ્તી થશે. મારું ચિંતન અને ધ્યાન કરશે તેજ આશ્રયપૂર્વક મારો ખેલ નિહાળશે અને ત્યારે જ મારો આ ખેલ પૂર્ણ થશે. પ્રેક્ષકગણોની જે આનંદ સંપત્તિ છે એ જ મારા ખેલની પરિપૂર્ણતા છે. મારા જગત ઉપર શાસન કરવાના કૌશલ્યને જોઈને, માનવી મારું કાર્ય પૂર્ણ થયું છે તેવું માનશે.'

માનવ મનને આનંદ આપનારા કર્મો અને દ્રવ્ય કમાવા માટેના જ પ્રયત્નો કરે તથા શરીરનું પોષણ કરવા પુરતું જ લક્ષ્ય રાખે તે પુરતું નથી. માનવ આયુષ્યની સફળતા બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તીમાં છે. ઉપનિષદ્ધોમાં જે તે બ્રહ્મજ્ઞાન કહ્યું છે તે જીવ અને શિવની અભેદ સ્થિતિનો સાક્ષાત્કાર થયો તે છે. પરમાત્માની ઉપાસના અને ભક્તોનો ભગવાન કહેવાય છે તે પણ એ જ કારણ છે. ગુરુ અને બ્રહ્મ આ બંને જુદી જુદી વસ્તુઓ નથી, આવું અભેદ જ્ઞાન જ્યારે થાય અને એવી જ ભક્તિ સાથે સાથે કરવામાં આવે એટલે માયાને, પાર કરી જવું ખૂબ સહેલું થઈ જય છે. જે પણ શ્રદ્ધાવાન પુરુષ જ્ઞાન અને વૈરાગ્ય પ્રાપ્ત કરીને આત્મસ્વરૂપમાં મશ થતા હોય છે તેવા ભક્તોને ભાગ્યવાન સમજવા. પોતાના ખરા ઝપનું જેને ભાન નથી, તે અજ્ઞાન દૂર કર્યા વિના પોતાને કૃતાર્થ સમજે તે વિચિત્ર બાબત ગણાય છે. જ્ઞાન અને અજ્ઞાન આ બંને મનોવૃત્તિઓ વિકાર અને મોહ ઉત્પન્ન કરનારી છે. કાંટાથી કાંટો કાઢીને જ્ઞાન અને અજ્ઞાનનું છેદન કરવું જોઈએ. જ્ઞાન વડે અજ્ઞાનને દૂર કરવું અને જ્ઞાન અને અજ્ઞાન પેલે પાર જઈને સ્વસ્વરૂપમાં લીન થવું તે જ મનુષ્ય જન્મનું અંતિમ ધ્યેય છે. જ્યાં લગી વિષયદ્વારા તેલની ભૂકી કરવામાં આવતી નથી, અને અજ્ઞાનદ્વારા કાજળની રાખ કરવામાં આવતી નથી તથા 'હું અને મારું' એ ભાવની એ હિંદેનોની હોળી કરવામાં આવતી નથી, ત્યાં સુધી જ્ઞાન પોતાનું તેજ પ્રકાશી શકતું નથી. માનવદેહમાં જે જે કર્મો ટાળવા જેવાં હોય કે ન હોય તે પણ બુદ્ધિથી લીધેલા સંકલ્પ કરીને જ કરેલાં હોય છે એમ સમજવું. આપણે બીજુ કંઈ જ કરવાની જરૂર નથી. જાતે સ્વસ્થતાપૂર્વક ઐશ્રય અને આરામ ભોગવા કે રામનામનું સ્મરણ કરીને ચિંતારહિત તથા ઈચ્છા રહીત થઈ જવું. તે વાતા નિશ્ચિત કરી લેવી. શરીરની ઇન્દ્રિયો મન અને બુદ્ધિ એ પણ આત્માની જ ઉપાધી છે. 'ઉદ્ઘારણ તરીકે જોઈએ તો-ઘટાકાશની બાબતમાં ઘટ અથવા તો ઘડો એ આકાશની ઉપાધિ છે. ઘટાકાશ એ એક મણ જેટલા દાણાને અવકાશ આપે છે. આ ડેકાણે ઘડો આકાશની ઉપાધિ છે, કારણ કે મણ દાણાને અવકાશ આપનાર જે આકાશ છે તેના સ્વરૂપમાં ઘડાનો પ્રવેશ નથી. ઘડો પૃથ્વી તત્ત્વ છે, માટે તેનામાં અવકાશ આપવાનું સંભવતું પણ નથી. માટે ઘડાનો આકાશના સ્વરૂપમાં પ્રવેશ શક્ય નથી. અને વ્યાપક આકાશથી ઘડામાંના આકાશને જુદુ કરતું હોવાથી તે મણ દાણાને અવકાશ આપે છે તેથી ઘડો આકાશ ઉપાધિ બને છે.'

'આ ઘડો છે' એમ કહેતાં 'ઘડો' એવા નામવાળો કોઈ પદાર્થ દશ્િ આગળ પ્રત્યક્ષ પ્રકટે છે. પરંતુ વિચાર કરવામાં આવે તો ઘડો છે જ નહિ. એ તો ઘડાના ઝેપે જણાતી માટી જ છે.' એ કારણે આત્મા પોતે અનાદિ જન્મ રહિત અને અભોક્તા ભોગ નહી ભોગવનાર હોવા છતાં પણ કર્મના ભોગ ભોગવ્યાની આપદા શરીર ઉપર ઓઢી લે છે. આત્માનું ભોગ ભોગવું એ પોતાની ઉપાધીના હિસાબે હોય છે. મૂળમાં સ્વાભાવિકપણો તો એ અભોક્તા જ રહે છે. આને માટે ન્યાયશાસ્ત્રમાં અન્વય વ્યતિરેક અસ્તિત્વ બતાવીને અને અભાવ બતાવીને પ્રતિપાદીત કરેલાં પ્રમાણ અને પુરવા આપેલાં

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

છે. આ રહસ્ય જાણીને જે કર્મ બુદ્ધિના હિસ્સામાં આવે તેવાં કર્મ બુદ્ધિને સોંપવા, મનના કામકાજ પણ અના જ હાથમાં સોંપવા. અને પોતે નિર્જર્મ કર્તા તેમ વર્તવું. પોતાના વર્ણના અને આશ્રમોનાં કર્તવ્ય પ્રમાણે સર્વ વિધિ અને આચરણનું પાલન કરવું. સદાય આત્મા એટલે શું અને પરમેશ્વર સિવાયના બીજા બધા પદાર્થો એટલે શું ? એ વિચારોનું મનન કરવું. આ જ નરહેતનું અંતિમ સાધ્ય છે, આત્મ સ્વરૂપમાં જ લીન થવું એટલે સમજવું કે મનને સુખ અને સંતોષ પ્રાપ્ત થશે. ચારે પુરુષાર્થ સાધવા માટે મનુષ્ય દેહ સિવાય બીજું કોઈ સાધન નથી. જે મનુષ્ય અભ્યાસ કરવા તત્પર હોય છે, એમને નારાયણપદ પ્રાપ્ત થાય છે. માટે જ જ્યાં લગી આ દેહ પડતો નથી, ત્યાં સુધી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતા રહેવું. મનુષ્ય જન્મની એક પણ ક્ષણ નકાર્મી જવા દેશો નહીં. (ઓ. ૬૩-૭૮)

સમુદ્રનું ખાડું પાણી જે મ મેઘનાં વાદળોમાં ડ્ર્પાંતરીત થાય છે કે એનું પાણી મીઠું બની જય છે. તેવી જ રીતે ગુરુચરણમાં શરણું લેતાં પોતાનાં દૃઃખોનું સુખમાં ડ્ર્પાંતર થઈ જય છે. આવા મનુષ્યદેહની સહગતિ ગુરુ સિવાય બીજા કોઈની પાસેથી સમજતી નથી. ગુરુ જ્યારે હાથ પકડે છે ત્યારે જ જડ અને મંહ જીવાત્માઓનો ઉદ્ધાર થાય છે. મંત્ર, તીર્થક્ષેત્ર, દેવ, પ્રાણી, જ્યોતિરી, વૈદ્ય અને સાતમો ગુરુરાજ આ સધાંસાં સ્થાનોમાં શ્રદ્ધા જ ફળે છે. તે સૌમાં જેવી પરીપક્વ શ્રદ્ધા હોય તે પ્રમાણે યશ અને સિદ્ધિ થોડી કે વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. સંત પુરુષો ભોક્ષ પ્રાપ્તિ ઈરછતા મુખુક્ષ જનોને તેને યોગ્ય બનાવે છે અને મુક્તિ અપાવે છે. સંતો અવ્યક્ત સ્થિતિએ પહોંચેલા હોવા છતા વ્યક્ત થઈને પરોપકાર માટે કાર્ય કરતા હોય છે. વ્યાખ્યાનો આપીને કે પુરાણો લખીને જે કાર્ય પૂરાં થતાં નથી, તે સત્તપુરુષોના માત્ર આચરણથી સરળતાપૂર્વક સિદ્ધ થતાં હોય છે. સંતોનું હુલનચલન અને વર્તન એ જ જાણો કે મૌન ઉપદેશ હોય છે. ક્ષમા, શાંતિ, નિઃસંગતપણું તેમજ ભૂત દ્વાયા, પરોપકાર અને ઈન્દ્રિયનિગ્રહ તથા નિરહંકારતા આ બધી વાતો આચરણમાં લાવનારો મનુષ્ય ભાગ્યે જ જેવા મળે છે. જે પુસ્તકો વાંચીને પ્રાપ્ત નથી થતું તે એકાદી સંત વિભૂતીના આચરણ અને વર્તનથી પ્રાપ્ત થાય છે. અનંત તારાઓનો સમૂહ જે કરી શકતો નથી તે કામ એકલો સૂર્ય જ કરતો હોય છે. તેવા જ વિશાળ મનના ઉદાર સંતો છે. એમની સહજ કિયા અનંત જીવને બંધન મુક્ત કરી અત્યંત સુખ પહોંચાડે છે. (ઓ. ૭૮-૮૭)

આમાના જ સાઈમહારાજ એ એક ઔદ્ધર્ય ચુક્ત શ્રીમંત અને શ્રેષ્ઠ સંત હતા. પરંતુ એમની વર્તણૂક એક સાહા ફીરી જેવી હતી. તેઓ સર્વદા આત્માના આનંદમાં રંગાયેલા રહેતા. જેમની સર્વે માટે સમદ્રષ્ટિ અને વર્તાવ સતત કાયમ રહેતો હતો તથા જેમની પાસે હું અને મારા પણાની કોઈ વાત ન હતી. તેમના મનમાં જીવ માત્ર માટે સદાયે દ્વાયા હતી અને તેઓ સર્વ પ્રાણીઓમાં મૂર્તિમંત ભગવાનને જ જેતા હતા. તેમને સુખ મળતાં હર્ષ થતો ન હતો કે દૃઃખ્ય પ્રાપ્ત થતાં કદી શોક થતો ન હતો. તેમને મન માટે શ્રીમંત અને બિભારી એક સરખા જ હતા. એમની અજબ લીલાઓ કંઈ સામાન્ય થોડી હતી ? જેમની ફક્ત ભરમના ઈશારે એક જ ક્ષણમાં બિભારીને શ્રીમંત કરી શકે એવા સક્ષમ હોવા છતાં તેઓ ખભા ઉપર બિક્ષાની ઝોળી લઈને ઘરે ઘરે ફરતા હતા. બાબા બિક્ષુક હોવા છતાં જે ઘેર જઈને કહેતા ‘છોકરી લાવરે એક ચોથીયું ભાખરી’ તો તે ઘરના મનુષ્યો ઘન્ય ઘન્ય થઈ જતા. એક હાથમાં પાણી પાવા માટેનું વાસણ ટમ્બલર લઈને અને બીજા હાથમાં બિક્ષાની ઝોળી સાથે પોતે જ નક્કી કરેલાં ઘરમાં બિક્ષા માટે ફરતા હતા. શાકભાજ, દાળ, હૂંધ, છાશ વગેરે પદાર્થો મનુષ્યો એક જ ટમ્બલરમાં રેડતા હતા. જુઓ તો ખરા આ ખાવાનો પ્રકાર કેવો છે ! રંઘેલો ભાત અથવા ભાખરી માટે તેઓ ઝોળી ફેલાવતા હતા. તેમને જુદા જુદા પદાર્થોનો સ્વાદ માણવાની ઈરછા. તો વળી કયાંથી થાય ? તેમની જીબને

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

સ્વાદ ચાખવાનો લોભ જ ન હોય, તો પછી મનમાં તો તેની ઈચ્છા કેવી રીતે ઉઠે ? યોગાનુયોગે જે કંઈ જોળીમાં પડે તે જ ખાઈને તૃપ્ત થએ જવું અને તે સ્વાદિષ્ટ છે કે સ્વાદ વગરનું છે તેનો વિચાર સુદ્ધાં નહીં કરવાનો તેવો તેમનો સ્વભાવ હતો. જુબ દ્વારા તેમને સ્વાદ લેવાની તેનું માત્ર હોંશ ન હતી. તેઓ દિવસના સમયે દરરોજ બિક્ષા માંગીને લાવેલા પદાર્થોનો ઉદ્ઘર નિવાહ કરીને સંતોષપૂર્વક રહેતા હતા. બાબા બિક્ષા પણ કંઈ નક્કી કરેલા નિયમિત સમયે થોડાજ મેળવતા હતા ? જ્યારે મનમાં આવે ત્યારે તે માંગતા, કોઈકવાર તો એક દિવસમાં તે બાર વખત બિક્ષા માંગવા માટે જતા હતા. આમ જે કંઈ અન્ન લાવતા હતા તે મસ્નિફની કુંડીમાં મૂકતા. એમાં જ કાગડા અને ફૂતરાંથે આવીને ખાતાં પરંતુ એમને પણ કદ્દી ભગાડતા નહીં. મસ્નિફ અને આંગણું સાફ કરવા માટે જે વ્યક્તિ ઝાડું વાળવા માટે આવતી તે પણ એમાંથી દશ બાર ભાખરી પોતાના ઘરે લઈ જતી. તે બાબતમાં તેમણે કોઈની ઉપર પ્રતિબંધ મુક્યો ન હતો. જેમને ફૂતરાં બિલાડાંને હેઠે હેઠે કરવું તે સ્વચ્છમાંથી ખખર ન હતી. તે ગરીબ ગુરબાઓને થોડી જ ના કહેવાના હતા ? ખરેખર બાબાનું જીવું ધન્ય હતું. શરૂઆતમાં તેઓ ‘ગાંડો ફીકીર’ના નામથી લોકોમાં જાણીતા હતા. ભાખરીના ટુકડા માંગીને જે પેટ ભરે એને વળી મોટાઈ કેવી ? તેઓ શરૂઆતમાં ફીકીર હોવા છિતાં પોતાના હાથ વહેચાવામાં ઉદ્ઘાર હતા. બાબા નિરપેક્ષ અને પણ પ્રેમાળ હતા. તેઓ બહારથી ચંચળ દેખાતા પણ અંદરથી એકદમ શાંત વૃત્તિના હતા. આ રીતે તેમની ન સમજય તેવી કળા અને ચતુરાઈ હતી. (ઓ. ૮૮-૧૦૪)

આ વિસ્તારના ગામડાના કેટલાક લોકો પહેલેથી જ દ્યાળું અંત:કરણના હતા. તેઓ તેમને મહંત અથવા તો શ્રેષ્ઠ દર્જના સાધુ માનતા હતા. તાત્યા કોતે પાટીલની ‘મા’ કે જેઓનું નામ બાયન્ઝબાઈ હતું. તે માથા ઉપર ટોપલીમાં ભાખરીઓ લઈને ભરખપોરે જંગલમાં કોસ કોસ સુધી ભટકતી, અને ગીય ઝાડી ઝાંખરમાં જઈને આ ગાંડા ફીકીરને શોધી કાઢીને પગે પડતી. એમની લલમનસાઈની કેટલી મોટાઈ ! ભર બપોરે જંગલમાં ફરીને લુખી સુખી ભાખરી સાથે લઈ જઈ બાબાને કોળિયા ભરાવતી. એવી એની તપશ્ચર્યા હતી. તે વાતને બાબા મૂલ્યુ પર્યંત ભૂલ્યા ન હતા. તેની સેવાઓ યાદ રાખીને તેનાં છોકરાનું બાબાએ કલ્યાણ કર્યું. આ સ્વી પુરુષના જેડાને ફીકીર પ્રત્યે દફ ભક્તિ હતી. ફીકીર જ તે બંનેના દેવ હતા. આખરે દેવ તો ભક્તોનો જ હોય ને ? ફીકીર ધ્યાનસ્થ બેઠેલા રહેતા. બાયન્ઝબાઈ ટોપલીમાંથી રાંધેલા પદાર્થો પીરસીને પ્રયત્ન પૂર્વક બાબાને જમાડતાં. બાબા સદાય કહેતા કે, ‘ફીકીર જ અવ્યલ બાદશાહી હોય છે. ફીકીરી કાયમની રહે છે જ્યારે શ્રીમંતાઈ કાણમાં નાશ પામે છે.’ ત્યારબાદ બાબાએ વનમાં ભટકવાનું ઝોડી દીઘું અને ગામમાં આવીને રહેવા લાગ્યા. મસ્નિફમાં અન્ન ગ્રહણ કરવાની શરૂઆત કરી. આમ કરીને તેમણે બાયન્ઝબાઈનું કષ ઓછું કર્યું. આ નિયમ તે વખતેથી બંનેએ ચાલુ કર્યો હતો. તેને તે પ્રમાણે તેમના પછી તેમના પુત્ર તાત્યાએ પણ ચાલુ રાખ્યો. (ઓ. ૧૦૫-૧૧૪)

સંતો તો ધન્ય હોય છે કારણ કે તેમના હદ્યમાં એકસરખું વાસુદેવનું સ્મરણ ચાલું હોય છે. તેવી જ રીતે તેમના ભક્તોના ભાગ્યને પણ ધન્ય છે કે જેઓને આવા સંતોના સમાગમનું ઐશ્વર્ય પ્રાપ્ત થયેલું હોય છે. તાત્યા કોતે પાટીલ મહાભાગ્યવાન અને મહાણસાપત્રિનો મોટા પુરુષવાન કહેવાય કારણ કે બાબાના સહિતાસનું માન બંને એક જ સરખું ભોગવતા હતા. તાત્યા અને મહાણસાપત્રિ મસ્નિફમાં સૂતા હતા. તેઓની બંનેની ઉપર બાબાનો અનુપમ પ્રેમ એકસરખો જ હતો. પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર આવી ત્રણેય દિશામાં ત્રણેયનાં માથા રહેતા. અને તેમના પગ એકબીજાની સાથે વચ્ચમાં જેડાયેલા રહેતા. આ રીતે તેમના બિછાનાં બીજાવીને તેઓ ગામગપાટા ચલાવતા. જે એકાદ જણાને ઝોકું

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

આવી જય તો બીજને ઉઠાડવો પડતો. તાત્યા ઘોરવા લાગે એટલે તેને બાબા અચાનક જ જગાઉતા. તેઓ તેને ઊંધો, છતો કરીને તેનું માથું પકડી રાખતા. મહાળસાપતિની મદદથી તેઓ બંને ભેગા થઈ તાત્યાને દબાવી રાખતા. અને પગ પકડી રાખતા અને એની પીઠ રગડતા. આવા આત્મીય સંબંધે તાત્યા સતત ચૌંદ વર્ષ મસ્નિદમાં બાબા સાથે સૂતા હતા. તેઓ કેટલા ભાગ્યશાળી, અને કેટલા ભાગ્યશાળી તે દિવસો હતા. તે અંગેની યાદ તેમના મનમાં સતત રમતી હતી. તેઓ માબાપને ધરમાં છોડીને અને બાબાના પ્રેમથી વશ થઈને તેઓ મસ્નિદમાં સૂતા હતા. એવા દિવ્ય પ્રેમનું કેવી રીતે માપી શકાય ? અને તે પ્રેમની કિંમત કેવી રીતે અંકાય ? આગળ ઉપર એમના પિતાનો સ્વર્ગવાસ થતાં તાત્યા ધરસંસારમાં પડયા. તેઓ પોતાના ધરના કર્તાંહર્તા તથા એક માત્ર પુરુષ હોવાથી અને પતિ હોવાને કારણે તેઓ પોતાને ઘેર સૂવા લાગ્યા. જેમની આવી નિષાવાન ભાવના હશે તેનેજ સાઈબાબાનો અનુભવ નહીં માગતાં મળશે. ભક્તોને તે ચયત્કાર દેખાય છે. (ઓ. ૧૧૫-૧૨૫)

એવી જ રીતે રાહતાના ખુશાલચંદ નામના એક શ્રીમંત જેઓ ગામના નગરશોઠ હતા અને બાબાના તે પરમ ભક્તા હતા. જેવી રીતે પ્રાણાત ગણાપત કોતે પાટીલ બાબાના ખૂબ જ ગમતા માણસ હતા, એવી જ રીતે ખુશાલચંદના કાકાનો દીકરો ચંદ્રભાણ શેઠ બાબાનો ખૂબ લાડીલો હતો. જતના ભલે તેઓ મારવાડી હતા. છતાં બાબાને માટે તેમનો પુરુષ આદર અને પ્રેમ હતો તથા ઝેંચાણ હતું. તેઓ એકબીજને વારંવાર મળતા હતા અને જ્યારે મળતા ત્યારે પ્રેમથી લેટા હતા. ઈશ્વર ઈચ્છાથી કુટુંબના વડીલ ચંદ્રભાણ શેઠ સને ૧૯૭૧માં મરણ પામ્યા, છતાં બાબા તે કુટુંબને કદ્દી ભૂલ્યા નહીં. ઊલટાનો એમનો પ્રેમ એ કુટુંબ તરફ બમણો વધ્યો. ત્યારબાદ તેમના ભત્રીજી ખુશાલચંદ ઉપર બાબાનો પ્રેમ વધતો જ ગયો અને જ્યાં સુધી બાબાના શરીરમાં પ્રાણ હતો ત્યાં સુધી તે રાત દિવસ તેમના કલ્યાણ માટે જગૃત રહ્યા. શિરડીથી દોઢેક માઠિલ દૂર રાહતામાં બાબા કોઈકવાર બળગાડામાં તો વળી કોઈકવાર ઘોડાગાડીમાં પ્રેમથી તેની સાથે જતા હતા. ગામલોકો ઢોલ, ત્રાંસા, વાલિંગ્રો વગાઉતા અને સામે ગામના પાછે આવી બાબાનું સ્વાગત કરતા. અને પ્રેમથી મળતા તથા બાબાને સાણંગ નમસ્કાર કરતા. પછી ત્યાંથી ઉત્સાહભેર વાજતેગાજતે અને ભક્તિભાવથી તેઓ બાબાને ગામમાં લઈ જતા હતા. ત્યારબાદ ખુશાલચંદ બાબાને પોતાને ઘેર લઈ જતા, અને ફરાળ કરાવીને તેમને આસન ઉપર બેસાઉતા. તેઓ જૂની પુરાણી વાતો કાઢીને એની યાદ એકબીજને કહેતા અને એનાથી એમને જે આનંદ મળતો તેનું વર્ણન કોણ કરી શકે ? આ પ્રમાણે મોજથી ગામગપાટા મારીને અને ફરાળ કરીને બાબા પોતાના સાક્ષીઓ સાથે શિરડીમાં પાછા ફરતા. (ઓ. ૧૨૬-૧૩૬)

એક બાજુ રાહતાગામ અને બીજુ બાજુ નિમગાંવ હતુ જ્યાં બાબા સાહેબ ડેગણે ઘેર બાબાની ફેરી રહેતી. આ બે ગામની વચ્ચે બાબા જ્યાં રહેતા હતા તે શિરડી ગામ હતું. તેને મધ્યબિંદુ ગણવામાં આવે તો આ બે ગામની આગળ બાબા સ્થૂળ દેહથી અને તેમણે દેહત્યાગ કર્યો ત્યાં સુધી કયારેય આગળ ગયા ન હતા. છતાં એમને માહિતી તો બધી જ જગ્યાની રહેતી હતી. તે બીજે કયાંય જતા નહીં અને રેલગાડીનાં તો દર્શન પણ નહોતા કર્યો. તેમ છતાં ગાડીઓના આવવા જવાનાં સમયપત્રક તેમને મોઢે રહેતા. ગાડીનો સમય સાચવવા ભક્તો ઘણીવાર ઉતાવળ કરતા પરંતુ બાબાની આજા લીધા વગર કોઈએ જવાનું ન હતું. અને ઉતાવળમાં આજા માંગવા જતા ત્યારે બાબા કહેતા કે, ‘હવે ઉતાવળ કેમ કરો છો ?’ તે સાંભળી ભક્તો જવાબ આપતા કે ‘બાબા ! હવે જે ઉતાવળ ન કરીએ તો મારી મુંબઇની ગાડી છૂટી જશે અને નોકરીમાં રજ પડશે તથા મારો સાહેબ મને કાઢી મૂકશે.’ ત્યારે બાબા કહેતા કે,

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

‘અહીંયા બિજે કોઈ જ સાહેબ નહીં, અહીં તો ફકીર માઠ જ સાહેબ છે. માટે આઠલી દોડાદોડી શા માટે કરો છો ? જવ જરા ભાખરીના બે દુકડા ખાઈને બ્યોરે નીકળ્યો.’ કોણી હિમત હોય કે બાબાની આજ્ઞાનું ઉલ્લંઘન કરે ? અને તેમના શબ્દોનો અનાદર કરે ? નાના મોટા તેમજ ડાહ્યા અને સમજદાર અનેક લોકોને આનો અનુભવ હતો. જેણે જેણે આજ્ઞા માની તેઓ કદ્દી ગાડી ચૂક્યા નહિ. પણ જેઓએ આજ્ઞા ન માની તે દરેકને જતાજતના અને ભાતભાતના વિચિત્ર અનુભવોનો સામનો કરવો પડ્યો હતો. (ઓ. ૧૩૭-૧૪૪)

અનેક લોકોને એક પછી એક એમ નવા નવા અને આશ્ર્વયકારક અસંખ્ય અનુભવો થયા. તેમને હું ટૂંકાણમાં કહીશ. હેમાદપંત સાઈચરણમાં શરણે આવ્યા છે. આગળના અધ્યાયમાં આ જ વાતોનું વર્ણન થશે. પોતાના ગામે પાછા જતી વખતે બાબાનું અનુમોદન જરૂરી હતું. જેમને આજ્ઞા મળે તેઓ જઈ શકતા અને આજ્ઞા ન મળે તો તેઓએ રહી જવું પડતું. જેઓ ન માનતા તેઓ સંકટમાં પડતા. આગળના અધ્યાયમાં આ અંગો આપણે થોડી વાતો કરીશું. તેવું જ બાબાની બિક્ષાવૃત્તિનું ધરે ધરેથી માંગી લાવેલું આજીવિકા ખાતર અન્ન અંગિકાર શા માટે કરેલું ? અને ‘પંચપાતકો’નું ધોવાઈ જવું એટલે શું ? એમાંની કંઈક વાતો આગળ ઉપર કહેવામાં આવશે. માટે શ્રોતાજ્ઞનોનાં ચરણોમાં આગ્રહથી અને વિનંતીથી જણાવું છું કે તેઓએ પોતાનું કલ્યાણ કરવા માટે આ સાઈચરિત્ર હંમેશા સાંભળવું. (ઓ. ૧૪૫-૧૪૬)

સર્વનું કલ્યાણ થાઓ. આવા પ્રકારે સંત અને સજ્જનની પ્રેરણા પામેલા, ભક્ત હેમાદપંત રચિત સત્ય

ચરિત્રનો ‘નરજ્જન્મ મહિમા, બિક્ષા અન્ન સેવન, બાયજાયાઈની ભક્તિનું વર્ણન તથા તાત્યા અને

મહાળસાપત્તિનું બાબા સાથે શયન’ આ નામનો આઠમો અધ્યાય સમાપ્ત થયો.

શ્રી સદ્ગુરુ સાઈનાથને અર્પણા.



॥ અધ્યાય ૬ ॥

આજ્ઞા, અવજ્ઞા, વિદ્ધન, લિક્ષાવૃત્તિ, પંચપાતક આદિ પાપોમાંથી

મુક્તિ તથા ભક્ત તર્ફની કથાનું નિર્ણયણ

(બાબાની આજ્ઞાના ઉત્સંહનને કારણે ઉભા થનારાં વિદ્ધનો, બાબા દ્વારા લિક્ષા માંગીને લોકોનાં પંચપાતક
આદિ પાપોનો નાશ કરવો અને ભક્ત તર્ફની કથાનું વર્ણન.)

(મૂળ ભરાઈ પુસ્તકમાં અધ્યાયને અંતે વિષય લખ્યો નથી. તે ભૂતથી લખવાનો રહી ગયો હો. માટે અધ્યાયને અંતે
ઉપરોક્ત વિષય દર્શાવાયો છે.)

શ્રી ગણેશજીને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કુળહેવતાને વંદન,
શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રજીને વંદન અને શ્રી સદગુરુ સાઈનાથ મહારાજને વંદન.

આગણ કહેવાયેલી કથાના અનુસંધાનમાં બાબાની આજ્ઞા લીધા કે માન્યા સિવાય ભક્તો જ્યારે પોતાને ઘેર પાછા ફરતા હતા ત્યારે એમને રસ્તામાં કેવી મુશ્કેલીઓ પડેલી તેનું વર્ણન કરાશે. તેજ રીતે ભક્તોના કલ્યાણ માટે પંચપાતકો-
પાંચ પાપો જેવા કે દળવું, ખાંડવું, ચૂલો સળગાવવો, પાણી ભરવું અને છાણનું લીપણ કરવું વગેરેથી મુક્ત થવા માટે
બાબાએ લિક્ષા માંગવાનું જે પ્રત તેમણે દેહત્યાગ કર્યો ત્યાં સુધી આચર્યું હતું તે વિષે અહીં કહેવાશે. તેજ પ્રમાણે શ્રી સાઈ
કૃપા કરીને ઈશ્વર બ્રહ્મહેવથી માંડીને સ્થાવર વસ્તુઓમાં વ્યાપી રહેલો છે. તે મનમાં કેવી રીતે દ્સાવતા હતા તે બધાનું હું
વર્ણન કરીશ. સર્વે શ્રોતાઓને આ કથા-વર્ણન ઉપર ધ્યાન દેવા વિનંતી કરું છું. જે ધ્યાન તથા આદરથી સાંભળવામાં
આવશે તો તેમાં એમનું જરૂર કલ્યાણ થશે. (ઓ. ૧-૪)

શિરડીયાત્રાની એક વિશેષ ખાસિયત એ છે કે, બાબાની આજ્ઞા સિવાય જે યાત્રાનું પાછા ફર્યા હતા. તેઓએ
સંકટોને નોતર્યા હતાં. તેવી જ રીતે શિરડીથી એક વખત પાછા જવાની બાબાની આજ્ઞા થયા બાદ જે લોકો એક ક્ષણ
પણ વધારે રહ્યા હતા તેમની ઉપર પણ યેનકેન પ્રકારે વિદ્ધનો આવી પડતાં હતાં. આ વાતનો અનુભવ ઉત્સંહન કરનારને
થતો. આજ્ઞા વિરુદ્ધ જે જે લોકોએ વર્તાવ કર્યો તેઓની રસ્તામાં ખૂબ ખરાબ હાલત થઈ જતી હતી. કેટલાકને તો
લૂંટારાઓએ લૂંટી લીધેલા અને તે આવી ઘટના જન્મભર ભૂતી શક્યા ન હતા. ‘ભાખરીનો દુકડો ખાઈને જણો,’ આવું
કહેવા છતાં પણ બાબાની આજ્ઞા સિવાય જે લોકો ઉતાવળમાં ખૂખ્યા પેટે નીકળી ગયા હતા, એમને સમયસર વાહન કે
ગાડી પણ મળતી નહીં અને તેઓ ભૂખે ટળવળતા અને રખડી પડતા હતા. આવા અનેક ભક્તોના અનુભવો છે. આ રીતે
સ્વ. કાકાસાહેબ દીક્ષિત, સ્વ. તાત્યા સાહેબ નુલકર, સ્વ. રઘુનાથ બાસ્કર પુરન્દરેના અનુભવો મૂળ પોથીમાં પણ નોંધેલા
છે. (ઓ. ૫-૮)

એક વખતે તાત્યા કોતે પાટીલ કોપરગાંવ તાલુકાના કોઈ ગામમાં જવા નીકળ્યા હતા. ત્યાં દૂર અઠવાડિયે બજર

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

ભરાતું હતું. ઘોડાગાડી બહાર ઊભી રાખીને તેઓ મસ્ટિજદમાં આવ્યા. અને બાબાના દર્શન કર્યા તથા હું ‘તરત આવું છું’ એમ બાબાને કહીને તે બાબાના પગમાં પડ્યા. આ રીતે તેમણે આજા લેવાનો દેખાવ પણ કર્યો. ઘણીવાર ભક્તો આજા લેવાનું ટાળતા પરંતુ બાબાને સારા નરસા સમયનું ધ્યાન રહેતું હોવાથી તેમણે તાત્યાને અધીરો થયેલો જેઠને બાબાએ કહ્યું, ‘થોડીવાર રોકાઠ જી,’ હમણાં બજલરમાં જવાનું રહેવા હો. તે પછી જેવાશે. હમણા ગામ બહાર જઈશ નહિ.’ છતાંપણ તાત્યાનો ખૂબ આગ્રહ જેઠને બાબાએ કહ્યું ‘શામાને જેઠે રાખજો.’ પરંતુ તાત્યાને મનમાં એમ થયું કે ‘શામાનું શું કામ છે ?’ એવું કહીને તાત્યાએ બેદરકારી દાખીને બાબાની આજા ટાળી અને ટાંગામાં જઈને બેઠા તથા બજલર તરફ જવા માટે નીકળી પડ્યા. આગળ જતાં ટાંગામાં જેઠેલા બે ઘોડા પૈકી એક વધારે ચ્યાપ હતો. જેને ત્રણસો ઢપિયા જેવી મોટી કિંમત આપી ખરીયો હતો. સાઉણવિહીર નામના ગામ નલ્જક આવતાં જ તે ઘોડો બેકાબુ થઈ ગયો અને મન ફાવે તેમ દોડવા લાગ્યો. કોઈ દિવસ ચાબુકના ચાબુખા ન ખાનારો અને થોડાજ સમયમાં બજલરમાં પહોંચાડનારો તે ઘોડો પડી ગયો અને ગાડી એકએક ઘક્કો લાગતાં નીચે બેસી પડી. તેથી તાત્યાની કમરમાં ખરાબ ચસક ભરાઈ ગઈ. કેવું બજલર અને કેવી વાત ? તાત્યાને સાઈ માઉલીની યાદ આવી ને મનમાં બોલ્યા, ‘જે બાબાની વાત સાંભળી હોત તો આ સંકટ ટળી ગયું હોત. પણ હવે જે બની ગયું એનો કોઈ ઉપાય નથી.’ (ઓ. ૮-૧૬)

આ પ્રમાણે બીજીવાર પણ બન્યું. તાત્યા શિરડીથી આશરે પરચીસ કી.મી.ના અંતરે આવેલા કોલહાર ગામે જવા નીકબ્યો. તે ઘોડાગાડી જેઠીને બાબાને પૂછવા માટે આવ્યા. બાબાના ચરણમાં વંદન કર્યા અને ‘હું હમણાં જઈને આવું છું’ તેમ બોલ્યા. તેમને બાબાની સંપૂર્ણ સંમતિ મળે તે પહેલાં જ તાત્યા ત્યાંથી નીકળી ગયા. હવે આગળ શું બન્યું તે હવે સાંભળો. પહેલેથી જ તીવ્ર ગતિથી દોડનારા એ ટાંગા પર સવાર થઈને તેઓ નીકળી પડ્યા. તેઓ રસ્તા ઉપરના આડા ટેકરાને કપરા વળાંકની ચિંતા કર્યા વીના ગાડી દોડાવતા હતા. તે પ્રસંગ તો જીવલેણ બની ગયેલો, પરંતુ સાઈ ફૂપાથી તે ટળી ગયો. ટાંગો બાવળના ઝાડ સાથે ખૂબ જ જેરથી અથડાયો. સારું થયું કે તે ત્યાં જ તુરી ને છૂટો થઈ ગયો અને મોટા અક્ષમાતમાંથી તેઓ ઉગરી ગયા. (ઓ. ૧૭-૨૦)

આ રીતે મુંબઈના એક મોટા અંગ્રેજ ગૃહસ્થ મનમાં કોઈ મક્કમ હેતુ સાથે શ્રી સાઈબાબાના દર્શન માટે શિરડી આવ્યા. ચાંદીરકરની ભલામણાથી તેમણે માધવરાવને એક પત્ર લખ્યો હતો. તેમણે શિરડી આવીને એક તંબુ મંગાવ્યો અને તેમની રહેવા માટેની સગવડ થઈ ગઈ. શ્રી બાબાની ઈચ્છા વિરુદ્ધ કોઈ એમ વિચારે કે મારે મસ્ટિજદમાં જવું છે અથવા તો દર્શન કરીને પોતાની મરળ મુજબ સ્વચ્છિંદીપણે પાછુ ફરવું છે તે અશક્ય હતું અને તે વાત જગતહેર હતી. પેલા અંગ્રેજ ગૃહસ્થે મસ્ટિજદમાં ત્રણ વખત પગથિયા ચઢવા માટે પ્રયત્ન કર્યો પણ તે નિષ્ફળ ગયા. તે અંગ્રેજ મહેમાન ઉદાસ થઈ ગયા તેમના મનમાં એવી ઈચ્છા હતી કે પોતે મસ્ટિજદમાં જઈને પોતાના ધર્મની પદ્ધતિ પ્રમાણે ઘૂંઠણ ટેકવીને બાબાની સામે બેસવું અને તેમને વંદન કરી તેમના હાથનું ચુંબન લેવું. પરંતુ બાબા મસ્ટિજદમાં તેમને પોતાની પાસે બેસવા હેતા નહોતા. ‘એને નીચે સભામંડપમાં જ રહેવા હો, જરૂર હોય તો તે ત્યાં જ બેસે અને ત્યાંથી જ દર્શન કરે. પણ મસ્ટિજદમાં તેણે આવવું નહીં.’ થોડીવાર પછી તે જવા માટે ઊભો થયો અને આંગણામાં સંદેશો આપવા માટે આવ્યો, ત્યારે બાબાએ તેને કહ્યું ‘કાલે જને. આટલી ઉતાવળ શાને માટે ?’ લોકોએ તેમને ખૂબ કહ્યું અને અનેક પ્રકારે સમજાવ્યા. પરવાનગી વીના જે લોકો ગયા તેમને પસ્તાવાનો વારો આવેલો તે પણ તેને સમજાવ્યું. છતાંપણ જે થવાનું છે તેને કોઈ રોકી શકતું નથી. તે અંગ્રેજને ઘણો જ સમજાવ્યો પણ તેના ગળે કોઈ વાત ઉત્તરી નહીં. એ તો પરવાનગી સિવાય નીકળી

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

પડ્યો અને રસ્તામાં તેના જે હાલ થયા તે સાંભળો. ઘોડાગાડી પહેલા તો વ્યવસ્થિત ચાલી અને ઘોડાએ પણ આગળનો રસ્તો પકડ્યો. સાચુળવિહીર ગામ પસાર કર્યું હશે અને આગળથી એક સાયકલવાળો પસાર થયો. ટાંગાના ઘોડા એકાએક ભડક્યા. અંગેજ ગૃહસ્થ ટાંગામાં પાછળની તરફ બેઠા હતા. ટાંગાનું સમતોલન જતાં એ એક બાજુ ઝૂકી ગયા અને પાછળ રસ્તા ઉપર ઉથલી પડ્યા. ગૃહસ્થ ધસડાવા લાગ્યા. તે જેઠને લોકોએ ખૂબ જ મહેનતથી ટાંગો રોક્યો. ટાંગો સીધો કર્યો અને તે અંગેજને ટાંગામાં ઉચ્ચકી પાછો બેસાડ્યો અને ફરીથી ટાંગો હુંકાર્યો. શિરડી એક બાજુએ રહ્યું અને મુંબદી બીજી બાજુએ. જે બાજુ કોપરગાંધની હોસ્પિટલ હતી. તે તરફ ટાંગો વાબ્યો. ત્યાં એ ગૃહસ્થ દુઃખી થઈને આજાબંગનું પ્રાયશ્રિત કરીને કેટલાય દિવસો સુધી તેના ભોગ ભોગવતો પડ્યો રહ્યો. (ઓ. ૨૧-૩૫)

લોકોને આવા અસંખ્ય અનુભવો થયા. તેઓ મનમાં થોડી શંકા રાખીને તથા બાબાની આજા પાળીને જ જવા માંડ્યા. આજા ન પાળવાથી કોઈની હિંમત થઈ નહિ. કોઈની ગાડીનાં પૈડાં નીકળી ગયા. તો કોઈકના ઘોડા થાક્યા અને કેટલાકની ગાડી છૂટી જવાથી ભૂખે મર્યાં. વળી કેટલાકને તો ભુસાં ભજ્યાં ફાકવાનો વારો આવ્યો. જેમણે આદરપૂર્વક શ્રી બાબાની આજા પાળી તેમને બધાને જ સમયસર ગાડી મળી અને મુસાફરી પણ સુખેથી થઈ. તેની યાદ જીવનભર ટકી રહી. (ઓ. ૩૬-૬૮)

કોઈના પણ મનમાં શંકા ઉત્પન્ન થાય કે વર્ષોનાં વર્ષો સુધી બિક્ષા માંગવાનું બાબાને કેમ ગમતું હશે? પાછળથી તેમને આરોગ્યા માટે ઉત્તમ પકવાનોના થાળ આવતા છતાં તે બિક્ષા માંગવાનું શા માટે ચાલુ રાખ્યું હશે. તે શંકાનું નિરાકરણ હવે સાંભળો. બાબાની વર્તાણુંક અને રહેણીકરણી જેતાં એમ લાગ્યું હોત કે તેમણે બિક્ષા જ માંગવી તે ઉચિત છે. આ રીતે વર્તાની લોકોને ગૃહસ્થાશ્રમના કર્તવ્ય પાલનનો આનંદ આપીને તેઓ તેમનું હીત સાધતા હતા. કાચા, વાચા, ચિત્ત અને સંપત્તિ આ સર્વ સાધીચરણે સમર્પિત કરનારા એકનિષ્ઠ ભક્ત સાઈબાબાને પુષ્કળ ગમતા હોય છે. ગૃહસ્થાશ્રમ પાળનારા ધરમાં જે પણ અન્ન રાંધવામાં આવે છે. તેની મુખ્ય પુરુષોએ પ્રથમ અનિદેવને અન્નની આહુતી આપવાની હોય છે તે પછી જ સ્વામી સંન્યાસી અને બ્રહ્મચારીને અન્ન આપવાનું હોય છે. એટલે કે જે પ્રત્યક્ષ હાજર હોય તેઓને ઉદારતાથી જમાડવા જેઠાએ. જે એમ ન કરાય અને ગૃહસ્થ પોતે પહેલા ભોજન કરે તો તેને કાચા, વાચા અને મનની શુદ્ધિકરણ ખાતર ચંદ્રાયણ વ્રત કરવું પડે, એવો શાસ્ત્રમાં નિયમ છે. સંન્યાસી અને બ્રહ્મચારીઓને અન્ન રાંધવાની મનાઈ હોય છે. જે તેઓ તેમ કરે તો એમણે પણ ચંદ્રાયણ વ્રત ચોક્કસ જ કરવું પડે છે. માટે તેમને પોષવાની વ્યવસ્થા શાસ્ત્રોએ ગૃહસ્થાશ્રમીઓને સૌંપી છે. સંન્યાસી પોતાના ભોજન માટે કયારેય કામ વંદ્યો કરતા નથી. બાબા તો ગૃહસ્થાશ્રમી પણ નહતા અને વાનપ્રસ્થી પણ ન હતા. માટે બિક્ષા માંગવી એમને માટે યથાયોગ્ય હતી. ‘અભિલ વિશ્વ મારું ધર છે’ અને ‘હું જ વાસુદેવ છું’ ‘વાસનાત્ વાસુદેવસ્થ, વાસિતં ભુવનત્રયં’ અર્થાત્ વાસ એટલે વાસ કરવો તે માટે વાસુદેવ એટલે જેનો ત્રિભુવનમાં વાસ છે તે હું વિશ્વભર છું અને હું જ અવિનાશી પરથલ છું એવું જેને શાન લાધ્યું છે તથા મનનો પાકો નિશ્ચય થયો છે એવાને વિશ્વ એ જ મારું કુટુંબ છે એમ સમજનારાને માટે બિક્ષાનો અને તે દ્વારા મેળવેતા અન્નનો પૂર્ણ અવિકાર હોય છે. નહિ તો બાકીના બીજાઓને માટે ચક્કા ઉપરના બિખારી જેવો ફંજેતીનો પ્રકાર સમજવો. માણસે પહેલાં તો પુરેખણા છોડવી જેઠાએ અને વિતેખણા તથા લોકેખણા છોડવી જેઠાએ. જેમણે આ નાણેય આકંક્ષાઓ છોડી હીધી છે, એમને જ બિક્ષાનું અન્ન આરોગ્યાનું મનમાં વિચારવું જેઠાએ. અથવા તો ‘બિક્ષાપાત્ર અવલંબણો નડો જિણો લાભિરવાણે’ અર્થાત્ બિક્ષાપાત્ર પર અવલંબીને જીવવું નહીં તે શરમજનક છે. આ તુકારામ મહારાજનું ગીત અર્થ-હીન અને સાર

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

વગરનું થઈ જશે. સાઈસમર્થી એક મહાન સિદ્ધ પુરુષ હતા એ બધાં જ જાણતા હતા. પરંતુ આપણે સદ્ગુરુ સાંસારિક આશા અપેક્ષાઓથી જકડાયેલા હોવાથી તેમના પવિત્ર ચરણોમાં આશકત થઈ શકતા નથી. (ઓ. ૩૮-૫૧)

શાસ્ત્રોએ પાંચ પ્રકારના મહાયજ્ઞ કહ્યા છે. જેવાકે વ્યક્તયજ્ઞ એટલે વેદ અને પુરાણોનું પઠન, દેવયજ્ઞ એટલે સ્વાહાકારથી દેવોને આહૃતિ આપવી તે, પિતૃયજ્ઞ એટલે સ્વાધીકારથી પિતૃઓને આહૃતિ આપવી તે તથા ભૂત્યજ્ઞ એટલે મનુષ્યોએ કિડા, મંકોડા, પશુ, પક્ષી માટે જ મતા પહેલાં અન્નનો કોળિયો બાજુ પર મૂકવો તે અને મનુષ્યયજ્ઞ એટલે કે અતિથિઓને ભોજન આપવું તે તેમ કર્યા સિવાય ગૃહસ્થાશ્રમી માણસનું જમણ નિષેધ જમણ કહેવાય છે. શિરડીમાં સાઈબાબા રોજ પોતે ઉપરોક્ત યજ્ઞો દ્વારા પવિત્ર કરીને ભોજન ગ્રહણ કરતા હતા. તેઓ દરરોજ પાંચ ઘેર બિક્ષા માંગીને અતિથિયજ્ઞની યાદ કરાવતા. આ પ્રકારે તે ભાગ્યવાન ગૃહસ્થો ઘરે બેસીને જ એનો લાભ લેતા હતા. જે મનુષ્યો આ પાંચ મહાયજ્ઞ કરીને વધેલું અન્ન ખાય છે, તેમના પાંચપાતકોના પ્રસિદ્ધ થયેલા તથા અજાણતાથી થયેલા અને સમજવામાં મુશ્કેલ અવાં પાપોનો નાસ થાય છે. (જુઓ, મનુસ્મૃતિ, અધ્યાય ત્રીજે લોક ૬૮-૭૧), ખાંડયું (ખાંડણીમાં નાખી છડવું અથવા કુટવું), રંધવુ (ચુલો પેટાવવો), દળવું (ધંટીના પથ્થરમાં દળવું), પાણી ગાળવું, લીપવું આ પાંચ પાપો પંચપાતકો તરીકે પ્રચલિત છે. સાંભેલાથી ખાંડતી વખતે નીકળેલી કુસકી તથા ફોતરાં કાઢી નાખવામાં આવે છે. તે વખતે અજાણતાથી અનેક સૂક્ષ્મ જીવો માર્યા જય છે. પરંતુ આ પ્રયોગ વગર અનાજ રંધાતું નથી. એટલે પંચપાતકોમાં આ પહેલું ‘ખાંડણી’ નામનું પાપ કહેવાય છે. ચૂલામાં બાળવા માટે લાકડાં મૂકીને અન્ન રંધતી વખતે જીવોની હત્યા થાય છે. તે બીજ પ્રકારનું પાપ ગાળવું છે. દળવામાં ધંટીના પથ્થર લઈને લોકો અનાજમાંથી લોટ બનાવે છે. ધંટીમાં દળતી વખતે પણ અજાણતાથી જીવોનો નાશ થતો હોય છે. એને ‘પોણણી’ એવું નામ આપેલું છે. કૂવામાંથી પાણી કાઢતાં અથવા તો તળાવ, નદીમાંથી ધડો ભરીને પુરુષ અને જીવીઓ પાણી લાવે છે તથા પાણી રેડે છે અને એઠાં વાસણ ધૂવે છે તે સમયે પણ અસંખ્ય જીવ નાશ પામે છે, ધડો સ્વચ્છ કરવા માટે હાથથી માટી અથવા તો રાખથી ધસવામાં આવે છે, ત્યારે પણ ઈચ્છા ન હોવા છતાં જે હત્યાઓ થાય છે તે ચોથું પાપ ‘ઉદ્દુંભી’ કહેવાય છે. તેવી જ રીતે હંડા અથવા ગરમ પાણીથી સ્નાન કરતાં અથવા તો રોજ સવારમાં કચરો કાઢતાં અને છાણા અને માટીનું જમીન ઉપર લીપણ કરતા અનેક પ્રકારની જીવહત્યા થતી હોય છે. એનું ‘માર્બની’ એવું નામ છે. આ પાંચ પ્રકારનાં પાપોથી મુક્ત થવા માટે ગૃહસ્થોએ વિધિપૂર્વક પંચમહાયજ્ઞો આચરણથી તે પંચપાતકોનો ક્ષય થાય છે. તે સદગૃહસ્થોની ચિત્તશુદ્ધિ થાય છે. ચિત્તશુદ્ધિના પ્રભાવથી પવિત્ર અને શુદ્ધ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને એવું જ્ઞાન થયા બાદ, એવા ભાગ્યવાન ગૃહસ્થોને ફળદ્રોપી કાયમનો મોક્ષ પ્રાપ્ત થતો હોય છે. આ સાઈના બિક્ષા માંગવાના વ્રત વિશે લખતાં લખતાં ગ્રંથ આગળ વધતો ગયો. હવે એક સત્યધટના સાંભળો. પછી હું આ અધ્યાય સમાપ્ત કરીશા. (ઓ. ૫૨-૬૫)

ભક્તને મનમાં વિશુદ્ધ પ્રેમ હોવો જોઈએ. પછી કોઈ વ્યક્તિ કંઈ પણ મોકલે અને લાવનાર વ્યક્તિથી જો તે વસ્તુ આપવાની વિસરાઈ જય તો બાબા તેની પાસેથી જોતે જ ભૂલાયેલું યાદ કરવાની તે માંગી લેતા. તે પછી ભાજુ કે ભાખરી હોય અથવા પેંડો હોય. ભક્તિનો ભાવ ગાઢ હોવો જોઈએ. આવો દ્રદ ભક્ત મળે તો સાઈબાબાના પ્રેમનાં પૂર ઉભરાતાં. આ એક પ્રેમાળ ભક્તની કથા છે. તે સાંભળીને શ્રોતાઓને જરૂર આનંદ થશે. કોઈ દ્વારા લીધેલાં કાર્યોમાં જો ભૂલ થાય તો બાબા તેને સાચા માર્ગ પર લઈ આવતા. આવી બાબાની સુંદર શિક્ષણ પદ્ધતિ ભક્તોને યોગ્ય સમયે જગૃત કરતી. આ અનુભવ જેને થયો હશે તેમના ભાગ્યને ધન્ય છે અને તેમને વર્ણન ન કરી શકાય તેટલો આનંદ પ્રાપ્ત થતો હશે. રામચંદ્ર

શ્રી સાઈનું સત્ય ચારિત્ર

નામના એક ગૃહસ્� જેમના પિતાનું નામ આત્મારામ હતું અને એમની અટક તર્ખડ હતી. તેમને માટે સાઈ જ એક વિશ્રાંતિનું સ્થાન હતું, પરંતુ જેમને બાબાસાહેબ તર્ખડ, આ જ નામથી હંમેશા સંબોધિત કરવામાં આવતા હતા, તેમની ખાતર આ ગ્રંથ આપણે આગળ ચલાવીશું. આ સિવાય ગ્રંથ આગળ ચલાવવાનું આપણે બીજું કોઈ કારણ નથી. સાઈપ્રેમથી ઉભરાઈ આવેલું તર્ખડનું હદ્દ્ય છલકાઈ જય એટલે તેઓ પોતે પોતાના અનુભવ કહેવા લાગતા અને તે સાંભળતાં ખૂબ જ આનંદ થતો. શું અદ્ભુત એમની ભક્તિની રીત હતી? તેઓ ડગલેને પગલે સાઈબાબાના એક પછી એક નવા અનુભવોનું સુંદર હાવભાવથી વર્ણન કરતા. બાબાસાહેબની ભક્તિ અનેડ હતી. એમને ઘેર ચંદ્નના લાકડામાંથી બનાવેલ ભવ્ય દેવધરમાં ત્રણે સમય પૂજા થતી જેમાં સાઈબાબાનું કાગળ ઉપર ઢોરેલું ચિત્ર હતું. તર્ખડ ખૂબ ભાગ્યવાન હતા. તેમને ત્યાં જન્મેલો છોકરો પણ ભક્તિબાવવાળો મખ્યો હતો. સાઈબાબાને છબીનું કાયા, વાચા અને મનથી પૂજન કરીને તે ભક્તિપૂર્વક નૈવેદ્ય ધરાવતો હતો. એનો દરરોજનો આ નિત્યક્રમ કંટાળો કર્યા વીના સતત ચાલતો હતો. તેનો આ દૈવી પરિશ્રમ સફળ થતાં તેને એક અનેડ અનુભવ થયો. તેનાં માતા પણ પરમ સાઈભક્ત હતાં. તેઓ શિરડી જવા માટે કાયમ ઉત્સુક રહેતાં. તેમને એમ થતું હતું કે આપણે શિરડી જઈને સમર્થ સાઈનાં દર્શન કરવાં અને ત્યાં વધુ સમય રહીને બાબાનાં ચરણોની સેવા કરવી. પિતાની પણ એવી ઈચ્છા હતી કે તેમના પુત્રએ પણ સાથે જવું. પરંતુ તે પુત્રનું ત્યાં જવા માટે મન થતું ન હતું. તેને એ ચિંતા થતી હતી કે હું ન હોઉ તો પૂજા કોણ કરશે? મારા પાછળ ધરમાં નિયમિતપણે પૂજા કોણ કરશે? પિતા પ્રાર્થનાસમાળ્ય હોવાથી તેમનો મૂર્તિ પૂજલમાં વિશ્વાસ ન હતો. તેથી મૂર્તિપૂજનું કષ્ટ તે શું કામ ભોગવે? તેના મનમાં એવો પેચીદો પ્રશ્ન જન્મ્યો. તેમ હોવા છતાં પણ ‘મારે શિરડી જવું જેઠાએ’ એવું પિતાનું ઉત્સુક મન જેઠાને તે છોકરાએ પ્રેમપૂર્વક પિતાને જે વિનંતી કરી તે સાંભળો. ‘સાઈબાબાને નૈવેદ્ય ધરાવ્યા સિવાય ધરમાં કોઈપણ અન્નનો સ્વીકાર કરશે નહીં, એની ખાત્રી કર્યા સિવાય મારું શિરડી જવું શક્ય જ નથી.’ છોકરાના આવા નિત્ય વ્રતની પિતાને અગાઉથી ખબર હતી. તેથી તેઓ બોલ્યા, ‘તું જ હું નૈવેદ્ય દરરોજ ધરાવીશ. તે બાબતે તું નિશ્ચિત રહે. બાબાને નૈવેદ્ય ધર્યા વીના ધરમાં કોઈ પણ અન્નનો કોળિયો દેશે નહીં.’ આ મારું તને વચન છે. તેમાં તું જરા પણ શંકા રાખતો નહીં. હવે તું સ્વર્સ્થ મનથી જા. આવું આશ્વાસન મખ્યા પછી દીકરો માતાને સાથે લઈને શિરડી ગયો. બીજા દિવસે તર્ખડ બાબાની પૂજન કરવા લાગ્યા. (ઓ. ૬૬-૮૬)

બીજા દિવસની પૂજની શરૂઆત કરતા પહેલાં બાબાસાહેબ તર્ખડે સાઈબાબાની છબીને સાણંગ નમસ્કાર કરી પ્રાર્થના કરી, ‘મારો પુત્ર જેવી રીતે પૂજા કરતો હતો તેવી જ રીતે મને તમારી સેવાચાકારી કરવાનો મોકો આપો. ફક્ત શરીરની કવાયતની જરૂર નથી. મારા અંતઃકરણમાં પ્રેમનું અને ભક્તિનું જરણું ફૂટવા હો.’ પછી રોજ વહેલી સવારે બ્રહ્મમૂહૂર્તમાં સ્નાન કરીને તર્ખડ પ્રાર્થનાપૂર્વક પૂજા કરીને નૈવેદ્ય ધરાવતા. નૈવેદ્ય માટે બાબાસાહેબ દરરોજ ખડીસાકર અર્પણ કરતા હતા. આ પ્રથા રીત ધણા હિવસો સુધી ટકી રહ્યો. પરંતુ એક દિવસ માટે તે નિયમ તૂટ્યો. તર્ખડનું મન પોતાના વ્યવસાયમાં પરોવાયેલ હતું. એમને યાદ રહ્યું નહીં. તેથી તે દિવસે બાબાને નૈવેદ્ય ધરાવ્યા વગર જ ધરમાં બધાએ ભોજન કરી લીધું. તર્ખડ એક મોટી કાપડ વણવાની મીલમાં મોટા અધિકારી હતા. માટે એમને દરરોજ વહેલી સવારથી બહાર જવું પડતું. તે જ્યારે બપોરે જમવા માટે બેસતા ત્યારે સૌ પ્રથમ બાબાને ધરાવેલી ખડીસાકરનો પ્રસાદ મળતો. પરંતુ એક દિવસ તેનું વિસ્મરણ થતાં રસોઈયણ બાંધાએ નિયમ ગ્રમાણે પ્રસાદ આપ્યો નહીં. તેથી જાણે અન્ન શુદ્ધિ ન થઈ હોય તેમ લાગ્યું. આ કારણે તર્ખડ થાળી ઉપરથી ઉઠી ગયા અને સાઈબાબાની છબી પાસે જઈને નમસ્કાર કરીને તે

શ્રી સાઈનું સત્ય ચિત્ર

બોલ્યા કે બાબા તમે આ કેવી માયા બતાવી ? હું શા માટે આપને ભૂલી ગયો ? આ રીતે તો આપે મારી પાસે ભાવના વિનાની કવાયત જ કરાવીને ? બાબા ! આ મારી કેવળ ભૂલ નથી પણ મેં ઘોર પાપ કર્યું છે. માટે મને ક્ષમા આપો. મારા આ ફૃત્યનો મને ખૂબજ પસ્તાવો થાય છે. મારા નિર્લજપણાની મને ક્ષમા કરો. આમ કહીને તર્ફિ છબી સામે દંડવત્ત્ર પ્રણામ કર્યા. એમનું અંતઃકરણ હું: ખથી ભરાઈ આવ્યું, અને ફરીથી બોલ્યા, ‘હે દ્વાના સાગર, સાઈમહારાજ ! મારી ઉપર દ્વા કરો.’ આમ બોલીને ખૂબ લાચાર થઈને તર્ફિ પોતાના પુત્રને એક પત્ર લખ્યો કે, મારે હાથે એક મોટી ભૂલ થઈ છે તેથી સાઈબાબા મને ક્ષમા કરે એવી શ્રી સાઈબાબાને તું પ્રાર્થના કરને. બાબા પાસે અનન્યભાવે શરણે આવેલા ઉપર દ્વા કરવાની અને ભીખ માગવાની વાત કરવી અને સેવક ઉપર કૃપા કરવા માટે બાબા અભય વચન આપે તેમ મારી લેવું. આ પ્રસંગ બન્યો મુંબઈના વાંદરામાં અને ચારસો કી. મી. દૂર તે જ સમયે ખબર પહોંચી ગઈ. ત્યાં બાબાના મુખે જે ઉદ્ગાર નીકળ્યા તે સાંભળો અને દેશકાળની કોઈપણ સીમાઓથી અટક્યા સિવાય સાઈમહારાજ ત્રીકાળજાની હતા. તેનું પ્રત્યક્ષ પ્રમાણ જુઓ. પુત્ર શિરડીમાં હતો તે દિવસે સાઈબાબાને વંદન કરી જવાની તૈયારી કરતી વખતે જે ઘટના બની તે શ્રોતાઓ દ્વારાન દ્વારા દીકરાની પૂર્વક સાંભળે. પુત્ર જેવો ખૂબ આનંદ અને ઉલ્લાસથી મા સાથે બાબાના ચરણમાં નમસ્કાર કરતો હતો એટલામાં બાબા છોકરાની માને ઉદેશીને બોલ્યા તે સાંભળીને તેઓ ખૂબ ચકિત થઈ ગયા. ‘શું કું મા. રોજની જેમ હું આજે વાંદરા ગયો હતો, પણ ખાવા માટે કે પીવા માટે કાંજ પણ ન હતી. માટે ભૂખ્યા પેટે પાછું આવવું પડ્યું હતું. સ્નેહસબંધ કેવો છે તે જુઓ. દરવાને ભલેને બંધ હતો છતાંય હું સ્વેચ્છાએ પ્રવેશ્યો. મને કોણ રોકી શકે ? ઘરનો માલિક મખ્યો નહિં. મારા પેટની આંતરડી ખૂબ કકળી અને ભૂખ્યથી હેરાન થયેલો હું ભરખપોરે અન્ન સિવાય જ પાછો વલ્યો. બાબાના આવા શર્જદો જ્યારે તર્ફડના ચિરંલુલીએ સાંભળ્યા, એ તાબડતોબ સમજુ ગયો કે મારા પિતાથી હું ધારું છું ત્યાં સુધી બાબાને નૈવેદ્ય દરાવવાનું ભૂલી જવાયું છે. છોકરો બાબાને વિનંતી કરવા લાગ્યો કે, મને ઘરે પાછો જવા દી. પરંતુ બાબાએ તેને જવા દીધો નહીં. અને ત્યાં જ તેની પાસે જ પૂજન કરાવી. એ દિવસે શિરડીથી તેણે સંવિસ્તાર પત્ર લખ્યો જે વાંચતાં જ એના પિતાનું મન પીગળી ગયું. વાંદરાથી લખેલ પત્ર પણ શિરડી પહોંચ્યો અને છોકરાને આશ્વર્ય થયું. એની પણ આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. ‘જુઓ કેવો આ સાઈનો ખેલ ! પ્રેમથી હદ્ય ભરાઈ કેમ ના આવે ? એવો તો કોણ નિર્દ્ય માણસ હશે કે જેનું અંતઃકરણ આ સાંભળીને કકળે નહીં ?’ (અં. ૮૭-૧૧૪)

આ જ છોકરાની પ્રેમાળ માતા એક વખતે શિરડીમાં હતી ત્યારે સાઈબાબાએ એમના ઉપર કેવી કૃપા કરી હતી તે દ્વારાન દઈ સાંભળો. ત્યાંના બોજનાત્યમાં થાળીઓ પીરસાઈ અને જમવાની તૈયારીઓ ચાલતી હતી તે સમયે બપોરે એક ભૂખ્યું ફૂતરું આવીને ઉભું રહ્યું. પેટી બાઈએ થાળીમાં જે ભાખરી હતી તેમાંથી એક ચોથા ભાગનો ટુકડો તેને ખાવા માટે નાંખ્યો. એટલામાં જ કાદવ કીચડમાં ખરડાયેલું એક દુક્કર ભૂખ્યથી પીડાતું ત્યાં જ આવી પહોંચ્યું. આ વાત તદ્દન સ્વાભાવિકપણે અને સહજ રીતે ઘટી. પણ બાઈના દ્વારાનમાં તે આવ્યું નહીં. પરંતુ બાબાએ જતે જ બપોરે તે વાત કહીં. તે બહેન બપોરના જમણ બાદ દરરોજના નિયમ પ્રમાણે દૂર મસ્નિજદમાં આવીને જેવાં બેઠાં કે બાબાએ એમને સંભોધ્યાં, ‘મા ! આજે તેં મને જમાડચો, એના કારણે ગળા સુધી મારું પેટ ભરાઈ ગયું. આ પ્રાણ ભૂખને કારણે આકુળ વ્યકુળ થયેલો હતો. તેં એને તૃપ્ત કર્યો છે. તું હંમેશાં આમ કરતી રહેને. આ વાત હંમેશા કામમાં આવશે. મસ્નિજદમાં બેસીને હું કદી ખોટું બોલીશ તેવું કદી નહીં બને. આવી જ મારા ઉપર દ્વારા રાખને. ભૂખ્યાને રોટલો પહેલાં આપવો પછી જ આપણો વિચાર કરવો. મનથી આ વાતને ભરાબર દ્વારાનમાં રાખને.’ સાઈ સમર્થ શું બોલ્યા એનો સાચો અર્થ બાઈને કંઈ સમજયો

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

નહિ. તે મનમાં બોલી, ‘આ કહેવાનો ભાવાર્થ શું હોઈ શકે ? બાબાનું બોલવું નિરથી નથી હોતું.’ પછી તે બાઈએ દૂરથી મોટા અવાજે બાબાને કહ્યું, ‘બાબા ! હું તમને કેવી રીતે જમાડી શકું ? હું જ બીજને આધારે જીવું છું તેમજ પૈસા આપીને જે મળે છે તે ખાઉં છું.’ તે સાંભળી બાબાએ જવાબ આપ્યો, ‘તારી પ્રેમની ભાખરી ખાઈને હું તૃપ્ત થયો છું અને હજુ પણ તેના ઓડકાર મને આવે છે. તું જ્યારે જમવા માટે બેઠી હતી તે વખતે ભૂખથી વ્યાકુળ થયેલું જે ફૂતાંતું તારા દરવાજા પાસે અચાનક આવેલું હતું તેનો અને મારો આત્મા એક જ છે. અને તેવી જ રીતે કીચ્યાડથી ખરડાયેલું અને ભૂખથી વ્યાકુળ થયેલું દુક્કર જ તેં જેયેલું તે પણ મારી સાથે એકાત્મ થયેલી વસ્તુ છે.’ બાબાના બોલેલા આ શાઢ્યો સાંભળીને બાઈને આશ્વર્ય થયું અને મનમાં વિચાર કરવા લાગી, ‘આ ફૂતસા, દુક્કર, બિલાડાં વગેરે જે આમતેમ ફરતાં હોય છે એ બધા બાબા જ છે શું ?’ એના મનમા ઉદ્ભવેલા વિચારોની જાણે પુષ્ટિ કરતા હોય એમ બાબા બોલ્યા ‘ક્યારેક હું ફૂતરો, તો ક્યારેય હું સુષ્વર, કોઈ વાર હું ગાય તો કોઈવાર હું બિલાડી, ક્યારેક કીડી તો ક્યારેક માણી, તો કોઈવાર માંછલાં વગેરે રૂપ ધરીને હું જગતમાં બટકતો રહ્યું છું. સર્વ પ્રાણીઓમાં જે મને જુઓ છે તે જ મને પ્રિય છે તે ધ્યાનમાં રાખો, અને ભેદભાવની બુદ્ધિ છોડીને મારી ભક્તિ કરતા જાવ.’ બાબાના આ શાઢ્યો એટલે જાણે કે પરમ શ્રીષ્ટ અમૃતની ધારા હતી. તે સાંભળીને બાઈનું મન ભરાઈ આવ્યું. એની આંખો અશ્રુઓથી છલકાઈ ગઈ, અને કંઠ ઢંઘાઈ ગયો. (ઓ. ૧૧૫-૧૩૧)

તે બાઈની આવી બીજી પ્રેમરસની વાત અને સાઈબાબાની પોતાના ભક્તો સાથે જે એકાત્મતા હતી તેની એક સુંદર કથા છે. એક વખતે વાંદરાના પુરન્દરે નામના એક ભક્ત શિરડી જવા નીકળ્યા. તેમની સાથે તે બાઈએ પ્રેમપૂર્વક રીંગણાં મોકલ્યાં અને તેમના પત્નીને વિનંતી કરી કે એક રીંગણાનું ભરતું કરવું અને બીજા રીંગણાને ગોળ કાપીને અને તેમને તળીને બાબાને પેટ ભરીને જમાડવા. તે બાઈના કલ્યા પ્રમાણે પુરન્દરે તેનો સ્વીકાર કર્યો. તે શિરડી ગયા ત્યારબાદ આરતી પછી તરત જ બાબાના જમવાના પુરંદરેના પત્ની સમયે ભરતું બનાવીને લઈ ગયા. હંમેશા પ્રમાણે નેવેદ્ય ધરાવીને થાળી મૂકીને તે બહેન ચાલ્યા ગયાં. ત્યારબાદ બધાનું મોકલાવેલું નેવેદ્ય બેગુ કરીને બાબા જમવા માટે બેઠા. ભરતા ચાખતાં જ બાબાને એનો સ્વાદ મજનો લાગ્યો અને એને આગ્રહથી તે બધાને પીરસ્યું પછી એમના મનમાં રીંગણાના પૈતાં (ચકતાં) ખાવાનું મન થયું અને હવે તે લાંબો તેવું બોલ્યા. ભક્તોને શું કરવું એ સમજયું જ નહીં. તેઓએ રાધાકૃષ્ણબાઈને સંદેશો મોકલ્યો કે, બાબાને રીંગણાના પૈતાં ખાવાનું મન થયું છે, અને તેઓ બોજન કરતાં અટક્યા છે. રીંગણાની તો આ મોસમ જ નથી. તે હવે મળશે કેવી રીતે ? એટલે તરત જ પુરન્દરેના પત્નીની અને લાંબેલા ભરતની શોધ શરૂ થઈ. તમે થાળી લાંબેલા તેમાં ભરત હતું એટલે કદાચ બીજી સામગ્રી સાથે રીંગણાં પણ હોઈ શકે તેવું તેમને લાગ્યું. તેમની પાસે તપાસ કરતા બાબાના પૈતાં માંગવાનો ખરો અર્થ સમજયો અને બાબાને તેમને માટે કેટલો બધો પ્રેમ હતો તેની પણ જાણ થઈ. બાઈ બોલ્યા, ‘એક રીંગણનું ભરત થયું તે બપોરે બાબાને અર્પણ થયું પછી રીંગણાના પૈતાં કરીશ અને લઈ જઈશ માટે ચીર્યા.’ રીંગણાની વાત શરૂઆતથી આખર સુધી બધાને ધીમે ધીમે સમજમાં આવવા લાગી. સાઈબાબાની વ્યાપકતાની અને ત્યાં બની રહેલી સર્વ હકીકતો જાણવાની શક્તિ જેઠિને લોકોને આશ્વર્ય થયું. (ઓ. ૧૩૨-૧૪૩)

ફરી એકવાર ૧૯૧૫ના ડિસેમ્બર મહિનામાં તે જ સ્વીએ બાબાને ખૂબ પ્રેમથી એક પેંડો મોકલ્યો હતો. બાતરામ માનકર સ્વર્ગવાસી થયા બાદ એમનાં કિયાકર્મ વગેરે કરવા માટે એમના છોકરાને શિરડી જીવું હતું. માટે તે વાત તર્ફડને ત્યાં કહેવા માટે આવ્યો. તર્ફડના પત્નીનો તે છોકરા સાથે બાબા માટે કંઈક મોકલવાનું મન થયું. તેમને ધરમાં શોધતાં

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

પેંડા સિવાય બીજું કશું જ મળ્યું નહીં. તે પેંડો પણ પહેલાં દેવસ્થાનમાં નૈવેદ્ય તરીકે ધરાવેલો હતો. તે છોકરાને પાઇએ જવાની ઉતાવળ હતી. વળી તે છોકરો સૂતકવાળો હતો. તે પેંડો પણ એઠો જ હતો. પરંતુ બીજે કોઈ રસ્તો જ નહોતો. છેવેટે તે પેંડો એ બાઈએ બાબાને અર્પણ કરવા માટે તે છોકરા સાથે મોકલ્યો અને તે બોલી, ‘બીજું ધરમાં કંઈ નથી હમણાં આજ લઈ જ અને બાબાને પ્રેમથી આપને. તેઓ એને ખૂબ ભાવથી ખાશો.’ તે છોકરો ગોવિંદજી એ પેંડો લઈ ને ગયો. તે જ્યારે બાબાના દર્શને ગયો ત્યારે તે પેંડો તે જ્યાં ઉત્ત્યો હતો ત્યાં ભૂલી ગયો. પણ બાબાએ ધીરજ ધરી. તે ફરીથી પાછો ગીજ પહોરે સુભારે સાડાચાર વાગે બાબાના દરબારમાં પાછો આવ્યો ત્યારે પણ પહેલાની માફક જ ખાતી હાથે મસ્તિજ્ઞમાં પહોંચ્યો. તેથી બાબાએ તેને પૂછ્યું ‘મારા માટે તું શું લાભ્યો છે ?’ આવું કહીને આડકતરી રીતે એને પૂછી જેણું. તે સાંભળીને તેણે જવાબ આપ્યો ‘કંઈ નહીં’ જ્યારે તે એવું બોલ્યો ત્યારે બાબાએ તેને થોડી યાદ દેવડાવી. ‘તારી જેઠે મારે માટે કોઈએ કોઈ વસ્તુ મોકલાવી છે કે ?’ તેમ છતાં પણ તે છોકરાએ ‘ના’ પાડી. તેથી સાઈસમર્થે એને સ્પષ્ટ પ્રક્ષ કર્યો, ‘અરે, ધરમાંથી નીકળતા માએ તારી સાથે પ્રેમપૂર્વક ખાવાની કોઈ વસ્તુ નથી મોકલી ?’ ત્યારે એને યાદ આવ્યું કે તે હું કેવી રીતે ભૂલી ગયો ? તેમ વિચારીને તે શરમાઈ ગયો. તેણે નીચી ગરદન કરીને બાબાની ક્ષમા માગી અને ચરણ વંદન કરીને તે દોડતો દોડતો તેના રહેઠાણ ઉપર ગયો. અને પેંડો લાવીને બાબાને આપ્યો. હાથમાં પેંડો આવતાં જ બાબાએ મોઢામાં મૂકી સ્વીકારી લીધો. આ રીતે બાબાએ માની ભક્તિનું સમાધાન કર્યું. તે મહાનુભાવ જેવી જેના મનમાં ભાવના હોય તેને તેવા અનુભવ બતાવીને બાબા ભક્તોનું માન સંમાન વધારતા.

જુઓ અધ્યાય ઉમાં બાબાએ કહેલાં વચ્ચનો.

હરિ તો નિઃભક્તે કર્યો । સદા ભોગાનો તે ભૂષ્યો ।

પ્રેમ માટે સમૂળ વેચાયો । દાંબિકોથી સદા હુઠે ॥અ. ૩ ઓ. ૮॥

તેજ રીતે ગીતામાં અધ્યાય દમાં શ્રી કૃષ્ણ ભગવાનાં વચ્ચનો –

પત્રં પુષ્પં ફ્લં તોયં યો મે ભક્ત્યા પ્રથચ્છતિ ।

તદહું ભક્ત્યુપહતમશાભિ પ્રયતાત્મન: ॥૨૬॥

(જે કોઈ મને પાન, ફૂલ, ફળ અથવા તો પાણી પણ ભક્તિથી અર્પણ કરે છે, એવા શુદ્ધચિત્ત મનુષ્યની લેટોનો હું ખૂબ જ પ્રેમ અને આદરથી સ્વીકાર કરું છું.) આ કથાનું બીજું એક રહસ્ય એ કે, પ્રત્યેક લુલાત્મકમાં સહૈવ દ્યશ્વરને જ જેવા, તે સર્વ શાસ્ત્રોને માન્ય છે. અને તે જ પ્રસ્થાપિત થયેલ સત્ય સિદ્ધાંત છે. (જુઓ ગીતા અ. ૬)

યો માં પશ્યતિ સર્વત્ર સર્વ ચ મથિ પશ્યતિ ।

તસ્યાહું ન પ્રણશ્યાભિ સચમે ન પ્રણશ્યતિ ॥૩૦॥

જે મને સર્વ ડેકાણે અને સર્વ પ્રાણી માત્રમાં જુએ છે અને સર્વ પ્રાણીઓને મારામાં જુએ છે, તેવાને હું એનો નથી એવું કદી થતું નથી. અને મને પણ એ મારો નથી એવું કદી લાગતું નથી. (હું એનો અને એ મારો થાય છે.)

સર્વભૂતસ્થિતં યો માં ભજત્યેકત્વમાસ્થિત: ।

સર્વથા વર્તમાનોડપિ સ યોગી મથિ વર્તતે ॥૩૧॥

જે યોગી સર્વે પ્રાણીઓમાં રહેતા મને અભેદ બુદ્ધિથી ભજે છે, તે ગમે તેવી રીતે વર્તે છતાં પણ એ મારી પાસે જ રહે છે. (ઓ. ૧૪૪-૧૫૮)

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

આગળના અધ્યાયમાં બાબાની રહેણીકરણી તથા બાબા ક્યાં અને કેવી રીતે સૂતા હતા વગેરે વાતો સમજશે જે શ્રોતાઓએ ધ્યાન દ્વારા સાંભળવું હેઠાડે સાહે ચરણોમાં શરણું લીધું છે. શ્રોતાગણો કહેવાયેલી કથાનું મનથી અને સંતોષથી વારંવાર ચિંતન અને મનન કરવું, તેથી કલ્યાણ થશે. (ઓ. ૧૫૮-૧૬૦)

સર્વનું કલ્યાણ થાઓ. આ પ્રકારે સંત અને સજજનથી પ્રેરણા પામેલા ભક્ત હેમાડપંત રચિત

શ્રી સાઈસમર્થના ‘આજ્ઞા, અવજ્ઞા, વિધન, ભિક્ષાવૃત્તિ અને પંચપાતક આદિ પાતક-ક્ષાલન તથા

ભક્ત તર્ખડ કથા નિર્દ્ધારણ’ આ નામનો નવમો અધ્યાય અહીં સમાપ્ત થાય છે.

શ્રી સદ્ગુરુ સાઈનાથને અર્પણ.



અધ્યાય નવનું અર્થ વિવરણ.

આ અધ્યાયમાં વર્ણોના વર્ણો સુવી સાઈબાબાને ભીક્ષા માંગવાની ટેવ કેમ હતી તેનું વર્ણન કરીને હેમાડપંત કહે છે ખાંડણીમાં નાખી ખાંડવું અથવા છડવું, ચૂલો સળગાવવો તથા ઘંટીના પડોમાં ફળવું કે ઉદ્દુંભી એટલે કે પાણી ભરવું અથવા ગાળવું અને છાણનું લીંપણ કરવું આ પંચપાતકના નામથી પ્રસિદ્ધ એવા ગૃહસ્થાશ્રમના વ્યક્તિથી જણતાં અન્નાણતાં થયેલાં અને સમજ શકાય નહીં તેવા પાપોનું સવિસ્તર વર્ણન કરેલું છે. તથા એ પાપોનું નિરાકરણ કરવા માટે અને ચિત્તશુદ્ધિ માટે પંચમહાયજ્ઞો કરવા માટે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. એટલું જ નહિ પણ પંચયજ્ઞ કર્યા સિવાય ખાદ્યલું અન્ન નિષેધ હોવાનું કહેવામાં આવ્યું છે.

અમુક વાંચકો કેટલાક પ્રશ્નો જરૂર કરશે કે હાલમાં અમે ક્યાં ખાણિયામાં ખાંડીએ છીએ કે ઘંટીમાં ફળીએ છીએ ? અમે ગેસની સગડી વાપરતાં હોવાથી ચુલો સળગાવવાનું આવડતું જ નથી. પણ મહાનગરપાલિકાઓ દ્વારા તેનું શુદ્ધિકરણ કરીને નણ દ્વારા ધરાંગણે મળે છે. વાસણો ધરસવા માટે તો બજરમાં સરસ સફેદ પાવડર ! પછી જીવ હત્યાનો પ્રશ્ન જ ક્યાંથી આવ્યો ? માટે પંચયજ્ઞની જરૂર શી છે ? પંચયજ્ઞ માટેની આ પ્રકારની વિધિ તથા ખોટી કટકટ અને વિધિના સ્થાનોમાં માથાકૂટ અને ગીર્દી અમને ફાવશે ખરાં ? દેવોને અને પિતૃઓને અશ્રિમાં આહુતિ આપવાની હોય છે. પહેલાં તો ચુલો સળગતો હતો હવે તે ક્યાંથી લાવવો ? ગેસ સળગતી અતવા વિદ્યુત દ્વારા ચાલતી સગડી ઉપર અન્નની આહુતિ આપવાથી તો તે ઓલવાઈ જરૂર અને કાયમની બગડી જરૂર. જીવજંતુ અને પશુ પક્ષીઓ માટે ફ્લેટમાં રહેનારાઓ દ્વારા કઢેલા અન્નતો ગટરમાં જ જરૂર. તે રીતે ઉપરના માળમાં રહેતા લોકો બીજી અથવા ત્રીજી મજલો પાસે ઉપર ચઢીને પર

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

અથવા તો એની ઉપર માળે કે જેના દરવાજી કાયમ બંધ રહેતા હોય ત્યાં દરવાજે ઘંઠી વગાડી બિક્ષા માંગવા માટે આવવું ભક્ષકો માટે પણ શક્ય નહીં બને.

આ બધું સાચું હોવા છતાં આજનાં સમયમાં પણ ગૃહસ્થાશ્રમમાં જીવન જીવતા વ્યક્તિઓ જ્ઞાણતાં અજ્ઞાણતા પંચપાતક કરતી જ હોય છે. આપણે રસોડામાં અથવા તો રેફિલેરેટમાં થતા અસર્પ્ય વંદા અને જીવાણું વારંવાર બેગોન જેવી ઝેરી દવા દ્વારા વારંવાર હત્યા નથી કરતા ? તેવી જ રીતે માંકડ અને મચ્છર માટે ‘ટીફિલેન્ટી’ અને ઉંદરો માટે બીજી કોઈ પ્રભાવિત રસાણો વાપરીને એમનો પણ એકસરખો નાશ નથી કરતાં ? આ પાપો કંઈ ઓછાં છે ? આજના સમયમાં આપણે ભલે જ્ઞતે ખાંડણીમાં ધાન્ય ખાંડતા નથી અથવા તો ધંઠી વળે અનાજ દળતાં નથી. આપણે તો સ્વર્ચય કરેલું ધાન્ય જ વેચાતું લાવીએ છીએ તથા ધંઠીથી અનાજ દળાવીએ છીએ. હકીકતમાં જે કામ આપણે કરવાના હતા તેને બીજી પાસે કરાવીએ છીએ. તેમ છતાં શું તે કામ પોતાને માટે કરાવ્યું નથી ? શું આવા કામોમાં આપણે બીજાં કરેલાં પાપોના ભાગીદાર થતા નથી ?

આમ કાળજીમે પરિસ્થિતિમાં અને રહેણીકરણીમાં ફેર બદલ થયો હોવા છતાં અજ્ઞાણતાથી અથવા તો અનિવાર્ય પરિસ્થિતિને કારણે થયેલાં પાપોનું પ્રક્ષાલન તો કરવું જેઠાં તેવું વિચારીને પાપ પ્રક્ષાલનનું આચરણ થવું જેઠાં માટે ઉદ્ઘાસ્ત અર્થે, બ્રહ્મયજી એટલે શાસ્ત્રોનું વાંચન કરવું. દેવયજી, પિતૃયજી અથવા તો ભૂતયજી માટે અશ્રિમાં આહુતિ આપવી આજના સમયમાં ભલે શક્ય ન હોય પરંતુ દેવસ્થાનમાં ખડીસાકરણનું નૈવેદ્ય ધરવું. સ્વર્ગસ્થ માબાપને તેમની પુણ્યતિથિના હિંસે યાદ કરીને શ્રાદ્ધ કરવું તથા ગરીબ વ્યક્તિને અપ્રદાન, અને ફૂતરો, બિલાડી તથા પક્ષીઓને રોટલી કે ભાખરીના ટુકડા તો મુકી શકાય ને ? મનુષ્ય યજી એટલે અતિથિને બોજન કરાવવું. તેમની ગ્રત્યે આણગમો ન દર્શાવતાં આનંદ અને પ્રેમભી નાસ્તો કે જમણ કરાવીને તૃપ્ત કરવા તે મનુષ્ય યજી તરીકે ઓળખાય છે. સાઈ ભક્તોએ તો જ્ઞાણે ખુદ બાબા જ પોતે પદ્ધાર્યા હોય તેવું સમજુને તે મહેમાનનો આદર સત્કાર કર્યો. સાઈબાબા પોતે પણ બહેબાબાને અતિથિ સમજુને પંગતમાં જમાડચા વિના પોતે જમતા નહીં. હેમાદપંત કહે છે -

અતિથિ પૂજને ઈષ પ્રાપ્તિ । થાય તેથી અનિષ્ટ નિવૃત્તિ ।

તેમ ન કરતા વિધન નક્કી । આવે શિષ્ય તેથી પૂજે તેમને ॥૧૨૫॥

આ બધી વિધિઓની પાછળ મૂળની મૂળ ભાવનાને તત્ત્વ સાઈબાબાએ અધ્યાત્મ રઘમાં સ્વ. અન્નાસાહેબ દાભોળકરના પ્રસંગમાં સમજલવી છે. તેમણે અણણાની મશકરી કરીને ‘એકલું ખાવું સારું નહિ’, એમ જે ઉપદેશ કર્યો હતો. તેમાં સમજલવું છે કે આપણને દૈવ દ્વારા જે કંઈ પ્રાપ્ત થતું હોય છે તેમાંનો થોડો ભાગ પરમેશ્વરને અને માનવ, પશુ પક્ષીઓને વહેંચવો અને પછી જ જ્ઞતે ખાવો અથવા ભોગવવો તે સનાતન ધર્મની શિખામણ કહી છે. ઈશાવાસ્ય ઉપનિષદમાં કહ્યું છે કે

તેન ત્વક્તેન ભુગ્ણથા, મા ગૃધ: કસ્ય સ્વિદ્ધ ધનમ् ॥૧॥

પરમેશ્વર સદ્ગ્યાયે આપણી પાસે જ છે, તેની યાદ રાખીને તેણે આપેલા ભોગ માણસોએ મમતા અને આશક્તિનો ત્યાગ કરીને ભોગવવા. આ ધન અથવા તો ભોગ્ય વસ્તુ કોની છે ? અર્થાત્ કોઈની નથી. ગીતાના ગીતાન અધ્યાત્મમાં શ્રીકૃષ્ણ ભગવાને પણ એ જ કહ્યું છે.

યજ્ઞશિષ્ટાશિન: સન્તો મુચ્યન્તે સર્વ ડિલ્લિષે: ।

ભુગ્ણતે તે ત્વધં પાપા યે પચન્ત્યાત્મકારણાત् ॥૧૩॥

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

યજ્ઞ કરીને બચેલા કે બાકી વધેલા ભાગનું સેવન કરનારો સહગૃહસ્થ સર્વ પાપોથી મુક્ત થતો હોય છે. પરંતુ જેઓ કેવળ પોતાને માટે અન્ન રાંધે છે અને તેનું સેવન કરે છે તે મનુષ્યો પાપનું જ ભક્ષણ કરતા હોય છે.

સારાંશ કે અતિલોભ કરવો અથવા સ્વાર્થીપણે વર્તવું એ પાપ છે. આજના સમયમાં એનાં ઉદાહરણો આવાં હોઈ શકે.

- (૧) સંસારમાં પૈસા તો કમાવવા જ પડે. આજની વધતી મૌંધવારી અને ડ્રિપિયાનું સતત અવમૂલ્યન થતું હોવાને કારણે થોડા વધારે જ કમાવવા પડે પરંતુ તેનું કારણ કરોડો ડ્રિપિયા એકઠા કરવા અને તે મેળવવા માટે ગમે તે માર્ગ અપનાવવો.
- (૨) સામાન્ય માણસને રહેવા માટે વેચાતી જગ્યા પણ ખરીદાતી નથી જયારે આજે હજરોની સંઘ્યામાં ફ્લેટ્સ બંધાય છે. છતાં તે ખાતી પડી રહેલા ફ્લેટ્સ ધનવાન લોકોએ જરૂર ઉપરાંત ચાર પાંચ ફ્લેટો પૈસાના રોકાણ માટે ખરીદીને ખાલી રાખ્યા છે.
- (૩) પેટ્રોલ, આધતેલ અને ખાંડની બજારમાં તંગી થઈ જવાની અફ્લાવા જણાતાં, તે વસ્તુઓનો કંઈક વધારે સંગ્રહ કરાય તો ચાલે. પરંતુ પૈસા છે માટે પોતાની પાસે એનો વિપુલ જથ્થો એકઠો કરીને સાધારણ પ્રજને બેહાલ કરવી.
- (૪) બસ અથવા તો આગગાડીમાં કતાર છોડીને અન્ય દરવાજે ધૂસ મારવી.

આજ સમયમાં બનતા આવા ઘણાં ઉદાહરણો પૂરાં પાડી શકાય ! આ સર્વ માણસો ગીતાના ત્રીજ અધ્યાયના લોક ૧૨માં કહ્યા પ્રમાણેના ચોર નહિ તો બીજ કોણ ? સ્તેન એવ સા:

અંતમાં એટલું જરૂર કહેવાનું કે, ઉપર નિર્દેશલા પંચયજ્ઞ કદાચ કરતાં ફાય્યું નહી તેમ છતાં ઉપર જણાવેલું મુખ્ય તત્ત્વ સમજ લઈને એ પ્રમાણેનો આપણો વ્યવહાર જે રાખવામાં આવે તો પોતાનું કલ્યાણ થશે. મુખ્ય તો એ કે મનને સંપૂર્ણ શાંતિ મળશે.



॥ અદ્યાય ૧૦ ॥

શ્રી સાઈ સમર્થ મહિમા

(શ્રી સાઈ બધુંજ કરી શકે તેવા ‘કર્તુમ’ જેમને અશક્ય લાગે છે તેવા સામાન્યજનો દ્વારા જે ન થઈ શકે તેને કરવાનું તેવું સામર્થ્ય ધરાવનારા ‘અકર્તુમ’ તથા જે હૃદાત હોય પરંતુ તેને જરૂર પડ્યે બદલી શકે કે ફેરવી શકે તેવા સામર્થ્યવાળા બાબાનું મહાત્મ્ય.)

શ્રી ગણેશજીને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કુળદેવતાને વંદન,
શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રજીને વંદન અને શ્રી સદગુરુ સાઈનાથ મહારાજને વંદન.

જે સર્વ લોકોના કલ્યાણ માટે અને હિત ખાતર બંધાયેલો છે અને જે સદાય પરમાત્માની સાથે ભ્રાહ્મ સ્થિતિમાં એકદ્વારા થયેલો છે તેનું ભક્તિપૂર્ણ મનથી સદાય સતત સ્મરણ કરો. જેના સ્મરણમાત્રથી જન્મ અને મરણના ગુંચવાડાઓ ઉંઠલાઈ જય છે તે આ સાધનાનું ઉત્તમ સાધન છે. તેને માટે એક કોઈનોય ખર્ચ કરવો પડતો નથી. અલ્પ પ્રયત્નોથી જ પૂર્ણ લાભ સહજ રીતે મળી જતો હોય છે. જ્યાં લગી આ ઈન્દ્રિયોનો સમૂહ સુદૃઢ છે ત્યાં સુધી પ્રત્યેક ક્ષણનો સદ્ગુરુયોગ કરી લેવો. બીજા બધા દેવ માયાવી છે અને ખાત્રીલાયક નથી. ગુરુ આ એક જ શાશ્વત દેવ છે. એનાં ચરણમાં વિશ્વાસ મૂકો એટલે દૈવીયોગથી આવનારા સંકટોને પણ તે રોકી રાખે છે. જ્યાં સદગુરુની ઉત્તમ પ્રકારની સેવા હોય છે, ત્યાં સંસારનાં દુઃખોનો જહમૂળથી નાશ થાય છે. ન્યાય, મીમાંસા વગેરેની વ્યર્થ માથાકૂટ કે ખટપટમાં પડવું પડતું નથી. સદગુરુ જે નાવિક હોય તો ભાવિક ભક્તો આધિભૌતિક, આદ્યાત્મિક અને આધિદૈવિક ત્રણ પ્રકારનાં દુઃખોથી સહેલાઈથી પાર ઉત્તરી જવાય છે. વ્યવહારકૃપી સાગર પાર કરવા માટે જે વિશ્વાસ નૌકા અને નાવિક ઉપર મૂકવામાં આવે છે તેવો જ વિશ્વાસ સંસારકૃપી સાગર તરી જવા માટે પોતાના સદગુરુ ઉપર મૂકવો. એટલે તે પોતાના ભક્તોની ભાવના અને ભક્તિ જોઈને પૂર્ણજ્ઞાનની સમજ આસાન કરી આપે છે અને શુદ્ધ આનંદ સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ સરળતાથી આપે છે. જેમના દર્શનથી હૃદયગ્રંથિઓ તૂટે છે તથા બધી વિષય વાસનાઓથી તે મનુષ્ય પાછો હેઠ છે અને પૂર્વજન્મનાં પાપ અને પુણ્યનાં કર્માનો સંગ્રહ તથા આવતા જન્મનાં ભોગવવા પડનારાં સુખ દુઃખદુઃખી ફળોનાં કારણે હાતના જન્મનાં સારાનરસાં ફૂંઝોનો કંબે કંબે ક્ષય થાય છે. તેના પ્રભાવનું વર્ણન કરીએ. (ઓ. ૧-૬)

આઈમા અદ્યાયમાં નરજન્મનું પ્રયોજન, બાયજનબાઈની ભાજી તથા ભાજરી, તથા ખુશાલચંદ વિષે બાબા દ્વારા તેમના સમાચારની પૂછપરછ, મહાણસાપત્ર અને તાત્યા કોતેનો ભસ્ત્રદમાં સુવાનો પ્રકાર જેવા કર્ણપ્રિય વર્ણનો થયાં. નવમાં અદ્યાયમાં બાબાની ન સમજન્ય એવી ગહન ભિક્ષા માંગવાની વૃત્તિનું રહસ્ય સાંભળવા મળ્યું. હવે શ્રોતાઓ બાબાની રહેણીકરણી, તેમની સુવાની રીત અને તેમનું ગમે ત્યારે અને ગમે તે જગ્યાએ ભટકવું વગેરે વિષયો દર્શાવતું તેમનું ચરિત્ર ધ્યાન દઈને શ્રવણ કરીએ. બાબાના લોકવ્યવહારમાંનો જીવનનો કાલક્રમ કેટલો પ્રશંસનીય હતો? હિન્દુ અને મુસલમાન આ બંને માટે તેઓ એક માતા સમાન હતા. જાણે કે દરેક પ્રશ્નોના નિરાકરણનું અને વિશ્વાસનું તે એક જ સ્થાન

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

હતું. હિન્દુ અને મુસલમાન તેમની સામે એક બીજી જોડે પ્રેમથી વર્તતા અને કોઈ પણ જતની શાંકા કુરંકા વગર ખેલદિલથી બાબા સાથે હરતા ફરતા. (ઓ. ૧૦-૧૩)

આ તો એક સાધારણ વાત થઈ. હવે સાઈની રહેણીકરણી કેવી હતી. અને તે ક્યાં અને કઈ જગ્યાએ સૂતા હતા, તે વિષે શ્રોતાઓ આદરપૂર્વક સાંભળે. ચાર હાથ લાંબું અને એક વહેંત પહોળું એવું લાકડાનું પાટિયાના બંને બાજુના છેડાને તેની બંને બાજુઓના છેડાને કપડાની ચીંદીઓથી બાંધિને ઉપર મોખ પાસે હિંચકાની જેમ ટાંગેલું હતું. બાબા તે લાકડાના પાટિયા ઉપર સુઈ જતા હતા. તેમના માથા તરફ અને પગ તરફ દીવાઓ પ્રગટાવેલા હોવા છતાં તે પાટિયા ઉપર કયારે ચઢતા અને કયારે ઉત્તરતા તે કોઈના ધ્યાનમાં આવતું નહીં. બાબા ડોક વાંકી કરીને ઉપર બેસતા અથવા સુતેલા હોય તેમ નજરે ચઢતા. તેમ છતાં તેઓ કયારે ઉપર ચઢતા કે ઉત્તરતા એની કોઈને પગ ખબર પહતી નહીં. સાવ જર્જરિત ચીંદીઓથી બાંધેલું લાકડાનું પાટિયું બાબાનું વજન કેવી રીતે વેઠતું હશે? અરે! મહાસિદ્ધિ જે યોગ દ્વારા પ્રાપ્ત થાય છે તે સિદ્ધિઓ આઠ પ્રકારની યોગ સિદ્ધિઓ જ હોય છે. અણિમા, મહિમા, ગરિમા, લઘિમાં, પ્રાણિ, પ્રાકાભ્ય, ઈશિત્વ અને વશિત્વ પામેલા મહાસિદ્ધિ તેમને લાકડાનું પાટિયું એ તો ફક્ત નામનો જ આધાર ગણાય છે. આંખમાં જ્યારે નાનો અમસ્તો કણ પણ ખુંચે છે પરંતુ ‘અણિમા’ દ્વારા આણુની જેમ નાના થઈ જવાની સિદ્ધિને કારણે ગમે ત્યાં છુપાઈ શકે છે. બાબા પણ માણી, નાના કીડાઓ અને કીડાઓના ઝયમાં સતત ફરતા રહેતા. અણિમાની સિદ્ધિ જેના ધરની દાસી હોય, તેમને માણીનું ઝય ધારણ કરતાં કેટલીવાર લાગે? જે આકાશમાં પણ કોઈપણ પ્રકારના આધાર સિવાય અદ્વાર રહી શકતા હોય, તેને વળી લાકડાના પાટિયાનું શું મહત્વ? અણિમા, મહિમા, લઘિમાં ઈત્યાદિ આઠ સિદ્ધિઓ અને કુબેરના મહાપદમાં પદ્મ શંખ ઈત્યાદિ નવ ખલના નવનિધિ જેની સામે જોડીને શિસ્તબદ્ધ ઊભા હોય તેમને માટે લાકડાનું પાટિયું એ તો એક નિમિત્ત નહીંકે! (ઓ. ૧૪-૨૧)

બાબા નાનું મગતું, કીડી કે દૂક્કર, ફૂતું, પણ, પક્ષી અથવા તો રાજી હોય કે રંક કે કોઈ મોટો હોય કે સાવ નાનો હોય પરંતુ બાબા તેમને સમાન દશ્ઠિથી જેતા. સાઈનાથ મહારાજ ભલેને શિરડીમાં રહેતા હતા અને એમની તેમની પાસે ફક્ત સાદાત્રણ હાથની શરીરની મિલકત હતી છતાં તે અત્યંત શુદ્ધ અને પવિત્ર હતા અને સહુના હૃદયમાં વાસ કરનારા હતા. અંતરમનથી ભલેને તેઓ કોઈની સોબત અને સંબંધ વગરના હતા તથા નિર્વિકાર અને સંસારથી અલિપ્ત હતા છતાં બહારથી તેમને લોકોને ભેગા કરીને ઉત્તમ માર્ગ પર લાવવાની જબરી હોંશ હતી. અંદરથી તેઓ ભલે સર્વ ઈચ્છાઓ તૈજસા હતા, તો છતાં બહારથી તેમને ભક્તોનો બહુ મોહપારા હતો. આંતરિક રીતે ભલે અત્યંત નિષ્કામ હતા. પણ બહારથી તેઓ ભક્તો માટે અત્યંત સકામ વૃત્તિના લાગતા હતા. અંદરથી ભલે તેઓ આત્મશાંતિના આશ્રયસ્થાન જેવા હતા પરંતુ બહારથી તેઓ ખૂબ દુઃખી દેખાતા હતા. તેમની અંદરથી પરબ્રહ્મ સ્થિતિ હતી છતાં બહારથી તમસ પ્રકૃતિવાળા સ્વભાવ બતાવતા. અંદરથી અદ્વૈત ઉપર પ્રેમ કરનારા અને કશામાં આશકત નહીં, છતાં પણ બહારથી આખા વિશ્વના પ્રક્ષોના ઉકલો લાવવા માટે રચ્યાપચ્યા રહેતા. તે કયારેક પ્રેમભાવથી જેતા તો વળી કદીક હાથમાં પથ્થર લઈને મારવા દોડતા. સાઈ કોઈકવાર ગાળો અને શ્રાપ હેતા તો કોઈકવાર આનંદથી મીઠો માર ફટકારતા. તેઓ અમુક વખતે શાંત અને મોનવિકાર પર કાબૂ મેળવેલા અને વિષયોથી નિવૃત્ત તેમજ સહનશીલ દેખાતા. વળી તેઓ સદાય સમાધિસ્થ આત્માનંદમાં ભન્ન અને ભક્તો પર પ્રસાદ દશ્ઠિવાળા જણાતા. એક જ બેઠક પર તેઓ સદા તલ્લીન થયેલા દેખાતા તથા એમને કયાંય આવવું જવું પડતું નહીં. સટકો એ જ જાણો કે એમનો સંન્યાસીની જેમ હાથને દંડ હતો. તેમની ખાવાપીવાની જીવનશૈલી

શ્રી સાઈનું સત્ય ચારિત્ર

કાળજી રહિત હતી. તેમને કીર્તિની કે ધનની કોઈ પણ લાલસા ન હતી. પ્રાણ રક્ષા કરવા માટે બિક્ષા માંગતા હતા. તથા આસનો અને પ્રાણાયમોની સાધનાનો ચિત્તવૃત્તિથી વિરોધ કરીને સમય પસાર કરતા હતા. તેમનો પોષાક અસલમાં એક સંન્યાસી જેવો હતો, હાથમાંનો સટકો એ સંન્યાસનો દંડ હતો. ‘અલ્લા માલિક – પરમેશ્વર બધાનો સ્વામી છે’ તે વાક્ય તેઓ અવારનવાર બોલતા હતા. ભક્તો ઉપર તેમને સંપૂર્ણ પ્રેમ હતો. શ્રી સાઈબાબાની આવી મનુષ્યની જેમ જણાતી સગુણમૂર્તિ તેમની અભિવ્યક્તિ અને સંપત્તિઝે આપણને પૂર્વે કરેલાં પુણ્યોના હિસાબે હાથમાં આવી હતી. તેમને જે લોકો મનુષ્યઝે સમજે છે, તે બધા કમનીસબ અને જઈ બુદ્ધિના છે. તેમની દૈવી ગતિ જ વિચિત્ર છે એમ કહેવાય. એવાઓને સાઈબાબાના આ ભાગ્યમાં પ્રાપ્તિ કેવી રીતે થાય ? સાઈબાબા આત્મજ્ઞાનની ખાણ છે, એમનું શરીર પૂર્ણ આનંદથી ભરેલું છે, ભવસાગર પાર કરવા માટે તેમનો આશ્રય તરત જ લઈ લો. ખરેખર તો જે અપાર અને અનંત છે, બ્રહ્મથી માંડીને, તે નાનામાં નાના જાંખરામાં ભરેલો છે, તેવા તે નિરંતર અખંડ અને અભિજ્ઞ પરબ્રહ્મ સ્વરૂપ સાક્ષાત મૂર્તિમંત બાબા પોતે જ છે. (ઓ. ૨૨-૩૫)

કલિયુગની કાળઅવધિ ચાર લાખ અને બત્તીસ હજાર વર્ષની છે. તે રીતે જેઠાં તો કળીયુગના પાંચ હજાર વર્ષ વીત્યા પછી બાબાનો આ પૃથ્વી ઉપર અવતાર થયો. અહિં શ્રોતાઓને શંકા થાય કે બાબાની જન્મતિથિની ખબર ન હોવા છતાં આ વર્ષો કેવી રીતે નક્કી કર્યા ? તો ધ્યાન દઈને સાંભળો કે બાબાએ શિરડી ક્ષેત્રમાં નિવાસ કર્યો તે પછી નિર્વાણ સુધી ત્યાં રહેવાનો સંકલ્પ કર્યો અને સાઈઠ વર્ષ સુધી ક્ષેત્ર સંન્યાસ વૃત્તિથી તેઓ ત્યાં રહ્યા. ક્ષેત્ર સંન્યાસ વૃત્તિ એટલે કોઈ એક પુણ્યક્ષેત્રમાં રહીને તે ક્ષેત્રને મરતાં સુધી ન છોડવું તેવા લીધેલા નિયમને ક્ષેત્ર સંન્યાસવૃત્તિ કહેવામાં આવે છે. આરંભમાં તેઓ સોળ વર્ષની વર્ષે શિરડીમાં પ્રગટ થયા તે વખતે ત્યાં તેઓ ત્રણ વર્ષ સુધી રહ્યા. ત્યારબાદ તેઓ ત્યાંથી અચાનક અદશ્ય થયા અને દૂર નિઝામના રાજ્યમાં વસ્યા તેવી જાણકારી મળે છે. તે સમયે ઔરંગાબાદ, બીડ, નાંદીદ, ઉસ્માનાબાદ અને પરબાણી આ મરાઠાવાડાના જિલ્લાઓ નિઝામના રાજ્યમાં હતા. તે સમય ભારતની સ્વતંત્રતા પહેલાનો હતો. તે પછી બાબા લગ્નની જન સાથે પાછા આવ્યા. ત્યારબાદ શિરડીમાં કાયમનો વસવાટ કર્યો. એ વખતે એમની ઉંમર ૨૦ વર્ષની હતી એમ કહી શકાય. ત્યારબાદ તેઓએ સાઈઠ વર્ષ સુધી અખંડ નિવાસ કર્યો તે વિષે સૌ કોઈ જાણે છે. શકે ૧૮૪૦ આસો સુદુર દશામ, ૧૫ ઓક્ટોબર ૧૯૧૮ના દશેરાના દિવસે શુભ મુહૂર્તમાં બાબા નિર્વાણ પામ્યા. આ પ્રમાણે બાબાનું આયુષ્ય ૮૦ વર્ષનું હતું. માટે એમનો જન્મ શકે ૧૭૬૦, ધ.સ. ૧૮૮૮માં થયો હોવો જેઠાં એવો અંદાજ સાધારણ રીતે બાંધી શકાય. (ઓ. ૩૬-૪૩)

કાળને માથે પગ મૂકીને ઊભા રહેનારા મહાત્માની આયુષ્ય મર્યાદા કદી કોઈનાથી નક્કી થઈ શકે ખરી ? આ કાર્ય સિદ્ધ કરવું ખૂબ જ અધરું છે. મહાત્માઓ સદાય પોતાને ડેકાણે સ્વસ્થતા પૂર્વક વાસ કરતા હોય છે. એમને જન્મ કે મરણ હોતું નથી. સૂર્યને વળી ઊગવું શું અને આથમવું શું ? તેઓ પોતાની જગ્યાનેથી કદી ચલિત થતા નથી. તેઓ તો સદા સ્વસ્થ રહે છે. શકે ૧૦૬૩ એટલે કે ધ.સ. ૧૬૮૧ની સાલમાં સમર્થ રામદાસ સ્વામીએ સમાધિ લીધી. એ પછી પૂરાં બસો વર્ષ વહી ગયા. ત્યારબાદ ધ.સ. ૧૮૮૮ની સાલમાં સાઈબાબાનો જન્મ થયો. ભારતવર્ષ પર મુસ્લિમાનોનાં આકમણ થતા રહેતા હોવાથી હિન્દુ રાજ્યો હાર્યા. ભક્તિમાર્ગ લગભગ લુપ્ત થઈ ગયો. તેમજ લોકો ધર્મને ભુલી ગયા. તે અરસામાં સ્વામી રામદાસનો જન્મ થયો. તેમણે શિવાળ મહારાજ દ્વારા મુસ્લિમાનોથી થતી કન્ડગત અને હેરાનગતી મીટાવવા માટે ગાય અને બ્રહ્મણોનું સંરક્ષણ કરાવ્યું. ત્યારબાદ પૂરાં બસો વર્ષ પણ વિત્યાં ન હોતા અને તેમણે વ્યવસ્થિત કરેલી સ્થિતિ ફરી

શ્રી સાઈનું સત્ય ચારિત્ર

વાર બગડી અને હિન્દુ મુસલમાનો વચ્ચે મતભેદો સર્જયા. જેનું નિરાકરણ બાબાએ કર્યું. તેઓ કહેતા ‘રામ’ અને રહીમ બંને એક જ છે. તેમાં જરા સરખો પણ ફરક નથી. તો પછી તેમના ભક્તોએ શા માટે જીદ કરવી અને એકબીજા સાથે પારકાપણા રાખીને વર્તાવું? તમે લોકો કેટલા મૂર્ખ છો? હિન્દુ મસુલમાનોમાં સંબંધ જોડો, સારા વિચારો મનમાં દ્રદ કરો, તો જ સામે કિનારે પહોંચાશો. વાદવિવાદ છોડી દો. તે સારો નથી. કોઈની સરખામણીની ઝટપટમાં ન પડતાં, સહાય પોતાના કલ્યાણનો વિચાર કરવો, એટલે શ્રી હરિ તમારું રક્ષણ કરશો. યોગ, યજા, તપ, જ્ઞાન એ સર્વે હરિને પ્રાપ્ત કરવાનાં સાધનો હાથમાં હોવા છતાં જેના હદ્યમાં જ હરિ ભક્તિ નથી તેનું જીવન વ્યર્થ છે. જે કોઈએ તમારી ઉપર અપકાર કર્યો હોય તેમ છતાં આપણે તેનો પ્રતિકાર કરવો નહીં. અને જો કરવો પડે તો તેની ઉપર ઉપકાર કરવો અથવા તો તેનું કલ્યાણ કરવું.’ બાબાના ઉપદેશનો આ પ્રકારનો સાર હતો. ઊંચ, નીચ, સ્ત્રી, શૂદ્ર અને સર્વને માટે સાદો ને સરળ સ્વાર્થ અને તેવી જ રીતે પરમાર્થ માટે અત્યંત કલ્યાણકારી સીધો માર્ગ છે. (ઓ. ૪૪-૫૫)

સ્વભનમાં રાજવૈભવમાંથી જગ્યા બાદ જેમ બધુ વ્યર્થ ભાસે છે તેવો જ આ સંસાર સાવ ખોટો છે, તેવી બાબાની માન્યતા હતી. દેહના સુખ અને દુઃખ સાચા નથી હોતાં તેવી સંસારની વાસ્તવિકતાની બાબાને જણા હતી. આત્માનુસંધાન કરીને એકચિત્તે સ્વભનનો ભ્રમ તોડીને તેમણે મોક્ષ સિદ્ધિ મેળવી હતી. શિષ્યોનું તથા ભક્તોનું સંસાર અને દેહનું ભરત્વ જોઈને તેમનું મન વ્યાકુળ રહેતું હતું. આવા ભક્તોનો દેહભાવ કેવી રીતે છૂટે તેની ચિંતા તેમને સતત રહેતી હતી. હું જ બ્રહ્મ છું એવી મનની ભાવના, અખંડ આનંદમાં રહેવાનો સ્વભાવ અને કોઈપણ જાતની આશા-આકંશા વગરની મનની સ્થિતિ તેમને પ્રાપ્ત હતી જ. હાથમાં જાંઝરી અને વીણા લઈને ઘરેઘરે ભટકવું અને નિઃસહાય થઈને દ્વારાનુક હાલતમાં આવતાં જતાં માણસો પાસે હાથ ફેલાવીને કંઈક મેળવવાની તેમને જરાય ખબર નહીં. (ઓ. ૫૬-૬૦)

એવા ગુરુઓ તો પુષ્કળ મળે છે જેઓ મનુષ્યોને પકડી લાવીને શિષ્યો બનાવતા હોય છે. તેમજ પૈસા પડાવીને બળજબરીથી માણસોના કાનમાં મંત્ર ફૂંકતા હોય છે. તેઓ શિષ્યોને ધર્મ પ્રમાણે વર્તવાનું શીખવે છે પરંતુ પોતે તો અધર્મનું જ આચરણ કરતા હોય છે. આવા ગુરુઓના કારણે સંસાર સાગર પાર કરવો અને જન્મમરણથી તરવાનું અશક્ય છે. આ સાઈભૂર્તિ પોતાના ધાર્મિકપણાની પ્રસિદ્ધિ થાય અને જગતમાં આપણો ઝડો ફરકતો રહે એવું જરા પણ માનતી નહીં. જ્યાં પોતાના અભિમાનને માટે જગ્યા જ ન હતી તથા જ્યાં શિષ્યો ઉપર અત્યંત પ્રેમની જ વૃત્તિ હોય તેવી સાઈ-માઉલી હતી. ગુરુના બે પ્રકાર છે. કાયમના અને તત્પુરતા એટલે કે નિયત અને અનિયત. તેમનું નિશ્ચિત કાર્ય હું શ્રોતાઓને સપણ કરીને કદી રહ્યો છું. સોળમાં અધ્યાયમાં દશાખ્લિલી દૈવી સંપત્તિ, સાત્ત્વિક વૃત્તિ, દ્વા, દાન, સત્ય, શાંતિ ઇત્યાદિ ગુણોનો સમૂહ પરિપક્વ કરીને અને અંતઃકરણ શુદ્ધ કરીને તેને મોક્ષ માર્ગે લઈ જવું. તેટલી જ અનિયત ગુરુની દેણ હોય છે. નિયત એટલે કે કાયમના ગુરુ સાથેનો સંબંધ જોડાય તો દૈતભાવ જતો રહે અને એકય ભાવ જગૃત થાય છે. ત્યારબાદ ‘તત્ત્વમસિ’ એટલે કે તત્ત્વ + ત્વં + અસિ એટલે બ્રહ્મ અને પરમાત્મા તું જ છે. ગુરુ સામવેદના મહાવાક્યનો અનુભવ કરાવે છે. આ પ્રકારના ગુરુ સકળવિશ્વમાં નિર્ગુણકૃપે સ્થિત હોય છે. તેઓ ભક્તોના કલ્યાણ માટે દેહ ધારણ કરતા હોય છે અને પોતાનું અવતાર કાર્ય પૂરું થતાં પાછા ચાલ્યા જલ્ય છે. શ્રી સાઈબાબા આ બીજી કોટિના ગુરુ છે. તેઓ મને જેવી બુદ્ધિ આપણે એ જ પ્રમાણે મારું આ લખાણ હશે. જગતમાં પ્રચલિત થયેલા વ્યવહારિક વિદ્યાના અનેક ગુરુઓ હોય છે. આત્મસ્વરક્રમનું જે ભાન કરાવે છે તે જ સાચો સમર્થ સદ્ગુરુ ભવસાગર પાર કરાવે છે. તેવા સમર્થ સદ્ગુરુનો મહિમા સાધારણ રીતે ન સમજ્ય એવો હોય છે. (ઓ. ૬૧-૭૦)

શ્રી સાઈનું સત્ય ચારિત્ર

જે કોઈ પણ દર્શન કરવા જતાં એના ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળનાં સંપૂર્ણ રહેસ્થો તેની સાબિતી સહિત તે વ્યક્તિઓને પૂછ્યા વિના સાથી કહી દેતા. તેઓ બધે જ ડેકાઝે સર્વ પ્રાણીઓમાં તે જ બ્રહ્મભાવને જોતા હતા. શત્રુ અને મિત્રમાં તેમને કોઈ ફરક ન હતો. બેદભાવની તેમને જરાયે ખબર ન હતી. તેમને કોઈપણ પ્રકારની અપેક્ષા ન હતી. તેઓ સૌનૈ સમાન દશ્થી જોતા હતા. તેમની ઉપર અપકાર કરનારાઓ પર પણ તેઓ અમૃતની વર્ષા કરતા હતા. ઉત્કર્ષ હોય કે અપકર્ષ હોય પરંતુ તેઓ સમચિત અને શાંત હોવાથી તેમને વિકલ્પો કદી સ્પર્શી શકતા નહીં. નાશવંત દેહમાં વર્તતો હોવા છતાં શરીરના અથવા તો ધરભારના મોહમાં જે પડતો નથી અને બહારથી દેહઢ્પી દેખાતો હોવા છતાં અંદરથી જે વિદેહી છે, તે જ આ શરીરથી મુક્ત અને મોક્ષ માર્ગે ગયેલો નહીં કહેવાય કે? (ઓ. ૭૧-૭૫)

ધન્ય છે શિરડીની પ્રજા. સાથી જ એમના પૂજય દેવ હતા. ખાતાં પીતાં અને સૂતાં તેઓને સાઈનું જ ચિંતન રહેતું. તેમનો પ્રેમ ધન્ય ધન્ય છે. તેઓ ધાન્યની ખળીમાં કે ધરની પરસાળમાં કામ કરતાં કે દળણું દળતાં અથવા ધાન્ય ખાંડતાં કે માટીના વાસણમાં રવાઈ વડે માખણ મેળવવા માટે દહીં વલોવતી વેળા બાબાનો જ મહિમા ગાતા હતા. ઉઠતાં બેસતા અને સૂતાં તેઓ બાબાના નામનો અખંડ જ્યપ કરતા. તેમને બાબા સિવાય બીજે કોઈ દેવ યાદ જ ન આવ્યો. શિરડીમાંની જીઓનો પણ પ્રેમ કેટલો? તે પ્રેમનું માધુર્ય પણ કેટલું? શુદ્ધ પ્રેમ જ કાવ્ય રચી શકે છે, કેવળ વિદ્ધતા નહિ. રતીભારની વિદ્યા કે શિક્ષણ વિના જ્યાં ફક્ત સાહી અને સરળ ભાષા જ છે તેમના દ્વારા કવિત્વ ચમકે છે અને ચતુરાઈ મનુષ્યની ગરદન ડોલાવે છે. અર્થાત્ વખાણ કરે છે. ખરા પ્રેમના અવિષ્કારને જ ખરું કાવ્ય કહેવાય છે. તે શ્રોતાઓએ બાબાના શબ્દોમાંથી શોધી લેવું. સાઈબાબાની દૃચ્છા હશે તો જ આ કવિતાનો પૂર્ણ સંગ્રહ બેગો થશે અને તેનો અધ્યાય બની શ્રોતાઓની એ કવિતા સાંભળવાની દૃચ્છા પૂર્ણ થશે. (ઓ. ૭૬-૮૧)

શ્રી બાબા મૂળમાં નિરાકાર હોવા છતાં ભક્તો ઉપર કૃપા કરવા માટે જ સાઈના રૂપે પ્રગટ થયા. તેમને ઓળખવા માટે દેહનો અહંકાર પહેલાં ત્યજવો જોઈએ. અને મનની કામ, કોધ જેવી વૃત્તિઓ અને વિકારો બિલકુલ નહિવત્ત થવા જોઈએ. તે સાથે ભક્તિ વધવી જોઈએ. ભક્તોનો પુણ્યકાળ ફળતાં અને તેમનો પ્રાપ્તકાળ બેગા થતા તે સાઈરૂપે પરિપૂર્ણ અંકુર રૂપે શિરડીમાં ફલિત થયો છે. જેનું વર્ણન કરવાનું ફાવતું નથી. સાઈનું વર્ણન કરવા માટે વાચા ફૂટી તેવા જનને હવે પદી જન્મ નથી છતાં ખરા જન્મ પ્રાપ્ત થયો. જેને આકાર નથી છતાં સાંચામાં ઢાળીને તૈયાર કરેલી મૂર્તિને કરુણ રસનો ધાર મળ્યો. શ્રી બાબાની આ મૂર્તિ યશોવંત, શ્રીમંત, વૈરાગ્ય યુક્ત તેમજ જ્ઞાનવંત, ઐશ્વર્ય યુક્ત અને ઔદ્ઘાર્યયુક્ત એવા જ ગુણોથી પૂરિપૂર્ણ હતી. બાબાનો સંકલ્પ અને વિરોધ કરવાની રીત બંને વિચિત્ર હતાં. પોતે કોઈપણ વસ્તુનો સંગ્રહ ન કરનારા અને નિરાકારવૃત્તિના હતા. તેમ છતાં ભક્તો ઉપર કૃપા કરવા માટે જ આ દેહ ધારણ કર્યો હતો. શું સુંદર એમનો આ કૃપાળું સ્વભાવ? ભક્તોનો પ્રેમભાવ પોતે જ સાધી લેતા. નહીં તો તેમની ભાળ કયા દેવને પડી હોત? વાળીના દેવતા જે બોલવાનું સાહસ કરવાના નથી, કાન પણ જે સાંભળતા શરમાઈ જય તેવા શબ્દો બાબા ભક્તોના કલ્યાણ માટે જ બોલતા હતા. જે શબ્દોનો ફરી ઉચ્ચારણ કે અનુવાદ કરવો અશક્ય છે. મૂંગા રહેવામાં જ ફાયદો છે, પરંતુ કર્તવ્ય ચૂકવું નહિ, માટે એ કહેવું પડે છે. કોઈ એક ભક્તને બાબાએ એક વખત અતિ નભ્રપણે કહ્યું હતું કે, ‘હું તમારા દાસોનો દાસ છું અને કાણી છું. તમારા જ દર્શન માટે હું નીકળ્યો છું અને તમારાં ચરણોનો મને સંગાથ મળ્યો એ તમારી જ મોટી કૃપા છે. તમારા મળનો હું એક કિડો છું અને તેથી હું આ સૃષ્ટિમાં આવીને ધન્ય થયો છું.’ બાબાની આ કેટલી મૂદૃતા? અભિમાન શૂન્યતા પણ કેટલી ઉચ્ચ છે તેમજ શાલીનતા પણ તેવી જ! બાબાના ઉપર જણાવેલા ઉદ્ગારો તદ્દન સાચા છે માટે રજૂ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

કર્યા છે. કોઈને આ અનાદર ચુક્ત લાગતા હશે તો હું તેમની ક્ષમા માંગુ છું. વાચા જે તેવું બોલવાથી અભડાઈ હશે અને સાંભળવાનું પાપ જે ટાળવંનું હશે તો સાઈનામનો ધોષ કરવાથી બધાંના જ દોષ નાશ પામશે. જન્મોજન્મની આપણી તપશ્ચર્યાનું ફળ એટલે જ આ સાઈની અસીમ ફૂપા છે. તરસ્યાને જેવી પાણીની પરબ સુખકર હોય છે. તેવી જ સાઈફૂપા અમારે માટે સુખહાઈ છે. (ઓ. ૮૨-૮૫)

બાબા જે જીબથી સ્વાદ ચાખતા હોય એમ જે બધાને માટે લાગતું હોય પરંતુ તેમણે શું ખાદ્ય છે તે તેમને કહી ઘ્યાલ રહેતો નહીં. તેમની જીબને કોઈપણ પ્રકારનો સ્વાદ માણવાની ઈચ્છા હતી નહીં. જેમને વિષય સુખ ભોગવવાની ઈચ્છા જ નથી, તે વિષયોનો શું ઉપભોગ કરવાના ? વિષયો જેમની ઈન્દ્રિયોને સ્પર્શી શક્તી નથી, તે વિષયસુખોમાં ઓતપ્રોત થોડા રહેવાના હતા ? જે કોઈ પદાર્થો એમની નજર સમક્ષ આવતા તેમને તે જેતા હતા. પણ તેમનું જેયુન જેયા બરાબર જ હતું. તેમને તેવું જેવાની ઈચ્છા જ થતી નહોતી. ભગવાન શ્રી હનુમાનજીની જન્મજલત બ્રહ્મચર્યની લંગોટી માત્ર તેમની માતા અથવા તો શ્રી રામચંદ્ર પ્રભુને દેખાતી હતી. જે વાત ભાવાર્થ રામાયણ કિર્ણિધાંડ અધ્યાય ૧ ઓવિ. ૪૮-૫૩માં જણાવી છે. માટે જ તેમનું બ્રહ્મચર્ય અનેડ ગણાય છે. પરંતુ શ્રી બાબાની બાબતમાં ખુદ એમની માતાને સુદ્ધાં ગુલ્ય ભાગોનું દર્શન થયું ન હતું તો બીજની તો વાત જ કયાં કરવી ? આ બાબતે તે જાણવું જરૂરી છે કે કોઈ પણ પોતાના નાના બચ્ચાના ગુલ્ય ભાગનું દર્શન થયું જ હોય છે. તેમ છિતાં હેમાઠપંત બાબાની બાબતમાં આમ માતાને કેમ કહી શકે ? તો તે વિશે એમ કહી શકાય કે હેમાઠપંત તો બાબાને અજન્મા કહીને માતાને પેટે નહીં જન્મેલા અને શિરડીમાં નિંબવૃક્ષ નીચે સોળ વર્ષની આયુમાં એકદમ ગ્રગટ થયેલા તેવું જ માનતા હતા. માટે તેમનું ઉપર પ્રમાણેનું વર્ણન ખોટું ન ગણાય. બાબાનું બ્રહ્મચર્ય કઠીન અને કડક હતું અને તે અપૂર્વ હતું. બાબાની કર્મરે લંગોટી કાયમ રહેતી હતી. તેમનું લિંગ ઘેટાના ગળાના ભાગમાં તેના મો અને ગળાની વર્ચ્યે જે બે ગોળી જેવા માંસલ અવયવો લટકતા દેખાય છે તે જ પ્રમાણે દેખાતું હતું. જે ફક્ત મૂત્ર ત્યાગની વ્યવસ્થા માટેનું એક અવયવ હતું. બાબાના દેહની સ્થિતિ આ પ્રકારની હતી. તેમની ઈન્દ્રિયો ભલે કાર્યરત હોત, છિતાં તેમને વિષય સુખની ઈચ્છાની પણ સુદ્ધાં ન હતી. સત્વ, ૨૪ અને તમ વગેરે ગુણ બાબાની ઈન્દ્રિયોમાં જે પૂરેપૂરા ઝીલેલા હોત અને બાબાના વ્યવહારમાં કર્તા ભાવ દેખાતો હોત તેમ છિતાં આશકિત તેમને કયાંયે સ્પર્શની નહોતી. બાબા સર્વે પ્રકારની માયા અને મોહથી મુક્ત, શુદ્ધ જ્ઞાન સ્વરૂપ અને આત્માના આનંદમાં હંમેશા ઘોવાયેલા રહેતા હતા. કામ, કોધ જેવા ખડરીપુ માટે તેઓ નાશ પામવાનું સ્થાન હતા. તેઓ સહા નિષ્કામ કોઈપણ પ્રકારની આશા આકાંક્ષા વગરના હોવાને લીધે સર્વ ઈચ્છાઓમાં પરિપૂર્ણ થયેલા હતા. વિષય સુખ પણ તેમને બ્રહ્મરૂપ જ લાગતું હશે. તેમના જીવનમાં પુણ્ય અને પાપોનું પરિભ્રમણ જાણે પાપ-પુણ્ય માટે એક વિરામનું સ્થળ હતું. બાબાની આ રીત પરમાત્મા સાથે લીન થઈ ગયેલી મુક્ત સ્થિતિ હતી. (ઓ. ૮૬-૧૦૫)

નાનાવત્તી નામનો એક પિશાચવૃત્તિથી જીવનારો હષ્પૃષ્ટ ગૃહસ્થ ઘણા દિવસ સુધી શિરડીમાં આવીને રહેલો. તેને નિવાસ દરમિયાન મન ફાવે તેવું વર્તન કરતો. બાબા તેની ઉપર અને તેને બાબા ઉપર ખૂબજ પ્રેમ હતો. એક દિવસ તેણે લહેરમાં આવીને સાઈબાબાનો હાથ પકડ્યો અને તેમને ઉભા કરી દીધા અને પોતે તેમની ગાઢી ઉપર જઈને બેસી ગણો, પણ તેણે એક જ મિનિટમાં જ બાબાને ખૂબ જ આદરપૂર્વક સાણંગ નમસ્કાર કરીને તેમને ગાઢી પર ફરીથી બેસાડ્યા. આ ગૃહસ્થ સાઈબાબાને ‘કાકા’ના નામથી ખૂબ મારતો. બાબાના દેહ છોડ્યા બાદ અતિશાય શોક અને કલ્પાંત કરીને તેણે બાબાની સમાધિના તેરમા દિવસે ‘કાકા કાકા’ એવી ખૂબ પાડતાં પાડતાં પ્રાણ છોડ્યાં હતાં. તેની સમાધિ લેંડીબાગના

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

પ્રવેશદ્વાર પાસે જ છે. બાબાને નાનાવલ્લીએ કહ્યું ઉઠ તે કહેતાની સાથે જ ગાઢી છોડીને જે બાજુ પર થઈ ગયા તે બાબાને દેહનું અભિમાન કે અન્ય વ્યક્તિઓ માટે ભેદભાવ સ્વખનમાં પણ કલ્પી શકાય નહીં. આ મૃત્યુલોકમાં જેને કંઈ મેળવવાનું જેવું રહ્યું નથી અને પરલોકમાં સાધ્ય કરવા જેવું કાંઈ રહ્યું નથી. તેવા આ સંત, લોકો પર અનુગ્રહ કરવા માટે આ પૃથ્વી ઉપર અવતર્યા હતા. સંત પુરુષો તો કરુણાના સાગર હોય છે. બીજ ઉપર કરુણા કરવી તે સિવાય તેમનો અવતાર ધરવાનો બીજે કોઈ હેતુ હોતો નથી. તેઓ બીજનું કલ્યાણ અને પરહિત કરનારા અત્યંત ફૂપાળું છે. તેમનું હદ્ય માખણ જેવું અત્યંત મૂદુ હોય છે એમ કહેવાય છે. પરંતુ આ ઉપમા સાચી નથી. કારણ કે માખણ તો ફક્ત પોતે ગરમ થવાથી પીગળે છે જ્યારે સંતોનું હદ્ય પારકાંને થયેલાં તાપ અને દુઃખો જેઠીને દ્રવી ઉઠ છે. થીંગડાં મારેતી કફ્ફની જેના અંગનું વક્ર છે, કોથળા જેમનું સૂવા બેસવાનું સાધન છે અને કોધ, લોબ અને લાલસા સિવાયની જેની વૃત્તિ છે તેને ચાંદીના સિંહસનની શું પરવા ? સિંહસન પર બેસવામાં જેને અડચણનો ભાસ થાય છે અને ભક્તો જે સિંહસન થોડુ પાછળ સરકાવે તો તેમના ભક્તિભાવ તરફ તે ધ્યાન આપતા નથી. સાઈબાબા સાક્ષાત્ શિરડીકૃપી સમુદ્રમાંના કમળ હતા. ભક્તો તેમની સુવાસનો ઉપભોગ કરતા હતા. બાબાની ભક્તિથી વંચિત રહેલા કમભાગી દેહકાંઘોના નસીબમાં કાદવ જ હોય છે, અને સદા તેને ખૂંદતા રહે છે. બાબા કોઈને પણ યોગાસનો, પ્રાણાયામ કે ઇન્દ્રિયદમન કરવાનું કહેતા નહીં, અથવા તો મંત્ર, તંત્ર, યંત્રથી પૂર્જન કે ભજન કરવાનું પણ કહેતા નહીં. તેમને શિષ્યોના કાનમાં મંત્ર ફૂંકવાનું સહેજ પણ ગમતું નહિ. તેઓ બહારથી સાધારણ લોકોના જેવો વ્યવહાર કરનારા દેખાતા પરંતુ અંદરથી સંદતર અલગ હતા. વ્યવહારમાં તેઓ અત્યંત હોશિયાર અને દક્ષ હતા. બીજને આ પ્રકારનો ચાતુર્ય કસબ શક્ય ન હતો. સંત તો ભક્તો માટે દેહ ધારણ કરતા હોય છે. એમના મનની સર્વ ભાવનાઓ કે વિકારો અને વ્યવહારનાં બધાં વર્તનો પણ ભક્તો માટે જ હોય છે જેને ધ્યાનમાં રાખો. સાઈમહારાજ શાંતિનો બંદાર છે તથા શુદ્ધ અને પરમ આનંદનું સ્થાન છે. તેમને મારા અભિમાન સિવાયના અને દોષ સિવાયના સાથાંગ નમસ્કાર થાઓ. જે જગ્યા પર સાઈમહારાજ ચાલીને આવ્યા તે સ્થાન શિરડી મોટાં પુણ્યો વડે પાવન થયેલું હોવું જેઠાંએ. પૂર્વજન્મમાં સારાં કર્મના સંગ્રહ સિવાય આવો ખજનો મળવો મુશ્કેલ છે. ‘શુદ્ધ બીજના પેટે જ રસાળ અને મીઠાં ફળ આવે છે.’ આ કહેવતની કસોટી શિરડીના લોકોએ કરી. તેઓ હિન્દુ નથી અને મુસલમાન પણ નથી. તેમને આશ્રમ કે વર્ષાં નથી. તેમ છતાં તે સુખદુઃખ, ધોર પરિશ્રમ અને ભયંકર ચિંતાઓથી ભરેલા સંસારકૃપી ભવસાગરને મૂળમાંથી કાપીને તેનો વિદ્વંશ કરે છે. બાબાનું ચરિત્ર ગગન જેવું અનંત, અપાર અને ગહન છે. તેને સમજવું એ તેમના સિવાય ડોનાથી શક્ય છે ? (ઓ. ૧૦૬-૧૨૦)

ચિત્તનું કામ વિચાર કરવાનું હોય છે, અને ચિત્તન કર્યા સિવાય એ એક ક્ષણ ચૂપ બેસી શકતું નથી. તેને જે વિષય આપવામાં આવે તો તે સુખેથી વિષયોનું ચિત્તન કરે છે અને જે ગુરુ મળે તો ગુરુનું ધ્યાન કરે છે. માટે સર્વે ઇન્દ્રિયોને કેવળ પોતાના કાનમાં કેન્દ્રિત કરીને ઉપર સાંભળ્યુ તે સાઈગુરુનું મહાત્મ્ય જીવન ઘડતર માટે સ્મરણ, કીર્તન અને ભજન થાઓ. પંચાંગી સાધના તથા યજા, યાગ, મંત્ર, તંત્ર અને અષાંગ યોગ જેવા પ્રયોગ ફક્ત બાહ્યણો માટે જ શક્ય છે. બીજાઓને એનો શો ઉપયોગ ? સંતોની કથા આવી નથી હોતી. તે સર્વેને સરળ માર્ગે દોરી જય છે તથા સંસારના અથવા આગવા જન્મના ભય અને દુઃખ કરે છે અને આપણને આપણો પરમાર્થનો માર્ગ બતાવે છે. સંતકથાઓનું શ્રવણ, મનન અભ્યાસ અને નિર્દિષ્ટયાસ કરવાથી બ્રાહ્મણ, શુદ્ધ, સ્વીઓ વગેરે સર્વે પાપમાંથી મુક્ત થઈને પાવન થાય છે. કોઈપણ વસ્તુ ઉપર જેને પ્રેમ નથી, એવો માણસ આ જગતમાં ભાગ્યે જ હશે. દરેકનું પ્રેમનું

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

દેકાણું બિન્ન પ્રકારે હોય છે. કોઈના પ્રેમનું સ્થાન સંતતી તો કોઈને ધનસંપત્તિ તો વળી કોઈને શરીર, ઘરબાર અને માન સંભાન, તથા કોઈને કીર્તિ તો કોઈને વિદ્યા પ્રાપ્તિનું હોય છે. જે પ્રેમ વિષયસુખો ઉપર વહેંચાઈ જય છે, તે જ્યારે એકત્ર થઈને હરિચરણદ્વારી ધાતુ ગાળવાની ભક્તીમાં પીગળે છે ત્યારે ભક્તિદ્વારે પ્રગટ થાય છે. માટે ઘરઆંગણે પ્રપંચોમાંથી સાઈચરણે ચિત્ત સમર્પણ કરવાનો આ સીધો અને સરળ માર્ગ અપનાવો. આ સહેલા માર્ગથી એની કૃપા તમારા ઉપર ઉત્તરશે. આમ આવા પ્રકારે જે અલ્યુ સાધનાથી મોટો લાભ થતો હોય તો એ શ્રેય સંપાદન કરવા માટે લોકો ઉદાસ શા માટે હોય છે? શ્રોતાઓના મનમાં સહેલ શંકા ઉપજે કે થોડા ઉપાયથી મોટો લાભ પ્રાપ્ત થતો હોવા છતાં અસંખ્ય લોકો આ માર્ગે કેમ ચાલતા નથી? તો તેને માટે એક જ કારણ છે કે પરમેશ્વરની પ્રેરણા થયા સિવાય સાદી ઈચ્છા પણ ઉત્પન્ન થતી નથી. પરંતુ જ્યારે ભગવંત પ્રસન્ન થાય છે ત્યારે જ સંતકથા સાંભળવામાં અતિશય આનંદ આપોઆપ પ્રગટ થતો હોય છે. માટે શ્રોતાઓએ સાઈબાબાના શરણે જ વું જેથી નારાયણ કૃપા થશે અને પ્રભુ શ્રવણની પ્રબળ ઈચ્છા જાગશે. તેથી આવું સહેલું સાધન હાથ લાગશે. (ઓ. ૧૨૧-૧૩૩)

ગુરુકુથાની સારી સંગત રાખો અને સંસારના ગુંચવાડામાંથી છૂટીને બહાર નીકળો. આમાં જ તમારું નિશ્ચિંતપણું સાર્થક છે. મનમાં શંકા રાખશો નહીં. દોઢાહાપણ અને લાખ ચતુરાઈ ત્યજીને ‘સાઈ સાઈ’ એવું નિરંતર નામ સ્મરણ કરો અને જુઓ! તમારો બેડો પાર થશે અને હેતુ સિદ્ધ થશે. તેમાં જરાય સંદેહ રાખશો નહીં. આ મારા શર્ષ્ટો નથી. ખુદ સાઈબાબાના મુખેથી ગંભીરતા પૂર્વક બોલાયેલા શર્ષ્ટો છે. એને નિર્થક સમજતાં નહીં. ‘ખરાબ સંગત એ જ્યાંથી ત્યાંથી બેગા કરેલાં હલકા પ્રકારનાં મહાદુઃખોનું આશ્રયસ્થાન છે. તે ન જાણતાં આડે માર્ગે દોરી જય છે, અને સાચા સુખોથી દૂર કરે છે. સાઈબાબા અથવા તો સદગુરુ સિવાય ખરાબ સંગતાનું શુદ્ધિકરણ કોણ કરી શકશે? દ્વાયાનો ઉભરો આવેલા ગુરુના મુખેથી જે કરુણાસભર ગુરુવચનો નીકળે તેનું હે ભક્તો કાળજીપૂર્વક જતન કરો. જેથી ખરાબ સંગતનું નિરાકરણ થશે. ઈશ્વરે નિર્માણ કરેલાં સૂચિના વિવિધ રૂપો જ્યારે આંખોમાં રમે છે, ત્યારે માણસોના સૌંદર્યને લોભાવનારું લોલુપ મન તેમાં રમવા માંડે છે. પણ તે જ દશ્ટ જ્યારે તેની વિરુદ્ધની દિશામાં ફરે છે ત્યારે તે સાથું સંતોની સંગતમાં વસે છે. સત્તસંગનો એટલો મહિમા છે કે એ દેહાભિમાનને જ મૂળથી કાઢી નાખે છે. માટે સત્તસંગ સિવાય અન્ય સાધન શોદ્યે જ હતું નથી. હુંમેશા સદગૃહસ્થનો સહલાસ રાખવો. અન્યનો સહલાસ દોષયુક્ત બની જય છે. સારા માણસોનો સહલાસ દરેક શુદ્ધ અને નિર્મળ હોય છે. સત્તસંગ દેહની આસક્તિ છોડાવે છે. એનામાં એટલી પ્રબળ શક્તિ હોય છે કે, એક વખત જે એનો ચસકો લાગી જય તો આ સંસાર બંધનમાંથી તરત જ મુક્તિ મળે છે. દૈવયોગથી જે કોઈ સત્તસંગનો લાભ મળે તો કોઈ પણ પ્રકારની ઉણાપ વિનાનો સંપૂર્ણ ઉપદેશ આસાનીથી મળી જય છે. તે જ ક્ષણે ખરાબ સંગતોનો મોહ ઊરી જય છે, અને સર્વ આસક્તિઓથી મુક્ત થયેલું મન સત્તસંગમાં રમવા માંડે છે. પરમાર્થના માર્ગના પ્રવેશ માટે વિષય વાસનાઓથી વિરક્તિ આ એક જ ઉપાય છે. સત્તસંગ સિવાય આપણા પોતાનું મૂળ સ્વરૂપ સમજતું નથી. સુખની પાછળ દુઃખ આવે છે અને દુઃખની પાછળ સુખ હોય છે. આમ જીવ એક સરખો સુખ તરફ જવા માટેનો પ્રયત્ન કરે છે. અને દુઃખોથી દૂર ભાગે છે. સામનો કરોકે ભાગી જવ, જે થવાનું છે તે જ ડર થાય છે. આ બંને ભોગો કરતાં, એક સંતનો સહલાસ જ છુટકો અપાવી શકે છે. સત્તસંગથી દેહાભિમાન બળીને ભર્ષમ થાય છે. જન્મમરણના ફેરા પૂર્ણ થાય છે. તેમજ ચેતનાની પૂર્તિ કરનાર મૂળ શક્તિનો એટલે કે પરમાત્માનો બેઠો થાય છે. અને હૃદયમાંથી ગ્રંથિઓ તડાતડ તૂરવા માંડે છે. ઉત્તમ ગતિ પ્રાપ્ત કરવા માટે સંતોનો સંગત એ એક જ પાપોથી મુક્ત કરનારી બાબત છે. સંતો પાસે અનન્યપણે શરણે જવાથી જ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

આપણે સ્વસ્થતા અને શાંતિ હાથ લાગે છે. જે લોકો કહી ઇશ્વરનું નામસ્મરણ કરતા નથી કે નમસ્કાર કરતા નથી અને જેઓને ઇશ્વર પ્રત્યે ભક્તિભાવ નથી કે કહી ઇશ્વરનું ભજન પણ કરતા નથી તેવાઓનાં મન ઇશ્વર તરફ વાળવા માટે સંતો અવતાર ધારણ કરતા હોય છે. ગંગા, ભાગીરથી, ગોદાવરી, કિષણા, વેણુણા, કાવેરી, નર્મદા આ નદીઓ પોતે પવિત્ર હોવા છતાં સાધુઓના પદ્ધકમળોની ઇચ્છા સેવતી હોય છે. તેઓ તેમનાં જળમાં સ્નાન કરવા માટે કયારે આવશે તેની રહે જેતી હોય છે. આ નદીઓ જગતનાં પાપો ધોતી હોય છે, પરંતુ તેમના જળમાં બેગા થયેલાં સર્વ પાપોનો નાશ સાધુઓનાં ચરણોના સ્પર્શ સિવાય થતો નથી. એને પાઇલા જન્મના ભાગ્યનો ઉદ્ય થતાં સાઈમહારાજનાં ચરણોનો લાભ મળ્યો. જન્મ મરણ તેના સ્થાને રહ્યાં અને મારા મનમાંથી આખા સંસારનો ભય નહીંવત્ત થઈ ગયો. (ઓ. ૧૩૪-૧૫૩)

સજજન શ્રોતાજનો ! અત્યાર સુધી સાંભળેલી કથાનું મનન કરીએ, થોડો આરામ કરીએ. પછી આગળની કથાનું નિદ્રપણ કરીએ. હેમાડપંત સાઈ શરણે આવ્યા છે. તે કહે છે, ‘હું તો સાઈના પગનું પગરખું છું. સહાયે કથાનું વર્ણન કરતો રહીશ અને સુખ સંપત્ત થતો જઈશ.’ શું સુંદર અને મનોહર એ બાબાનું ધ્યાન ? મસ્જિદના કઢેરા પાસે ઊભા રહીને ભક્તોના કલ્યાણ કરવાના હેતુથી બાબા ઉદ્દી આપવા માટે હુંમેશા ઊભા રહેતા. આ સંસાર મિથ્યા છે એવી જેને જણ છે, તે સદાય બ્રહ્માનંદમાં લીન છે, અને જેનું મન ખીલેલા સુમન જેવું સદાય તાજું, કાંતિવાળું અને પ્રકુલ્પિત છે તેમને સાચાંગ નમસ્કાર થાઓ. આગળનો અધ્યાય પણ ઘણો સુંદર છે. કાન દ્વારા શ્રવણ કરીને હૃદયમાં અંતર પ્રવેશ થવા દેવાથી હૃદયરૂપી મંદિર પાવન થરો. મનનો મેલ ધૂટો પડશે. (ઓ. ૧૫૪-૧૫૯)

સર્વનું કલ્યાણ થાઓ. આ પ્રકારે સંત અને સજજનની પ્રેરણા પામેલા ભક્ત હેમાડપંત રચિત

શ્રી સાઈસમર્થના સત્ય ચરિત્રના ‘શ્રી સાઈ સમર્થ મહિમાન’ આ નામનો દશમો અધ્યાય

અહીં સમાપ્ત થાય છે.

શ્રી સદ્ગુરુ સાઈનાથને અર્પણા.



॥ અધ્યાય ૧૧ ॥

શ્રી સાઈમહિમા વર્ણન

શ્રી ગણેશજીને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કુળહેવતાને વંદન,
શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રજીને વંદન અને શ્રી સદ્ગુરુ સાઈનાથ મહારાજને વંદન.

અગાઉની કથાનું અનુસંધાન કંઈક આવું છે કે બાબાનું સાંકડા ઉપર ઉંચે સૂંબું અને કોઇને પણ દેખાય નહીં તેવી રીતે
તેની ઉપર ચઢવું કે ઉત્તરવું. તેવું તેમનું ન સમજું શકાય એવું કૌશલ્ય હતું. હિંદુ હોય કે મુસલમાન હોય પરંતુ બાબા બંનેની
સાથે એક સરખો જ વર્તાવ રાખતા હતા. જેમના જીવન કાળનું નીરિક્ષણ કરાયું તેવા શ્રી સાઈ સમર્થ શિરડીની પ્રજ્ઞા માટે
એક પૂજન માટે એક પૂજય અને દેવતા હતા. (ઓ. ૧-૨)

હવે એવું લાગે છે કે આ સુંદર કથાને શાણગારીને આ અગિયારમો અધ્યાય ભાવપૂર્વક સાઈચરણમાં અર્પણ કરીએ.
તેમ કરવાથી બાબાના સગુણાઙ્ગનું ધ્યાન થશે અને યજુર્વેદમાં ગવાયેલા રુદ્રાધ્યાયની પ્રસિદ્ધ રુદ્ર મંત્રનું અગિયાર વખત
પારાયણ થશે. તે સાથે બાબાનો પંચમહાભૂત પરની સત્તાનો પુરાવો પણ મળશે અને તેનો મહિમા પણ સમજશે. ઈન્દ્ર
પરજન્ય દેવતા, દેવતા ઈન્દ્ર અદ્દિન અને જગ દેવતા વરુણ બાબાના શાખાનું કેવું માન રાખતા હતા. તેની થોડી માહિતી
જેઠ લઈએ. શ્રોતાજનોએ ધ્યાન આપવું. (ઓ. ૩-૫)

શ્રી સાઈબાબાનું સગુણાઙ્ગ મૂર્તિમંત પૂર્ણ વૈરાગ્ય અને અનન્યપણે ભક્તિ કરવાનું વિશ્રાંતિનું સ્થાન હતું. તેનું
આપણે પ્રેમપૂર્વક મનન કરીએ. ગુરુનું વાક્ય એ જ સાચું એવો વિશ્વાસ રાખવો, અને તેમને બેસવા માટે આસન આપવું
તથા સર્વ કામોનો ત્યાગ કરીને તેમજ સંકલ્પ કરીને તેમનું પૂજન કરીએ. પથ્થર કે મારીની પ્રતિમાં સ્થંડિલ એટલે ચોરસ
ઓટલી, અદ્દિન, તેજ, સૂર્યમંદળ, પાણી અને બ્રાહ્મણ આ સર્વે સાત પૂજનસ્થાનો કરતાં ગુરુરાજ એ શ્રેષ્ઠ છે. તેમની
અનન્ય ભાવે પૂજન કરીને તથા અનન્યભાવે શરણે જવાથી ગુરુ તો શું પણ પરબ્રહ્મ સુદ્ધાં હાતી જશે અને જગશે તેમજ
ધ્યાન પણ આપશે. ગુરુ પુજનો એટલો બધો પ્રભાવ છે. ગુરુભક્તોએ તેનો અનુભવ લેવો. (ઓ. ૬-૮)

પૂજન કરનારો જે દેહભાન સાથે હોય તો, તેને ગુરુ પણ દેહધારી લાગે છે. તેવી જ રીતે દેહભાન ભૂલેલા ભક્ત પૂજનીને
નિરકાર અને સૂક્ષ્માઙ્ગળ ધારણ કરેલા ગુરુનું ધ્યાન થાય છે. એવો શાસ્ત્રોનો નિર્ણય છે. સગુણ સંપત્તિ ગુરુનું કે દેવતાનું ધ્યાન
કર્યા સિવાય ભક્તિભાવ કરીએ પ્રગટ થતો નથી. અને જ્યાં સુધી સપ્રેમ ભક્તિ થતી નથી ત્યાં લગી મનની કળી ઝીલતી
નથી. ઝીલ્યા વિનાની કળીમાં કયારેય સુવાસ હોતી નથી અને તેવા ફૂલમાં મધ પણ નથી હોતું. તેથી ભમરો ત્યાં ક્ષાળભર
પણ રોકાતો નથી. જુઓ ઝપ અને ગુણ સંપત્તિ એટલે જ સાકાર અને આકાર સાથેનું સ્વરૂપ અને ઝપ અને ગુણ વીનાનું
નિરકાર સ્વરૂપ બંને એક બીજાથી ભિન્ન નથી જ. સાકાર અને નિરકાર એક જ છે. થીજી ગયેલું હોવાં છતાંપણ એ ‘ધી’
જ છે. ઘટ થાય કે ઓગળે છતાં તેને ધી જ કહેવાય છે. બ્રહ્મદેવે સગુણ અને નિર્ગુણ બંનેને એકત્ર કરીને સમરસ કર્યા છે.
આંખોથી જેને નિહાળી શકાય છે, જેના ચરણોમાં માથું મૂકી શકાય છે તથા જ્યાં જ્ઞાન આપોઆપ થાય એવી સગવડ

શ્રી સાઈનું સત્ય ચિહ્ન

હોય છે, તેવે જ ડેકાણે પસંદગી સહેલાઈથી થાય છે. જેમની સાથે પ્રેમની વાતો કરી શકાય અને ગંધ અને અક્ષત દ્વારા પૂજન કરી શકાય તેથી જ સગુણ અને સાકાર સ્વરૂપ જરૂરી છે. નિર્ગુણ કરતાં સગુણને સમજવું ખરેખર ખૂબ જ સહેલું છે. સગુણ સાથે પ્રેમ દટ થાય એટલે નિર્ગુર્ણ આપોઆપ સમજની જન્ય છે. ભક્તોને નિર્ગુણની સમજ પાડવા માટે બાબા અનેક ઉપાયો યોજ્યતા. દેરેકના અધિકાર પ્રમાણે તેને દૂર બેસાડીને ખાસ્સા લાંબા સમય સુધી પોતાનાં દર્શન થવા હેતા ન હતા. એકાદ જણાને શિરડીથી દૂર દેશાંતર કરાવતા. જેમ કે બાળરામ માનકરને મધીદીર ગઢ પર મોકલ્યો. વળી, કોઈકને એકાંતમાં શિરડીમાં ગોધી રાખતા. જેમ કે ઉપાસની મહારાજને ખંડોબાના મંદિરમાં એકલા રાખ્યા હતા. તો વળી કોઈકને વાડામાં રોકીને નિયમપૂર્વક પોથી વાંચવાનું કહેતા. કાકાસાહેબ દીક્ષિતને તેમના વાડામાં રાત્રે ભાવાર્થ રામાયણ અને દિવસે એકનાથી ભાગવત વાંચવાનો નિયમ લેવડાયો હતો. આ બધા પાછળનો હેતુ એટલો જ કે વર્ષોનાં વર્ષો સુધી આવો અભ્યાસ થતાં બાબાના નિર્ગુણ ઝપનું આતુરતાથી ચિંતન વધતું અને ઉઠતાં બેસતાં અને જમતાં તેઓને મનમાં બાબાનો સહવાસ થતો. (ઓ. ૧૦-૨૦)

આપણું આ શરીર નાશવંત છે. કયારે ને કયારેક તો એનો અંત થવાનો જ છે. માટે ભક્તોનું દુઃખ ન કરતાં જન્મ રહિત અને મૃત્યુ રહિત અનાદિ અને અનંત પરમેશ્વર તરફ ધ્યાન આપવું. આ સૂછિ ઉપર દેખાતો અનેક પ્રકારનો ફેલાવો તે માયોનો પ્રભાવ છે. જે અભ્યક્તમાંથી આકારમાં આવેલે છે અને અભ્યક્તમાં જ સમાઈ જય છે. બ્રહ્મથી માંડીને નાનાં ઝાંખરાં સુધીની સૂછિમાં અનેકો જીવ અને અનેક સમૂહથી ભરેલું આ બ્રહ્માં સમાયેલું છે. તે અભ્યક્તમાંથી જ આકાર પામેલું છે અને છેલ્લે એમાં જ સમરસ થઈને મળી જય છે. આમ મરણ કોઈને પણ નથી હોતું, તો પછી સાઈબાબાને તો કયાંથી હોય? શ્રી સાઈ શુદ્ધ, પવિત્ર, જ્ઞાની, નિરંજન અને દીષ રહિત તથા મૃત્યુથી પર છે. અમુક લોકો તેમને ભગવાનના ભક્ત કહે છે. અથવા મહાન વૈષણવ પણ કહે છે. પરંતુ અમને તો એ સાક્ષાત્ મૂર્તિમંત પરમેશ્વર જ લાગ્યા. ગંગાનદી સમુદ્રમાં મળતાં પહેલાં પહેલાં વહેતાં રસ્તામાં ગરમીથી તપેલાં કંઢાઓને ઢંડા કરે છે અને ત્યાં આવેલી હુરિયાળી તથા વૃક્ષોને જીવન બક્ષે છે, અને દરેકની તરસ છીપાવે છે. એ પ્રમાણે સંતોની અવતાર સ્થિતિ હોય છે. સંતો પ્રગટ થતા હોય છે અને વિદ્યાય પણ થઈ જતા હોય છે. પરંતુ તેમની જીવન શૈલી એ વર્તન જગતને પાવરી અને પાપમુક્ત કરે છે. બાબાનો ક્ષમાયાચનાવાળો સ્વભાવ કમાલનો હતો તેમજ શાંત કુદરતી રીતે વિલક્ષણ હતી અને નિષ્કપટા, કોમળતા સહનશીલતા અને હંમેશાની સમાધાની વૃત્તિ અન્ને હતી. દેખાવે ભલે તેઓ દેહધારી હતા. છતાં તેઓ ઝપ ગુણ અને કામ, કોથ ઠિયાદિ વિકારો વિનાના હતા. તેઓ આ સંસારી જગતમાં ફરતા હોવાં છતાં તેમના અંત: કરણમાં સંગ રહિત વૃત્તિ હતી. દરેક પ્રકારનાં મોહનાં બંધથી તે મુક્ત હતા. શ્રીકૃષ્ણ સાક્ષાત્ પરમેશ્વર હતા. તેમ છતાં સંતો માટે કહી ગયા છે કે, ‘સંત તે મારો પ્રાણ છે. તે મારી જ જીવંત પ્રતિમા છે.’ સંત એટલે હું જતે જ છું. પરંતુ સંતોને પ્રતિમાની ઉપમા સુદ્ધાં ન શોભે! ‘સંત મારું જ ઝપ છે,’ માટે એ મારા ભક્તોની પ્રતિષ્ઠાને આંચ ન પહોંચે માટે એમની જવાબદારીનો ભાર હું મારા શરીર પર ઉપાડું છું. સંતોને શરણે જે જન્ય છે તેના ચરણને હું વંદુ છું. ‘સંતોનું આવું મહાત્મ્ય શ્રીકૃષ્ણ ભગવાને તેમના મિત્ર ઉદ્ઘવ ને કહ્યું છે. દરેક સગુણ વસ્તુઓમાં જે શ્રેષ્ઠ સગુણ વસ્તુ છે અને સર્વ નિર્ગુણ વસ્તુમાં શ્રેષ્ઠ વસ્તુ છે તથા સારા ગુણોવાળા ગુણવંતમાં જે સર્વશ્રેષ્ઠ ગુણ છે અને સર્વ ગુણીજનોમાં જે અત્યંત શ્રેષ્ઠ ગુણ ધારણ કરેલો એવો ગુણીજનોનો ગુણીરામ રાજ છે. જે કૃતકૃષ્ણ થયેલો સર્વ દીચદા પૂર્ણ થયેલો અને દેવની દીચદા માનનારો છે તથા જે સતત પોતાના સ્વરૂપમાં અત્યંત તત્ત્વીન હોવા છતાં સુખ દુઃખથી પર છે. અને જે આત્માનંદનું ઐશ્વર્ય છે તેની મોટાઈનું વર્ણન કોણ કરી

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

શકે ? જે સાક્ષાત् પૂજનીય પરમાત્મા છે તથા જેનું વર્ણન કરવું અશક્ય છે તેવી વર્ણન ન કરી શકાય તેવી શક્તિ પૂર્ખી ઉપર ક્ષિતિજ રૂપે દશ્યમાન થઈને અવતરેલી છે. સત્ય, જ્ઞાન અને આનંદના સુખની મૂર્તિ અને જ્ઞાનની પૂર્ણ ઓળખ તે આજ છે. જેનું અંત:કરણ બ્રહ્મ જેઠે એકરૂપ થયેલું છે. તે મૂર્તિ પણ આ જ છે. જેના પ્રપંચોની નિવૃત્તિ થયેલી છે અને જેની સંસાર સંબંધના વહેવારમાંથી મુક્ત થયેલી બ્રહ્મ અને આત્માનું ઐક્ય અનુભવની સ્થિતિ છે. તેવી શુદ્ધ આનંદ મૂર્તિ તે આ જ છે. ‘આનંદો બ્રહ્મેતી’ આનંદ એટલે બ્રહ્મ અથવા પરમાત્મા આ શુદ્ધ શ્રોતાઓ દરરોજ સાંભળે છે, અને પુસ્તકો વાંચનારા ગ્રંથમાં વાંચે છે. પરંતુ ભોળા અને ભાવિક ભક્તો શિરડીમાં તેનો પ્રત્યક્ષ અનુભવ કરે છે. ધર્મ અને અધર્મ વગેરે જેનાં લક્ષણો છે, એવો આ સંસાર વિચિત્ર છે. જેમને પોતાના સ્વરૂપનું ખરું જ્ઞાન થયું નથી તેમને દરેક ક્ષણે આ સંસાર સંભાળવો પડતો હોય છે. પણ જેમને પોતાનું સાચુસ્વરૂપજ્ઞાન અથવા તો આત્મજ્ઞાન થયું છે તેમને માટે સંસાર આ વિષય નથી. તેઓ સદા આત્મસ્વરૂપની સ્થિતિમાં હોય છે. તેઓ હુંમેશા સંસારના બંધનોથી દૂર મુક્ત અને આનંદ સ્વરૂપમાં વિહરતા હોય છે. તેઓ સદાય શુદ્ધ જ્ઞાનસ્વરૂપ ચિન્મય રૂપમાં અર્થાત પરમાત્માના રૂપમાં હોય છે. (ઓ. ૨૧-૪૦)

બાબા સર્વના આધારસ્થાન હતા. પછી એમને બેસવા માટે આધાર (આસન) શા માટે અને તે પણ ચાંદીનું જીંહાસન ? પરંતુ બાબા લાડકોડ પૂરા કરનારા હતા. ધણા દિવસોથી તેમને બેસવા માટેનું એક આસન હતું. તેની ઉપર બેસવા માટે ભાવિક ભક્તોએ સુંદર મજાની ગાઢી પાથરી અને પાછળ અફેલવા માટે ભીતી ત્યાં તકિયો ગોઠવ્યો. જેવા ભક્તોના ભાવ તેવું બાબા પણ વર્તતા હતા. વાસ્તવમાં સાઈબાબાનું રહેવાનાં સ્થળ ભલે શિરડી દેખાતું હોય છતાંયે તેઓ સર્વ ડેકાણે વિચનારા હતા. અને તેનો પરચો તો પોતાના ભક્તોને હુંમેશા બતાવતા. એમની પોતાની કોઈ મનોભાવના ન હતી. તેમ છતાં તેઓ ભક્તોની શ્રદ્ધા પ્રમાણે વિવિધ પ્રકારની પૂજના ઉપયારો અને તેમની સેવા સ્વીકારતા. કોઈ ચામરથી માંઝી ઉડાડતા તો કોઈ પંખાથી બાબાને પવન નાખતા, તો વળી કોઈ શુભ ચોધાયિ મંગળવાદ્ય વગાડીને પૂજન કરતા હતા. કોઈ હાથ પગ ધોતું તો કોઈ અત્તર કે અષ્ટગંધ લગાવતું. કોઈ મહા નૈવેદ્ય ધરસ્તું તો કોઈ તેર પદાર્થોવાળું પાનબીડને અર્પતું. તે તેર વસ્તુઓ આ પ્રમાણે છે. (૧) રસા કાઢેલું નાગરવેલના પાનનું બીડ (૨) કાપેલી સોપારી (૩) ચૂનો (૪) ખેરનો કાથ્યો (૫) કેસર (૬) કસ્તુરી (૭) બદામ (૮) કપૂર (૯) જલપત્ર (૧૦) ઇલાયચી (૧૧) લવીંગ (૧૨) જલફળ (૧૩) સોનામુખીનાં પાન, આ બધી વસ્તુઓ વાળું પાનનું બીડું અર્પણ કરાતું હતું. કોઈક લોકો શિવલીંગ પર લગાવે છે તેવી રીતે બે આંગળીઓ વડે એક સરખુ કપાળો ગંધ લગાવીને ત્રિપુર કરતા તો વળી કોઈ કસ્તુરી ભેળવેલું ગંધ અથવા ચંદન લગાવતા. (ઓ. ૪૧-૪૮)

એક વખતે તાત્યા સાહેબ નુલકરના ડાક્ટર શ્રી પંડિત નામના સ્નેહી સાઈબાબાના દર્શન માટે શિરડી આવ્યા. શિરડી પહોંચતા જ તેઓ મસ્નિદ્રમાં ગયા અને બાબાને સાણાંગ નમસ્કાર કરીને થોડીવાર શાંત ચિત્તે બેઠા. ત્યારબાદ બાબાએ તેમને કહ્યું, ‘જ દાદા ભટ પાસે જ્ઞ,’ ભટ તેજ દાદા કેળકર જે રાવબહણહુર સાઈના સસરા થાય. ‘આમ જલ આમ જલ’ એમ કહ્યાને બાળાએ તેમને આંગળીથી માર્ગ ચીધ્યો. પંડિત દાદા પાસે ગયા. દાદાએ તેમનું યોગ્ય રીતે સ્વાગત કર્યું. પછી દાદા બાબાની પૂજન માટે નીકળ્યા અને પંડિતને એમ પૂછ્યું કે તમે આવો છો ને ? તેથી જવા માટે ગયા. દાદાએ બાબાનું પૂજન કર્યું. ત્યાં સુધી બાબાના કપાળમાં તિતક કરવાનો કોઈને વિચાર આવ્યો ન હતો કે ઘૈર્ય પણ ન હતું. ગમે તેવો ભક્ત આવે તેમ છતાં બાબા કપાળો ચંદન લગાવા દેતા નહિ. મહાળસાપત્ર ફક્ત ગળા ઉપર જ

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

ચંદ્રન લગાવતા. અને અન્ય ભક્તો બને ત્યાં સુધી પગે ગંધ લાગવતા હતા. પરંતુ આ ભોળા ભાવિક પંડિતે દાદાની તબકડી હાથમાં લઈને બાબાનું માથું પકડીને કપાળ પર સરસ ત્રિપુંડ ખેંચ્યું. તેમનું આ સાહસ જેઈને સામે ઉભેલા ભક્તોના મનમાં ધ્રાસકો પડ્યો. આ કઈ જાતનું સાહસ ? બાબા ખૂબ ગુસ્સે થવાના એવું લાગ્યું પરંતુ જે કદી ન બન્યું હોય તેવું બન્યું. બાબા એક પણ શબ્દ બોલ્યા નહીં. ઉલ્ટાના મનથી પ્રસંગ થઈને પંડિત ઉપર જરાપણ ગુસ્સો કર્યો નહીં. થોડો સમય પસાર થવા હીથો, પણ દાદાના મનમાં ઉચાટ રહી ગયો. એમને તે વાત સાંજે બાબાને પૂછી કે, ‘તમારા કપાળ ઉપર ઉદ્ઘાસબેર તિલક કરવા જતાં અમને કપાળનો સ્પર્શ પણ કરવા દેતા નથી. આજે સવારે આમ કેમ બન્યું ? આપને અમારા તિલકનો કંટાળો આવે છે અને પંડિતના ત્રિપુંડને અંતઃકરણથી પ્રેમ કરો છો ? આવી કેવી વિચિત્રતા ? આનો કાંઈ તાલમેલ બેસતો નથી.’ તેથી સાઈબાબા પ્રેમથી હસ્યા અને દાદાને જે કહ્યું તે મધુર શાબ્દો દરેકે સ્વસ્થ ચિંતે સાંભળવા જેવા. ‘દાદા ! એમનો ગુરુ બ્રાહ્મણ છે અને હું જાતનો મુસલમાન કહેવાઉ પરંતુ હું એ જ છું તેમ સમજુને તેમણે મારું પૂજન કર્યું. પોતે મોટો પવિત્ર બ્રાહ્મણ અને આ પ્રકારના અપવિત્ર યવનનું પૂજન હું કેવી રીતે કરું તેવી તેમની મનમાં શંકા સુદ્ધાં આવી નહીં. આ રીતે તેમણે મને ફસાવ્યો. મારા બધો ઉપાય પાછા પડ્યા અને ના કહેવાનું તો બાજુ પર રહ્યું. પરંતુ મેં મારી જાતને તેમને આધિન કરી.’ બાબાનો આવો જવાબ સાંભળતા દાદાને તો એક વિનોદ જ લાગ્યો પરંતુ દાદા જ્યારે ઘેર પાછા આવ્યા ત્યારે તેનો ખરો સંકેત દાદાને મનમાં સમજલયો. બાબાની વિસંગતતા દાદાને મનમાં ખૂબ ખૂંચી હતી. પરંતુ પંડિતની જોડે ગપ્પા મારતાં મારતા તેમને બાબાની સુસંગતતા તરત જ સમજાઈ ગઈ. કાકા પુરાણીના નામથી જે જાણીતા હતા તે ધોપેશ્વરના રધુનાથ તેમનાં ચરણોમાં ડૉ. પંડિત ખૂબજ આસકતા હતા તથા તેમની સાથે શિષ્યત્વનો ઝણાનુંબંધ પણ હતો. પંડિત કાકાને પોતાના ગુરુ માનતા હોવાથી અને તેમને આ પ્રકારનો અનુભવ થયો. જેના મનમાં જેવો ભાવ અને શ્રદ્ધા હોય છે તેવી જ તેમની ભક્તિનું જેમ પણ હોય છે. (ઓ. ૪૮-૬૮)

વિવિધ પ્રકારની સેવાઓ જે તેમના મનમાં આવે તો જ બાબા કરવા દેતા હતા. જે મનમાં ન હોય તો પૂજની થાળીઓ ફેરી દેતા અને નૃસિંહનું ઝ્રૂપ બતાવતા હતા. આવું ઝ્રૂપ પ્રગટ થયા બાદ કોની હિંમત હોય કે ત્યાં ઊભા રહે ? આમ ઉકળી ઉઠતાં જ, જે તે મનુષ્ય પોતાનો જીવ બચાવીને ભાગી જતા. કોઈકવાર અચાનક કોધાયમાન થઈને તેઓ ભક્તો ઉપર આગ ઓકતા અને અતિશય દોષારોપણ કરતા, તો વળી કયારેક માખણ જેવા નરમ સ્વભાવના થઈને જાણે કે શાંતિ અને ક્ષમાનું પૂતાણું થઈ જતા. કોઈક વખતે પ્રલય કાળના ભારેલા અજિની માફક વર્તતા અને ભક્તોને તલવારની ધાર પર રાખતા, તો કદી માખણથી પણ નરમ દેખાતા અને આનંદવૃત્તિથી વર્તતા. કોધથી ભલે થરથર કાંપતા અને આંખોથી ભલે ચકરભમર ફેરવતા છતાં પણ માને જેમ બાળક માટે કારૂણ્ય ભાવ હોય છે તેમ તેમના અંતઃકરણમાં ભક્તો માટે કરુણાનાં જરણાં વહેતાં. બાબા કણ માત્રમાં પોતાના મૂળ સ્વભાવ પર આવી જતા અને ભક્તોને બૂમ મારી ને બોલાવતા તથા કહેતા, ‘મારા મનને કોઈના પર ગુસ્સો ઢાલવવો ગમતો નથી. મા જે બાળકને લાતો મારે અને સમુદ્ર જે નહીંઓને પાછી વાળે તો જ હું તેમને કાઢી મૂકીશ કે તમારું નુકશાન કરીશ. હું તો મારા ભક્તોનો આજ્ઞાધારક છું. અને એમની પાસે જ ઊભો રહેલો છું. હું સદ્ગુરૂ પ્રેમનો ભૂખ્યો છું અને ભક્તોની હંક સાંભળતાં જ તેમની મદ્દ માટે દોડી આવું છું. (ઓ. ૬૬-૭૬)’

આ કથા લખતાં લખતાં ઉપરના વિધાનના સંદર્ભમાં એક સરસ વાત યાદ આવી. જે ઉદાહરણ ઝ્રૂપ કહી રહ્યો છું. શ્રોતાજનો ધ્યાનપૂર્વક સાંભળો. એક વખતે કલ્યાણનો સિદ્ધીક ફાળું નામનો મુસલમાન મક્કા મદીનાની હજ કરી શિરડી

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

આવી પહોંચ્યા. એ વૃદ્ધ હાજ ઉત્તર તરફ આવેલી ચાવડીમાં ઉત્થો. તે સમયે શિરડીમાં સામસામે બે ચાવડી હતી. એકનું મુખ ઉત્તર તરફ અને બીજનું દક્ષિણ તરફનું હતું. દક્ષિણ તરફ જેનું મુખ હતું તેમાં શ્રી સાઈબાબા ૧૦ ડિસેમ્બર ૧૯૦૮થી એક દિવસના આંતરે સૂવા માટે જતા હતા. છેલ્લા નવ મહિનાથી બાબા સિદ્ધીક ફાળકે કે જે ચાવડીમાં ઉત્થો હતો તેની તેમનો યોગ્ય સમય આવ્યો ન હતો. માટે તેનો ફેરો ફોગાઠ ગયો. તેણે લાખ પ્રયત્નો કર્યા પરંતુ બાબાની નજરો સામે તેની નજર મળતી જ નહીં. આમ તો મસ્ઝિદમાં દરેકને આવવા જવા માટે છૂટ હતી. કોઈ પણ જતની રોકટોક માટેનું એ ગુપ્ત સ્થાન પણ ન હતું. પરંતુ આ ફાળકેને મસ્ઝિદમાં ઉપર ચઢવાની કે પગ મૂકવાની પણ આજા ન હતી. ફાળકે મનમાં ખૂબ દુઃખી થયા. ‘નસીબ કંઈ વિચિત્ર લગે છે ! મસ્ઝિદમાં પગ પડતો જ નથી ! શું લાપ કર્યા છે એ તો ભગવાન જ જાણો ! શું કરું તો બાબા મારી ઉપર પ્રસન્ન થાય ?’ એ જ વિચાર રાત અને દિવસ હૃદયરોગની જેમ ફાળકેના મનમાં રમવા લાગ્યો. એટલામાં જ કોઈકે એમને કહ્યું કે આમ ઉદ્ઘાસ ન થતાં માધવરાવ દેશપાંડે શામાની મહદું લો એટલે મનની આશા પૂરી થરો. જે રીતે નંદીના દર્શન કર્યા પછી શિવળુના દર્શન કરતાં તે પ્રસન્ન થાય છે તેવી આ વાત છે. ફાળકેને આ માર્ગ સરળ અને સ્વીકારવા યોગ્ય લાગ્યો. પ્રથમ દાણીએ શ્રોતાઓના મનમાં આ એક અતિશ્યોક્તિ ભર્યું લાગશે. પરંતુ શિરડીમાં બાબાના દર્શને જનારા ભક્તોને આવોજ અનુભવ થતો હતો. જેમને બાબાની જેએ શાંતિથી સંભાપણ કરવું હોય તેમણે શક્તાત્માં તેમની સાથે માધવરાવને લઈ જવા પડતા હતા. માધવરાવ બાબાને સમજનવતા કે આ વ્યક્તિ કોણ છે ? કયાંથી આવ્યા છે ? અને શા માટે આવ્યા છે ? તે બધું તેમણે બાબાને મીઠાશથી સમજનવું પડતું હતું. તેમના કામનો આ રીતે પ્રારંભ થતો. બધી પૌરાણિક કથાઓમાં, સૂત એટલે રથ ચલાવનારા જીતિને એક પુરાણિક કહ્યો છે. માટે પ્રત્યેક પુરાણ કથાના પ્રારંભે આ શાખ હોય છે કે સૂત ઉવાચ તેમના બોલ્યા પછી સાઈ સમર્થ બોલવા તૈયાર થતા. આ બધું સાંભળીને હાડીએ માધવરાવને આગ્રહ કર્યો અને કહ્યું, ‘એકવાર મારી આ તાલાવેલીનો અંત લાલો અને મળવામાં દુર્લભ એવી બાબાની મુલાકાત કરવી આપો’ આ પ્રકારે માધવરાવે આગ્રહ કર્યો તેથી કામ અધરું હોય કે નહિ, પણ પ્રયત્ન કરી જેવાનો મનમાં પાકો નિશ્ચય કર્યો. પછી તેઓ મસ્ઝિદમાં ગયા અને ધીરજ ધરીને ખૂબ ધીમા અવાજે બાબા પાસે વાત કાઢી. ‘બાબા ! પેલો વૃદ્ધ ખૂબ જ દુઃખી છે, તેની ઉપર મહેરબાની કરો ને ?’ એ હાજ મક્કા મહીનાની યાત્રા કરીને શિરડી તમારાં દર્શને આવ્યો છે, તમને એની દ્વારા કેમ નથી આવતી ? એને મસ્ઝિદમાં આવવા દો ને ! અસંખ્ય લોકો મસ્ઝિદમાં આવીને દર્શન કરે છે, અને તરત જ પાછા પણ જતા રહે છે. જ્યારે આ બિચારો બહાર દર્શન માટે રાહ જેતો રહ્યો છે. એની ઉપર આપ એકવાર કૃપાદાનિ કરો જેથી એક વખત મસ્ઝિદમાં તમારી મુલાકાત થઈ શકે. તે એના મનની વાત પૂર્ણીને તરત જ પાછો જતો રહેશે. આ સાંભળી બાબા બોલ્યા, ‘શામ્યા ! તારા હોઠ પરની લાળ હજુ રતીભર સુકાઈ નથી, તું બહુ નાનો છે. તને કંઈ સમજાણ પડતી નથી.’ ‘અલ્લાની શક્તિ’નું પીઠભણ એને જ મળેતો હું તેના માટે વળી શું કરી શકવાનો હું ? અલ્લીમીયાંના ઋણી થયા સિવાય આ મસ્ઝિદમાં કોણ ચઢી શકે ? અહિના ફકીરની કરણી અભૂતપૂર્વ છે, હું એનો કંઈ ઘણી નથી. બાબાએ શામાને કહ્યું કે પાસેની પેતી વાવા બાજુની જે લાંબી પગદંડી છે તેની ઉપર તું વ્યવસ્થિત ચાલીને આવી શકીશ કે ? હાજીએ ઉત્તર આપ્યો, ‘તે કેટલીએ વિકટ હશે તેમ થકા તેની ઉપરથી હું વ્યવસ્થિત ચાલીને આવીશ. પરંતુ આપે મને આપની પ્રત્યક્ષ મુલાકાત આપો અને આપના ચરણ પાસે મને બેસવા દો.’ શામાના મેઢેથી જવાખ સાંભળીને બાબાએ એને એક વધારાનો પ્રક્રિયા, ‘ચાર વખત ચાતીશ હજાર રૂપિયા તું મને આપીશ કે ?’ શામાએ આ સંદેશો કહ્યો તે સાથે જ હાજ બોલ્યા, ‘આપ એ શું પૂર્ણી રહ્યા છો ? માંગશો તો ચાલીસ લાખ સુદ્ધાં

શ્રી સાઈનું સત્ય ચાચિત્ર

આપીશ. હજરોની શી વિશાત છે ? એ સાંભળીને બાબાએ શામાને પૂછ્યું ‘એને પૂછી જે કે આજે મસ્ઝિદમાં અમારો વિચાર બકરો કાપવાનો છે. તો તને ફક્ત એનું માંસ જ જોઈએ, કે કોઈ એક ભાગનું માંસ વાળું હાડકું પણ જોઈએ ?’ અથવા તને તેના અંડકોશ ખાવાની ઈચ્છા છે ? શામા ! જ અને એ ડોસલાને પૂછ કે ખરેખરમાં તને શું જોઈએ ? આમ બાબાએ જે જે કહ્યું તે શામાએ તે હાજીને ફરમાવ્યું, પણ હાજીએ સ્પષ્ટપણે કહ્યું કે, ‘આમાનું મને કંઈ પણ જોઈએ નહીં, જે આપને યોગ્ય લાગે તે મને આપજે. મારી ફક્ત એજ આસ્થા છે કે, બિક્ષાપાત્રના શકરોમાંથી એક ટુકડો ભાખરી પણ જે મળશે તો મારું અવશ્ય કલ્યાણ થયું એવું માનીશા.’ હજુનો આ સંદેશો લઈને શામા (માધવરાવ) પાછા આવ્યા અને તે બાબાને સધળી વાત જણાવી. તેવું સાંભળતાની સાથે જ બાબા ગુસ્સે થયા અને પોતે પાણીની માટલી ઉંચકી અને દરવામાંથી બહાર ફેંકી દીધી. બાબા હાથ કચકચાવતા હાજીની પાસે આવ્યા અને પોતાના બંને હાથો વડે પોતાની કફ્ફની હાજ સામે ઉચી કરીને બોલ્યા, ‘તું તારા મનમાં સમજે છે શું ? મારી સામે હોશિયારી મારે છે ? ઘડપણમાં તું મને તુમારી બતાવે છે ? તું શું આવું કુરાન વાંચે છે ? મક્કાની હજ કરી આવ્યો તેથી તું અભિમાનમાં આટલો બધો છકી ગયો છે ? પણ તું મને ઓળખતો નથી.’ આ પ્રકારે બાબાએ હાજીનું અપમાન કર્યું. તેને ન બોલાય તેવા અને ન ખોટું લાગે તેવા શર્ફો બોલ્યા. હાજી બીકનો માર્યો ગભરાઈ ગયો. પછી બાબા મસ્ઝિદમાં તરત પાછા આવ્યા. મસ્ઝિદના આંગણમાં ધૂસતાં જ માલણને કેરી વેચતા જોઈ. તેના બધા મોટા ટોપલા વેચાતા લધી લીધા. અને તે બધા જ તરત જ હાજીને મોકલી આય્યા. પછી તરત જ બાબા પાછા ફર્યા અને પેલા હાજી પાસે ગયા. ખીસ્સામાંથી પંચાવન ઢપિયા કાઢયા અને એની હૃથેળીમાં મૂર્કી દીધા, ત્યારબાદ હાજી ઉપર પ્રેમ ઉભરાયો અને એને જમવાનું આમંત્રણ આય્યું. બંને જણા જાણે કશું બન્યું નથી તેમ બધું જ ભૂલી ગયા. તેથી હાજી આનંદમાં તળબોળ થઈ ગયો. ત્યાર પછી તે ત્યાં થોડા દિવસો રોકાઈને શિરડી છોડીને બહાર ગામ ગયો. તે ત્યાંથી પાછો ફર્યો અને બાબાના પ્રેમમાં પૂરેપૂરો રંગાઈ ગયો. બાબાએ તે પછી પણ હાજીને ઘણીવાર પૈસાની મદદ કરી હતી. (ઓ. ૭૭-૧૧૩)’

હાજી સાથે બાબાએ તિરસ્કાર ભર્યો વર્તાવ કર્યો તેનું કારણ એ હતું કે હાજી સિદ્ધીક ફાળ્ફેને પોતાના વૃદ્ધત્વનો અને મક્કા મહીનાની યાત્રા કરી આવ્યાનો ખૂબ ઘમંડ હતો. તેની અપેક્ષા હતી કે તે શિરડી પહોંચે ત્યારે બાબા તેનું ભવ્ય સન્માન કરે. બાબા આ બધું જ જાણતા હતા. માટે જાણી જોઈને નવ મહિના સુધી તેને મસ્ઝિદના પગથિયાં ચઢવા દીધો નહીં. અહંકાર જેમ જેમ ઉત્તરવા માંડયો ત્યારે બાબાએ તેને ઉપર જણાવેલા પ્રશ્નો પૂછ્યા, અને તેની શરણાગતીની કક્ષાની પરીક્ષા લીધી. પહેલા પ્રશ્નથી તે પોતાના શરીર દ્વારા કરેલું કષ્ટ બોગવવા માટે તૈયાર છે. તે જણયું બીજે પ્રશ્ન પૂછીને તે કેટલું દ્રવ્ય ખર્ચવા તૈયાર છે તે અને ત્રીજી પ્રશ્ન દ્વારા તે બાબાને માટે પોતાના મનની ઈચ્છા, આકંશાઓને કેટલે અંશે મારી નાખવા માટે તૈયાર છે તે બાબાએ તપાસી જોયું. હાજીએ પણ યથાયોગ્ય અને વ્યવસ્થિત રીતે ઉચિત જવાબો આપીને બાબાને પોતાનું તન મન અને ધન એ ત્રણેની શરણાગતી દર્શાવી. તેથી બાબા ખરેખર સંતુષ્ટ થયા. આ બધું થયા છતાં બાબા ફરીથી તે હાજ ઉપર ગુસ્સે થયા ગમે તેમ કેમ બોલ્યા હોશે ? તેનું કારણ એ હતું કે આ ગુસ્સો હાજીની ખરાબ વૃત્તિઓનો નાશ કરવા માટે હતા. માટે જ એ કર્યા બાદ બાબાએ એને કેરીના ટોપલા વેચાતા લઈને મોકલી આય્યા હતા. ઉપરથી પંચાવન ઢપિયા પણ આય્યા અને સાથે જમવાનું આમંત્રણ પણ આય્યું. બાબાનો આવો ગુસ્સો હંમેશા ભક્તોનું અંતિમ કલ્યાણ કરવા માટે જ રહેતો. આ અદ્યાયની પાછળની ઓવી. ૭૩-૭૬માં તેનું દર્શન થાય છે.

આકાશમાંના મેઘ ઉપર જેની સત્તા છે તેવા શ્રી સમર્થને ઇન્દ્રદેવની પ્રાર્થના કરતા જોઈને મને ખૂબ જ આશ્રમ્ય

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

થયુ. તે પ્રસંગ અતિશય વિચિત્ર હતો. સમગ્ર આકાશ અંધારપથી છવાઈ ગયું હતું. પશુપક્ષીઓ ભયબીત થયાં હતાં. પવનના ભયંકર સૂસવાટા સાથે વરસાદની ઝડીઓ શડ થઈ ગઈ. દિવસ આથમ્યો અને સંદ્યાકાળ થતાં એકાએક જબરજસ્ત વાવાજોડું શડ થયું. આખુંય વાતાવરણ ખળખળી ઉઠ્યું. એમાં પાછો વાદળોનો ગગડાટ, વીજળીના ભયંકર કડાકા અને મેઘનું તાંડવ શડ થઈ ગયું. જમીન અને છાપરા ઉપર કરા પડવા લાગ્યા જણે કે નાના પથ્થર તડતડ કરતા વરસી રહ્યા ન હોય ! ગામના લોકો ગભરાટના માર્યાં સમસમી ગયા. તે સમગ્રે ઢોર ઢાંખર જેરજેરથી ભાંભરવા લાગ્યાં. મસ્ઝિફના છાપરાની નીચેના ભાગમાં બિખારીઓના એક સમુદ્દરી ઝડીઓથી બચવા આશરો લીધો. ઢોર ઢાંખર અને વાઇરડાં પણ મસ્ઝિફમાં ધૂસી ગયાં અને મસ્ઝિફ ખીચોખીચ ભરાઈ ગઈ. ચારેબાજુ પાણી જ પાણી થઈ ગયું અને કાપણી કરેલું વાવેતર વહી ગયું. ખળખોમાં ધાસ અને ધાન્ય ભીજાઈ ગયાં અને ગામના બધા માણસ ગભરાઈ ગયું તથા મુજાઈ ગયા. અને સભામંડપમાં આવીને સૌ બેગાં થયા. કેટલાક લોકો મસ્ઝિફના છાપરા નીચે ઊભા રહ્યા અને બાબાને આજીજ કરવા લાગ્યા. જેગાઈ, જાખાઈ, મરીઆઈ, શની, શંકર, અંબાબાઈ, મારુતી તથા અંડોબાના પત્ની વગેરે મહાલ્સાઈ સર્વ દેવદેવીઓ શિરડીના ખુણે ખુણે હતાં. પરંતુ આવો કપરો પ્રસંગ હોવાને કારણે શિરડીના ગામલોકોને એક પણ દેવદેવીઓનો સહારો મળ્યો નહિ. તેમને ચાલતા, બોલતા તથા ઢોડતા સંકટમાંથી ઉગારવા માટે આ એક જ દેવ હતા. અને તે સાઈ. તેમને મરધો, બકરો કે પૈસા કંઈ જ ધરાવવું પડતું નહીં. તેઓ તો ભાવનાના બુખ્યા હતા. અને તે સંકટનો નાશ કરવાવાળા હતા. આમ ગામના લોકોને ભયબીત થયેલા જોઈને સાઈમહારાજ ખૂબ દુઃખી થયા અને ગાઢી છોડીને આગળ આવ્યા તથા મસ્ઝિફના ઓટલા પર કઠેડા જોઈ ઊભા રહ્યા. આકાશ તો પહેલેથી જ મેઘના અને વાદળોના ગગડાટથી ભરેલું હતું. વીજળીઓ કડાકા સાથે ચમકી રહી હતી. એવામાં જ સાઈમહારાજ ઊંચા મોટા અવાજે ગળું તરડાઈ જય ત્યાં સુધી જોરથી બૂમો પાડવા લાગ્યા. પોતાના જીવ કરતાં પણ પોતાના ભક્તોને અને સાધુસંતો દેવોને વધારે પ્રિય હોય છે. ઈશ્વર એમના કલ્યા પ્રમાણે જ વર્તતા હોય છે અને તેમને માટે જ અવતાર ધારણ કરતા હોય છે. ભક્તોની મદદે એમની પ્રાર્થના સાંભળીને દેવોને પણ તેમનું ધ્યાન રાખવાની ફરજ પડે છે. ભક્તોની ભક્તિ યાદ કરીને તેમના શબ્દો તરત જ ધ્યાનમાં લઈને જીતવા પડે છે. બાબાનું આંકદ અને બૂમાબૂમ ચાલી, એમનો અવાજ અવકાશમાં ધૂમવા માંડચો. તેથી મસ્ઝિફ હચમચવા લાગી હોય તેવો ભાસ થવા લાગ્યો. બધાના કાનમાં જણે દૂચા વાગી ગયા. પર્વતોમાં ધુમતાં મોટા અવાજના પડધાની જેમ મસ્ઝિફ અને મંટિરોમાં બાબાનો અવાજ ધૂમવા લાગ્યો. તેથી વાદળોએ પોતાની ગર્જનાઓ પર કાબૂ કર્યો અને વરસાદની ઝડીઓ ઓછી થઈ ગઈ. બાબાની આવી બૂમાબૂમથી આખો સભામંડપ ધણાધણી ઉઠ્યો અને ભક્ત મંડળી ભયબીત થઈને પોતાની જગ્યા ઉપર સ્તરબધ થઈ ગઈ. સાચેસાચ બાબાની આ લીલાની કલ્પના પણ કરી શકાય તેમ નથી. વરસાદની ઝડીઓ આસ્તે આસ્તે બંધ થઈ ગઈ અને તેની સાથે પવનના સૂસવાટા અને ધુમ્મસ પણ ઓસરી ગયા. વરસાદ પણ લગભગ થોભી ગયો અને પવન અટકી ગયો. અંધારું ઓછું થયું અને આકાશમાં તારાના સમૂહ દેખાવા લાગ્યા. ત્યારબાદ વરસાદ સંપૂર્ણ થોભી ગયો અને ચંદ્ર પણ દેખાવા લાગ્યો. તે જોઈ બધાના મનમાં આનંદ થઈ ગયો. ઈન્દ્રને જણે દ્વા આવી ગઈ હોય તેથી અને સંતોના શબ્દને માન આપતા હોય તેમ લાગ્યું. વાદળો ચારે દિશામાં ફુટાઈ ગયાં અને તોફાન શાંત થઈ ગયું. હવે પવન મંદમંદ વહેવા માંડચો અને વાદળોનો ગગડાટ પણ ત્યાં જ થંભી ગયો. પશુ પક્ષી પણ પોતાના સ્થાને નિર્ભય થઈ ગયાં. મસ્ઝિફના છાપરા નીચેથી ગાયો અને વાઇરડાં

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

બહાર નીકળી જઈ નિરાંતે ફરવા લાગ્યાં અને પદ્ધીઓ પણ આકાશમાં ઉડવા લાગ્યાં. આવા ભયંકર પ્રકોપથી ઉગારવા બદલ બાબાનો ઉપકાર માનીને ગામ લોકો પણ પોતપોતાના ઘેર શાંતિથી ગયા. સાઈ દ્વારા મૂર્તિ હતા અને તેમને ભક્તોનું ખૂબ બેંચાણ હતું. જાણે કે એક માને બાળક ઉપર ભાવનાનો ઉમળકો આવ્યો ન હોય આવા અલૌકિક પ્રેમનું હું શું વર્ણન કરું ? (ઓ. ૧૧૪-૧૩૬)

શ્રી બાબાની અશ્રી પર પણ આવી જ સત્તા હતી. તે વિષય પરની એક નાની સરખી વાર્તા શ્રોતાઓએ કાળજીપૂર્વક સાંભળવી જેથી બાબાની શક્તિનું અસાધારણ પ્રભુત્વ અને શ્રેષ્ઠ તત્ત્વ સમજશે. એક દિવસે બપોરનો સમય હતો. ધૂણી પ્રજ્વલિત થઈ અને તેણે અચાનક પ્રચંડ રૂપ ધારણ કર્યું. એ સ્થિતિમાં ત્યાં કોણ ઊંચું રહી શકે ? જવાળાઓ ભડકી ઊંચી તેથી અને પ્રચંડ જવાળાઓનો અશ્રી લાકડાની વળીઓ તે સ્પર્શ તો હવોથી શું મસ્ઝિદ બળીને ખાખ જરો એમ લાગ્યું. છતાં બાબા તો સ્વસ્થ બેઢા હતા. પણ બીજી બધા લોકો ચિંતાગ્રસ્ત થઈને આશ્રયમાં ડૂબી ગયા અને મોઢામાં આંગળા નાંખવા લાગ્યા. કોકે કહ્યું, ‘શું આ બાબાની કમાલ !’ તો બીજે કહે, ‘પાણી લાવ,’ ‘પણ તે છાંટશે કોણ ?’ છાંટવા ગયો તો ઊંડો ફટકારો ! ત્યાં જય કોણ ?’ ત્યાં બેઠેલા સર્વે અધીરા થઈ ગયા પરંતુ બાબાને પૂછવાની હિંમત કોઈનામાં ન હતી. પછી બાબાએ પોતે જ સ્વસ્થ થઈને પોતાના દંડ પર હાથ મૂક્યો. જવાળાના ભડકા જોઈને એમણે સટકો હાથમાં લીધો અને ફટકા ઉપર ફટકા મારીને બોલવા લાગ્યા, ‘હીં જ અહિયાથી’ ધૂણી તરફ એક હાથ દ્વારા થાંભલા પર પ્રહાર કરતાં કરતાં અને જવાળાઓ સામું જેતાં જેતાં કહેવા લાગ્યા, ‘સભૂર સભૂર’ એક ફટકે જવાળાઓનું જોશ ઓછું થવા માંડયું અને આગ બંધ થતી ગઈ. ધૂણી શાંત થવાથી બધાનો ડર જતો રહ્યો. (ઓ. ૧૪૦-૧૪૮)

આ શ્રેષ્ઠ સંત સાઈ જે ઈશ્વરનો બીજે અવતાર છે તેમનાં ચરણો પર આપણું માથું મુક્તાં એમનો ફૂપાળું હાથ મસ્તક ઉપર મૂકશે. જે કોઈ શ્રદ્ધાથી અને ભક્તિસહિત સ્વસ્થચિત્તે આ અદ્યાયનું નિત્ય પારાયણ કરશે તેમને સંકટોથી સંપૂર્ણપણે મુક્તિ મળશે. વધારે તો હું શું કહું ? અંત:કરણ શુદ્ધ કરીને, નિયમિતપણે અને કડક રીતે ધાર્મિક વિધિ અને ફૂત્ય કરનારા બનો, અને સાઈબાબાની ભક્તિ કરો, એટલે શાશ્વત એવા પરમાત્માની પ્રાપ્તિ થશે. ભક્તના મનમાં રહેલી અસાધારણ ઈચ્છાઓ પણ પૂરી થશે અને છેવટે પૂર્ણપણે નિષ્કામ થઈ જવાશે. જ્યાં ઈશ્વર અને જીવ વચ્ચેનો બેદ નહીં જેવો થઈ જય છે, એવું દુર્લભ સાયુજ્ય મુક્તિનું સ્થાન પ્રાપ્ત થશે. કદી તેમને સમાધાન મળશે. જે ભક્તોના મનમાં પરમાર્થ સુખ બોગવવાની ઈચ્છા હોય તેમને આ અદ્યાય વારંવાર વાંચવા માટેની ઉત્સુકતા અને ઉમંગ કેળવવા. એમાની કથાઓ વાંચીને ચિત્તવૃત્તિ શુદ્ધ થશે, પરમાર્થ પ્રાપ્ત કરવા માટે પ્રવૃત્તિ થશે અને સર્વે અપ્રિય અને અશુભ વાતોનો નાશ થઈને પ્રિય અને શુભ વાતો પ્રાપ્ત થશે. તમે બાબાની પ્રતીતિનો અનુભવ લઈ જુઓ ! (ઓ. ૧૪૯-૧૫૪)

હેમાડપંત સાઈને શરણે આવ્યો છે. હવે પછીનો અદ્યાય અત્યંત પાવન અને પવિત્ર છે. તેમાં ગુરુશિષ્યના સંબંધોની ગાથા ગવાઈ છે. અને ગુરુનો ઉપદેશ ગ્રહણ કરેલા ‘મુણે’ નામના શિષ્યને પોતાના ‘ધોલપ’ નામના ગુરુનું દર્શન કેવી રીતે થયું તે તેમણે વર્ણવેલું છે. ‘શિષ્ય ગમે તેવો પ્રસંગ આવી પડે, તેમ છતાં તેણે પોતાના ગુરુદેવને ક્યારેય છીડવા નહીં’ આ તત્ત્વનો પ્રત્યક્ષ અનુભવ કરવીને સાઈબાબા જેની જે સ્થાને દદ ભક્તિ થઈ હોય તેને તે વધારી આપતા. જે જે ભક્તો સાઈના ચરણોમાં આવ્યા તે દ્વેક ભક્તોને વિવિધ સ્વરૂપે જુદાં જુદાં અને આશ્રયકારક રૂપોમાં દર્શન કરાવ્યાં તે ભક્તોના આરાધયદેવો અને ગુરુ ભક્તિને બાબા દદ કરતાા. (ઓ. ૧૫૫-૧૫૭)

શ્રી સાઈનું સત્ય ચિત્ર

સર્વનું કલ્યાણ થાઓ. આ પ્રકારે સંત અને સજજનોની પ્રેરણા પામેલા ભક્ત હેમાડપંત રચિત
શ્રીસાઈ સમર્થના સત્યચરિત્રનો ‘શ્રી સાઈ મહિમા વર્ણન’ નામનો અગિયારમો અધ્યાય
અહીં સમાપ્ત થાય છે.

શ્રી સદગુરુ સાઈનાથને અર્પણા.



અધ્યાય ૧૧નું અર્થ વિવરણ

આ અગિયારમો અધ્યાય ખૂબ જ મહત્વનો છે. હેમાડપંતે તો આ અધ્યાયના પઠનને યજુર્વેદના પ્રસિદ્ધ રૂપ અધ્યાય જેવો કહ્યો છે જેનું અગિયાર વખત પઠન કરવાથી જે ફળ મળે તેવો કહ્યો છે. શ્રીધર સ્વામીકૃત શ્રીશિવલીલામૃતનો પણ અગિયારમો અધ્યાય શ્રેષ્ઠ માન્યો છે. ‘છે સર્વ ભાવે નિશ્ચિત। અખંડ ધારણુ શિવલીલામૃત। ધારો કે ન સમજાય ત્વરિત। આ અધ્યાય તો જરૂરથી વાંચવો’ ॥૭૮॥ શ્રીમદ્ ભાગવત ગીતાનો અગિયારમો અધ્યાય તો પ્રસિદ્ધ જ છે. એમાં અર્જુનને ભગવાને પોતાનું વિશ્વકૃપનું દર્શન કરાવ્યું છે, અને પછી અર્જુને શ્રીકૃષ્ણને ભાગવત સ્વરૂપ તરીકે ઓળખીને તેમને વારંવાર નમસ્કાર કરીને કહ્યું છે કે-

ત્વમાદિતેવः પુરુષः પુરાણસ્તવમસ્ય વિશ્વસ્ય પરં નિધાનમ् ।

વેતાસિ વેદં ચ પરં ચ ધામ, ત્વયા તતં વિશ્વમનનતરૂપं ॥૩૮॥

તમે જ આધિતેવ, પુરાણ-પુરુષ, વિશ્વનો આધાર, જ્ઞાની, જણવા યોગ્ય અને પરમધામ (શ્રેષ્ઠ સ્થાન) છો. અનંતરૂપે આપ જ આ વિશ્વમાં વ્યાપેલા છો ॥૩૮॥

નમः પુરસ્તાદિ પૃથતસ્તે, નમોડસ્તુ તે સર્વત એવ સર્વ ।

અનન્તવીર્યામિતવિકમસ્તવં, સર્વ સમાપ્નોષિ તતોડસિ સર્વ ॥૪૦॥

હે સર્વઅાત્મા ! હું આપને સામેથી, પાછળથી અને સર્વે બાજુથી નમસ્કાર કરુ છું. તમારા પરાક્રમો અગણિત અને શક્તિ અનંત હોવાને લીધે આપ સર્વમાં વ્યાપેલા છો અને આપ જ ‘સર્વ’ છો. ॥૪૦॥

શ્રી સાઈ સત્ય ચરિત્રનો અગિયારમો અધ્યાય વાંચ્યા બાદ જ આપણાને ‘કેવા ઈન્દ્ર અજિન વરુણ । બાબાનાં

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

વચનોને આપે માન ॥’ અને ‘એ આ સાઈ સંતોમાં શ્રેષ્ઠ । ઈશ્વરનો બીજો અવતાર’ એની પ્રતીતિ થાય છે, માટે હેમાઇપંત કહે છે કે –

કહે કોઈ ભગવત ભક્ત । કોઈ કહે મહા ભાગવત ।

અમોને તો એ સાક્ષાત્ ભગવંત । મૂર્તિમંત દેખાયા ॥૨૫॥

આ અધ્યાયમાં સગુણ અને નિર્ગુણ ભક્તિનું સ્પષ્ટીકરણ કરેલું છે.

સગુણ ધ્યાન કર્યા વિના । ભક્તિભાવ કરી પ્રગટે ના ।

ને સપ્રેમ ભક્તિ પ્રાપ્તિ વિના । મન પાંડી ઘીલેના ॥૧૧॥

તે જો કાંઈ ઘીલે નાહીં । તો કણ્ણિકા (કરણનું કુલ) સુગંધ આપે નહીં ।

મધ્ય નથી બ્રહ્મર પણ નથી । ટકનાર ત્યાં ક્ષણાભર ॥૧૨॥

સગુણ તે જ સાકાર । નિર્ગુણ તે નિરાકાર ।

નથી બિન્ન પરસ્પર । સાકાર નિરાકાર છે એક ॥૧૩॥

થિજ્યું તો પણ ધી જ થિજ્યું । ઓગજ્યું પણ ધી કહેવાયું ।

સગુણ નિર્ગુણ એક જ થયું । વિશ્વક્રપે સમરસ ॥૧૪॥

અનિમિષ નથને જોઈ શકીયે । ચરણે મસ્તક મૂકી શકીએ ।

ધ્યાન સગવડ મેળવી શકીયે । પ્રેમ જરણ તો ત્યાં ફૂટે ॥૧૫॥

બેસી જેમની પાસે । પ્રેમવાર્તા કરી શકીએ ।

ગંધ અક્ષતે પૂજુ પણ શકીયે । આકૃતિ તદ્દ અર્થે જોઈએ ॥૧૬॥

નિર્ગુણથી તેથી સગુણનું । આકલન રહેલું છે સાચું ।

દઢ સગુણ પ્રેમ પ્રાપ્તિનું । ફળ છે નિર્ગુણનું બોધન ॥૧૭॥

તેવી જ રીતે સંતોનું મહાત્મ્ય પણ છે –

મળવા જતા સમુદ્રને ગંગા । માર્ગે શિતલ કરે તખ્યાં જે ।

સિંયે જળ કાંઠાના વૃક્ષને । ને તૃપા હરે છે સર્વની ॥૨૬॥

સંત અવતાર સ્થિતિ તેવી છે । પ્રકટ થાય ને જતી રહે ।

પણ આચાર વિચાર તેમના જે । કરે પાવન જગતને ॥૨૭॥

અને બાબાના બ્રહ્મસ્વરૂપનું વર્ણન પણ કેટલું સુંદર છે ?

સગુણમાં જે છે સગુણ । નિર્ગુણમાં જે નિર્ગુણ ।

ગુણિયલોનો જે અનુપમ ગુણ । ગુણોનો ગુણવાન ગુણીરાજ ॥૩૩॥

પર્યાપ્ત કામ જે કૃત કૃત । સદા ય દાચદા લાલ તૃપ્ત ।

જે અનવરત આત્મનિરત । સુખ દુઃખ તીત જે ॥૩૪॥

આત્માનંદનો જે વૈભવ । વર્ણવી શકે કોણ તે ગૌરવ ।

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

તે અનિર્વાચ્ય સર્વથૈવ । સાકાર વ્રહ્મ દેવત જે ॥૩૫॥
 કે શું તે અનિર્વચનીય શક્તિ । દશ્યદૃપે અવતરી અહીં ।
 સચ્ચિતસુખાનંદની મૂર્તિ । જ્ઞાન સંવિતિ તે જ તે ॥૩૬॥
 અભાકાર અંતઃકરણ મૂર્તિ । જેમની થઈ પ્રપંચ નિવૃત્તિ ।
 નિત્ય નિષ્પ્રપંચ પ્રકાત્મૈક સ્થિતિ । કેવળ આનંદ મૂર્તિ તે ॥૩૭॥
 આનંદો વ્રહ્મમેતિ શ્રુતિ । શ્રોતા કાને નિત્ય પડતી ।
 પુસ્તકજ્ઞાની વાંચે પોથી । ભાવિકને પ્રતીતિ શિરડીમાં ॥૩૮॥

ડા. પંડિતની ત્રિપુરુંધરની કથામાં આપણને બાબા ભોલે શંભુ હોય તેવાં જ દર્શન થાય છે. ભક્તોની અનન્ય ભક્તિ આગળ એમનું કંઈ ચાલતું નથી. ભક્તોની કોઈ પણ હઠ બાબા ગુસ્સે થયા વિના તે પુરી કરતા.

અમે મોટા પવિત્ર પ્રાલિણ । આ જતનો અપવિત્ર મુસલમાન ।
 કેવી રીતે કરું એનું પૂજન । એવામાં તનમન શંકા થઈ ॥૬૩॥
 ફસાવ્યો મને એણે એ રીતે । ન ઉપાય મારો ત્યાં ચાલે ।
 ના કહેવાનો માર્ગ ના ઉરે । આધીન હું એને આથી થયો ॥૬૪॥

તેવી જ રીતે સિદ્ધીક ફાળકેની કથા સાંભળતાં જ બાબાનું શંકર ભગવાન જેવું રૌદ્રદ્વાપ દેખાઈ આવે છે, પણ તે સાચું નથી. ભક્તોની યોગ્યતા થતાં તેમની ઉપર કૃપાની વર્ષા થઈ જ સમજો -

ભલે કોણે કોપાયમાન થાઉ થરથરી । ડોળા જે ફરે ગરગર ।
 તો પણ અંદર કરુણાના ઝરણાં । મા અને બાળક જેવી સ્થિતિ આ ॥
 કહું છું વારંવાર તમને । જ્વ જ્વ ગુસ્સો મને ચેઢે ।
 તવ કહું છું હું શું કેને । સમૃતિ તેની ના રહેતી મને ॥૭૩॥
 મા મારે બાળને લાતો । સમુદ્ર નદી પાછી કાઢે ।
 તો જ હું તમને અવગણીને । અહિત કોઈ કાળો કરું ॥૭૪॥
 ઝાણી છું હું મમલકતોનો । છું એમની પાસે સદા ઊભો ।
 એ પ્રેમનો સદા ભૂખ્યો । બૂમ પાડતા જ ‘ઓ’ હું બોતી ઉંદું ॥૭૫॥

ખરેખર સાઈબાબા ખુદ શંકર ભગવાન જ હોવા જેઠાંએ. તેથી હેમાંડંતે આ અદ્યાયને શંકરને ગમતો ‘રુદ્રાધ્યાય’ અમસ્તો જ નથી કહ્યો. આગળના અદ્યાય ૨૮માં ગુજરાતી પ્રાલિણ મેધાને થયો સાઈનો અનન્ય ભક્તન । માને સાઈને શંકર પ્રત્યક્ષા । શંકર શંકર મુખે ગર્જન । કરે ને અન્ય દૈવત ના માને ॥૧૪૬॥

આવા સર્વ શક્તિમાન એને ભક્ત વત્સલ દેવ શિરડીની પ્રજનને મખ્યા. તે તેમનું કેટલું મોદું ભાગ્ય । ન જેઠાંએ તેને બફરાં મરધાં । ન જેઠાંએ તેને પેસા દોડકા । એક ભાવના ભૂખ્યા રોકડા । સંકટ જટ તે દૂર કરે ॥૧૨૪॥

માટે જ હેમાંડંતે આ અદ્યાયના વાંચનની જે ફળશુત્તિ કહી છે, તેમાં શંકા કરવાનું કોઈ કારણ જ નથી રહેતું.

